

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૯૫

મુંબઈ, પોષ, ૧૯૪૭

સત્સવરૂપને અભેદરૂપે અનન્ય ભર્તાએ નમસ્કાર

માર્ગની છચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને

આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે : -

“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં

થતી નથી ? અને તે શું કરવાથી થાય ? ”

આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી

ચિંતના કર્યા વિના, તેને માટે દઢ થઈ જૂયા વિના માર્ગની

દિશાનું પણ અલ્ય ભાન થતું નથી; અને ભવિષ્યકાળે પણ

નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ

શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જાણાય છે.



શ્રીમદ્ રાજચંદ્ર
પત્રાંક-૧૮૫

પ્રવચન-૧
તા.૨૫-૮-૬૭

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત. પત્રાંક ૧૮૫. પત્રાંકનું મથાળું છે,
“સત્તસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભર્ત તથે નમસ્કાર” સત્તસ્વરૂપ એટલે
કે ત્રિકાળ જે સત્ત રૂપ છે, એટલે કે હ્યાત છે. જેની હ્યાતી ત્રિકાળ
છે એને કહે છે ત્રિકાળી સત્ત. એવું જે પોતાનું સ્વરૂપ તેને અભેદરૂપે
નમસ્કાર. એટલે હું નમસ્કાર કરનાર અને મારું સ્વરૂપ નમસ્કાર કરવા
યોગ્ય એમ ભાવમાં બે-પણું નથી એટલે કે પોતાના સ્વરૂપમાં પર્યાય લીન
થઈ જાય છે, ફળી જાય છે - તે જ અભેદ નમસ્કાર છે.

પ્રશ્ન : અભેદ ભર્ત તને વધારે સ્પષ્ટ કરવા વિનંતી.

પૂ. ભાઈશ્રી : સત્તસ્વરૂપ એટલે ત્રિકાળી અસ્તિત્વ જેનું છે, અવિનાશી
અસ્તિત્વ છે - એવું જે પોતાનું સત્તસ્વરૂપ, તેને અભેદભાવે નમસ્કાર.
એટલે કે નમસ્કાર કરનાર અને નમસ્કાર કરવા યોગ્ય એવો ભેદ જેમાં
નથી રહ્યો. પરંતુ પોતાના સ્વરૂપની મહાનતા, પોતાના સ્વરૂપની પવિત્રતા,
પોતાના સ્વરૂપના એવાં દિવ્ય ગુણો જોઈને, જોનાર અવસ્થા તેમાં પોતાપણું

કરીને એમાં લીન થાય તેને અભેદ ભર્તી તથી નમસ્કાર કહેવામાં આવે છે. અભેદ, અનન્ય ભર્તી ત, અનન્ય એટલે એવી બીજી કોઈ ભર્તી ત નહીં. એ પરાભર્તી ત છે. પરાભર્તી ત એટલે છેલ્લી હંદની ચરમસીમાની ભર્તી ત. બે-પણું ન રહે તે પરાભર્તી ત છે. એ યપણું થઈ જાય છે. દ્વય, પર્યાયનું એ ય થઈ જવું. એવી નિર્વિકલ્પ અવસ્થાને અનન્ય ભર્તી તરૂપ નમસ્કાર કહેવામાં આવ્યા છે. એવી પોતાની ભર્તી તનું સ્મરણ કરીને પત્રનો પ્રારંભ કરે છે.

“માર્ગની છચ્છા જેને ઉત્પત્ત થઈ છે” માર્ગ એટલે ઉપાય સંસારનો નાશ કરવાનો ઉપાય અને સિદ્ધપદ-મોક્ષપદ, નિર્વાણપદ પ્રાપ્ત કરવાનો ઉપાય – એને કહે છે ‘માર્ગ’. એટલે કે રત્નત્રયરૂપ માર્ગ, સમ્યગ્રદર્શન, સમ્યક્જ્ઞાન, સમ્યક્યારિત્ર તે જ તેનો ઉપાય છે. સંસારના નાશનો પણ તે જ ઉપાય છે અને મોક્ષપદનો પણ તે જ ઉપાય છે. એવા માર્ગની છચ્છા, માર્ગની છચ્છા એટલે કે માર્ગ પ્રાપ્ત કરવાની છચ્છા જેને ઉત્પત્ત થઈ છે. “તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી-ફરી સ્મરણ કરવો અવશ્યનો છે.”

પ્રશ્ન : બધા વિ લ્યો છોડીને - એમાં પરલક્ષ થાય છે તે લેવું ?

પૂ. ભાઈશ્રી : પરલક્ષ છોડવું અને નીચે જે વિકલ્પ આપ્યો છે એને છોડી બીજા વિકલ્પ ન કરવા. માર્ગપ્રાપ્તિ અર્થે અન્ય પ્રકારના ઉપાયમાં ન જવું. આ જ વિકલ્પમાં રહેવું એમ કહેવા માંગે છે. પરલક્ષની વાત તો દૂર રહી પણ અન્ય અન્ય ઉપાયાંતર પણ ન કરવા. શું ? બીજા ઉપાય પણ ન કરવા એમ વાત છે.

પ્રશ્ન : ભાઈશ્રી ! આપશ્રીએ કહ્યું કે એ વિકલ્પનું વારંવાર સ્મરણ કરવું જોઈએ તો એ કેવી રીતે ?

પૂ. ભાઈશ્રી : સ્મરણ કરવું એટલે યાદ કરવું. જેમ કે આપણે આ વચ્ચે વાંચ્યું કે “માર્ગની છચ્છા જેને ઉત્પત્ત થઈ છે” તો આ વચ્ચનો સ્વલ્લેષે સ્વાધ્યાય કરતાં, આપણે આપણું પરિણમન તપાસી લેવું જોઈએ, એવું Checking કરી લેવું જોઈએ કે શું ખરેખર મને માર્ગની છચ્છા ઉત્પત્ત

થઈ છે ? (જો થઈ હશે) તો આપણે અહીંયાં જ્ઞાનીપુરુષ જે વાત કરે છે તેનો સ્વીકાર કરી શકશું. જો ઈમાનદારીથી આપણાને એ છચ્છા નથી, એટલે કે સંસારની પણ ઈચ્છા રહેતી હોય, સંસારના અમુક પ્રસંગની, અમુક પદાર્થની ઈચ્છા રહેતી હશે તો એ વાત સ્મરણમાં રહેવાની નથી, એનું સ્મરણ ધૂટી જશે. જેને માટે તેઓશ્રી એમ કહે છે કે વારંવાર એનું સ્મરણ કરવું પણ સંસારની ઈચ્છાવાળાને તેવું સ્મરણ રહેવાનું નથી. તો અહીં સર્વ પ્રથમ આપણે એ તપાસી લેવાનું છે કે ખરેખર-વાસ્તવમાં મને માર્ગની ઈચ્છા છે કે નહીં ? એટલે ખરેખર પોતે સંસાર છોડવો છે કે નથી છોડવો અને ભોગવવો જ છે ? શું વાત છે ? એ સૌથી પહેલાં આપણે જોઈ લેવું જોઈએ. તો પછી આગળની વાત કામની છે નહિતર એ કામ થવાનું નથી. સ્વાધ્યાય થઈ ગયો એટલે વાત પૂરી ! એમ આ વાત માત્ર સ્વાધ્યાય કરવા પૂરતી નથી. અહીં જે કહી રહ્યા છે તે વાત અમલીકરણની છે, શું ? માત્ર સ્વાધ્યાય કરવા માટે નથી, અમલીકરણની છે. માટે પહેલા બરાબર એ વાત ચેક કરી લેવી જોઈએ કે શું મને માર્ગની ઈચ્છા ખરેખર ઉત્પત્ત થઈ છે ?

કોઈ પણ માણસ પરસ્પર વિરુદ્ધ એવા બે માર્ગ પર એકસાથે ચાલી શકતો નથી. એક માર્ગ માનો કે પૂર્વમાં જાય છે જ્યારે બીજો માર્ગ પણ્ણમમાં જાય છે. ચાલવાવાળો કાં તો પૂર્વમાં ચાલશે કાં તો પણ્ણમમાં ચાલશે. એક સાથે બને દિશામાં જઈ શકશે ? ના. એવું જ સંસાર અને મોકષનું છે. બને પ્રતિપક્ષમાં છે. તો તું જો તારી અંદરમાં કે તારે કઈ દિશામાં જવું છે ? બે ઘોડાની સવારી તો થઈ શકવાની છે જ નહીં. એ રીતે અંતરથી જેને સંસારને માર્ગ નથી જવું અને અંદરથી જેને સંસારનો થાક લાગ્યો છે કે હવે મારે સંસારમાં નથી જવું – એને માટે આ પત્ર છે. નહીંતર સ્વાધ્યાય તો અનેક વાર કરવા છતાં આપણી પરિસ્થિતિ તેની તે જ રહેશે.

ક્યો વિકલ્પ વારંવાર સ્મરણ કરવો અવશ્યનો છે ? કે “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયાં છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ?” અનંતકાળથી જીવનું – એટલે કે મારું, જીવ કોડા છે ? હું છું. જીવ એટલે હું, કોઈ

બીજાનો, પરનો વિકલ્પ આપણે નથી કરવાનો. અનંતકાળથી મારું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? પરિભ્રમણ શા માટે ચાલુ ને ચાલુ રહ્યું છે ? અને એવું હું શું કરું ! કે જેથી આ પરિભ્રમણનો નાશ થાય. આ મારા સંશોધનનો વિષય છે. અનંત કાળથી મારું પરિભ્રમણ ચાલુ રહ્યું છે અને તેનો નાશ નથી થતો – આ મારી ચિંતાનો વિષય છે અને કેવી રીતે નાશ થાય એ મારા સંશોધનનો વિષય છે, મારી જિજ્ઞાસાનો વિષય છે, મારી ભાવનાનો વિષય છે. આ બે પ્રકારનાં પરિણામ વારંવાર થવાં જોઈએ. એટલે કે વિસ્મૃત ન થવાં જોઈએ. જ્યાં સુધી ? કે જ્યાં સુધી પૂર્ણ શુદ્ધિનું લક્ષ ન બંધાઈ જાય ત્યાં સુધી. કારણ કે આ ચિંતના અને આ (માર્ગ) પ્રાપ્તિની ભાવનાની વેદના તે માર્ગની અપ્રાપ્તિ હોવાને લીધે પૂર્ણતાના લક્ષમાં પરિણામિત થશે. કારણ-કાર્ય બજેને સંબંધ છે. અને એવું પૂર્ણતાનું લક્ષ જ્યારે ફળસ્વરૂપે બંધાય ત્યારે જ યથાર્થ ચિંતના અને વેદના થઈ છે એમ ગણવું, નહીંતર થોડું (દુઃખ) થઈ, થોડો ખેદ થઈ પાછો જતો રહેશે. જેનું કંઈ મહત્વ નથી. કારણ કે તે ખેદ કાર્યસાધક ન થયો. કાર્યસાધક થયો યારે ગણાય ? કે જ્યારે પૂર્ણતાનું લક્ષ, પૂર્ણ શુદ્ધિનું ધ્યેય નિશ્ચિત થાય ત્યારે. માટે જ્યાં સુધી આવું લક્ષરૂપ-પૂર્ણ શુદ્ધિના લક્ષરૂપ Result (ફળ) ન આવે ત્યાં સુધી તેનું વિસ્મરણ ન થવું જોઈએ. જો તે વિસ્મરણ થઈ જતું હોય અને જ્યાં સુધી એ રીતે વિસ્મૃત થતું રહેશે ત્યાં સુધી, એમ સમજવું કે મને ભવભ્રમણનો ભય છે જ નહીં. મને એની કોઈ ચિંતા નથી. એમ સમજને ચાલવું. એ વાત સાબિત કરવાની જરૂરિયાત નથી રહેતી.

હવે કહે છે કે “આ વા યમાં અનંત અર્થ સમાયેલો છે” સમાવિષ્ટ છે. તે કેવી રીતે ? કે તમે એ ચિંતનામાં આવો તો ખબર પડો. માત્ર સાંભળવાથી તો સાંભળેલું નહીં સાંભળ્યા બરાબર થઈ જશે. યાં સુધી તે સ્મરણમાં રહેશે ? સાંભળેલી વાત વળી યાં સુધી સ્મરણમાં રહેશે ? તે વધુ સમય નથી રહેતી. જે પરિભ્રમણની ચિંતનામાં આવે છે તેને જ્ઞાનીના આ વચનમાં – આ જે વચન લખ્યું છે તેમાં કેટલો અર્થ, કેટલો ભાવ

ભર્યો છે એની (અનુભવથી) ખબર પડે છે. કેવી રીતે ? કે જીવને પૂર્વમાં પરિભ્રમણના કારણરૂપ અનેક પ્રકારના, અનંત પ્રકારના ભાવો જ થયા છે, અને અત્યારે થઈ રહ્યાં છે તેનું ભાવભાસન આવશે. તે એવા પ્રકારે કે આ જે પરિણામો ચાલી રહ્યાં છે એ બધાં મારા પરિભ્રમણના કારણભૂત છે. આવી આવી ભૂલો કરીને જ મેં પરિભ્રમણ કર્યું છે, અમસ્તુ મારું પરિભ્રમણ નથી થયું. તો એ પ્રકારે ચિંતના શરૂ થતાં જ એમાં કયા કયા અર્થ સમાયેલા છે તેનો ખ્યાલ આવી જશે. એક વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. જુઓ જ્ઞાનીનું જ્ઞાન ! એક વા ય કહીને, એક વચન કહીને એમ કહે છે કે જુઓ ! આમાં અનંત અર્થ સમાયેલો છે ! કેવી રીતે કહે છે ? કારણ કે પોતે એ પરિસ્થિતિમાંથી પસાર થયા હોવાથી તેમને ખબર છે. અહીંયાં તો સમસ્યા અને તેનું સમાધાન બને સાથે આપી રહ્યાં છે કે તારી જે આ સમસ્યા છે તે સમસ્યાને ઉકેલતી વખતે તને આવું આવું થશે. જો આવું ન થતું હોય તો માની લેજે કે તું બરાબર રીતે તારી સમસ્યામાં પડા ઘેરાયો નથી. કેમ ? કારણ કે બહુભાગ ઘણીબધી બાબતો સાંભળીને બૌદ્ધિક સ્તરે એનો નિર્ણય લેવામાં આવતો હોય છે અને બૌદ્ધિક સ્તરે આગળ વધવાનો પ્રયત્ન થતો હોય છે. અહીંયાં એ પ્રકારે વાત નથી. અહીંયા તો એમ કહેવું છે કે એની અસર આવતાં જ તને પરિભ્રમણનું ભાવભાસન આવ્યું ? કે એમાં કેટલાં-કેટલાં દુઃખ છે ? જેનો કોઈ હિસાબ ન થઈ શકે એટલા દુઃખ છે, એવો ભાવ ભાસિત થતાં જ તેની ચિંતા થયા વગર રહેશે નહીં; ત્યારે પછી એ ચિંતા કરવી નહીં પડે, પરંતુ થઈ જશે અને બીજી રીતે કોઈ કરવા જાય, કૃત્રિમતાથી રોઈ (કૃત્રિમતાથી) રોવાનું બની જાય તો અનું કોઈ મૂલ્ય નથી. એટલા માટે કહે છે કે “આ વા યમાં અનંત અર્થ સમાયેલો છે.”

“અને એ વા યમાં કહેવી ચિંતના કર્યા વિના” અથવા ચિંતના થયા વિના...

પ્રશ્ન : અનંત અર્થ બાબત આપશીએ જે કહ્યું, તે સિવાય બીજું કોઈ પડખું એમાં છે ? બીજી કોઈ Side છે ખરી ?

પૂ. ભાઈશ્રી : નહીં, સાઈડ તો એક આ કીધી અને બીજી સાઈડમાં એનું Solution (ઉકેલ) ભાસિત થાય છે કે આટલાં બધા પરિભ્રમણના કારણરૂપ પરિણામો છે તો એની સામે તેનો ઉપાય પણ હોવો જોઈએ. જે દોષોથી પરિભ્રમણ થઈ રહ્યું છે, જ્યારે આવા આવા દોષોથી પરિભ્રમણ થઈ રહ્યું છે તો તે-તે દોષોને મટાડવા અર્થ એનો તથારૂપ ઉપાય પણ હોવો જોઈએ. એવો ભાવ ડાણમાંથી વિચાર કરતાં આવ્યા વગર રહેશે નહીં. એટલે ભાવોનું જગત કેટલું વિશાળ છે તેનો ખ્યાલ આવશે. ભાવોની જે દુનિયા છે એની પણ ઘણી વિશાળતા છે એ વાત ખ્યાલમાં આવી જશે અને એ ભાવોમાં હું ભટકી રહ્યો છું, એવી મારી ભાવ પરિભ્રમણની પરિસ્થિતિ છે કે જેને કારણો પછી બિન-બિન ક્ષેત્રે, બિન-બિન પરિસ્થિતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી તર્યચમાં, મનુષ્યમાં, દેવમાં અને નારકીમાં મારા જન્મ-મરણ થઈ રહ્યાં છે. જેને દ્રવ્ય-પરિભ્રમણ કહે છે. જીવ જે દ્રવ્ય પરિભ્રમણ કરી રહ્યો છે એનું કારણ ભાવ પરિભ્રમણ છે. ભાવ પરિભ્રમણ કાર્ય છે, દ્રવ્ય પરિભ્રમણ એનું ફળ છે. અનંત કાળથી મારું પરિભ્રમણ થઈ રહ્યું છે તેનો નાશ કેમ નથી થતો ? એને શોધવા જશે તોપણ માલૂમ પડશે કે એમાં અનંત અર્થ સમાયેલો છે.

આપણે એ વાતને પ્રવચનથી નથી સમજવી પરંતુ ચિંતનામાં આવીને એ વાત સમજવી છે, કેમ ? કારણ કે એ Feeling Stage છે. ચિંતના છે એ �Feeling Stage છે. વૈચારિક Stage નથી. Feeling Stage જે હોય, Feeling સ્ટર જે હોય, તેને યથાર્થરૂપે સમજવા માટે તેવી Feelingમાં આવીને સમજવું તે જરૂરી છે. જેમ કે એક માણસ મને મળ્યો અને (એણે મને કીધું) કે તમે કહો છો કે અમને અમારા આત્મા ઉપર પ્રેમ હોવો જોઈએ, અમને ગુણનો પ્રેમ હોવો જોઈએ. પરંતુ મારા જીવનમાં મને યાંય પ્રેમ થયો જ નથી. કોઈના ઉપર પ્રેમ મને થયો જ નથી અને હું એ પ્રેમની ભાષા સમજતો જ નથી - તો હું શું કરું ? તો એને તો પ્રેમનો ભાવ આવશે ત્યારે જ ખબર પડશે કે તે પ્રેમ શું ચીજ હોય છે ? કે જેની સાથે પ્રેમ હોય છે એના વગર કેવી તરપન થાય છે ? એ ત્યારે જ

ખબર પડે છે. આ જે બધી Feelingની વાતો છે એને Feelingથી સમજવાની હોય છે. એ પ્રકારની Feeling ન હોય તેને, એ પ્રકારની Feelingના અભાવવાળાને એ વાત સમજમાં નથી આવતી. માટે જો સમજવું હોય તો એ Feelingમાં આવી જાવ, નહીંતર આ વાત (યારેય) યથાર્થરૂપે સમજમાં આવવાની નથી.

જેમ એક મા ને જે માતૃત્વપ્રેમ હોય છે, એ માતૃત્વપ્રેમની ખબર પિતાને નથી પડતી તો બીજાને તો યાંથી ખબર પડે. જ્યારે એમ જોઈએ તો સંતાન છે એ તો બનેનું છે તેમ છતાં મા તે મા હોય છે. મા તે મા જ હોય છે. માને જેટલો પ્રેમ હોય છે તેનાથી ચોથા ભાગનો પ્રેમ પિતાને હોય છે. એનાથી વધારે નથી હોતો. જોકે આ તો General વાત છે, કોઈ વ્યદ્ધ તગત વાત નથી. સામાન્ય રીતે આપણે ત્યાં આ વાત એ પ્રકારે બોલાતી હોય છે કે મા ઈ મા જ હોય છે. હવે કોઈ સમજવા માંગે કે માનો માતૃત્વપ્રેમ કેવો હોય ? તો કહેવું પડે કે એ તો તું મા બન તો જ તને ખબર પડે. યારે ખબર પડે ? મા બનીશ ત્યારે, એ પહેલાં (માતૃત્વપ્રેમનો) ઘ્યાલ નહીં આવે.

એવી જ રીતે સ્વાનુભવનું સુખ છે. કોઈ જ્ઞાની – અનુભવી કેટલું પણ કહી બતાવે, તેમ છતાં સમજમાં નહીં આવે. આનંદનો મહિમા કરશે (પરંતુ) સમજમાં નહીં આવે. (કારણ કે) એની બરાબરી કરી શકવા માટે જગતમાં કોઈ ચીજ છે જ નહીં. તેમ છતાં કહેવું હોય તો કહી શકાય કે ઇન્દ્રનું ઇન્દ્રાસન એની આગળ કાંઈ નથી. જ્યારે ખરેખર એ પ્રકારની Comparision કરવાની કોઈ એવી ચીજ જ નથી. કારણ કે કોઈથી એની બરાબરી થઈ જ ન શકે એવી તે અનુપમ ચીજ છે. કોની ઉપમા દેવી ?

પ્રશ્ન : જગતના જીવોને જેની મહિમા છે તેનાથી બરાબરી કરી સમજવે તો ?

પૂ. ભાઈશ્રી : તોપણ સમજમાં નહીં આવે. એના માટે તો સ્વાનુભવ હોવો જરૂરી છે.

પ્રશ્ન : ભાઈશ્રી ! આ જે કદ્યું કે સંશોધનમાં જવું જોઈએ કે મારું

પરિભ્રમણ કેમ થઈ રહ્યું છે ? એનો અર્થ શું થાય છે ?

પૂ. ભાઈશ્રી : સંશોધન એટલે જિજ્ઞાસા, ભાવના. મારું પરિભ્રમણ કયા કારણથી થઈ રહ્યું છે ? અને શું કરવાથી મટે ? એનો ઉપાય શું ? એ ઉપાયને માટે દઢ થઈ જૂયા વિના “એ વા યમાં કહેલી ચિંતના કર્યા વિના” એટલે કે પરિભ્રમણની ચિંતના કર્યા વિના “તેને માટે દઢ થઈ જૂયા વિના” જુરણા તેને માર્ગપ્રેમ કહે છે. માર્ગભર્ત ત કહે છે. એ યારે આવે છે ? કે એને માટે જ્યારે જુરણા આવે છે ત્યારે. બહુ જ તરસ લાગે ત્યારે તડપવું થાય છે ને ! જૂયા વિના એટલે અપ્રાપ્તિનું દુઃખ, ઉપાયની પ્રાપ્તિ નથી એનું દુઃખ લાગ્યા વગર, જેમકે અરે ! મારી પાસે મારા પરિભ્રમણથી ધૂટવાનો કોઈ ઉપાય મને પ્રાપ્ત નથી ! મને જે જોઈએ છે તે નથી મળતું !

“તેને માટે દઢ થઈ જૂયા વિના માર્ગની દિશાનું પણ અલ્ય ભાન થતું નથી.” વર્તમાનમાં કોઈને પણ આ સ્થિતિમાં આવ્યા વગર માર્ગની સૂઝ આવતી નથી. Feeling Stage માં આવ્યા વગર કોઈને પણ માર્ગ કેવો હોય છે એનું ભાન તો થતું જ નથી, પરંતુ માર્ગ કઈ દિશામાં છે એનું પણ અલ્ય ભાન થતું નથી. માત્ર ધારણાવાળો કહી દેશે કે અંતર્ભૂખ દિશામાં માર્ગ છે, અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રકૃપ છે. પરંતુ અહીંયા તો એના ‘ભાન’ની વાત ચાલી છે, માત્ર જાણકારી પૂરતી વાત નથી ચાલી. તારી જાણકારી છે એ કંઈ ભાન નથી. જુઓ શબ્દપ્રયોગ શું કર્યા છે ? ‘ભાન’ લીધું છે. જાણકારી એવો શબ્દ નથી. એવું ભાન થવું કે ‘હું પરિભ્રમણ કરી રહ્યો છું’ અને તો જ એની ચિંતા થશે અને તેની જુરણા આવશે, અને ત્યારે માર્ગની દિશાનું ભાન આવશે. નહીંતર માત્ર જાણકારી તો વ્યર્થ જશે. માત્ર જાણકારી નકામી જ છે. એનાથી કંઈ થવાનું નથી. મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે મુમુક્ષુની ભૂમિકા જોઈએ અને તે મુમુક્ષુની ભૂમિકાનું આ પ્રથમ ચરણ છે. મુમુક્ષુ થયા વગર, આત્માર્થી થયા વગર કોઈ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતું નથી અને જે મુમુક્ષુ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા અર્થે મુમુક્ષુતામાં આવે છે તેને પહેલું Stage, પ્રથમ ચરણ આ જ આવે છે.

એ રીતે લખે છે કે “માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી પૂર્વ થયું નથી અને ભવિષ્યકાળે થશે પણ નહીં. અમે તો એમ જાણ્યું છે.” અમારા અનુભવથી તો અમે એમ જાણ્યું છે. “માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે” કોઈને બાકી નથી રાખ્યા. જેમ કે તમે વિદ્વાન છો માટે તમને વેદના નહીં આવે તો ચાલશો, તમે માત્ર શાસ્ત્ર વાંચન કરશો (તો ચાલશો). “ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે.” શું જાણવું જોઈએ, શું કરવું જોઈએ એ પછી જાણવામાં આવે છે, એ પહેલાં જે કાંઈ પણ જાણવામાં આવે છે બધું નકામું જશો, એમ કહેવાનો (અભિપ્રાય) છે. (સમય સમાપ્ત થયો).

d

પરિભ્રમણની વેદના - એ પરિભ્રમણના કારણભૂત ભાવો અંગેનો પશ્ચાત્તાપ છે, જેનાથી અંત:કરણની શુદ્ધિની પ્રક્રિયા થાય છે, વિપરીત અભિપ્રાયોમાં ફેર પડે છે, પ્રતિબંધ ઢીલા પડે છે, અને યથાર્થ ઉદાસીનતા પૂર્વક દર્શનમાટે મંદ થવાની શરૂઆત થાય છે.

- પૂજ્ય ભાઈશ્રી

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૨૮

વવાણિયા, પ્રથમ ભાડ્રપદ, સુદ ૬, ૧૯૪૬

ધર્મચુક ભાઈઓ,

પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત સંબંધીમાં કોઈ

પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા

મન, વચન, કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય

તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું.

અંતર્જાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો

નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ

જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિ લ્યનું રટણ ન

કર્યું હોય, અને એ વડે 'સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર

એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.

વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ

સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા

જીવો પરત્વે કોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ

કરતાં કે અન્યથા કરતાં તે માટું છે એમ યથાયોગ્ય કાં

ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું

એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.

વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ

હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રી આદિક)

તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ

પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું છે.

વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉ; જેને કોઈ
કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ધેર પુત્રપણે, સ્ત્રીપણે,
દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાતુ
એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની
તો છચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા
પરત્વે જીગુપ્તા નહીં આવતી હોય ? અર્થાતુ આવે છે.

વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભાંતિપણે ભમણ
કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવનું એ ચિંતના થઈ પડી
છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દફતા
આત્મામાં પ્રકાશો છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ
કરવું ? જે દફતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ
રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે,
અર્થાતુ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું
જાય છે, અને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જ્ય ન
થાય ત્યાં સુધી, એમ દફતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ
રીતે તેમાનું કંઈ કરીએ તો તેવું સ્થાન યાં છે કે જ્યાં જઈને
રહીએ ? અર્થાતુ તેવા સંતો યાં છે, કે જ્યાં જઈને એ દશામાં
બેસી તેનું પોખણા પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?

“ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા
પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે
તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી
પડે, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ
એક સમય માત્ર હો, અને દુર્નિમિત હો, પણ એમ કરવું જ.

ત્યાં સુધી હે જીવ ! ધૂટકો નથી.”

આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય
લાગે છે.

ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક
કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો
અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય
તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે
ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ)
સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભી તમાં અતિ
શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો
પછી માગવાની ઇચ્છા પણ નથી.

જમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.

સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના

અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાંગે જવાતું

નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.

“એ કંઈ ખોટું છે ?” શું ?

પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ
તો ?

લઈ શકાય.

એ પણ આશ્ર્યકારક છે.

અત્યારે એ જ. ફરી યોગવાઈએ મળીશું.

એ જ વિજ્ઞાપન.

વિ. રાયચંદ્રના યથાયોગ્ય.

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૨૮

પ્રવચન-૨

તા.૨૫-૧૨-૯૭ (સવારે)

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૧૨૮.

અંતરાત્મામાંથી પરિભ્રમણ સંબંધીનો નિષેધ, તે આ પત્રનો વિષય છે. અંતરાત્મામાંથી એટલે ઉપર ઉપરથી નહિ. પરિભ્રમણનો નિષેધ આવે એ નાસ્તિક છે, અસ્તિત્વમાં (પરિભ્રમણનો નાશ થાય તો) મોક્ષની પ્રાપ્તિ થાય. તો પરિભ્રમણનો નિષેધ આવે ત્યારે કાંઈ મોક્ષ ન થઈ જાય પણ મોક્ષ સંબંધીનો નિર્ધાર અવશ્ય થાય. આત્માને મોક્ષ પામવા માટે, આ બે પાયાના પથ્થર છે, —કોઈ પણ આત્મા સંસારથી મુક્ત થયા છે, મોક્ષ પામ્યા છે, પામે છે અને પામશે એ બધા જીવોના પાયાના કામમાં આ બે પ્રકારના પરિણામ અવશ્ય અવશ્ય હોય છે. એક પરિભ્રમણનો અંતરાત્મામાંથી વેદનાપૂર્વકનો નિષેધ અને (બીજો) સંપૂર્ણ શુદ્ધિ અને મોક્ષ પામવા સંબંધીનો નિર્ધાર.

મોક્ષની અત્યારે ખબર નથી પણ જન્મ-મરણ નાશ થવાનો નિર્ધાર.

જન્મ-મરણની તો ખબર છે ને ? એ જન્મ-મરણ ન જોઈએ, (અને) મુક્ત આત્માને જન્મ-મરણ હોતાં નથી, એવો મોક્ષનો નિર્ધાર, નિશ્ચય આ બે પ્રકારનાં પરિણામ કેવાં હોય છે; એનો ચિત્તાર – (એ) આ પત્રનો વિષય છે. એ બસે પ્રકારના પરિણામ કેવા હોય છે ? અને ત્યારે જ એ આત્મા મું તના માર્ગ સમીપ જવાની તૈયારીમાં આવે છે, પછી મું તનો માર્ગ એને પ્રાપ્ત થાય છે. અને સરવાળે એની મું ત થાય છે.

પહેલી ભૂમિકા મુમુક્ષુની છે; જે મું તના માર્ગની સમીપ જવાની ભૂમિકા છે. પછી મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે એ સાધકની ભૂમિકા છે, ધર્માત્માની ભૂમિકા છે. એના મુખ્ય બે વિભાગ છે. એક ગૃહસ્થ અને એક ત્યાગી મુનિ. ત્યારપછી એનું ફળ આવે છે. તે મુક્તદશા છે, કે જે અરિહંત દશા અને સિદ્ધ દશા છે. આપણા માટે આ પ્રયોજનભૂત વિષય છે. અત્યારે આ પ્રકારના પરિણામ જો આપણા અંતરાત્મામાંથી ઉત્પત્ત થાય તો આપણે મોક્ષમાર્ગની સમીપ જવાની તૈયારીમાં આવીએ. અને એ તૈયારીના જેટલા કોઈ પ્રકારના પરિણામ છે એમાં મુમુક્ષુની ભૂમિકામાં જગ્ઘન્ય ભૂમિકા, મધ્યમ ભૂમિકા, અને ઉત્કૃષ્ટ ભૂમિકા(ને) પ્રાપ્ત થઈ અને ત્યારપછી મોક્ષમાર્ગના પ્રારંભમાં ચતુર્થ ગુણસ્થાને આવે છે. એ મોક્ષમાર્ગની શરૂઆત છે. પછી ઉપરના ગુણસ્થાનો આપણા આગમોની અંદર પ્રસિદ્ધ છે. – ચોથું, પાંચમું, છહું, સાતમું....બાર ગુણસ્થાન સુધી સાધક દશા છે, તેરમે ગુણસ્થાને અરિહંત દશા છે, ચૌદમું ગુણસ્થાન પણ અયોગી કેવળીનું છે. એટલે (કે) મોક્ષદશા, દેહ વિનાની દશા છે. આ અરિહંત દશા દેહસહિતની, સયોગીકેવળીની છે; યોગી, – યોગ અર્થાત્ મન, વચન, કાયાનો યોગ. અને સિદ્ધદશા છે એ સિદ્ધાલયમાં અશરીરીદશા છે, દેહ વિનાની મું ત દશા છે. એ દશા પામતાં સંસારના સર્વ કલેશ અને સર્વ દુઃખનો નાશ થાય છે. અને અનંતકાળ પર્યતના અનંત સુખની પ્રાપ્તિ થાય છે. પરમાનંદમાં એ આત્મા બિરાજમાન થાય છે. જગતપૂજ્યપદ હોવા છતાં પણ અને જગત આખું સચરાચર અમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થતું હોવા છતાં પણ અને વીતરાગભાવે પોતાના પરમાનંદમાં બિરાજમાન રહે છે. તો

પત્રનો એ મુખ્ય વિષય છે. ત્યાર પછી એમણે કેટલાંક સિદ્ધાંત-સૂત્રો લખ્યાં છે, એ પણ બહુ કીમતી સૂત્રો લખ્યાં છે. અને એ રીતે પત્રને સમાપ્ત કર્યો છે.

જેને પત્ર લખવામાં આવ્યો છે એ ખંભાતના ધર્મચ્છક-ધર્મની છચ્છા જેમને હતી એવા ધર્મચ્છક ભાઈઓ છે. ધર્મની છચ્છા કરનારા ધર્મચ્છક 'ક' એટલે કરનારા. કેટલાક ભાઈઓ ખંભાતની અંદર સામૂહિક રીતે ફુપાળુદેવના પરિચયમાં આવેલા વળી પોતે પણ અવારનવાર સત્સંગ અર્થે ખંભાત પધારતા હતા. છેવટે ખંભાતમાં એમણે એક પાઠશાળા શરૂ કરેલી અને ત્યાં હજુ આજે પણ એ પાઠશાળા ચાલુ છે અને અનેક ગ્રંથો ત્યાં વિદ્યમાન છે. એની ફુપાળુદેવના હથે સ્થાપના કરેલી છે, જે ધર્મના છચ્છાવાળા મુમુક્ષુઓ પરિચયમાં આવેલા, એ પણ આપણા જેવા ગૃહસ્થો હતા, લગભગ આપણી યોગ્યતા જેવા હતા, યોગ્ય ભાવનાવાળા હતા. કોઈ આપણાથી વિશેષ યોગ્યતાવાન પણ હોઈ શકે અંબાલાલભાઈ જેવાં, અંબાલાલભાઈ અને ત્રિભોવનભાઈ કરીને બે મુમુક્ષુઓની દશા કાંઈક, મુમુક્ષુતામાં પણ વિશિષ્ટ દશા, સારી દશા હતી, એમ પત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. આપણી ભૂમિકાના મુમુક્ષુઓને સંબોધન કરીને લખાયેલો પત્ર હોવાથી, આપણા માટે સીધો લાગુ પડે એવો વિષય છે. એટલે કે એકદમ પ્રયોજનભૂત, સીધો પ્રયોજનભૂત વિષય છે. એટલું આ પત્રનો સ્વાધ્યાય કરતાં આપણા લક્ષમાં હોવું જોઈએ કે આ મારે કામની ચીજ છે.

એ સ્પષ્ટતા એટલા માટે જરૂરી છે કે સ્વાધ્યાયમાં તો અનેક વાતો આવે, મુમુક્ષુની ભૂમિકાની આવે, જ્ઞાનીઓની ભૂમિકાની આવે, મુનિઓની વાત આવે, મુનિ દશાની વાત આવે, કેવળજ્ઞાનીઓની, તીર્થકરોની વાત આવે, પણ ઉપરની દશાઓની (વાત) આપણી ભાવનાની હોવી જોઈએ. ઉપરની દશાનો વિષય ચાલે તે આપણી ભાવનાનો વિષય થવો જોઈએ કે આપણને પણ તેવી દશા પ્રગટ થાય તો કેવું સારું ! અને આપણને લાગુ પડે એવો જે વિષય હોય એના ઉપર તો આપણું એકદમ લક્ષ કેન્દ્રીત થઈ જવું જોઈએ: કેન્દ્રીત થઈ જવું જોઈએ એટલું જ નહીં, એ ઉપરાંત

એ ભૂમિકામાં આપણો પ્રવેશ થાય એ પ્રકારનાં પરિણામો ચાલુ થઈ જવાં જોઈએ. તો સ્વાધ્યાય યથાર્થ રીતે કર્યો ગણાય.

હમણાં આગ્રામાં થોડો વિષય ચાલ્યો હતો. બે દિવસ આગ્રા જવાનું બન્યું હતું. તો વિષય એ ચાલ્યો કે આપણે ખાલી સ્વાધ્યાય કરીને જે વચ્ચનો હોય એનો અર્થ સમજી લઈએ, અને એનું રટણ કરીએ, વારંવાર એને વાંચીએ, સાંભળીએ તો તે એક Routine રૂઢિ થઈ જશે જ્યારે આપણો આ વિષયને Routine (રૂઢિ) નહીં બનાવવો જોઈએ. આપણને લાગુ પડે એ ભૂમિકાનો વિષય, આપણે સ્વાધ્યાયમાં લઈને એનું પરિણામન આપણને ચાલુ થાય એવો કોઈ આપણો પ્રકાર સ્વાધ્યાય દરમિયાન અથવા સ્વાધ્યાય પછીના તરતના સમયમાં હોવો જોઈએ કે થવો જોઈએ તો એ સ્વાધ્યાય ખરેખર સ્વાધ્યાય કર્યો ગણાય, નહિંતર એ Routine (રૂઢિ) થઈ જશે.

પર્યુષણ પૂરાં થયાં છે એટલે શરૂઆતની બે લીટીમાં ખંભાતના ભાઈઓને એમણે ક્ષમાપના લખી છે કે, “પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અશાતાના, અસમાધિ મારા મન, વચ્ચન, કાયાના, કોઈ પણ યોગાધ્યાવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું.” પોતે જ્ઞાનીપુરુષ છે. જેને પત્ર લખ્યો છે એ મુમુક્ષુ છે. તેમ છતાં ક્ષમાયાચના એમણે લખી છે. જોકે જૈનદર્શનમાં આ ક્ષમાપનાના વ્યવહારની પદ્ધતિ પ્રથમથી જ છે, જ્યારથી સંપ્રદાય છે ત્યારથી (છે) અને એ અનાદિથી છે.

બધા સંપ્રદાય અનાદિથી છે. કોઈ સંપ્રદાય નવા નથી કે જૂના નથી કેમકે જગતમાં અજ્ઞાની જીવો પણ અનાદિથી છે અને જ્ઞાની જીવો પણ અનાદિથી છે અને બજેના સંપ્રદાય ચાલે છે એટલે પૌરાણિકતા ઉપરથી કયો સંપ્રદાય સાચો એનો નિર્ણય કરવાની કોઈ જરૂર નથી. નહીંતર લૌકિકમાં અત્યારે (લોકો) એમ માને છે કે મહાવીરસ્વામી (ને) ૨૫૦૦ વર્ષ થયાં એટલે જેન સંપ્રદાય તો ૨૫૦૦ વર્ષ જૂનો છે. બાકી બીજા ઘણાય સંપ્રદાય જૂના છે એ બધાય સાચા હોવા જોઈએ, એના કરતા જૂના (છે એટલા માટે, પરંતુ) એવું નથી. ચોવીસમા અંતિમ તીર્થકર તો ૨૫૦૦ વર્ષ પહેલાં

થયા એ પહેલાં એક કરોડ સાગર વર્ષ (ગુજરાત) એક કરોડ સાગર વર્ષ, ત્યારે આદિનાથ ભગવાન પહેલાં વેલા થયા. સાગરનું માપ બહુ મોટું છે, એ આ વર્તમાન ચોવીસીની વાત છે. એવી તો અનંતી ચોવીસી થઈ ગઈ. આ ભરતક્ષેત્રમાં એવી તો અનંતી ચોવીસી થઈ ગઈ. વિશ્વમાં અનંતકાળથી જૈન-ધર્મ ચાલે છે અને જૈન ધર્મ સિવાયના બીજા ધર્મો પણ અનંતકાળથી ચાલે છે, એ વિશ્વની કુદરતી વ્યવસ્થા છે.

અહીંયા તો આપણે એટલું લેવું છે કે જ્ઞાની કે મુમુક્ષુ જગતના સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના હશ્યે છે. “ખામેભિ સવ્વ જીવા” એટલે મુમુક્ષુ એમાં આવી જાય અને જ્ઞાનીઓ એમાં આવી જાય અને જગતના પરિભ્રમણ કરતાં નિગોદના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યતના બધા જીવો આવી જાય. એમ કેમ ? આ એક બહુ કુદરતી ઉત્પત્ત થતો ભાવ છે. જે આત્માને સંપૂર્ણ નિર્દોષ થવું છે એ કોઈના પ્રત્યે કાઈ પણ અનુચ્છિત/દોષિત વ્યવહાર કરવા હશ્યતો નથી. કારણ કે પોતાને સંપૂર્ણ નિર્દોષ થવું છે ને !

જૈનદર્શન એ સંપૂર્ણ નિર્દોષ થવાની કાર્યપદ્ધતિ છે. શું ? જૈનદર્શન શું છે ? સંપૂર્ણ નિર્દોષ થવાની કાર્યપદ્ધતિ છે. આપણા જ્ઞાનીઓએ એ દોષોને કેવી રીતે વ્યવસ્થિત રીતે હટાવવા, કાઢી નાખવા અને કેવી રીતે સંપૂર્ણ નિર્દોષ થવું ? એની વ્યવસ્થિત યોજના, મુમુક્ષુની ભૂમિકાની અને સાધકની ભૂમિકાની પ્રસિદ્ધ કરેલી છે. કૃપાળુદેવે તો મુમુક્ષુની ભૂમિકા ઉપર ઘણો પ્રકાશ પાડ્યો (છે.) બાકી, જે પુરાણ અને આગમો છે એપણે મોક્ષમાર્ગ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે, મુમુક્ષુની ભૂમિકા ઉપર જેટલો પ્રકાશ કૃપાળુદેવે પાડ્યો છે, એટલો અન્યત્ર જોવામાં નથી આવતો.

(એટલે અહીંયાં) એવો ભાવ આવ્યા વિના રહેતો નથી કે મારા આત્માના પરિણામના નિભિત્તે એટલે યોગાધ્યવસાયથી એને યોગાધ્યવસાય કહે છે મન, વચન, કાયાનો યોગ છે. જીવના પરિણામ એ અધ્યવસાય છે. બસેની નિભિત્ત-નૈભિત્તિક સંબંધી પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિના નિભિત્તે બીજા જીવોને દુઃખ થવાનું કારણ ઉત્પત્ત થાય છે. કોઈ જીવોની હિંસા થાય છે, તો કોઈ જીવોને પીડા થાય છે, કોઈ જીવોને Tension

થાય છે, તો કોઈ જીવોને કાંઈ ને કાંઈ પ્રકારનું દુઃખ થાય છે. નહિ ઈચ્છવા છતાં પણ થાય અને કેટલુંક ઈચ્છાપૂર્વક પણ થાય છે. બજે પ્રકારના ભાવો અને પરિસ્થિતિ ઉત્પત્ત થાય છે. ક્ષમાપના માંગનાર અંતઃકરણથી – શુદ્ધ અંતઃકરણથી એવી કોઈ પરિસ્થિતિને અંતરથી ઈચ્છતો નથી, એવી એક લાગણી અંદરથી ઉત્પત્ત થાય છે, એમાંથી આ વ્યવહારનો જન્મ થયો હુશે એમ આપણો માનીએ. બાકી એક વાર તો એવી લાગણી ઉત્પત્ત થયા વિના રહેતી નથી, પછી મુમુક્ષુની ભૂમિકાની ગાડી આગળ ચાલે છે, કે મારાં મન, વચન, કાયના, યોગના નિભિતે અને મારા કોઈ પરિણામના નિભિતે કાંઈ કરવું, કરાવવું કે અનુમોદવું નવ કોટિએ, કૃત-કારીત અનુમોદના અને મન, વચન ને કાયાથી ત્રણોયને (એકબીજા સાથે) ત્રણથી ગુણો – નવમાં કોઈ પણ પ્રકારે કોઈ જીવને મારાથી દુઃખ થવું ન જોઈએ – એમ હું ચાહું છું, ઈચ્છાં છું અને કદાચ થઈ ગયું હોય, જાણ્યે કે અજાણ્યે તો એની હું ક્ષમા માગું છું. ક્ષમા માંગવાથી જીવ હળવો થઈ જાય છે. કેવો થઈ જાય છે ? સાવ હળવોકુલ થઈ જાય છે. એકદમ હળવો થઈ જાય છે.

એને જરા વધારે સ્પષ્ટ કરીએ તો – બુદ્ધિપૂર્વક, સમજણ પૂર્વક ઉદ્યની અંદર રાગ-દ્વેષ-મોહના પરિણામ બધા સંસારી જીવોને થાય. થાય તારે કોઈને ને કોઈને દુઃખ થાય છે One cannot please all. કોઈ (એક) બધાને ખુશ રાખી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. ત્યારે જે જીવોને દુઃખ થયું હોય, એમાં કોઈ વાર પોતાની ભૂલ એવી થાય છે કે હું બરાબર હતો, એને દુઃખ થયું એમાં હું શું કરું ? હું મારી જગ્યાએ બરાબર હતો. એને દુઃખ થયું પણ ભૂલ તો એની જ છે, મારી ભૂલ નથી. જીવનમાં એવાં-એવાં-પ્રકારો બને છે, અનેક પ્રકારો બને છે. એને લઈને જીવમાં અમુક ગ્રંથિ બંધાય છે, જેને શાસ્ત્રભાષામાં શલ્ય કહેવામાં આવે છે, શલ્ય રહી જાય છે. એ શલ્ય ન રહે એના માટે આ ઉત્તમ કોટિનો ક્ષમાપનાનો વ્યવહાર છે, કોઈના પ્રત્યે કાંઈ શલ્ય રાખવાની જરૂર નથી. જગતમાં અયોગ્યતાવાન જીવો અને યોગ્યતાવાન જીવો, બધી કક્ષાના જીવો હોય,

બધા પ્રકારના પરિણામવાળા જીવો હોય, આપણે કોઈની સાથે કંઈ પણ પ્રકારની ગ્રંથિ સંબંધ કે શલ્ય રાખવાની આવશ્યકતા નથી આપણે મુજબ તના માર્ગે જવું છે ને એ રસ્તે આપણે આગળ ચાલ્યા જવું છે એમાં મનમાં કે અભિપ્રાયમાં કોઈના પ્રત્યે કંઈ પણ રાખવું નહીં, કે આ તો આવા જ છે, આ તો આવો જ છે, આ તો આવી જ છે, કંઈ નહીં, જે જેવા હોય તેવા આપણે એની સાથે કંઈ નિસ્ખલત નથી. જગતમાં તો બધી જાતના જીવો હોઈ શકે, આપણે આપણાં તરફથી ક્ષમા માંગી લઈએ, એટલે આપણી વાત પૂરી થઈ ગઈ.

એટલે કોઈ પણ પ્રકારનો અવિનય થયો હોય (તો ક્ષમાપના માંગી લેવી) કેમકે આ પત્ર લખે છે ત્યારે ફૂલાળુદેવની ઉંમર તો રત વર્ષની છે, એમના પરિચયમાં મોટી ઉંમરના માણસો આવતાં એમનાથી ઘણી મોટી ઉંમરના માણસો આવતા હતા. સૌભાગ્યભાઈ પરિચયમાં આવ્યા એ એમનાથી લગભગ ૪૪ વર્ષ મોટા હતા. એમની ૬૭ વર્ષની ઉંમર હતી ૪૪ વર્ષ મોટા હતાં. મોટા પ્રત્યે, કે વડીલ પ્રત્યે - (એક) વ્યવહાર હોય છે, એ વ્યવહાર ન જળવાય તો એને એમ લાગે કે મારો વિનય નથી રાખતા. ઉંમરમાં આ છોકરડા જેવા છે અને આપણે આટલા મોટા, એમ લાગે. તેથી કોઈ અવિનય થયો હોય, અશાતના થઈ હોય, કંઈ અશાતના-વિરોધ કર્યો હોય, કંઈ અસમાધિ એટલે અશાંતિનું કારણ બન્યું હોય દુઃખનું કારણ, અશાંતિનું કારણ બન્યું હોય, તો વારંવાર તેને માટે ક્ષમા યાચ્યું છું. એમ કરીને ક્ષમાપનાની બે લીટી લખી છે.

હવે પત્રનો વિષય શરૂ થાય છે. “‘અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય.’”

“‘અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં...’” એટલે અંતરાત્માંથી સ્મરણ આવ્યું છે. ભૂતકાળનો વિષય છે એટલે સ્મરણમાં લીધું છે. પરિભ્રમણની ચિંતામાં પોતાનો ભૂતકાળ છે એનું સ્મરણ આવે છે અને એ અંદરથી આવે છે,

ઉપર ઉપરથી નથી આવતું. સાંભળીને, વાંચીને વિચાર કરે છે એમ નહીં પરંતુ અંદરથી એ આત્માને સ્કુરણા આવે છે. આ જીવ એટલે મારા આત્માએ ‘આ જીવ’ શબ્દ વાપર્યો છે ને ! આ જીવ એટલે કોઈ Third Person / Second Person નથી લેવાનું, First Person. (ની વાત છે) મારા આત્માએ ભૂતકાળની અંદર જન્મ-મરણ ન કર્યા હોય અને મું ત થયો હોય એવો (કોઈ) કાળ જણાતો નથી. જન્મ-મરણ કરતો જ આવ્યો છે, જન્મ-મરણ કરતો જ આવ્યો છે. પરિભ્રમણ કર્યું છે એટલે ચૌદ બ્રહ્માંડમાં બધા ક્ષેત્રે જન્મ પામ્યો છે અને એકેન્દ્રિય થી પંચેન્દ્રિય પર્યતના ચારે ગતિના ભવો કર્યા છે.

આપણાને દેખાય કે ન દેખાય પણ આ એક Visualise કરવા જેવો વિષય છે – કે આ વિશ્વની અંદર એક બહુ મોટુ cyclone (વાવાજોડું) ચાલે છે. Cyclone (અર્થાત) વાવાજોડું જેને કહેવામાં આવે (છે) આપણો ત્યાં આ જે વાવાજોડું થાય છે એમાં Light પહેલા જાય છે. અંધારું થઈ જાય છે, વરસાદ અને પવન (જોરથી શરૂ થાય), જાડો પડવા લાગે, મકાનો પડવા લાગે, અને બધો વ્યવહાર ખોરવાઈ જાય. બધે પાણી ભરાઈ જાય, કચાંય પણ Electricity ન હોય એટલે અનેક જાતના આપણા Problem (સમસ્યા) ભા થાય. થોડાક કલાક (વાવાજોડું) ચાલે તો બધા થાકી જઈએ. પણ જો થોડાક દિવસ ચાલે ને તો તો ત્રાહિમામ પોકારી જઈએ.

અમારે ત્યાં ભાવનગરમાં દસેક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના કિનારે (વાવાજોડું) થયું હતું વાવાજોડું એક દિવસ ૨૪ કલાક પણ પૂરું નહોતું ચાલ્યું, બપોર પછી ત્રણ/ચાર વાગ્યે શરૂ થયું હતું. આખી રાત પવન, વરસાદ ને વાજડી. બધું ચાલ્યું. બીજે દિવસે બપોર સુધીમાં લગભગ ઠંડું થયું પણ માણસો ત્રાસ-ત્રાસ પોકારી ગયા; કારણ બધું અસ્તિત્વસ્ત, થઈ જાય; ઘરની બહાર નીકળી શકાય નહીં. દુકાનો તો ફટાફટ બંધ થવા મંડી, બપોરે જેવું શરૂ થયું એ ભેગું Announcement (ઘોષણા) આવવા મંડ્યું કે આ બહુ મોટું તોફાન છે અને બધા સહીસલામત ઘરે પહોંચી જાવ, અને ઘરમાં ભરાઈ જાવ. ઘરમાં ભરાયા પછી કંપાઉન્ડમાં (compound)

આજુબાજુના કયા જાડો પડશે અને કયું મકાન દબાશે એ ફફડાટ (થયા કરે) ફફડાટ, ફફડાટ-ચાલુ ને ચાલુ.

આ અનંતકાળનું વાવઝોડું ચાલે છે જુઓ !! એક સેકન્ડમાં અસંખ્ય જીવો, અનંત જીવો પ્રાણત્યાગ કરીને મરે છે, એક સેકન્ડમાં બીજા એ ને એ જન્મે છે. ક્યાંય ના ક્યાંય ફંગોળાય છે. આપણો તો હજુ ઘરમાં ભરાઈને બેસી રહીએ, બારી-બારણા બંધ કરીને બીતાં બીતાં પણ થોડીધારી સહીસલામતી અનુભવીએ કે ચાલો ઘરમાં તો છીએ, રસ્તા ઉપર તો નથી, ટ્રેનમાં તો નથી, ખેનમાં તો નથી. કે કોઈ બહાર વાહનમાં તો નથી. આમાં તો કોઈ સંરક્ષણ મળે એવું છે જ નહીં. અહીંયાં આંખ મીચાણી કે ક્યાં ફેંકાઈ ને ગયો એનો પત્તો નથી. કોઈનું Address (સરનામું) હાથમાં આવતું નથી. સરનામું મળે છે કોઈનું ? કોઈનું ન મળે ફેંકાફેંક, ફેંકાફેંક ચાલે છે; બહુ મોટું Cyclone (વાવાઝોડું) ચાલે છે. અને જીવો ફેંકાતા જાય છે. જન્મે છે ત્યારે એટલો દુઃખી થાય છે ! મરે છે ત્યારે પણ એટલો જ દુઃખી થાય છે અને વચ્ચાગાળામાં પણ એને ક્યાંય શાંતિ અને સુખ નથી. અજ્ઞો, અજ્ઞો-Tension, Tension. પીડા-બાધા, કાંઈક પ્રકારનાં દુઃખો આવી પડે છે. અહીંયાં એ બધાં દુઃખોનું સ્મરણ થાય છે, આ મારી હાલત પરિભ્રમણમાં થઈ છે અને આમાંથી હજુ હું મુક્ત નથી થયો.

અનંતકાળમા એવો કોઈ કાળ નથી કે આ Cycloneની (વાવાઝોડાની) અંદર હું વચ્ચે સપડાયો નથી, અત્યારે ભલે પાંચ / પચીશ / પચાસ વર્ષ આ ખબર નથી, એટલે ખોટું સમાધાન કરી લે શાંતિ રાખે, કે નાના આપણને વાંધો નથી. પણ મૃત્યુનો ભય તો બધા સંસારી જીવોના કાળજાને કોરી જ ખાય છે. સમયે સમયે કાળજામાં બેઠેલો ભયનો ઉંદર કાળજુ કોરે છે. કયારે શું થશે કંઈ કહેવાય નહીં કેમકે એવા પ્રસંગો જોવામાં આવે છે. કે કાંઈ નો'તુંને મૃત્યુ થઈ ગયું. એટલે એમાંથી બચવા માટે વિચારવાન જીવો વિચાર કરે છે અને જ્યારે વિચાર કરે છે ત્યારે એનો Very First Thought-પહેલો વિચાર આ છે કે અરેરે ! મારા આત્માએ

અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે, એ પરિભ્રમણનું કારણ શું ? સંકલ્પ-વિકલ્પ. પહેલા સંકલ્પ-વિકલ્પથી ભાવ ભ્રમણ થાય છે એના ફળમાં પછી જન્મ-મરણ થઈને દ્રવ્ય પરિભ્રમણ થાય છે. પહેલા ભાવ પરિભ્રમણ કરે છે. અહીંયાં ગયો, અહીંયાં ગયો, અહીંયાં ગયો, એક સેકન્ડમાં અમેરિકામાં જાય, વાર લાગે છે ? એવું અહીંથી જતા પણ વાર નહીં લાગે અહીંથી પ્રાણ ધૂટતાં જ, ત્યાં પહોંચવામાં વાર નથી લાગતી, એક સેકન્ડેય નથી લાગતી / વિચારને તો હજ સેકન્ડ લાગે છે, જીવને પહોંચવામાં (એક) સેકન્ડ પણ લાગતી નથી. ત્યાં તો એક, બે સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. અહીં તો હજ નક્કી કરે, ન કરે એ પહેલાં તો ત્યાં પહોંચી ગયો. અહીં તો ડો. ટૃ કહે ત્યારે પાંકું થાય ને કે હવે જીવ નથી. ત્યારે તો કેટલી મિનિટો વહી ગઈ હોય, સેકન્ડો નહીં. આપણું વિજ્ઞાન એમ બોલે છે કે કોઈ પણ પ્રાણી દેહત્યાગ કરે છે ત્યારે બીજા જ સમયે ઉત્પન્ન થઈ જાય છે, એક સમય વચ્ચે વિગ્રહગતિનો છે. કોઈને બે સમય છે, કોઈને ત્રણ સમય છે, પણ એ તો એક સેકન્ડના અસંખ્યાતમા ભાગ છે બધા, કેટલા ? કરોડમા ભાગ નહીં, અબજમા ભાગ નહીં, અસંખ્યમાં ભાગ છે ! એટલો ટૂંકો કાળ છે.

હવે આ જે કુતૂહલવૃત્તિ છે ને ! – આ જોવું ને તે જોવું; આ જોવું ને તે જોવું. (એમાં) પહેલાં ભાવપરિભ્રમણ કરે છે. નાયગ્રાનો ધોધ જોવા જાવું કે ન જાવું ? હે ! જાવું હોય તો કેનેડાનો પાસપોર્ટ કઢાવવો પડે, એની fees આપી દેવી પડે. પણ ભાવે ભ્રમણ કરશો તો દ્રવ્યે ભ્રમણ થાશે (તે) સમજ લેવાનું. ત્યાં જાવું હોય તો (જોવા) જાવું. અત્યારે ભાવથી ને પછી દ્રવ્યથી આયુષ્ય એવી રીતે બંધાઈ જાય છે, પોતાને ખબર પડતી નથી કે મારું નવું આયુષ્ય કર્યારે બંધાઈ ગયું ? અને એનો ઉદ્ય કર્યારે શરૂ થશે એની પોતાને ખબર નથી હોતી અને જીવને સામાન્ય લાગે છે, એમાં શું ? અમેરિકા જઈએ ત્યારે, નાયગ્રા Falls સુધી તો જાવું જ જોઈએ ને ! દુનિયાની અજાયબી છે, નાયગ્રા Falls સુધી તો જાવું જ જોઈએ ને. એ લોકો પણ સગવડ કરી દે છે, ૫૦ ડોલરમાં તો આપણને લઈ

જાય છે vusa (વુડા) ટિકિટમાં લઈ જાય છે ને ! જાય બધા. હા.. એ વખતે જ જો આયુષ્ય બંધાઈ ગયું (તો) તું ત્યાં પાણીનો જીવ થઈશ. એ પાણીમાં અનેક જાતિનાં જીવો છે. એમાં એકાદો થાય, એ વખતે આયુષ્ય બંધાણું હશે તો. ત્યારે એમાં કુતૂહલવૃત્તિમાં મજા આવે, ભલે ટાકે ઠરતાં ઠરતાં પણ. કુતૂહલવૃત્તિમાં મજા આવે પણ નુકસાન કેટલું છે ? આપણને એના સાયન્સની ખબર નથી. આપણને એના વિજ્ઞાનની ખબર નથી. કે, આમાં જીવ અને પરમાણુના વિજ્ઞાનથી બધા કેવા - કેવા (Refarcation) રીફરકેશન ભા થાય છે ? એના ફળ શું આવે છે ? એ કંઈ આપણને ખબર નથી એટલે (આપણે) આપણી રીતે બધી કલ્યના કરી અને સુખદુઃખની કલ્યના કરી, ને જીવોએ છીએ અને સરવાળે આપણું પરિભ્રમણ ચાલુ રહે છે.

એ દુઃખથી મુકત થવાની અંતર ઈચ્છા જેને થઈ છે તેને અંતર્જ્ઞાનથી સ્મરણ આવે છે – અંદરના વિકલ્યથી સ્મરણ આવે છે – એવું કૃપાળુદેવે નથી લખ્યું; પરંતુ અંતર્જ્ઞાનથી સ્મરણ આવે છે, એના શુત્રજ્ઞાનમાં એ ભાવ આવે છે, અરે ! મારાં જીવે (આવાં દુઃખો ભોગવ્યા છે !) (એ) Visualise કરે છે, પરિભ્રમણને Visualise કરે છે, પરિભ્રમણના દુઃખોને જોવે છે અને આખું Cyclone (વાવાઝોડુ) જોવા મળે છે અને અહાહા ? અહાહા !! આ જગતમાં મોટો વંટોળ ચાલે છે જીવોની ફેંકાફેંકી થઈ રહી છે. આપણી પણ આમ જ થઈ રહી છે. આ ન જોઈએ; હવે આ ન જોઈએ. હવે આ ન જોઈએ, કોઈ પણ ભોગે ન જોઈએ, એ વાત કરશો. “અને એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય” (એ) આત્મશાંતિને ભૂલ્યો છે. કોઈ ને કોઈ બહાને આત્મશાંતિને ભૂલ્યો છે, સંકલ્ય-વિકલ્ય કરતાં કરતાં કયાંક ને કયાંક એણે માનસિક શાંતિની કલ્યના કરી છે અને પોતાની આત્મશાંતિને ભૂલ્યો છે. વળી તકલીફ એ થાય છે (કે) માનસિકશાંતિમાં કોઈવાર જીવ આવે છે ત્યારે એને આત્મશાંતિના વિષયથી વધારે દૂર થવાનું બની જાય છે,

(એક મુમુક્ષુ ભાઈએ) વિપશ્યના ધ્યાનની શિબિરો કરી હશે શું ?

મને કહે ‘બહું સારું લાગે છે, ફરી ફરીને જવાનું મન થાય, શાંતિ રહે છે, (વળી) બીજું કંઈ નહીં, (તો) વ્યવહારમાં પણ થોડીક સરળતા આવે છે, નમ્રતા આવે છે, આવો પણ થોડો ફાયદો થાય છે ! (મેં કહ્યું) જુઓ ભાઈ ! એ જે કેન્દ્રો ચાલે છે એ બૌદ્ધધર્મના અનુયાયીઓનો ચાલે છે. કોનો ચાલે છે ? ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરસ્વામી થયા એ વખતે સમકાળે ગૌતમ બુદ્ધ થયા, જેમણે આ ધર્મ પ્રવર્તાવ્યો. લગભગ સમકાળીન છે - ૨૫૦૦ વર્ષ પહેલાં, હવે તીર્થકરના માર્ગ કરતાં પણ કોઈ ધર્મમાં વધારે ધર્મસાધન સારું હોય એવું તમે કેવી રીતે કલ્પો છો ? કંઈ બીજી તો વાતચીત કરવાનો બહુ પ્રસંગ નહોતો, કંઈ ટાઈમ પણ નહોતો, અને છેલ્લે ટિવસે દશ / પંદર મિનિટ માટે બેઠા હતા. જેને ત્યાં તરીએ ત્યાં તો ધમાલ જારી હોય એને વાતચીત કરવાનો (ક્યાં સમય મળે ?) બધાને સાચવે કે વાત કરે શું ? એટલે Tensionમાંને Tensionમાં ટાઈમ જાય. છેલ્લે છેલ્લે જતાં પહેલાં (કહે કે બેસીએ થોડી વાર) કેમ કરવું ? વાત તો ડી છે ને લાંબી છે. તો ઓછામાં ઓટંબું એટલું વિચારો કે સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્ર પરમાત્મા તીર્થકરદેવે જે માર્ગ કહ્યો એનાથી કોઈ છભસ્થ જીવ વધારે ધર્મસાધન બતાવી શકે ખરા ? પહેલાં તો આપણો એક મર્યાદા રાખવી રહી કે જિનેન્દ્ર પરમાત્માના માર્ગ સિવાય મારે ધર્મ સાધન બીજે કયાંય ગોતવા જવાનો પ્રશ્ન હોઈ શકે નહીં, કેમકે એ વીતરાગ પણ હતા અને સર્વજ્ઞ પણ હતા. એમનાથી કંઈ અજાણ્યું ન હતું. વિશ્વમાં એથી આગળ કોઈ ગયું નથી. જઈ શકે એવી પરિસ્થિતિ પણ નથી. એમણે નિર્દ્દ્દિષ્ટતાની ચરમસીમા પ્રાપ્ત કરી છે અને અનુભવ કરીને માર્ગ બતાવ્યો છે (તો) જિનમાર્ગ છોડવો નહીં એટલું તો નક્કી રાખવું. બાકી એ વાત Guaranteed છે, સારું છે કે, અમારા (પિતાશ્રીનો) આ સંપ્રદાય નથી એટલે અમે પક્ષપાત કરીએ છીએ એવો કોઈ આરોપ જ ન કરી શકે. નહિ તો એમ કહે કે તમારા બાપાએ એ કર્યું એટલે તમે તો એનું જ કહો ને ! અમારા પિતાશ્રીનું (કુળધર્મ વૈષ્ણવ એટલે) કુદરતી બીજી રીતે આવવાનું થયું. અમારી તો આ પક્ષપાત વગર વાત છે અને એ બધું તપાસ્યા પછી,

ગોત્યા પછી, માથાફોડ કર્યા પછી, માથું બધે માર્યા પછી આ નક્કી કરેલી વાત છે કે જિનમાર્ગ જેવો માર્ગ આ વિશ્વમાં બીજો કોઈ નથી. જેમ એક સ્થાનમાં બે તલવાર ન હોય, કૃપાળુદેવે કહું ને, અમ આ વિશ્વમાં બે જૈન ન હોઈ શકે. એટલે જૈનની બરાબરીમાં કોઈ ન હોઈ શકે એટલે તો એમણે ટીકા પણ કરી છે કે જૈન સંપ્રદાયમાં આટલા વાડા છે એ આપણી કરુણાજનક સ્થિતિ છે. ‘એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ’ એક જ માર્ગ હોય, એક જ પદ્ધતિ હોય, બે પદ્ધતિ હોઈ શકે જ નહીં, કામ કરવાની પદ્ધતિ એક જ હોઈ શકે. કેમકે આ તો Absolute Science છે, વિજ્ઞાન છે, આ કોઈ રૂઢિ, કે ધર્મરિવાજ કે કોઈ Orthodoxy કે અંધશ્રદ્ધ થોડી છે ? અર્થાત્ એવું કાંઈ નથી.

પ્રશ્ન :— અન્ય ધર્મનો તુલનાત્મક અથવા પરીક્ષા દ્વારા અભ્યાસ કરવો કે નહિ ?

સમાધાન :— એટલી શક્તિ, એટલી યોગ્યતા અને એટલો સમય ત્રણ ચીજ હોય તો, નહીંતર આવા કૃપાળુદેવ જેવા જ્ઞાનીપુરુષને અનુસરવું. એટલા માટે કે (એ) અતિ બુદ્ધિશાળી હતા, કેવા હતા ? આપણે લોકો એમની પાસે કાંઈ નથી, એમ સમજ લ્યો Intelligencyની દ્વારા જોઈએ તો કૃપાળુદેવે જે ૧૭મે વર્ષે શતાવ્ધાન કર્યા (અને) એમ કીદું કે સહસ્રાવ્ધાન કરવા હોય તો મારા ડાબા હાથનો ખેલ છે. એટલે એમની પાસે (આપણી) બધાની બુદ્ધિ પાણી ભરે, એ વાત નક્કી છે. અને એ તો એમના વચનો વાંચે તો ગમે એવો બુદ્ધિશાળી હોય એ ભો રહી જાય, એક વાર તો

ભો રહી જાય, કે મારાં જીવનમાં આ વાત મેં વિચારી નથી. એવી કોઈ વાત આ કરે છે અને એ વાત કરનાર છે કોઈ, મારા કરતાં આગળ. એ વાતનો વિશ્વાસ અને ખાતરી થઈ જાય, સારું છે કે આપણા નસીબે આ સાહિત્ય રહી ગયું છે એટલે ખાતરી થઈ જાય. બરાબર ! પછી શું કરવા માથું મારવું ? હા, એના કરતાં વધારે બુદ્ધિ હોય, એમના કરતાં વધારે સમય હોય, અને વળી યોગ્યતા હોય ! યોગ્યતામાં શું (કે) એક જોરદાર તર્ક આવે ને કે આપણો તર્ક (Bowled થઈ જાય) કિકેટમાં જેમ

દાંડી તી જાય એવી રીતે આઉટ જ થઈ જાય કેમ કે આ તો બૌદ્ધિકતર ઉપર એટલી બધી વાતો છે. ફિલોસોફી (Philosophy) ની અંદર, અન્ય ધર્મતોમાં પણ (એટલી બધી વાત છે કે) કે તમે પૂર્ણ જૈનધર્મની ફિલોસોફી સમજ્યા ન હો, એવી પૂરી સમજ્યા ન હો, અધકચરા હો, (અને) એમાં એકાદ જોરદાર વાત આવી જાય એટલે તમને એમ જ થાય કે આ બરાબર છે, જૈનર્ધનને મૂકો પડતું. આ લોકો બહુ સારી વાત કરે છે

હમણાં આપણા એક મુમુક્ષુ રમણ મહર્થિનું પુસ્તક લઈને કલકત્તામાં આવ્યા હતા. મને કહે કે આની અંદર એટલું સરસ અધ્યાત્મ છે એટલું સરસ અધ્યાત્મ છે. અને આજે પણ કૃપાળુદેવના ઘણા અનુયાયીઓ રમણ મહર્થિના પુસ્તકો વાંચે છે, ત્યાં પોતીચરો સુધી આંટા પણ મારી આવે છે. શું ? બહુ સરસ છે, આપણા જેવું જ આધ્યાત્મ છે અને કૃપાળુદેવ (જીવી) ઘણી વાત ને જૈન ધર્મના ઘણા સિદ્ધાંતોનો મેળ ખાય છે. પણ (મેં કહું) એક સવાલ પૂછું ? લાંબીયોડી ચર્ચાનો આપણી પાસે સમય પણ નથી. સર્વજ્ઞ, વીતરાગ, તીર્થકર જિનેન્દ્રદેવ અને એમનો માર્ગ આ વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમનું સાહિત્ય અને આગમો પણ પ્રસિદ્ધ છે. કૃપાળુદેવ જેવા એમના અનુયાયીઓ – જ્ઞાનીપુરુષો પણ પ્રસિદ્ધ છે. આ બધું હોવા છતાં (એમણે) જિનેન્દ્રદેવનો સ્વીકાર કર્યો છે કે નથી કર્યો ? એ કહો. (તો કહે) કે, ક્યાંય એમને સ્વીકાર્ય તો નથી, જિનેન્દ્ર પરમાત્માને સ્વીકાર્ય નથી. સાધકને સ્વીકારવા તો બહુ મુશ્કેલ છે, બહુ કઠણ પડે એવી વાત છે. કેમકે એ (તો) બધી પ્રવૃત્તિ ઘણી કરે, એ પણ (કૃપાળુદેવ) દુકાને જઈને બેસતા હતા. ટાઈમ થાય ત્યારે જવેરી બજારની દુકાને જઈને બેસતા હતા. રૂપિયા કમાવા માટે જતા હશે ને ત્યાં બીજું શું કામ હોય ? એમને રૂપિયાની જરૂરત, તો પડતી હશે ને ? અને ઘરે બૈરાં - છોકરાં હતાં. તો આ બધો જે સંસાર તો છે, ખાલી વાત કર્યથી શું કામ આવે ? (એ પ્રકારે શંકા કરે) પણ જિનેન્દ્ર પરમાત્મા તો એવા છે (કે) ત્યાં ક્યાંય આંગળી મૂકવાની પણ જગ્યા નથી, ને આંગળી ચીંધવાની પણ જગ્યા નથી, એવા નિર્દોષ પરમાત્મા છે. વીતરાગ, સર્વજ્ઞ છે (એમાં) ક્યાંય શંકા કરવાનો

અવકાશ / ગુજરાઈશ નથી અને એ પ્રસિદ્ધ છે. એમનું સાહિત્ય અને એમનું સ્વરૂપ સમજ્યા પછી એનો અસ્વીકાર કેમ થયો ? અને અસ્વીકાર થયો એવા એ અધ્યાત્મની કિંમત કેટલી ? આપણાને બેસતું નથી. પહેલી વાત છે કે દેવ, ગુરુ, શાસ્ત્ર એના ક્યા છે તે જુઓ – જગતમાં આબરુ મોટી હોઈ શકે, કોઈ પણ મહાત્માના નામની ગમે તેટલી મોટી આબરુ હોઈ શકે એ પુષ્યયોગ છે. આબરુ કોઈ મોટી વાત નથી એ તો જેમ પૈસા મળે એમ આબરુ મળે, બીજું કાંઈ નથી અને એ તો પાપીમાં પાપી પ્રાણી પાસે (પણ) હોય છે. પૈસા અને આબરુ પાપીમાં પાપી, કઠલખાના ચલાવવાવાળા પાસે પણ હોય છે એની કોઈ આ માર્ગમાં કિંમત નથી. પુષ્યની, પુષ્યના ફળની કોઈ કિંમત વીતરાગમાર્ગમાં નથી. જિનેન્દ્ર પરમાત્માને સ્વીકાર્ય છે ત્યાં ? નથી સ્વીકાર્ય (તો) મૂકો ચોકડી. આપણે ક્યાંય ડા ઉત્તરવાની પણ જરૂર નથી. એ રીતે અમુક જાતનું લક્ષ હોવું જોઈએ કે નિર્દ્દેખતા પ્રત્યે વધારે સારી રીતે, વધારે સુયોગ રીતે કોણ લઈ જાય છે ? એ પ્રકારની તુલનાત્મક બુદ્ધિ હોય તો જ તપાસ કરી શકે. નહિતર તપાસ કરવા જાય, એ પોતે જ અંદરમાં કયાં ખોવાઈ જાય એની પોતાને જ ખબર ન પડે. જાય તપાસ કરવા અને પોતે જ ખોવાઈ જાય.

પ્રશ્ન :- ગૃહીત મિથ્યાત્વ થઈ જાય ?

સમાધાન : - ગૃહીત મિથ્યાત્વનું તો એવું છે કે સાચા દેવ, ગુરુ, શાસ્ત્રનું સ્વરૂપ તમે સમજો એટલે Comparatively રાગી દેવ, ગુરુ, શાસ્ત્રને અનુસરવું, એ એક જ વાત રહી. તો ગૃહીત મિથ્યાત્વ જાય. ગૃહીત મિથ્યાત્વ ક્યારે જાય ? (કે) બુદ્ધિપૂર્વક, બીજો વિકલ્પ ન રહે ત્યારે. બુદ્ધિપૂર્વકનો બીજો વિકલ્પ થાય (એટલે) ગૃહીત મિથ્યાત્વમાં આવી ગયો આ વિષયને એકલો જો બૌદ્ધિક સ્તર પર લઈ જાય તો ભૂલ થયા વિના રહે નહીં. એટલે ગૃહીત મિથ્યાત્વમાં આવ્યા વિના રહે નહીં, એવું કામ છે જરા (પ્રયોગે ન ચડે તો) ભૂલ થયા વિના રહેવાની નથી. કેમકે વિધિનો વિષય

પ્રયોગાત્મક છે, પરિણમનનો વિષય છે અને એ પ્રયોગપૂર્વક સ્વરૂપ સમજાય છે, સ્વરૂપનો પ્રતિભાસ આવે છે. એ પહેલાં એ સંબંધીનો વિચાર કાલ્યનિક હોય છે. વિધિ સંબંધી પણ કલ્પના હોય છે અને એ ગૃહીત મિથ્યાત્વમાં જાય છે. એમાં ઓઘસંજ્ઞા કામ આવે નહીં.

એટલે અહીંયા એમ કહે છે કે આ જીવે સંકલ્પ-વિકલ્પથી ભાવે ભ્રમણ કર્યું, અનંત કાળ એના ફળ સ્વરૂપે જન્મ-મરણ કરીને, ભવભ્રમણ કર્યું, ઘણી અશાંતિ ને ઘણું દુઃખ ભોગવતો, ભોગવતો, ભોગવતો અહીંયાં ચાલ્યો આવ્યો છે. અને હીવે એ દુઃખ ખરેખર સંસાર પ્રત્યેના મહા વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. કેવી રીતે ? કે “નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે.” નહિતર આ Problem છે. આ વાત સાંભળ્યા પછીનો આપણા મુમુક્ષુઓનો આ Problem છે, કે વાત તો બરાબર છે પણ એમને પરિભ્રમણનું દુઃખ નિરંતર લાગતું નથી. વિચારીએ છીએ, વાંચીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ત્યારે સમજાય છે, ઘ્યાલમાં આવે છે. ઇચ્છીએ છીએ એવું કાંઈ થાય તો, મોક્ષનો નિર્ધાર થાય, તો મુમુક્ષુની ભૂમિકાની પૂર્ણતાના લક્ષે વાસ્તવિક શરૂઆત થાય. પણ અંતઃકરણની શુદ્ધિ માટે જે વેદના અને જે ચિંતના થવી જોઈએ એ નિરંતર ચાલતી નથી એ મોટી સમસ્યા છે. અને તેથી યોગ્ય પ્રમાણમાં એના ફળસ્વરૂપે જે વૈરાગ્ય આવવો જોઈએ એ વૈરાગ્ય આવતો નથી.

શું લખ્યું છે ? “નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્ય ને આપે છે.” હીવે આપ એમ કહો કે નિરંતર ન રહે એનું કરવું પણ શું ? ત્યારે પ્રશ્નની સામે ઉત્તરમાં એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે એટલે સમજાઈ જશે કે ડૉ. ટર એમ કહે કે તમને અહીંયાં (એક) ખાલી ફેડકી થઈ હતી અને મટતી નહોતી એટલે Investigationમાં જવું પડ્યું, શું ? અને લેબોરેટરી (Laboratory) ટેસ્ટમાં એની (અંદર) કેન્સરના (Cancer) ચિહ્નો બધા ચોખ્યા આવ્યા છે. તમને અત્યારે બહુ પીડા નથી, તેથી આ સામાન્ય લાગે છે કે આ મટતી નથી. મહિના / બે મહિનાથી ચાલે છે, ઘણી antibiotics (દવા) લીધી, ઘણાં ઇન્જેક્શનો લીધાં, દવાઓ કરી, પર્ટીપણા બાંધ્યા, છતાં એમને એમ રહ્યા જ કરે છે. ઠીક છે, બહુ વાંધો નથી પણ

આ મટે તો સારું. એટલે ડૉ ટર કહે ચાલોને જરા Investigationમાં, Deep Investigationમાં જઈએ, કાંઈ લાગુ પડતું નથી, આ પણ એન્ટીબાયોટીક, ઓલી પણ એન્ટીબાયોટીકમાં એકેય લાગુ જ નો પડે. ત્યારે ખબર પડી કે કેન્સર છે. ત્યારે હે... એ... હે થઈ ગયું પછી તમારું હે... એ... મટી ગયું? સાંભળી લીધુ, બરાબર છે (કેન્સર) બહુ ખરાબ, એમાં તો મરી જવાય, ફલાણું થાય. કાંઈ વાંધો નહીં, હાલોને હવે દુકાને જઈએ, કામ છે. આપણે આજ ફલાણાની સાથે મીટિંગ છે, બહુ મહત્વની મીટિંગ છે, બહુ સારી મહત્વની મીટિંગ હોય તો શું થાય? અરે! બધુ જ પડ્યું રહે એકે એક વાત પડી રહે. ચારેકોર કોલ થઈ જાય કે આની કોઈ દવા છે કે નહીં? કોઈએ શોધી છે? ગઈકાલે કોઈના હાથમાં જડીબુદ્ધી આવી હોય તોપણ અમને કહી દેજો. અત્યાર સુધી આપણા ધ્યાનમાં નથી. છે જ નહીં આની દવા? Research (શોધ) તો ચાલુ જ છે. દુનિયા આખી રીસર્ચ કરે છે અને દવાની શોધ ગઈકાલે થઈ હોય અને આપણને ખબર ન હોય, તપાસ આપણે બધે કરો, કોઈ હાથપગ વાળીને બેસી જતું નથી, કે દવા નથી મળતી તો કાંઈ નહીં, મરી જઈએ તો ભલે મરી જઈએ! નહીં, કોઈને મરવું નથી અને પછી એ ચિંતા નિરંતર ચાલે કે ભૂલી જાય, હે? સારી મીઠાઈ ભાણામાં આવે તો ભૂલી નો જાય? નો ભૂલી જાય? અરે! એ મીઠાઈ ખાવાના હોશ રહે નહીં. હોજરી ઉપર ચિંતાની અસર એટલી આવે કે ભૂખ ડી જાય, ને જે ભાવતું હોય એ ભાવે નહીં. ભાવવા નહીં ભાવવાનું (ચાલ્યું) જાય, ઘ ડી જાય.

એમ એક વાર આ નિરંતર ચિંતનાથી આ Stageમાં આવવનું જોઈએ, આવવાનું સહજ થવું જોઈએ કે ખાવું, પીવું ને ઘવું બધું હરામ થઈ જાય. કેમકે એ કેન્સર તો એક ભવમાં રોગ થાય છે, આ તો અનંત ભવનો ભવરોગ છે, અનંત કેન્સરનો દાઢો છે, આ ભવરોગ એટલો મોટો રોગ છે અને અનંતકાળનો કોણીક (Chronic) છે. આ તો (કેન્સર તો) મહીના / બે મહિનામાં હતું ને ખબર પડી ગઈ. આ તો અનંતકાળનો Chronic Disease છે, ઘર કરી ગયેલો છે, એને મટાડવાની વાત છે, કાંઈ

નાનીસૂની વાત નથી. (એટલી) ગંભીરતા અને (એટલી) એ વિષયની ચિંતા ભી થાય ત્યારે અંતઃકરણની શુદ્ધિ થઈ અને વૈરાગ્યપૂર્વક મોક્ષનો નિર્ધાર થાય નહીંતર ન થાય. પછી ઉપરના Stage આવે. એ પહેલાં કોઈને ઉપરના Stage આવે નહીં. કોઈ માને કે અમે આગળ વધી ગયા છીએ. એ બધા ભ્રમમાં છે. ભલે જ્ઞાયક - જ્ઞાયક કરે, બધો ભ્રમ છે. એમાં કાંઈ માલ નથી એમાં આ પહેલું આવવું જોઈએ. બધા જ્ઞાનીઓની, અનંતા જ્ઞાનીઓની આ અનુભવસિદ્ધ વાત છે. સમય થયો છે. (હવે) પછી આગળ લેશું.

d

સ્વકાર્યની અગંભીરતા - તે જીવનો અપરાધ છે. દર્શનમોહની પ્રબળતાને લીધે જીવ નિજ હિતની વાતને ગંભીરતાથી ઉઠાવતો નથી અને સમજવા છતાં પ્રમાણને છોડતો નથી. ગંભીર ઉપયોગ થવા અર્થે તથારૂપ સત્તસંગ ઉપકારી છે.

- પૂજય ભાઈશ્રી

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૨૮

પ્રવચન-૩

તા. ૨૫-૧૨-૯૭ (રાત્રિ)

(શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૧૨૮ ચાલે છે.) ખંભાતના મુમુક્ષુભાઈઓને પત્ર લખેલ છે. લખવાનો આશય એ છે કે જેને જન્મ-મરણથી ધૂટવું છે, ભવભ્રમણથી મું ત થવું છે, તે જીવને મું ત થવાનો ઉપાય શું છે એની તો ખબર નથી એટલે આ વિષયમાં આકુળતા થાય છે, જીવ ખૂબ મુંજવણમાં આવી જાય છે. સવાલ માત્ર એટલો જ છે કે એ જીવની એવી યોગ્યતા હોય છે ‘મારે આ ભવભ્રમણ જોઈતું જ નથી’. ભવભ્રમણમાં ખૂબ દુઃખ છે, એ વાત એને ભાસે છે. વિચાર થવો એક વાત છે, ભાસવું બીજી વાત છે. (આ વાત) ભાસે છે. એવી જ કોઈ યોગ્યતા હોય છે (જેથી) એ જીવને આવા પ્રકારનાં વિચાર ચાલે છે. અંતરાત્મામાંથી આ વિચારો આવે છે. અને આવાં જે-જે વિચારો ચાલે એને પરિભ્રમણની ચિંતા કહે છે.

કૃપાળુદેવે આગળ પણ એક ૮૬ નંબરનો પત્ર લખ્યો છે અને પાછળ

એક ૧૮૫ નંબરનો પત્ર લખ્યો છે. વચ્ચેનો ૧૨૮મો પત્ર ચાલે છે. ૮૬ અને ૧૮૮માં એક જ વાત છે. જે જીવને મુ ત થવાના માર્ગની છઢ્યા ઉત્પન્ન થઈ છે, એને ધર્મસાધન કરવાના બધા વિકલ્યો મૂકી દઈ સૌથી પહેલા આ જ વાત વિચારવી જોઈએ અને ભાસવું જોઈએ કે હું પરિભ્રમણ કરી રહ્યો છું અને ગમે-તેમ કરીને પણ મારે અનાથી મુ ત થવું છે. આ વાત એના ચિત્તમાં, એના અભિપ્રાયમાં (અને) એના વિચારમાં આવી જવી જોઈએ. આમ થયા વગર કોઈને માર્ગ સૂજતો નથી, અને માર્ગ કઈ દિશામાં છે એનું ભાન, અલ્ય ભાન પણ થતું નથી. મોટા ભાગના જીવ આ કમમાં આવ્યા વગર, આવી ચિત્તનામાં આવ્યા વગર પોતપોતાના સંપ્રદાયમાં જે કંઈ પણ કિયા ચાલતી હોય, જે પણ રૂઢિ-રિવાજ, જેને પણ સાધન માનવામાં આવ્યાં હોય તેનું અનુસરણ કરતાં હોય છે. પરન્તુ એનું કોઈ પારમાર્થિક ફળ એટલે આત્મ-કલ્યાણવાળું કોઈ ફળ આવતું નથી. એટલે જ ફૂપાળુંદેવે નિષ્કારણ કરુણાથી આ વાતની પ્રસિદ્ધિ કરી છે કે બધા વિકલ્યોને મૂકીને પહેલા આ થતું જરૂરી છે અને માર્ગની વાસ્તવિકતા પણ આ જ છે કે પહેલાં આમ જ થાય છે અને એ જ (જીવ) મોક્ષમાર્ગ સુધી પહોંચે છે. જેને નથી થતું તે મોક્ષમાર્ગ સુધી પહોંચી શકતો પણ નથી. આ ચિત્તના કેવી હોય છે ? એનું વર્ણન અહીંયાં ફૂપાળુંદેવે ચાર પેરેગ્રાફમાં કર્યું છે. સવારે પહેલો પેરેગ્રાફ ચાલી ગયો છે, ફરીથી લઈએ.

“અંતર્જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નર્થી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે (એટલે આપણા જીવે) પરિભ્રમણ ન કર્યું હોય....” અનંતકાળથી આ જીવ પરિભ્રમણ કરતો આવ્યો છે. ભવભવાંતર(માં) દુઃખી થતો-થતો, વર્તમાનમાં અત્યારે મનુષ્યભવમાં આપણો જીવ (આવ્યો છે.) પૂર્વકાળમાં ખૂબ જન્મ-મરણ, અનંત જન્મ-મરણ કર્યા છે અને તેનું કારણ સંકલ્પ-વિકલ્પ છે. ઘણા પ્રકારના સંકલ્પ-વિકલ્પ કર્યા છે, તેના કારણે પોતે પોતાની આત્મ-શાંતિને ભૂલ્યો છે.

આત્મશાંતિના વિષયમાં થોડું સ્પષ્ટીકરણ ચાલ્યું હતું કે ધર્મસાધન કરનારને માનસિક શાંતિ મળે છે ભલે હિન્દુ હોય, કે મુસ્લિમાન હોય,

કે ખ્રિસ્તી હોય કે જૈન હોય, કે બૌધ્ધ હોય, (બધા) પોતપોતાના ધર્મસ્થાનમાં જાય છે, (ત્યાં) કંઈક ને કંઈક કિયાઓ હોય છે, જે મંદ કખાયરૂપ હોય (છે) અને કખાયની મંદતા હોવાથી માનસિક શાંતિ પણ હોય છે, સંસારનાં કાર્યોમાં માનસિક અશાંતિ હોય છે અને ધર્મસ્થાનમાં માનસિક શાંતિ હોય છે. અશાંતિની જગ્યાએ શાંતિ થાય છે, (ત્યારે) જીવ સંતોષાર્થ જાય છે કે ચાલો વારંવાર અહીંયાં આવવું જોઈએ તો થોડીક શાંતિ મળી રહેશે. પછી કિશ્ચન દર રવિવારે ચર્ચમાં જાય અને મુસલમાન દર જુમ્મે મસ્જિદમાં જાય. જુમ્મે એટલે શુક્વાર, અને જુમ્માનો વાર કહે છે. બધાને એવો જ અનુભવ થાય છે કે અહીંયાં આવીએ છીએ તો ઠીક લાગે છે. એટલે (પછી) એ રૂટિન (Routine) થઈ જાય છે અને એમ જ ચાલ્યા કરે છે, પણ એમાં આત્મશાંતિ નથી. સંસારનાં કાર્યો અને અયથાર્થ ધર્મસાધનના કારણે જીવ આત્મશાંતિને ભૂલ્યો છે.

અહીંયાં, કૃપાળુદેવનો કહેવાનો અભિપ્રાય એ છે કે જેને આત્મશાંતિ જોઈએ છે એની માટે આ વાત છે. જીવ થોડા સંકલ્પ કરીને, થોડા વિકલ્પ કરીને, કંઈક ને કંઈક કરીને આત્મશાંતિ ને ભૂલ્યો છે, સંસારનાં મોટા ભાગના જીવો તો પંચેન્દ્રિયનાં વિષયમાં માનસિક શાંતિનો અનુભવ કરે છે, થોડા લોકો ધાર્મિક કિયામાં માનસિક શાંતિનો અનુભવ કરે છે. પંચેન્દ્રિયના વિષયમાં જે શાંતિ માને છે એને મજા કહે છે, મજા આવે છે, (એન્ટરટેઇનમેન્ટ) Entertainment અને ધર્મસ્થાનોમાં પણ Entertainment જેવી જ વાત થઈ જાય છે કારણ કે (એ પણ) એક માનસિક શાંતિ (મેળવવાની) રીત છે, બીજુ કંઈ નથી.

જિનેન્દ્રાદેવનો માર્ગ, કહો અથવા જ્ઞાનીપુરુષનો માર્ગ કહો, કૃપાળુદેવ (એને) જ્ઞાનીપુરુષનો માર્ગ કહે છે કારણ કે આજે તો જિનમાર્ગના નામથી અનેક સંપ્રદાયો ચાલે છે; આપણા જૈનના નામે પણ (સંપ્રદાય ચાલે છે). એમાં જ્ઞાની અલગ તરી આવે છે, તેઓ સંપ્રદાયમાં ભળતા નથી. જ્ઞાની સંપ્રદાયમાં ભળતા નથી કારણ કે માનસિક શાંતિમાં કખાયની મંદતા છે – એ ચારિત્રમોહની મંદતા છે જ્યારે જ્ઞાનીના માર્ગમાં અથવા જિનેન્દ્રના

માર્ગમાં સૌથી પહેલાં દર્શનમોહની મંદ્તાનો ઉપાય છે (એટલે) એ માર્ગ થોડો અલગ પડે છે. દર્શનમોહ મંદ થયા વગર દર્શનમોહનો અભાવ થઈ સમ્યક્દર્શન ન થાય અને ત્યારે જે ચારિત્રમોહ મંદ થાય છે એ સમ્યક્પ્રકારે થાય છે. જે ચારિત્રમોહને તો મંદ કરે છે પણ (તેનો) દર્શનમોહ એમનેએમ રહે તો તેનો ચારિત્રમોહ થોડા સમય સુધી Temporary મંદ થાય છે, પછી પાછો તીવ્ર થઈ જાય છે કારણ કે મોહનું મૂળ દર્શનમોહમાં છે, ચારિત્રમોહમાં નથી. મોહરૂપી એક ઝાડ છે અને તેનું મૂળ દર્શનમોહ છે, બાકીનાં જે પાંદડાં છે, ફળ-કૂલ છે એ ચારિત્રમોહ છે, મૂળ એમને એમ રાખીને કોઈ પાંદડાં કાપે તો એ તો પાછા નવા આવી જાય છે. આપણે ગુજરાતીમાં ‘પાંગરે છ’ એમ કહીએ છીએ. (એમ આ) મોહનું ઝાડ પાંગરે છે. શું થાય છે ? હિન્દીમાં ‘પનપતા હૈ’, એમ કહેવાય છે, કારણ કે મૂળમાં તો સિંચન ચાલુ છે. કોઈ થોડા પાંદડાં કાપે (અર્થાત્ ચારિત્રમોહરૂપી પાંદડાં) ત્યાગ કરીને અથવા કાંઈ પણ કરીને, તો પાછા એ પાંદડાં ગી નીકળે છે એટલે એ સાચો (યથાર્થ) ઉપાય નથી અને એ સાચો (યથાર્થ) કમ પણ નથી.

આવી પરિભ્રમણની ચિંતનામાં સૌ પ્રથમ, વ્યવસ્થિત યોજનાપૂર્વક, દર્શનમોહ ઉપર પ્રણાર પડે છે. મિથ્યાત્વ ઉપર પ્રણાર પડે છે. ફૂપાળુદેવે આ વાત યોજનાબદ્ધ (રીતે) કરી છે. આખો ૨૫૪ નંબરનો પત્ર એકદમ એના (કમ) ઉપર ૪ લખાયેલો છે. એટલે, આ ૧૨૮ (નંબરનો પત્રમાં) જે મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, ત્યાંથી એ ૨૫૪ (પત્ર) ચાલુ થાય છે અને સ્વરૂપનો નિશ્ચય થાય, ઓળખાડા થાય – એમાં સ્વરૂપસન્મુખતા સુધીનો કમ લીધો છે. અને સ્વરૂપસન્મુખતા પછી તો અલ્યકાળમાં સ્વાનુભૂતિની પ્રાપ્તિ થાય છે અને સ્વાનુભૂતિની ઉપલબ્ધથી મોક્ષમાર્ગમાં પ્રવેશ થઈને મોક્ષ સુધીની પ્રક્રિયા સહજ ૪ ચાલે છે. કેમ ? કેમકે, ત્યાં મોહનું મૂળિયું ક્રાર્થ જાય છે પછી જે પાંદડા લીલા છે (એ) થોડા સમય રહેશે, પછી પોતાની મેળે સુકાઈ જશે, સૂકવવા નહીં પડે - સુકાઈ જશે.

આ જિનેન્દ્રાદેવનો માર્ગ છે પણ લોકો જાણતા નથી. જિનમાર્ગના

નામે બીજું-બીજું વાતો ચાલે છે, આ કમ ક્યાંય નથી. એટલે જ્ઞાનીઓએ આ કમ બોધ્યો છે અને એટલે જ (કૃપાળુદેવે) એને ‘જ્ઞાનીઓનો માર્ગ’ કહ્યો કૃપાળુદેવે આ ગ્રંથમાં અનેક જગ્યાએ મુમુક્ષુને જ્ઞાનીના માર્ગ ચાલવાની શિક્ષા આપી છે. પોતાની આ વાત ઉપર વજન આપ્યું છે. એનો અર્થ એ છે કે તું તારો મતિથી, મનમાની રીતે ધર્મસાધન ન કર. જેમ જ્ઞાની કહે છે, તેમ જ કર (અર્થાત્) જ્ઞાનીના માર્ગ જ ચાલવું. અને એ જરૂરી પણ છે. ખૂબ જ જરૂરી છે. જેમ કોઈ ગંભીર શરીર રોગ ઉત્પન્ન થાય અને દર્દીને હોસ્પિટલાઈઝ (Hospitalize) કરવામાં આવે છે (ત્યારે) એને ડૉ. ટરની સૂચનામાં, ડૉ. ટરની પરેજામાં જ Compulsory રહેવું પડે છે. જો એને ધૂટવું હોય, રોગ મટાડવો હોય તો Fully Surrender (પૂરું સમર્પિત) થવું પડે છે. તો આ ભવરોગને મટાડવા માટે એના જે તજજ છે. એ જ્ઞાની છે કે જેમણે પોતાનો ભવરોગ મટાડયો છે અને એમની સૂચનામાં Surrender થઈને ચાલવું પડશે. (પછી) તેઓ જેમ કહે તેમ કરવું પડે, પોતાની મનમાની નહીં ચાલે. પોતાની મનમાની રીતે જ અનંતકાળથી ધર્મસાધન કરતો આવ્યો છે. ‘ધર્મ, નિયમ, સંયમ, આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયો’, ધણું કર્યું તોપણ એનાથી કાંઈ (કામ) થવાનું જ નથી.

પ્રશ્ન :— અનંતકાળમાં સમજણ કરી હશે ?

પૂ. ભાઈશ્રી :— બની શકે, સમજણ કરી હશે પણ અમલીકરણ ન કર્યું તો સમજણ શું કામની ? સમજણ બે પ્રકારની હોય છે. એક સ્વલ્ખી અને એક પરલક્ષી. જે આત્મલક્ષી સમજણ હોય છે એમાં આત્મા અનુસરણ કરવા લાગે છે, એટલે જે સમજણ હોય છે એને પોતાના પરિણમનમાં લાગુ કરે છે, (Apply) કરે છે. જ્યારે પરલક્ષી સમજણવાળો સમજણમાં જ સંતોષાઈ જાય છે અને (એ) અમલીકરણમાં નથી આવતો; તો (આ વાત) અનંતકાળમાં પરલક્ષી જ્ઞાનમાં સમજ હશે. જો સ્વલ્ખી જ્ઞાનમાં સમજણ થાય (તો તરત) અમલીકરણ ચાલુ થાય. જેમકે આપણે લોકો માર્ગની, જ્ઞાનીએ કહેલા કમની ચર્ચા કરીએ છીએ, પરન્તુ જ મુમુક્ષુઓ

પરલક્ષી જ્ઞાનમાં એની સમજણ કરે છે તેઓ અમલીકરણમાં આવતા નથી અને (જેને) સ્વલક્ષી જ્ઞાનમાં (સમજણ) આવે છે તે અમલીકરણમાં આવે છે. એટલે એ બન્ધેમાં ઘણો ફરક છે. કહેવામાં તો બન્ધે મુમુક્ષુ જ કહેવાય છે. એક જ શાસ્ત્ર વાંચે છે, એક જ (પ્રકારના) સત્સંગને Attend કરે છે. કહેવાય એમ કે તમે પણ મુમુક્ષુ છો, હું પણ મુમુક્ષુ છું, એમાં શું ફરક પડ્યો ? પણ બહુ ફરક છે. એટલે પરલક્ષવાળાઓ શું માને છે – કે આ પણ મારા જેવો જ છે, આ પણ મારા જેવો છે, પણ એમ નથી. જ સ્વલક્ષવાળો છે એ પરલક્ષવાળા કરતાં યાંય સારો છે. ઘણો સારો છે, આ વાત ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે એ અમલીકરણમાં આવ્યો છે. ઓણે ક્રમમાં પ્રવેશ કરી લીધો છે. એટલે એને તો જ્ઞાનીના માર્ગની લાઈન હાથમાં આવી જાય છે. આ ચિંતના થવાથી શું કરવું એની સૂજ આવી જાય છે. એના પહેલા કોઈ સૂજ હોતી નથી, આ વાત તેઓશ્રીએ ૧૮૫ નંબરના (પત્રમાં) લખી છે. આવી જે અંતરની સૂજ છે, એ આપમેળે જ માર્ગ કરે છે, અંદરમાં જ માર્ગ કરવા લાગે છે અને જેને સૂજ નથી એ અંધારામાં ભો છે. પછી (એ) જે કાંઈ પણ કરે છે એ Jumping in The Dark, Firing In The Dark (એના જેવું છે.) એ અંધારામાં જે કંઈ પણ કરે છે, એને ખબર નથી (કે) હું શું કરું છું ? કચાં જઈશ ? કચાં જઈશ ? કાંઈ ખબર નથી, અને કર્યા કરે છે, પણ અંધારામાં ભો છે. સ્વલક્ષી સમજણ અને પરલક્ષી સમજણવાળા મુમુક્ષુમાં આટલું મોટું અંતર છે. મુમુક્ષુ મુમુક્ષુમાં ઘણું અંતર છે.

પ્રશ્ન :– પરલક્ષી સમજણમાં કેવા ભાવ ચાલે છે ?

પૂ. ભાઈશ્રી :– સ્વલક્ષથી વિરુદ્ધ ભાવ છે, પણ એ શું કરે છે ? બરાબરી કરે છે, (કે) આ પણ મુમુક્ષુ છે - હું પણ મુમુક્ષુ છું, એ પણ વાંચે છે-સાંભળે છે, હું પણ વાંચું છું - સાંભળું છું, એ પણ મંદિર જાય છે - હું પણ મંદિર જાવ છું. એને બહારની કિયા તો સરખી જ લાગે ને ! (પણ) અંદરમાં બહુ મોટો ફરક છે. યોગ્યતામાં બહુ મોટો ફરક પડી જાય છે. આ અંતર પણ સમજવું જોઈએ.

ખરેખર તો, જે સ્વલ્પભાં નથી આવતો, એણે સ્વલ્પભાં કેવી રીતે આવયું ? (એ વાત) એણે (સ્વલ્પભાણા) પાસેથી સમજવી જોઈએ. કોની પાસેથી ? કે જે સ્વલ્પભાં આવીને વેદનાભાં આવ્યો છે એની પાસેથી આ વાત એણે (પોતે) સમજવી જોઈએ, કે તમને શું થયું ? કેવી રીતે થયું ? કેવી રીતે (વેદનાભાં) આવ્યા ? અમે તો કોશિશ કરીએ છીએ (પણ) આવી નથી શકતા, શું વાત છે ? આટલી ગરજ પોતાને આવવી જોઈએ ત્યારે જ તો સ્વલ્પભાણાનો મોકો છે, નહીંતર એમનેમ ચાલશે કે આપણે બધા સાથે તો સત્સંગ કરીએ છીએ, એમાં શું થઈ ગયું ?

બીજી વાત એ છે કે પરલ્પભાણાને બીજાના દોષ તરત જ દેખાય જાય છે. એનાભાં ગુણગ્રાહીપણાની ઓછુપ હોય છે અથવા નહીંવત્ત હોય છે અને બીજા જે મુમુક્ષુ હોય છે એ કોઈ સર્વગુણસંપત્ત તો હોતા નથી. સર્વગુણસંપત્ત તો પરમાત્મા જિનેન્દ્રદેવ હોય છે, જ્ઞાની પણ નથી. એટલે (જ્યારે બીજાના) દોષ દેખાય છે (ત્યારે) એના (દોષની) મુખ્યતા થઈ જાય છે અને પોતાના દોષ તો દેખાતા હોતા નથી કે એના કરતાં પણ મારામાં વધારે (દોષ) ભરેલા છે, એ તો દેખાતું નથી – આ ગડબડ થઈ જાય છે. આવી જે ઘણા પ્રકારની વિટંબણાઓ છે એનો ઇલાજ શું ? કે Under Strict Supervision- જે Hospitalise થાય છે; એવી રીતે સત્સંગભાં રહેવું અને પોતાના દોષ જોતા જવા, કહેતા જવા, દેખાડતા જવા અને બીજાને બતાવવા માટે વિનંતિ પણ કરતા જવી કે મારો કોઈ દોષ હોય તો બતાવજો, મારે કાઢવો છે. ત્યારે તો સ્વલ્પભાણાનો અવાશે. આ પરિણામોની ચર્ચા છે એ કારણથી જ છે કે આખા દિવસમાં તમે તમારા લક્ષ્યથી, સ્વલ્પભાણાનો પોતાના પરિણામભાં કેટલી વાત જોઈ ? શું શું જોયું ? અને બીજા કોઈ આપણો દોષ દેખાડે તો ગમે છે કે નથી ગમતું ? આ પણ ખબર પડશે.

આમ, જ્ઞાનીનો જે માર્ગ છે એમાં દર્શનમોહની તાકાત તોડવાની એક યોજના છે. જો આ યોજના અનુસાર કોઈ ચાલે તો એક દિવસ એનો દર્શનમોહ અવશ્ય તૂટે છે અને એ સમ્ય દર્શનને પ્રાપ્ત કરીને એ જીવ મોકષમાર્ગભાં ચાલશે, આવી જશે. તો આનું કોઈ સૌથી પહેલું ચરણ હોય

એટલે કે (સૌ) પ્રથમ આચરણ કરવા લાયક કોઈ વાત હોય તો એ આ પરિભ્રમણની ચિંતના છે. એમાં એ આત્મશાંતિ માટે પ્રયત્ન કરે છે, કારણ કે આત્મશાંતિના વિષયમાં જ ભૂલ્યો છે. શું લખ્યું છે ? કે, ‘એ વડે ‘સમાધિ’ ન ભૂલ્યો હોય’ સમાધિ એટલે આત્મશાંતિ.

આપણા શ્રી નિહાલચંદ્રજી સોગાનીજનો આ વિષયમાં એક જીવંત ઉદાહરણ છે કે એમને સત્સંગ પ્રાપ્ત નહોતો એટલે આ વિષયમાં શું કરવું ? શું ન કરવું ? કંઈ જ ખબર નહોતી. સંપ્રદાય અનુસાર બધી કિયાઓ કર્યા કરતા, લગનથી કરતા હતા એટલે ખૂબ કરતા હતા. શાસ્ત્ર પણ આખો દિવસ વાંચ્યા કરતા, યારેક કોઈ યોગની કિયા -- આ જે બતાવે છે ને ધ્યાનશિબિરમાં ? એ પણ બહુ કર્યું, લાકો સુધી કર્યું, યોગની કિયામાં પણ પડ્યા હતા, શાસ્ત્ર-સ્વાધ્યાયમાં પણ ઘણું લાગી રહેતા અને જિનેન્દ્ર પૂજા પણ કર્યા કરતા, છ-છ કલાક (કરતા હતા) કેટલી ? છ કલાક. પણ એકેય વાત યોજનાબદ્ધ નહોતી. છતાં પણ હોનહાર સારું હોવાને કારણે એમની આત્મશાંતિની ખોજ ચાલુ રહી. ધર્મસાધન કરવા છતાં ચારેય મંદક્ષાયમાં સંતોષાપણા નહીં. એટલે તેઓ સમાધિના વિષયમાં ભૂલ્યા નહીં. શું ? To The Point વાત શું છે ? કે જીવ સમાધિના વિષયમાં ભૂલ્યો છે એટલે આત્મશાંતિના વિષયમાં ભૂલ્યો છે. એમને (સોગાનીજને) આત્મશાંતિ નહોતી મળતી, આત્મશાંતિની પિપાસા હતી અને પિપાસાનો એવો સ્વભાવ છે કેમકે તરસ છે ને ! તીવ્ર તરસને પિપાસા કહે છે. એનો એવો સ્વભાવ છે કે જેટલો કાળ જાય એટલી પિપાસા વધતી જાય. અને આ માર્ગમાં એ એક બહુ સારું લક્ષણ છે. નહીંતર શું થાય છે ? કે મુમુક્ષુઓ પણ આ વાંચતા-વાંચતા, સાંભળતા-સાંભળતા, ઠંડા પડી જાય છે અને સંતાપાઈ જાય છે કે અમે આટલાં વર્ષો સુધી આવો સ્વાધ્યાય કર્યો તેથી હવે અમને બહુ ગુસ્સો નથી આવતો, અમારામાં થોડી સરળતા પણ આવી ગઈ છે, આ પણ થયું છે, અમે નિવૃત્તિ પણ લઈ રહ્યા છીએ, આમ નથી કરતા, પહેલા આમ કરતા હતા હવે એમ નથી કરતાં – સંતુષ્ટપણામાં આ બધું આવી જાય છે. ગણતરી કરવા લાગે છે. આ ગણતરી

કરવી એ બહુ ખરાબ લક્ષણ છે. એ દર્શનમોહને વધારનારાં પરિણામ છે. બહુ ખરાબ એટલા માટે છે કે એ દર્શનમોહને વધારનારાં પરિણામ છે. આમ થઈ જાય છે (પણ) આમ ન થવું જોઈએ. એમને (સોગાનીજને) તો પિપાસા વધતી જ ગઈ, પિપાસા વધતી જ ગઈ. જેમ કોઈ તરસ્યો પાણી નહીં મળવાથી મરી જાય છે. એના પ્રાણ ધૂટી જાય છે – એ તરસની ચરમસીમા છે, એમને પણ એમ જ થયું. આત્મશાંતિની પિપાસામાં એમને લાગતું કે જો મને આત્મશાંતિ નહીં મળે તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે. આ સં વ્યવિકલ્પની અશાંતિ છે, ભવે ધર્મના વિષયમાં જ સંકલ્પ-વિકલ્પ ચાલતા હતા, એ અશાંતિ એટલી હતી કે, ‘મારું જીવવું મુશ્કેલ છે.’ એમના પોતાના શબ્દોમાં આ વાત છે કે, ‘યા તો વિકલ્પ ફટકડકે આત્માકી શાંતિ -- નિર્વિકલ્પતા હો જાયેગી યા તો દેહ ધૂટ જાયેગા.’ બેમાંથી એક થવાનું હતું કાં તો વિકલ્પ ફાટીને નિર્વિકલ્પતા આવી જાય, નહીંતર દેહ ધૂટીને – પ્રાણ ધૂટી જાય. દેહ ધૂટી જાય – પ્રાણ ધૂટવાથી, (પછી) ત્રીજું (કાંઈ) નથી થવાનું. એટલી હદે આત્મશાંતિની જરૂરિયાત લાગી ત્યારે કુદરતે વ્યવસ્થા બેસાડી અને તેઓ તરત સોનગઢ પહોંચી ગયા અને જ્ઞાનીપુરુષનો યોગ થઈ ગયો, સત્સંગ મળી ગયો, પ્રત્યક્ષ યોગ મળ્યો, અને એક જ દિવસમાં બોધને પ્રાપ્ત કરી લીધો.

કૃપાળુદેવે ૭૫૧ નંબરનાં પત્રમાં (અને) આત્મસિદ્ધિમાં જે ત્રણ પ્રકારના સમકિત કહ્યા છે, એ ત્રણેય પ્રકારના સમકિત એક જ દિવસમાં પ્રાપ્ત કરી લીધા – જુઓ ! (પ્રત્યક્ષ યોગ) હોવો બહુ જ આવશ્યક છે અને એ ત્યાં રાજ્યાનમાં નહોતો. આત્મધર્મ જે અહીંયાથી (સોનગઢથી) નીકળતું હતું એ દેવવશાત્ત કહો કે ભાગ્યવશાત્ત કહો, એમને મોકલવામાં આવ્યું, આપવામાં આવ્યું. અને તેઓ સોનગઢ આવી ગયા. એક જ દિવસમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો પરિચય કર્યો, ઓળખાણ કરી, સ્વરૂપની ઓળખાણ કરી અને એ જ દિવસે નિર્વિકલ્પ સમ્ય દર્શન પણ પ્રાપ્ત કરી લીધું. ત્રણેય સમકિત એક જ દિવસમાં (પ્રાપ્ત) કરી લીધા. કારણ કે આત્મશાંતિની જે જરૂરિયાત લાગી હતી એ ચરમસીમાએ પહોંચી હતી.

આપણે આ પત્રમાં જે વાત ચાલી રહી છે એ To The Point વાત છે કે જીવ ધર્મસાધન કરતાં અથવા નહીં કરતાં, સમાધિ એટલે આત્મશાંતિને ભૂલ્યો છે. એટલે, બધા મુમુક્ષુઓનું આ લક્ષણ હોવું જોઈએ -- મને મારી આત્મશાંતિ નથી મળી, મને મારી આત્મશાંતિ નથી મળી, -- કંઈપણ ભલે થયું હોય, પણ મારે તો આત્મશાંતિ જોઈએ છે. જે કંઈપણ થયું છે એ મારે ગણવું નથી. શું ? મુમુક્ષુની ભૂમિકામાં જે કંઈપણ થયું છે એને એ ગણતો નથી, મારે તો આત્મશાંતિ જોઈએ છે. જો એવી ચાહત ન રહી તો આત્મશાંતિ માટેનો પ્રયાસ બંધ થઈ જશે, પ્રયાસ જ નહીં ચાલે. પછી, એ Routine માં આવી જશે. ચાલો, રોજ સ્વાધ્યાય કરો, સત્સંગ કરો. વાંચી લ્યો, સાંભળી લ્યો, આ કરી લ્યો, તે કરી લ્યો -- સંપ્રદાયમાં તો આ બધું હોય જ છે. એવું જ અહીંયાં થઈ જશે. ત્યાં સંપ્રદાયમાં એવું થાય છે. આપણે તો સંપ્રદાયમાં ગયા વગર જ સંપ્રદાય આવી ગયા જેવું થાશે.

એટલે આ શબ્દો જે કૃપાળુદેવે લખ્યા છે (એ) ઘણા અનુભવથી, અનુભવનાં ડાણથી આ વાત આવી છે. એટલે, એ આત્મશાંતિને ન ભૂલ્યો હોય એવો કોઈ કાળ ગયો નથી. ‘નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે.’ આ વાત ભુલાતી નથી. એનું સ્મરણ રહ્યા જ કરે છે કે મેં કેટલી મોટી ભૂલ કરી છે અને એના ફળમાં પરિભ્રમણ કર્યું -- એનો પશ્ચાત્યાપ (થાય છે). દોષનો પશ્ચાત્યાપ થયા વગર પવિત્રતા નથી આવતી. અનંતકાળથી જીવ દોષિત છે, એને સૌથી પહેલા તેનો (દોષનો) પશ્ચાત્યાપ થયા વગર પવિત્રતાની દિશામાં એક ડગલું પણ એ આગળ નહીં વધી શકે. પરિભ્રમણની ચિંતામાં આ વાત હોય છે. ‘અને એ મહાવૈરાગ્યને આપે છે’ આ જે સ્મરણ છે, એ મહાવૈરાગ્ય આપે છે; એટલે બહુ જ ઉદાસીનતા આવે છે.

જીવને નુકસાન કરવાવાળા પરિણામોમાં અનેક પ્રકારના પરિણામો છે, એમાં મુખ્ય અપેક્ષાવૃત્તિ છે, શું છે ? આ જોઈએ, તે જોઈએ, આ જોઈએ, તે જોઈએ, કાંઈ નહીં તો છેવટે તમે મારી સામે જોયું નહીં - એ પણ એક અપેક્ષા છે. તમે મને આ પૂછ્યું નહીં -- એ પણ એક અપેક્ષા જ છે. જીવને, અહીંયાંથી માંડીને ગણી શકાય નહીં તેટલી અપેક્ષાવૃત્તિ

હોય છે. આ અપેક્ષાવૃત્તિ એ એક એવી આગ છે કે (જે) જીવને બાળે છે અને જેમ જેમ અપેક્ષિત વસ્તુઓ મળે છે એ આગમાં ધી હોમવા બરાબર થાય છે. એને યારેય શાંતિ નથી મળતી. આ ચિંતામાં આવવાથી અપેક્ષાવૃત્તિ ખલાસ – ખતમ થઈ જાય છે. જુઓ ! દર્શનમોહનો અનુભાગ તો તૂટે જ છે. સાથેસાથે ઉદાસીનતાના કારણે અપેક્ષાવૃત્તિ મરી જાય છે. એટલે ઉદાસીનતા આવે છે. ઉદાસીનતા અને અપેક્ષાવૃત્તિ આપસમાં પ્રતિપક્ષમાં છે, વિરુદ્ધ છે.

પ્રશ્ન :— અપેક્ષાવૃત્તિ એટલે તૃષ્ણા ?

પૂ. ભાઈશ્રી :— તૃષ્ણા એનાથી વધારે હોય છે, અપેક્ષાવૃત્તિ ઘણી વધી જાય ત્યારે એને તૃષ્ણા કહે છે. અહીંયાં, તો નાની-મોટી અપેક્ષા પણ ન હોવી જોઈએ (એમ કહેવું છે)

પ્રશ્ન :-- અપેક્ષા રાખવી એ પણ અસરળતા છે ? હું તો સરળતાથી યારેક કંઈક ઇચ્છાનું હું ?

પૂ. ભાઈશ્રી :— જુઓ ! ‘હું સરળ હું’ એવું સરળતાવાળાને રહેતું નથી એ તો પોતે જ અસરળતા છે. અને બીજાથી સરળતાની અપેક્ષા રાખવી એ તો એનાથી પણ વધારે અસરળતાવાળી વાત છે. (એ તો) બહુ જ અસરળતાવાળી વાત છે, સરળતાવાળી કોઈ વાત નથી. સરળતા (એ) અલગ ચીજ છે. આપણાને તો એવી સરળતા હોવી જોઈએ કે હું બીજાથી શું કામ કંઈ અપેક્ષા રાખું ? શું કામ રાખું ? મારે નથી રાખવી – એક વાત, બીજી વાત એ કે જેને ઉદાસીનતા હોય છે એને અપેક્ષા હોતી જ નથી. એ તો ચિંતામાં દૂબેલો છે કે મારા પરિભ્રમણનું શું ? મારા પરિભ્રમણનું શું ? મારો (આ) રોગ કેવી રીતે મટે ? મારો ભવભ્રમણનો રોગ -- ભવરોગ કેવી રીતે મટે ? એની ચિંતામાં એ પડેલો છે, એને અપેક્ષાવૃત્તિ નહીં આવે. એ ઉદાસ, ઉદાસ, ઉદાસ થઈ જાય છે. કેવો થઈ જાય છે ? ખૂબ ઉદાસ થઈ જાય છે. ત્યાં સુધી કે એને ખાવા-પીવામાં યાંય રસ આવતો નથી. જે દરરોજનું Routine (રૂટિન) છે (દૈનિક કિયાઓ) – ખાવા, પીવું અને જે દરરોજ નું રસ લેવાનું રૂટિન (ઘરેડરૂપે

થઈ ગયું) છે શું ? ખાવા-પીવાનું પણ છે અને રસ લેવાનું પણ એક Routine છે. આ જે Daily (દૈનિક) Routine છે એમાં એ ઉદાસ થઈ જાય છે. ઉદાસીન થવાથી, આ લાઈનમાં આવવા માટે જે અપેક્ષાવૃત્તિ અવરોધક હતી, એ (અવરોધક કારણ) દૂર થઈ ગયું. અવરોધ મટયો તો માર્ગમાં આવવા માટે સરળતા થઈ.

આ ચિંતનામાં વૈરાગ્યના કારણો અનેક પ્રકારનાં પડખા આપોઆપ ઉભા થઈ જાય છે કે જે આ કમમાં થવાવાળા આનુષ્ઠાંગિક પરિણામો છે. એટલે, આ પરિણામની સાથે-સાથે બીજા-બીજા પરિણામોનું Co-ordination (મેળ) થઈ જાય છે. ચિંતના વૈરાગ્યને જન્મ આપે છે, વૈરાગ્ય અપેક્ષાવૃત્તિને ઉડાડે છે. આમ, Co-ordination (મેળ) થઈ જાય છે અને અવરોધ મટી જાય છે. એટલે પહેલા જ ભવભ્રમણના વિષયમાં અને એના કારણરૂપ અપરાધોના વિષયમાં પશ્ચાતાપ થાય છે અને ભવિષ્યમાં આમ થશે તો શું થશે ? એની ચિંતા થાય છે, વેદના આવે છે અને એના નાશ થવાના ઉપાય માટે એ તડપે છે, જૂરે છે- એવી એક પરિસ્થિતિ ભી થાય છે.

પ્રશ્ન :— અપેક્ષાભાવ ભાંતિ છે ?

પૂ. ભાઈશ્રી :— હા, એ ભાંતિ છે. એ ભાંતિ ઉદાસીનતામાં ઢીલી પડી જાય છે. અપેક્ષા તો સુખબુદ્ધિના કારણે થાય છે. જેટલી પણ અપેક્ષાઓ છે એના પાછળ અભિપ્રાય સુખબુદ્ધિનો છે આધારબુદ્ધિનો પણ છે, અને ભો તાબુદ્ધિ પણ છે કારણ કે સુખ પણ ભોગવવું છે ને ! સુખ પણ ભોગવવું છે એટલે એ ભો તાબુદ્ધિ પણ હોય છે એનાથી કર્તાબુદ્ધિ પણ થાય છે એટલે બધી ગડબડ સાથે જ હોય છે. આવી ઉદાસીનતા આવવાથી એ ઢીલી પડે છે. આ જે બધા વિપરીત અભિપ્રાયો છે, બુદ્ધિ એટલે અભિપ્રાય, (એ) બધા ઢીલા પડે છે. પાચામાં જે કામ થાય છે એ બહુ જ મહત્વપૂર્ણ કામ થાય છે. જેને પરિભ્રમણની ચિંતના અને વેદના થઈ છે એનો અર્થ એ છે કે એને પરિભ્રમણ નથી જોઈતું, તો અભિપ્રાયની દૃષ્ટિએ વિચારીએ તો એનો સંસાર - પરિભ્રમણનો અભિપ્રાય હવે ગયો અને અભિપ્રાયની દૃષ્ટિએ ત્યાં મું ત થવાનો અભિપ્રાય થયો. આ અભિપ્રાય

વિષયક Change (ફેરફાર) થયો. બધા સંસારીઓનો અભિપ્રાય સંસાર વધારવાનો (અને) ભોગવવાનો હોય છે -- જે મોક્ષ વિરુદ્ધ (છે). અને એ જ અભિપ્રાય થી એ ધર્મસાધન કરે છે જેના ફળમાં એને સંસાર જ મળે છે. સૌથી પહેલાં આ અભિપ્રાયની ફેરબદ્ધી થવી જરૂરી છે અને આ અભિપ્રાય મૂળમાંથી બદલાય છે. એટલે એના ફળમાં નિર્વાણપદ આવશે. અભિપ્રાય બદલ્યા વગર, પરિણામ બદલવાવાનો કે યોગ્યતા બદલવાવાનો કોઈ અવસર આવતો નથી.

પ્રશ્ન :- આગ્રહભાવમાં પણ અપેક્ષા છે ?

પૂ. ભાઈશ્રી :- આગ્રહમાં અપેક્ષા તીવ્ર હોય તો આગ્રહ થઈ જાય. જ્યારે અપેક્ષા તીવ્ર થાય છે ત્યારે તો એ અપેક્ષિત ચીજ મળવી જ જોઈએ, ન મળે તો સળવળાટ શરૂ થઈ જાય, તોફાન ભું થઈ જાય, કષાય તીવ્ર થઈ જાય છે; આગ્રહમાં કષાય તીવ્ર થઈ જાય છે એટલે કે એ અપેક્ષા વધારે તીવ્ર થઈ ગઈ, તારતમ્યતા વધી ગઈ; અપેક્ષામાં તારતમ્યતા વધી ગઈ. કૃપાળુદેવે ચારેય પેરેગ્રાફના અંતમાં એ વાત લખી છે.

એનો અર્થ એ થાય છે કે પરિભ્રમણની ચિંતના આવા-આવા પ્રકારથી ચાલતી હોય છે અને ત્યારે વૈરાગ્ય અનિવાર્યરૂપે હોય જ છે. એ તો લૌકિક ચિંતામાં પણ એવી જ હાલત હોય છે. ભલને ગમે તેટલું પોતાને ભાવતુ-સારુ જમવા બેઠો હોય, જમતા હોઈએ અને ઇન્કમટે સની (Income Tax) રેડ (દરોડો) પડે, (તો) શું થઈ જાય ? જમવાનો રસ વૈરાગ્યમાં પરિવર્તિત થઈ જશે, રસ ડી જશે. - પરિણામ ઇન્કમટે સની રેડનો સામનો કરવામાં લાગી જશે. કેમ ? કે એક ચિંતા ભી થઈ ગઈ. જ્યારે એ તો એક કષાય છે. ઇન્કમટે સની રેડની ચિંતા થવી એ પણ એક કષાય છે કે જે બીજા કષાયને મારે છે -- જમવામાં જે રસ આવતો હતો એ પણ એક કષાય હતો. જ્યારે એક કષાય બીજા કષાયને મારે છે તો કષાયનો અભાવ કરવાવાળો ઉપાય (વેદના) કષાયને ન મારે એવું કેમ બને ? એ તો મારે ને મારે જ, એમા શું મોટી વાત છે ? (કારણ કે) એનો ઉપાય જ એ છે. ત્યાં તો બીજા વિષયમાં કષાય પરિવર્તિત થઈ ગયો, અહીંયાં

તો અક્ષાય સ્વભાવમાં જોવાની વાત છે. એટલે આ ચિંતાથી તો વૈરાગ્ય આવે, આવે અને આવે જ અને આ વૈરાગ્ય આખ્યો એ ચિંતનાની યથાર્થતાને સૂચિત કરે છે. જો વૈરાગ્ય ન આવે તો કાંઈ ચિંતા-ચિંતના આવી જ નથી, એમ સમજુ લેવું. સાથે -- સાથે આ એનું માપ કરવાનું લક્ષણ છે. એટલે જ કૃપાળુદ્દેવે ચારેય પેરેગ્રાફમાં આ વાત લખી છે. બીજો પેરેગ્રાફ કાલના સ્વાધ્યાયમાં લેશું.

d

જિઝાસા : ચાલતા પરિણામોનું અવલોકન કરવાથી વેદના-જુરણા આવે કે ‘વેદના કેમ નથી આવતી ?’ એવી ચિંતનાથી વેદના આવે ? યથાર્થ પદ્ધતિ કઈ છે ?

સમાધાન : ‘વેદના કેમ નથી આવતી ?’ એવી ચિંતનાથી વેદના આવતી નથી. પરંતુ અનંત પરિભ્રમણની (વાસ્તવિક) ભયંકરતા ભાસે અને તેના કારણરૂપ પોતાની વર્તમાન દશા હજી પણ ચાલુ છે. તે મટાડવાની છચ્છા હોવા છતાં. તેમ થતું નથી, તેની મુંઝવણ થવાથી, અને તે પરિણામો એક લયે ચાલવાથી વેદના આવે છે. અહીં પ્રારંભમાં ચાલતા પરિણામોનું અવલોકન થાય તેવી ભૂમિકા નથી, તેથી તે વેદના આવવાનું કારણ નથી.

- પૂજ્ય ભાઈશ્રી

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૨૮

પ્રવચન-૪

તા.૦.૨૬-૧૨-૯૭ (સવારે)

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્ર ૧૨૮ ચાલે છે. પરિભ્રમણની ચિંતના કેવા કેવા પ્રકારે હોય છે તેનું પોતાના સ્વાનુભવથી વર્ણન કરે છે. બીજા પેરેગાફથી (આગળ લઈએ), “વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ?”

“વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદે કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ?”

સ્વચ્છંદ એટલે તીવ્ર રસવાળો કષાય. એ પણ સ્વચ્છંદનો એક પ્રકાર છે કે જેમાં ખચકાટ ન હોય -- Without Hesitation (ખચકાટ વગર) – લૌકિક પ્રવૃત્તિમાં તીવ્ર કોધ, માન, માયા, લોભના પરિણામ થાય છે એને સ્વચ્છંદ કહે છે. ધાર્મિક પ્રવૃત્તિમાં જ્ઞાનીની આજ્ઞાએ નહીં ચાલીને પોતાની મનમાની કરવી -- એ સ્વચ્છંદ છે, એટલે જ્ઞાનીના માર્ગ નહીં ચાલીને પોતાની કલ્યનાથી ધર્મસાધન કરવા એ સ્વચ્છંદ છે. આવી રીતે સ્વચ્છંદ કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી ? ‘આમ ન કરવું જોઈએ’ – એવું

કેમ ન આવ્યું ? ‘મારે આમ નહોતું કરવું જોઈતું -- એમ કેમ ન આવ્યું ?

શરીરનાં રોગના વિષયમાં આપણે આવી ભૂલ નથી કરતા. આપણે શું ? અભિષ્ણ માણસ હોય છે, એ પણ નથી કરતો. આપણે તો કંઈક બુદ્ધિજીવી માણસો છીએ, બુદ્ધિથી કંઈક કામ કરીએ છીએ, બુદ્ધિથી જીવન જીવીએ છીએ. આપણું ઉપજીવન-કમાણી વગેરે બુદ્ધિથી કરીએ છીએ પણ જે અભિષ્ણ હોય છે, શારીરિક પરિશ્રમથી પેટ ભરતો હોય, એ પણ રોગ થાય ત્યારે ડો. ટૃ પાસે જાય છે, એ પોતાની મેળે દવા નથી લેતો. અને કોઈ છલાજનું પુસ્તક વાંચવાનો પ્રયાસ નથી કરતો. આપણે શું કરીએ છીએ ? કાં તો ગ્રંથ વાંચવા બેસી જઈએ છીએ, કાં તો વ્રતાદિ ઉપવાસ કરી લઈએ છીએ, જેમ મનમાં આવે તેમ કરીએ છીએ. જેની પાસે શરીરબળ છે એ વ્રતાદિમાં લાગી જાય છે, જેની પાસે બુદ્ધિબળ છે એ ગ્રંથ વાંચવામાં લાગી જાય છે. એ તો થયું તનબળ અને મનબળ, હવે રહ્યું ધનબળ. જેની પાસે પૈસા હોય એ દાન દેવામાં લાગી જાય છે અને માને છે (કે) અમે કંઈક ધર્મ કરીએ છીએ. પણ, આ વિષયના તજજી કોણ છે ? જ્ઞાની કોણ છે ? અને આ ધર્મસાધન કેવી રીતે કરવા જોઈએ ? આ વાત સમજ્યા વગર પોતાની મનમાની કરી લ્યે છે.

આમ જ અનંતકાળ વીત્યો છે; એટલે પરિભ્રમણ ધૂટચું નહીં, પરિભ્રમણ મટચું નહીં. જેને મટાડવાની અભિલાષા હોય, જન્મ-મરણથી જેને ધૂટવું હોય, એને આ વિચાર આવે છે (કે) મેં આવું કેમ કર્યું ? આવી ભૂલ કેમ કરી ? નહોતી કરવી જોઈતી. “બીજા જીવો પરત્યે કોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માંનું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ?” આ અહિતકર છે, આત્માને અહિત કરવાવાળા છે એમ કેમ ન જાણ્યું ? ‘યથાયોગ્ય’ કેમ ન જાણ્યું ? એટલે કે કોધ, માન, માયા, લોભના જે પરિણામો થાય છે, એને યથાર્થતામાં (અહિતકર્તા છે) એમ જાણવું જોઈતું હતું. યથાર્થતા એટલે શું ? મુમુક્ષુની ભૂમિકામાં (પરિણામ) કેવા હોય છે ? જ્ઞાનીની ભૂમિકામાં (પરિણામ) કેવા હોય છે ? આ ચાર પ્રકારની

કર્મ-પ્રકૃતિ છે – કોધ, માન, માયા, લોભ. બધા જીવોને આ ચારેય પ્રકૃતિનો કર્મથી ઉદ્ય આવે છે. યારેક બે કે ત્રણનો સાથે પણ (ઉદ્ય આવે) છે.

યારેક કોઈને ચારેય મુખ્ય હોય છે, યારેક કોઈને ત્રણ મુખ્ય હોય છે, યારેક કોઈને બે મુખ્ય હોય છે, વળી યારેક કોઈ પણ એક મુખ્ય હોય છે અને ત્રણ સામાન્ય હોય છે. તો મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનુંધીનો પ્રકાર શું છે ? જ્ઞાનીની ભૂમિકામાં અનંતાનુંધીનો પ્રકાર નહીં હોવાથી આ ચાર પ્રકૃતિના પરિણામ કેવા હોય છે ? મુનિદશામાં સંજ્વલનના પ્રકાર કેવા હોય છે ? એ યથાયોગ્ય કાંઈ ન જાણ્યું. એટલે આપણો જે મુનિ નથી એને મુનિ માન્યા, જે જ્ઞાની નથી એને જ્ઞાની માન્યા, જ્ઞાની છે એમને અજ્ઞાની માન્યા અને મુમુક્ષુને પણ ન ઓળખ્યા કે કોણ કેવા હોય છે? યથાયોગ્ય ન જાણ્યું. કારણ કે આ દોષ છે એમ પરિચય છે એટલે સમજાય છે પણ યાં (કંઈ ભૂમિકામાં) કેમ હોય એનું વિજ્ઞાન આપણી પાસે નહીં હોવાથી આપણે જાણતા નથી.

“એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું”,..... આ જાણવું જરૂરી હતું, આપણા હિત-અહિત માટે જાણવું જરૂરી હતું. “છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે”. પરિભ્રમણ નહીં કરવાના વિષયમાં, કરવાના એટલે નહીં કરવાના વિષયમાં વૈરાગ્ય આપે છે; પરિભ્રમણ નથી કરવું. આ પરિભ્રમણનાં કારણોને છોડી દેવા જોઈએ. ખાસ કરીને પોતાના જે તીવ્ર પરિણામ છે – કોધ, માન, માયા અને આપણી ધર્મપ્રવૃત્તિ જ્ઞાનીની આજ્ઞા અનુસાર નથી, એ વિષયમાં આપણા એવા પ્રકારનાં પરિણામ હોવાં જોઈએ કે એ આપણા પરિભ્રમણનાં કારણ બને છે. હવે, મારે પરિભ્રમણથી છૂટવું છે – પરિભ્રમણમાં ચાલવું નથી, આમ વૈરાગ્યપૂર્વક પરિણામ ચાલવા જોઈએ તો જ રસ ઓછો થશે.

મુમુક્ષુની ભૂમિકામાં જે વૈરાગ્ય હોય છે, એ નિરસ પરિણામોને વૈરાગ્ય કહે છે. લોકો ત્યાગને વૈરાગ્ય સમજે છે પણ મુમુક્ષુની ભૂમિકામાં એ વાત નથી. કોઈ (ત્યાગ) કરે છે. ઠીક છે, પણ, નિરસતા એ જ વૈરાગ્ય છે અને એ જ આ ભૂમિકાનો ત્યાગ છે. કોધ, માન, માયા, લોભનાં પરિણામોમાં

નિરસતા આવવી જોઈએ, આ ચારિત્રમોહનાં પરિણામો છે, જે પરિભ્રમણની ચિંતનાનાં કારણે ચારિત્રમોહનાં પરિણામોમાં નિરસતા આવશે તો જે દર્શનમોહનાં પરિણામ છે એની શરીર (પણ) કીણ થશે. શું સંબંધ થયો? વાત શું લીધી છે? કે ચારિત્રમોહનાં પરિણામો સ્વચ્છંદથી એટલે તીવ્ર રસે કર્યા છે, હવે જેને પરિભ્રમણની ચિંતા થઈ એના કોધ, માન, માયા, લોભના પરિણામો ફિક્કા પડી જશે. ફિક્કા થવાથી દર્શનમોહનાં પરિણામો પણ કીણ થતા જશે. આ બસે વાત બનવાથી જ્ઞાનમાં નિર્મળતા (આવે છે એટલે) પોતાના હિત-અહિતની સૂજ (અને) એ પ્રકારના વિવેકની પ્રાપ્તિ થાય છે. આમ, ચારિત્ર, શ્રદ્ધા અને જ્ઞાનમાં ફેરફાર થાય છે કે જે મુખ્યગુણો છે. આને એક જ શબ્દમાં ‘પાત્રતા’ કહેવાય છે. એક શબ્દમાં એને ‘પાત્રતા’ કહેવાય છે. મુમુક્ષુની પાત્રતા, મોક્ષાર્થીપણું, આત્માર્થીપણું. અમાં શું હોય છે? કે એનો જે દર્શનમોહ છે એ નભળો પડે છે. એના જ્ઞાનમાં હિત-અહિતનો વિવેક પ્રાપ્ત થાય છે અને એના ચારિત્રમોહના પરિણામ ફિક્કા પડી જાય છે. આમ, મોક્ષમાર્ગમાં જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું એ જ ત્રણેય પ્રધાન ગુણોમાં, મુમુક્ષુતાની ભૂમિકામાં આ પ્રકારનો ફેરફાર આવી જાય છે. અને આ જ ફેરફાર આગળ વધીને એ ત્રણેય ગુણો આત્મસનુભ થાય છે અને એને (જ) સમ્યક્ કહે છે. આ પરિભ્રમણની ચિંતનાથી આ પાત્રતાની શરૂઆત થાય છે અને એ વૈરાગ્ય સહિત હોય છે.

“વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રી આદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંતકાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશર્યકારક નથી.” શું કહે છે? (પહેલા) રાગનો વિષય લીધો (છે). જીવને તીવ્ર રાગ હોય છે. પતિને પત્ની ઉપર, પત્નીને પતિ ઉપર રહે છે, કે એના વિના હું જીવી નહીં શકું. મારું જીવન નહીં ચાલી શકે, તીવ્ર રાગ આવો હોય છે. અનંતકાળમાં આવાં ઘણાં પરિણામ કર્યા અને આયુષ્ય પૂરું થયે આવા પદાર્થો છોડ્યા, વિયોગ પણ થઈ ગયો. પોતાનું (આયુષ્ય પૂરું) થઈ જાય અથવા તો સામેવાળાનું (આયુષ્ય પૂરું) થઈ જાય.

કોઈ ને કોઈનું તો આયુષ્ય પૂરું થવાનું જ. તોપણ ચાલતા જીવનમાં એમ લાગે કે હું જીવી નહીં શકું. આના વિના હું જીવી નહીં શકું. આવો તીવ્ર રાગ હોય છે. છતાં, એના વગર પોતે મર્યાદાની જીવતો રહ્યો છે એની સાબિતી વર્તમાન વિદ્યમાનતા છે કે વર્તમાનમાં આપણે જીવતા છીએ-એ વાત જે આપણા અનુભવમાં આવી હતી કે ‘હું નહીં જીવી શકું - હું નહીં જીવી શકું’ એ વાત તદ્દન ખોટી હતી. ખોટી હતી એટલે કલ્યાનામાત્ર હતી, શું ? કલ્યાનામાત્ર હતી. એમ જ કહેશે.

“અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો રાગ કહો કે સાંસારિક પ્રેમ કહો, પ્રીતિ કહો (એક જ વાત છે) જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્યિત હતો” શું હતું ? કલ્યિત હતો. વાસ્તવિક પરિસ્થિતિ એવી નહોતી. એક જમાનામાં યારેક યારેક એવું થતું (કે કોઈ) માણસ મરી જાય તો (એની) સ્ત્રી એની પાછળ સતી થઈ જતી, એ પણ ચિંતામાં બળી જતી, કે હવે મારું જીવનું કંઈ જરૂરી નથી. એ એક માન્યતા છે કે એની સાથે હું પણ ચાલી જઈશ. એવું કાંઈ સંભાવિત નથી કે મરી ગયો (છે) એની સાથે બીજો મરે તો (બસ્તે) સાથે જ જાય. એ કાંઈ આપણા કંદ્રોલની (Control) વાત નથી. કારણ કે જીવનમાં જે પણ કર્મબંધન કર્યા છે એ બધાએ અલગ-અલગ પ્રકારના કર્યા છે અને પોતપોતાનાં કર્મ ભોગવવા ભોગ્યસ્થાનોમાં એ ઉત્પન્ન થઈ જાય છે. એમાં કોઈનું ચાલે નહીં, કે હું આની પાછળ જાઉં; સાથે રહું, એવો જે સાથે રહેવાનો રાગ છે એ (રાગ) કામમાં આવતો નથી. તોપણ, તીવ્ર રાગવશાત્ કોઈ આવું કરી લેતા હતા. હવે તો એ જમાનો નથી, પણ આવું કરતા હતા. તોપણ, એ રાગ અનુસાર વસ્તુસ્થિતિ તો છે જ નહીં.

વસ્તુનાં સ્વરૂપ અનુસાર, સિદ્ધાંત એવો છે કે રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ જ નથી. (કોઈ) પણ પ્રકારનો રાગ લઈ લ્યો, કે દેખ લઈ લ્યો, અથવા કોઈ પણ વિકારભાવ લઈ લ્યો; એના અનુસાર વસ્તુનું સ્વરૂપ જ નથી. આ સિદ્ધાંત છે. બતાવો લ્યો ! કોઈ પણ એક દૃષ્ટાંત લઈ લ્યો કે આવો રાગ થયો (અને એવું જ) વસ્તુનું સ્વરૂપ છે. કેમ (નથી) ?

કે રાગ બીજા પદાર્થો પર કરવામાં આવે છે, (જેમાં) કોઈ ચેતન છે, કોઈ અચેતન છે. હવે. બસે પદાર્થ (તો) બિન છે, (પણ) જીવ રાગથી સંબંધ જોડે છે. રાગના માધ્યમથી જીવ બિન પદાર્થો સાથે સંબંધ કરે છે. ખરેખર તો બે પદાર્થને યારેય સંબંધ જ નથી. બે પદાર્થને વચ્ચે દ્વય-ક્ષેત્ર-કાળ-ભાવ, ચારેય પડખેથી અત્યંત અભાવ છે. અભાવ છે એટલે એકબીજામાં, એકબીજાનું કામ થવાનો કોઈ પ્રકાર બનતો (જ) નથી. જે કાંઈ પણ પરિણામ થાય છે એ બનેમાં પોતપોતાની યોગ્યતાનાં કારણો, પોતપોતાની યોગ્યતા અનુસાર થાય છે. બધા પદાર્થો પોતાના ગુણધર્મ અનુસાર પરિણામન કરે છે, આ પદાર્થનું વિજ્ઞાન છે. આમાં ઇચ્છા, રાગ, દ્વષ, મોહ કાંઈ કામમાં ન આવી (શકે). સંસારનાં લોકો કે જે એનાથી અજાણ છે, તેઓ ચાહે છે કે પોતાની ઇચ્છા અનુસાર બનતું રહે. પણ, એમ થતું નથી, બહુભાગ એમ બનતું નથી. એટલે જ બેદબિન થાય છે, આકુળિત થાય છે, દુઃખી થાય છે, અને દુઃખનું કારણ જાણતા નથી (કે) આપણે દુઃખી કેમ થયા ? એનું કારણ જાણતા નથી. એક જ વાતની જીદ, હઠ હોય છે કે પદાર્થ મળે તો હું સુખી થઈશ, નહીં મળે તો હું દુઃખી થઈ જઈશ. અને મળે ત્યારે સુખ થતું નથી, કારણ કે સુખ માટે ફરીને પાછો પ્રયાસ ચાલુ (જ) રહે છે. જો, સુખ મળતું હોત તો કોઈ સુખ માટે પ્રયાસ જ ન કરતો હોત.

અહીંયાં, મનુષ્યલોકમાં તો એટલો પુણ્યયોગ નથી જેટલો દેવલોકમાં (છે). તોપણ, ત્યાં પણ ખૂબ જ આકુળતાની અજિન હોય છે, સામાન્ય નથી હોતી - બહુ જ હોય છે. ત્યાં કર્દી વેપાર, ધંધા, વ્યવસાય, નોકરી કાંઈ નથી, બધા સંપત્તિ છે, બીમારી નથી, ત્યાં કોઈ ડો ટર નથી, દેવોમાં ધન્વન્તારિ વૈદ્ય હોય છે પણ દેવો તો બીમાર પડતા જ નથી. એટલે એની જરૂર જ પડતી નથી. ન તો બાળપણ છે, ન વૃદ્ધાવસ્થા છે તોપણ બહુ જ દુઃખ છે, ખૂબ જ દુઃખી છે, કારણ શું છે ? કે સમાધાન નથી થતું. સુખ નથી મળતું એ વિષયમાં કાંઈ સમાધાન થતું નથી. અને ત્યાં પણ ઓછા-વધતા, ઓછા-વધતા પુણ્યવાળા દેવ હોય છે. જે ઓછા પુણ્યવાળા

હોય છે તે વધારે પુષ્યવાળાની ઈર્ષા કરે છે, જેમ અહીંયાં થાય છે, અહીંયાં શું થાય છે ? ચાલવાવાળો (કે) સાયકલ ચલાવવાળો ગાડી સાથે પોતે ભટકાઈ જાય તો માર કોને પડશે ? ગાડીવાળાને. કેમ ? એમ કેમ ? એમાં કાઈ ન્યાય છે કે નહીં ? ભૂલ ગાડીવાળાની ન હોય છતાં માર કોને પડે છે ? ગાડીવાળાને. કેમ ? ગાડીની ઈર્ષા છે ને ! બધાની પાસે તો ગાડી ન હોય (તો) જેની પાસે છે એણે આમ કેમ કર્યું ? બસ ! કોઈ જોશે નહીં, કોઈ વિચાર પણ નહીં કરે ! આ જ ઈર્ષાનું પ્રમાણ લોભની તીવ્રતાનાં કારણે, દેવલોકમાં સૌથી વધારે હોય છે. એટલે ત્યાં દેવલોકમાં બહુ જ દુઃખ હોય છે. કેટલા દુઃખી છે ? કે ખૂબ જ દુઃખી છે.

આપણો ત્યાં એવું થાય છે કે નહીં ? જે મોટા-મોટા Industrialist (ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ) હોય છે તેઓ (બીજાના) Murder (ખૂન) કરાવે છે કે નહીં ? હું ! એકને પણાડવામાં, મારવામાં કેટલી (રાજનીતિ) ચાલતી હોય છે એમાં !? લાખો-કરોડો (રૂપિયા) હોવા છતાં તેઓ કેટલા દુઃખી છે ? એના પરિણામની Film (ફિલ્મ) દેખાડવામાં આવે તો બબર પડી (જાય) કે બહુ જ દુઃખી છે- આપણા કરતાં વધારે દુઃખી છે.

એટલે જ, સંસારમાં ગરીબ પણ સુખી નથી અને ધનવાન પણ સુખી નથી. મનુષ્ય પણ સુખી નથી અને દેવ પણ સુખી નથી. તિર્યંચ, નારકી તો કેટલા દુઃખી જ છે એ કહેવાની જરૂર નથી. એટલે આપણો પ્રયાસ ચારેય ગતિનાં પરિભ્રમણથી ધૂટવાનો હોવો જોઈએ અને એ પ્રયાસ કરવામાં આપણા કેવાં-કેવાં પરિણામથી પરિભ્રમણ થાય છે ? એ વાત આપણી સમજણમાં આવવી જોઈએ, આપણી સૂજમાં આવવી જોઈએ અને આ વિષયમાં એનો નિષેધ હોવો, એનો કરડો નિષેધ હોવો એ જ પરિભ્રમણની ચિંતના અને વેદના છે. આમ થયા વિના ધૂટવાના માર્ગમાં કોઈ આગળ વધી ન સકે.

આવો રાગ અને પ્રીતિભાવ કલિપત હતો, “એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાય આપે છે.” મને આવું કેમ થયું ? આવી કલ્પના મેં કેમ કરી ? કે જેનાથી મારું પરિભ્રમણ વધારે વધી ગયું,- આવું મેં

કેમ કર્યું ? આવા તીવ્ર રાગના પરિણામ પરિભ્રમણ વધારનારા છે. હવે અહીંયા સવાલ એ ભો થશે કે શું પરિવારના સભ્યો પ્રત્યે રાગ ન હોવો જોઈએ ? આ તો અમારી Feelings (લાગણીઓ) છે, અને આ જ અમારું જીવન છે – જો આ ન રહે તો પછી જીવનમાં શું રહેશે ? શું વધશે ? આ સવાલ ભો થાય છે. આ સવાલ કોને ભો થાય છે ? કે જેને પરિભ્રમણની ચિંતા ન હોય તેને; પરિભ્રમણની ચિંતાવાળાની આ વાત નથી. આવો પણ એક સવાલ સામે આવશે, આમ જોઈએ તો આ સવાલ તો તમારે કરવો જોઈએ કે જ્યારે આપસમાં Feelings નથી રહેતી તો પછી એક બીજાની એકબીજા પ્રત્યેથી જે Duty (ફરજ) છે, અનું પાલન કોણ કરશે ? આવી વાત સાંભળીને તો દીકરો બાપની સેવા જ નહીં કરે અનું શું ? પછી ઘર, ગૃહસ્થીની વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા કેવી રીતે ચાલશે, આવો સવાલ સામે આવશે. જુઓ ! આ માર્ગ વિવેકનો છે, અવિવેકનો નથી, એ વાત ઠીક છે ! વિવેક એટલે પરમવિવેકનો છે. હવે, જેને આત્માની, પોતાના હિત-અહિતનો વિવેક જગ્યાત થયો છે એને પરસ્પરના લૌછિ વ્યવહારમાં આપસમાં કેવી રીતે સુખ-શાંતિથી રહેવું એ વાત સારી રીતે સમજાય જાય છે. આ ઉપદેશનો કોઈ એવો અર્થ નથી કે તમે જે કોઈ વ્યવહારિક Duty કે ફરજ હોય એને બંધ કરી ધ્યો; ઉપદેશનો આશાય એવો નથી. પણ, આવા કાર્યો કરતી વખતે જે પોતાપણું થાય છે એને બંધ કરી ધ્યો.

માનો કે જેમ કોઈ એક છ-બાર મહિનાનું બાળક છે, એની મા પોતાપણું કરીને અનું પાલન-પોષણ કરે છે અને નોકરાણી છે એ એની પરવરિશ કરશે, એની મા પણ પરવરિશ કરશે; રાજા, મહારાજા, શ્રીમંતશેઠને ત્યાં આવી Lady (આયા) રાખવામાં આવે છે જે મા કરતા પણ વધારે સારી રીતે પરવરિશ કરે છે. કેમ ? કેમકે (એ) આયા આ વિષયમાં Expert હોય છે. એટલે જ તો એને આ નોકરી દેવામાં આવે છે, કે બાળકોની પરવરિશ કરવામાં (એ) બહુ Clever (હોશિયાર), બહુ Expert (તજ્જશ) હોય છે. અને મા કરતાં પણ સારી (પરવરિશ) કરે છે. એટલે બાળકોની

પરવરિશ કરવી એ કોઈ અપરાધ નથી પણ ‘મારું બાળક’ એવા પરિણામ અપરાધ છે.

જો ઘરમાં કોઈ બીમાર હોય (તો) એની (માટે) દવા લાવવી, એને કોઈ સેવાની જરૂરત હોય તો એ કામ કરવા એ કોઈ અપરાધ નથી. પણ, આ મારા ફલાણા છે એટલે હું આમ કરું – આ પરિણામ અપરાધ છે, કારણ કે આ મમત્વ જે છે એ ભય અને બધા પ્રકારના દુઃખો અને દોષોનું ઉત્પાદક છે. એટલે ફરક પડે છે તોપણ, કોઈ Problem (સમસ્યા) હોય તો (એની) ચર્ચા કરી શકીએ છીએ. તમને શું-શું Problem આવે છે બતાવો - કેમ હોવું જોઈએ ? કેમ ન હોવું જોઈએ ? વ્યવહારિક કામો બરાબર કરો, (પણ) બિમત્વ રાખીને, બિમત્વ સમજીને; પોતાપણું નથી કરવું – એટલી જ વાત છે. કારણ કે આપણું અસ્તિત્વ અને બીજા જીવનું અસ્તિત્વ ઓક નથી. બિમત્વ બિમત્વ અસ્તિત્વ છે, મમત્વ કરવાથી કોઈ ફાયદો નથી. નુકસાન જ નુકસાન છે. મમત્વ કરવાથી નુકસાન જ નુકસાન છે. કોઈ ફાયદો નથી, અને કામ તો જે થવાનું હોય એ જ થાય છે, ન થવાનું હોય એ નથી થતું. કાંઈ છચ્છાથી થાય છે એવું કાંઈ નથી. એમ, આપણે છચ્છાએ કે ઘરમાં કોઈ બીમાર પડે જ નહીં અને તોપણ બીમારી આવી જાય તો દવા દેતાંની સાથે જ એ ઠીક થઈ જાય – એવું કાંઈ સંભવ નથી. થવાનું હોય એમ જ થાય છે, ન થવાનું હોય એ નથી થતું. આપણે પોતાપણું નહીં કરીને Duty Perform (ફરજ બજાવવી) કરવાની છે. Duty (કાર્ય) તો કરવાની છે પણ પોતાપણું કરીને નહીં એ ફરક છે. એ તો વાત થઈ અંદરની, બહારમાં તો સારી રીતે કામ થશે, અંદરમાં પરિણામ ફરી જશે, તો પોતાને દુઃખ નહીં થાય, આકુળતા નહીં થાય નહીંતર (જ્યાં) મમત્વ છે ત્યાં પહેલા ભય થાય છે, મમત્વની સાથે ભય હોય જ (છે) જોઈ લ્યો તમે જ્યાં જ્યાં મમત્વ થતું હોય, જેટલું મમત્વ વધારે, એટલો ભય વધારે અને એટલું દુઃખ વધારે. Practical વાત છે, એકદમ Practical વાત છે.

જ્યારે (બીજો) પદાર્થ બિમત્વ છે તો મમત્વ કરવાનો ફાયદો શું ?

જ્યારે વસ્તુસ્થિતિ એવી છે કે બિન-બિન પદાર્થ છે, આપણું અસ્તિત્વ જ ત્યાં નથી, (તો) આપણો પોતાપણું કેવી રીતે કરીએ છીએ ? પોતે જ છેતરાય છે કે આ દીકરો મારો છે, આ મારી છે, એ મારું છે- (બધી) ગરબડ છે. આપણું અસ્તિત્વ અહીંયાં છે, એનું અસ્તિત્વ ત્યાં છે અને આપણો ઈચ્છાએ એવા જ દરેક સમયે પરિણામ પણ સામેવાળાના નથી હોતા. આપણો ઈચ્છાએ કે (એના) (એવા) પરિણામ થાય, આને આવો ભાવ થાય, આને આવો ભાવ થાય, આને આવો ભાવ થાય, - એ શું થઈ શકે ? એના ભાવ એની યોગ્યતા અનુસાર થશે, આપણા ભાવ આપણી યોગ્યતા અનુસાર થશે. એકબીજાનાં પરિણામ કરી શકાય છે શું ? યારેય સંભવ નથી.

પ્રશ્ન :— શું અભિપ્રાયમાં પારકાપણું રાખવું ?

પૂ. ભાઈશ્રી :— અભિપ્રાયમાં એ વાત છે -- બધા બિન-બિન છે, બાકી તો બહારની જે Duty છે એ Perform કરી લેવી. અભિપ્રાયમાં બિનતા (હોવી જોઈએ) સમજણમાં અત્યારે તો એ રીતે સમજણ હોવી જોઈએ.

પ્રશ્ન :— આત્મકલ્યાણનું લક્ષ સૌ પ્રથમ રાખીને પ્રવૃત્તિ કરવી ?

પૂ. ભાઈશ્રી :— પહેલાં જ આત્મકલ્યાણનું લક્ષ કરવું. સૌથી પહેલાં જ આત્મકલ્યાણનું લક્ષ નથી એ રીતે તો સંસારના જીવો જીવે છે. બધાંય એમ જ જીવે છે. પહેલા તો એ (લક્ષ) હોવું જ જોઈએ, પછી જ એને અનુસાર બધી જ પ્રવૃત્તિ યથાયોગ્ય લક્ષપૂર્વક ચાલશે, નહીંતર નહીં ચાલે.

એક સવાલ છે, વધારે સ્પષ્ટતા કરીએ; યારેક આત્મકલ્યાણનાં લક્ષવાળો જીવ પોતાના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધે છે, અગ્રેસર થાય છે ત્યારે એનું સાંસારિક Duty ઉપરથી લક્ષ ઓદ્ધુ થઈ જાય છે. ત્યારે સાથે રહેનારને એવું થાય કે મારા પ્રતિ Negligence (ઉપેક્ષા) Intentionally (ઇરાદાપૂર્વક) થઈ રહી છે. શું ? ઇરાદાપૂર્વક આ મારા પ્રતિ બેદ્રકાર (રહે) છે અને આ અમે(હું) સહન નથી કરી શકતા. શું ? આ

વાત અમે સહન (નથી કરી શકતા). આમ વાત બને છે ત્યારે પરિસ્થિતિ નાજુક બને છે, ત્યારે પરિસ્થિત થોડી નાજુક બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ? કોણો - શું કરવું જોઈએ ? જેને અસમાધાન રહે છે તેણે શું કરવું ? કેવી રીતે સમાધાન કરવું ? આ પ્રશ્ન તો તમારે લોકોએ ઉદાવવો જોઈએ કે નહીં ? (બધાને) અનુભવ તો થતો જ હોય છે (ને) ! ત્યારે ખરેખર, તો એની ચર્ચા કરી લેવી જોઈએ, કે આ આમ કેમ થાય છે ? જો Honestly એટલે કે પ્રમાણિકતાથી એવું બનતું હોય, અર્થાત્તુ એ પોતાના આત્મકલ્યાણનાં પરિણામ લાગ્યા હોય અને બીજી બાજુ ધ્યાન ન જતું હોય (તો) આ વાતને સહન કરી લેવી સારી છે. (કે) આપણો તો નથી કરી શકતા પણ ઓછામાં ઓછું જે કરે છે એની અનુમોદના તો કરીએ ! એ આપણા માટે સારુ છે. આપણા પોતાને માટે આ માર્ગમાં આવવા માટે આ સારી વાત છે, પણ આપણો આપણી સુવિધા માટે એટલી હદે Selfish (સ્વાર્થી) ન થઈ જવું કે સામેવાળો પોતાનો માર્ગ છોડી આપણા ઉપર ધ્યાન દેવા લાગે, એમ ન થવું જોઈએ. અને આપણી જે અપેક્ષાવૃત્તિ છે એ આપણને જ દુખદાયક છે. આપણો બીજાથી અપેક્ષા શા માટે રાખવી ? શું કારણ છે ? જેટલી અપેક્ષાવૃત્તિ રહેશે એટલું ઉદાસીનતાથી દૂર (જ) જવાનું છે. જેટલી અપેક્ષાવૃત્તિ રહેશે એટલું ઉદાસીનતાથી દૂર જવાની વાત છે. અનંતકાળથી અપેક્ષા કરી કરી ને જ તો દુઃખી થઈ રહ્યો છે. હવે તો વૈરાગ્યમાં આવવાનું છે. ઉદાસીનતામાં આવવું છે તો અપેક્ષાવૃત્તિને તો છોડવી જ જોઈએ. સંસારમાં નાનામાં નાની લડાઈ, વિગ્રહ, કલેશ છે તે અપેક્ષાવૃત્તિ ને કારણે જ છે. મારી અપેક્ષા પૂરી ન થાય એટલે મને ગુસ્સો આવે છે. બસ ! કલેશ અહીંથી શરૂ થાય છે. હવે કે જ્યારે આપણા સિદ્ધાંતો અને વસ્તુસ્વરૂપ તો એવા છે કે અપેક્ષા થાય જ નહીં.

પ્રશ્ન :-- જ્યાં અમારું મમત્વ છે ત્યાં જ્યુટી પરફોર્મ કરી લઈએ અને જ્યાં મમત્વ નથી ત્યાં ઉપેક્ષા રાખીયે. એ બરોબર છે ?

પૂ. ભાઈશ્રી :-- એ તો બિલકુલ બરાબર નથી. મમત્વ છે તો ઉદાસીનતા છે જ નહીં યાંય પણ મમત્વ છે તો ઉદાસીનતા છે જ નહીં.

અને ભમત્વ હોય ત્યાં તો સહુ કોઈ કરે છે અને ભમત્વ ન હોય ત્યાં નથી કરતાં, આખી દુનિયા એમ જ કરે છે. તો પછી એમાં ને આપણામાં શું ફરક પડ્યો? બધાં એમ જ કરે છે. એમાં ને આપણામાં શું ફરક પડ્યો? અહીં તો ખરેખર જે આત્મકલ્યાણને માર્ગ આગળ વધે છે, આગળ વધી રહ્યા છે, તેને કારણે ઉદાસીનતા આવે છે. સંસારિક કાર્યોમાં ઉદાસીનતા આવે છે, તો તે બરાબર છે. એવી ઉદાસીનતા હોવી જોઈએ અને અને કારણે સંસારમાં, ઘરમાં કલેશ નહીં થવો જોઈએ. એના કારણથી નહીં થવો જોઈએ.

પ્રશ્ન :-- ભાઈશ્રી ! આપ જે રીતે કહો છો એ પ્રકારે મુમુક્ષુ આત્મકલ્યાણના માર્ગમાં આવે અને ઘરમાં કલેશ શરૂ થઈ જાય. જેને ઉદાસીનતા આવી હોય તે ઘણું Explain કરે, સમજાવવા પ્રયત્ન કરે, તોપણ કલેશ ચાલુ રહેતા હોય તો અમારે મુમુક્ષુએ શું કરવું ?

પૂ. ભાઈશ્રી :- મુમુક્ષુએ તે પ્રકારનો ઉદ્ય જ્ઞાણીને તેમાં પણ ઉદાસીન રહેવું. એ પણ એક પ્રકારનો ઉદ્ય છે, આપણે ઘણું છચ્છીએ કે સામેવાળાને સમાધાન થઈ જાય, એને પણ શાંતિ રહે, પરન્તુ એ જરૂરી નથી કે આપણે છચ્છીએ તેમ બને જ, ન પણ બને. અને એમ નહીં થવામાં તેનું કારણ તેની પાસે છે અને (આપણાં) ઉદ્યનું કારણ આપણી પાસે છે. શું છે ખરેખર ? આપણે પૂર્વમાં એવા કર્મો બાંધ્યા છે અને તે જ ઉદ્યમાં આવી રહ્યાં છે, તો એમ થવાનું કારણ તો આપણું પોતાનું જ છે, અને સામેવાળાને પરિણામ નથી થતાં એનું કારણ એની પાસે છે. આપણે આપણું પોતાનું કારણ જોવાનું છે. સામે વાળાનું કારણ આપણે નથી જોવાનું-સમાધાન આ પ્રકારે કરવુ - યારેય પોતાનાં પરિણામ થવામાં બીજા કોઈની જવાબદારી છે એમ નથી લેવાનું. યારેય નહીં ને ! આપણાં પરિણામ પણ આપણે કારણે જ છે અને આપણો ઉદ્ય પણ આપણે કારણે જ છે. ભલે તે ઉદ્ય પછી પ્રતિકૂળતાનો હોય કે અનુકૂળતાનો હોય.

હવે તમે કહેશો કે આ પ્રતિકૂળ ઉદ્ય છે એટલે અમને ગમતો નથી. એ પ્રકાર શું અમને ન હોવી જોઈએ ? -- પણ પ્રતિકૂળ ઉદ્ય તો આ

માર્ગમાં વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર હોય છે. આ માર્ગમાં, આ લાઈનમાં પ્રતિકૂળતાનો ઉદ્ય જીવને તરવા બરાબર છે, અને વૈરાગ્ય ઉત્પન્ન કરનાર છે. ત્યારે સંસારનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જેથી વૈરાગ્ય આવશે, અને ઉદાસીનતા વધશે તો એ પ્રતિકૂળતા આપણે માટે પ્રતિકૂળતા નહીં રહે પરન્તુ પ્રતિકૂળતા આપણે માટે એક પ્રકારની અનુકૂળતા થઈ પડશે. આ લાઈનમાં (માર્ગમાં) જ્ઞાની થવા માટે આ એક બહુ જ સુંદર ન્યાય છે. કારણ કે જ્ઞાનીઓની એ જ Policy છે, એ જ નીતિ છે. આપણે એનું અનુસરણ કરવાનું રહે છે. કોઈ પણ ઉદ્ય આવી જાય ભલે અનુકૂળતાનો હોય કે પ્રતિકૂળતાનો હોય, એ માત્ર કહેવા પૂરતું છે, જ્યારે વાસ્તવમાં એવું કાંઈ છે જ નહીં. વસ્તુના સ્વરૂપમાં એવું કાંઈ છે જ નહીં. પરન્તુ કોઈ પણ પરિસ્થિતિ બને, પછી ભલે એને અનકૂળતા કહેવાતી હોય કે પ્રતિકૂળતા કહેવાતી હોય, આપણે એને કેવી રીતે આપણાં આત્મકલ્યાણમાં વાળી દેવી એ વાત, એ ટેકનીક આપણી પાસે હોવી જોઈએ. એ કાર્યપદ્ધતિ છે. જ્ઞાનીઓની એવી કાર્યપદ્ધતિ છે, અને મુમુક્ષુને એવી કાર્યપદ્ધતિ હોવી જોઈએ કે કેવી રીતે આપણે એ પ્રસંગોને આત્મકલ્યાણમાં ઘટાવી લેવા. એ રીતનો વળાંક લેવાનો છે. પછી તમને યાંય તકલીફ થવાની નથી. ગમે તેવી પરિસ્થિતિમાં તમે આત્મકલ્યાણમાં અગ્રેસર થઈ આગળ વધતાં જશો. કોઈ પણ ઉદ્યની ચિંતા તમને નહીં થાય.

જેમકે તમારી કોઈ નિંદા કરે છે. અને માનો ન કરવા જેવી નિંદા કરે છે. બરાબર ! તો તમને ખરાબ લાગશે પણ ખરેખર ન લાગવું જોઈએ. કેમ ? તમને ખરાબ લાગશે પણ ખરેખર ન લાગવું જોઈએ કેમ ? કેમકે પણ એક પ્રકારના કર્મનો ઉદ્ય છે જે અર્થ ભૂતકાળમાં આપણે કોઈ પરિણામ કર્યા હતાં. તો એ તો આપણાં અપરાધને કારણે થયેલું કાર્ય છે. સામેવાળો વર્તમાનમાં અપરાધ કરે છે. તેનું તે જાણો. હવે આપણો જે ઉદ્ય છે તે એક પ્રકારનું કરજ હતું જે આપણે ચૂકવી રહ્યા છીએ. ચૂકવવાનું તો આપણે છે એમાં પેલો મદદ કરે છે. તો એનું આપણે ખરાબ શા માટે લગાવવું ? તે તો મદદ કરવાવાળો છે. જેમકે તમારા કપડાં મેલાં થયાં હતાં અને

સામેવાળો પોતાના સાબુ, પાણી, સોડા બધું પોતાનું લઈને આવ્યો, અને ધોવાનો પરિશ્રમ પણ તે જ કરે છે, ત્યારે તમે એનું ખરાબ લગાડો તો એ યાંનો ન્યાય છે ? બિલકુલ ખરાબ લગાડવું ન જોઈએ. અંદરથી ખુશ ખુશ થઈ જવું. કેમ ? ભલે બહારમાં કાંઈ દેખાવ કરવાની જરૂર નથી. પણ અંદરમાં રાજી-રાજી થઈ જવું કે ચાલો આ સારું થયું. આ પણ એક સારું થયું. આ પણ એક સારું થયું, તમને કાંઈ થવાનું નથી. વળી તમને શું ફરક પડે છે ? એના પરિણામ એની પાસે છે. એના પરિણામ, એના ભાવ, એના આત્મામાં ચાલે છે, તમને તો કોઈ સ્પર્શ પણ કરતું નથી. આપણે આપણી જાતને શા માટે Involve કરીએ, ભેળવીએ. કોઈ જરૂરિયાત નથી.

સમાધિશતકમાં આચાર્યદેવ પૂજ્યપાદસ્વામી છે તે કહે છે કે કોઈ નિંદા કરનાર, ગાળ દેનાર મને તો જોઈ શકતો નથી. મને તો કોઈ જોઈ શકતું નથી. હું તો અરૂપી આત્મા છું, એમના ઇન્દ્રિયજ્ઞાનનો વિષય થઈ શકું તેમ નથી. કોઈના પણ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય હું તો છું નહીં અને આ શરીરને જુઓ છે પણ એ તો હું છું નહીં. જેને એ દેખે છે એ તે હું છું નહીં અને મને એ જોઈ શકતો નથી, પછી તે મને કહે છે એ વાત યાંથી આવી ? એ મારી વાત છે નહીં. સંસારમાં યાંચ દુઃખી થવાનું કારણ છે જ નહીં. સંસારમાં કોઈ દુઃખનું કારણ છે જ નહીં. કેમ ? કારણ એણો તો આપણું કરજ ચૂકવી આપ્યું, કરજ ચૂકવવામાં મદદ કરી દીધી. સારી વાત છે. આપણી ફરજ તો એ હતી કે આપણું કરજ સામે ચાલીને દેવા જવું જોઈએ કે ભાઈ ! તમે મને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા, તેનું વ્યાજ અટલું થાય છે, તે સાથે તમે લઈ જાઓ. એના બદલે સામેથી એ જ લેવા આવી ગયો તો પછી પ્રમાણિકતા તો એમાં રહી છે કે તમને વ્યાજ પણ દેવું જોઈએ અને આવવા-જવાનું ભાડું અથવા પેટ્રોલના પૈસા પણ આપી દેવા જોઈએ. પ્રમાણિકતા પૂર્વક આટલી ઓફર મૂડી દેવી જોઈએ. અને તમારો સમય બગડ્યો માટે હજી વધારે બોલો તો હજુ વધારે આપી દઈએ એવું થવું જોઈએ કારણ કે અમારો તો સમય બચ્યો. તમારા રૂપિયા

હતા, તમારું વ્યાજ હતું અને તમે આવવા-જવાનો પરિશ્રમ લીધો -- તેથી પરિશ્રમના પૈસા પણ લઈ લ્યો. સમય બગડ્યો તેના પણ પૈસા લઈ લ્યો અને આવવા-જવાનું ભારું પણ લઈ લ્યો. એમ પૂરી પ્રમાણિકતાથી થઈ જાવ ઉદાર ! એવી વાત છે.

હવે કહો જોઈએ ! ચા ઉદ્યમાં તમને તકલીફ પડે છે ? બતાવો તેમ છતાં કોઈ ઉદ્યમાં તકલીફ થતી હોય તો કહેજો. બધાંનું Solution (સમાધાન) છે. એક પણ સવાલ એવો નથી કે જેનો જવાબ અહીંયાં નથી. No Question Remains Unanswered એક પણ સવાલ નથી રહેતો. આત્મા સર્વાંગ સમાધાન સ્વરૂપ છે અને આત્મા પ્રાપ્ત કરવાનો માર્ગ પણ સર્વાંગ સમાધાનરૂપ જ હોય છે. એક અંગમાં પણ અસમાધાનનો સવાલ નથી રહેતો. એટલા માટે જ્ઞાનીને ગમે તે પરિસ્થિતિમાં સમાધિ હોય છે. લખે છે કે નહીં કૃપાળુદેવ કે ઉપાધિમાં સમાધિ રહે છે. એ વાત તો પરસ્પર વિરુદ્ધ છે. ઉપાધિ પોતે જ દુઃખદાયક છે જ્યારે સમધિ સુખદાયક છે, પણ અહીંયાં બસે વાત છે. એટલા માટે જ સામાન્ય મનુષ્યને જ્ઞાનીનું સ્વરૂપ સમજાતું નથી. કે પરસ્પર બે વિરુદ્ધ વાત કેવી રીતે એકસાથે ચાલી રહી છે ? કે બરાબર ચાલે છે. પૂર્વકર્મ પોતાની ટ્રેક પર ચાલે છે, જ્યારે આત્મા પોતાની ટ્રેકમાં ચાલે છે. બસે ગાડીના ટ્રેક અલગ-અલગ છે તો પણ ચાલે છે બરાબર. અને તેનું નામ જ સાધકદશા છે. સાધકદશામાં તો બસે પ્રકાર ચાલવાના છે.

પ્રશ્ન :-- જ્ઞાનીગુરુથી પણ સમાધાન ન મળે તો દુઃખ નથી મટતું, તો શું કરવું ?

પૂ. ભાઈશ્રી :-- કોઈ અસમાધાન રહેવાનું જ નથી. કૃપાળુદેવે આત્મસિક્ષિશાસ્ત્રમાં ‘પરમ જ્ઞાન સુખધામ’ એમ લીધું છે. શું લીધું છે ? પરમ જ્ઞાન પણ તે જ અને સુખધામ પણ તે જ.

આ તો વાત ચાલી રાગના વિષયમાં, કે મેં ભૂતકાળ માં બહુ તીવ્ર રાગ કર્યો હતો અને તેના કારણે જ પરિભ્રમણ કર્યું. મારા તીવ્ર રાગના પરિણામ પરિભ્રમણના કારણભૂત થયાં છે હવે એવું ન થઈ જાય એ

વિષયમાં મારે જગ્રત રહેવાનું છે. તે જગૃતિ ઉદાસીનતાને ઉત્પન્ન કરશે. એ જગૃતિ નિરસપણાને લાવશે. અને શરૂઆતની ભૂમિકા માટે તે જ યથાર્થ પરિસ્થિતિ છે. જેટલો રાગ તીવ્ર હશે એટલું દુઃખ પણ તીવ્ર થશે. આ ભૂમિકામાં તે જેટલો મોળો પડશે, તેટલું આપણે માટે સારું છે. વીતરાગ તો રાગના અભાવમાં થવાય છે. આપણાં જે કોઈ વીતરાગ જિનેન્દ્ર પરમાત્મા થયાં તે સર્વેએ રાગનો અભાવ કરી દીધો. પણ એનું વિજ્ઞાન એવું છે કે રાગ મંદ પડ્યા વગર તેનો અભાવ થઈ શકે નહીં. અનંતકાળથી તેને ધૂંઠચો છે. અને તેની પરિણાતી બનીને જામ થઈ ગઈ છે. જેમ કાટ લાગી જવાથી બોલ્ટ-નટ જામ થઈ જાય છે. તેમ આમ જોઈએ તો કાટના પરમાણુ તો બહુ ઝીણાં-ઝીણાં હોય છે પરન્તુ એનામાં તાકાત એટલી બધી હોય છે કે તેને ફેરવવા વાળો કેટલી પણ મહેનત કરે ટસથી મસ નથી થતો. એક સેન્ટીમીટર પણ તે ખસતો નથી. પછી તેમાં કેમીકલ રસાયણની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે કાટ ઢીલો પડે છે. અને પછી તે બોલ્ટ ફરે છે. નહીંતર તાકાત લગાવવાવાળા પાસે મોટા મોટા સાધન હોય છે, અને તાકાત પણ ઘણી લગાડે છે જ્યારે પેલાં કાટનાં પરમાણુ તો સાવ થોડા છે તોપણ મચક નથી આપતાં. પછી ત્યાં કોઈ એવું સોલ્યુશન / કેમીકલ લગાડી એને કમજોર કરી નાખવામાં આવે છે અને પછી તાકાત લગાડવામાં આવે છે તો કામ થઈ જાય છે. દરેક કામની પણ કોઈ ટેકનીક હોય છે.

અહીંયાં પણ આપણે વ્યવસ્થિત કામ કરવું છે. ગમે-તેમ નથી ચાલવું પરન્તુ વ્યવસ્થિતરૂપે યોજનાબદ્ધ કામ કરવાનું છે. અને તો જ સરળતાથી, સુગમતાથી હંમેશ માટે આ કામ થશે. હંમેશ માટે સુખ-શાંતિ જેનું ફળ છે એ પ્રાપ્ત થશે. આપણે પણ કાંઈ પણ કરીને કે નહીં કરીને પણ સુખ-શાંતિ જ જોઈએ છે. આપણે ખોટો રસ્તો છોડી દઈને સાચો રસ્તો પકડી લેવાનો છે. એટલી જ વાત છે. અને તે અર્થે જ જ્ઞાનીઓએ આ બધી લાંબી-લાંબી વાતો કરી છે.

પ્રશ્ન :— મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રોજે ટ બનાવવો પડશે ?

પૂ. ભાઈશ્રી :— હા ! પ્રોજેક્ટ બનાવવો પડશે. પૂર્ણતાનું લક્ષ બાંધવાનું છે અને પરિભ્રમણની ચિંતનાથી એની પ્રોસેસ (પ્રક્રિયા) શરૂ કરવાની છે. એકદમ વ્યવસ્થિત વાત છે. Scientific વાત છે. ઉભાંગડે ચાલવાનું નથી. અત્યાર સુધીમાં મનમાની તો બહુ કરી. હવે એ કરવાની નથી.

હજુ તો આ રાગના વિષયમાં પેરેગ્રાફ લખ્યો છે. હવે દ્વેષના વિષયમાં લખે છે, કે મેં દ્વેષ પણ કેટલો કર્યો છે, જ્યારે પરિણામમાં દ્વેષ હોય છે, પ્રતિપક્ષમાં રાગ તો હોય જ છે. બસે એક મોહનાં જ સંતાન છે. કેવાં છે ? મોહનાં જ સંતાન છે. બસે હોય જ છે. કોઈને ફ ત રાગ જ હોય અને દ્વેષ ન હોય એવું નથી બનતું. રાગની પૂર્તિ નથી થતી, ત્યારે દ્વેષનો જન્મ થઈ જ જાય છે. તે પાછળ ભો જ છે. પડદા પાછળ તે ભો જ છે. આપણા આત્માએ દ્વેષ પણ બહુ જ કર્યો છે. કેવી-કેવી રીતે કર્યો છે તે અને તે જ આપણા પરિભ્રમણનું કારણ થયું છે — એ વિષયમાં હવે પછીના પેરેગ્રાફમાં કહેશે. તે સાંજના સત્સંગમાં લઈશું.

d

શ્રીમદ્ રાજચંદ્ર
પત્રાંક-૧૨૮

પ્રવચન-૫
તા. ૨૬-૧૨-૯૭ (રાત્રિ)

(શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૧૨૮ ચાલે છે.)

કલ્યાણથી કેવો તીવ્ર રાગ થાય છે કે જેનો રાગ થાય છે. એના સંયોગ વગર જીવી નહીં શકાય એટલી હદનો રાગ થાય છે. કોઈ કોઈ તો મૃત્યુ પણ પામે છે. એ રાગને વશ કોઈ કોઈ તો મૃત્યુ પણ પામે છે. પણ એ કેવળ કલ્યાણ હોય છે. જીવ એ સંયોગ વિના અનંતકાળ રહેવાનો છે અને રહેશે. એ કલ્યાણનો વિચાર કરતાં પણ એના ફળસ્વરૂપે વૈરાગ્યની અને ઉદાસીન ઉત્પત્તિ થાય છે. હવે દ્વેષ કેવા પ્રકારે થાય છે, તે કહે છે.

“વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં,” મોહું જોવા માંગતો નથી. એટલે કેવો દ્વેષ હોય ? કે એની સામું હું જોવા માંગતો નથી. સામે આવે તો સામું જોવા માંગતો નથી. “જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં કરું,” સ્વીકાર નહીં કરું, સામેથી ગરજ કરીને આવે તોપણ હું હવે સ્વીકાર

કરવાનો નથી, “તેને વેર પુત્રપણો, સ્ત્રીપણો, દાસપણો, દાસીપણો, નાના જંતુપણો, શા માટે જન્મ્યો ?” એવા જ કોઈ કર્મનું બંધન થાય છે કે એને ત્યાં પોતે દીનતા કરે એવી પરિસ્થિતિ(માં) જન્મે છે. દ્વેષ ઘણો કર્યો હોય, અધિકાર બુદ્ધિથી દ્વેષ કર્યો હોય, લટાનો એને ત્યાં દાસપણો, દાસીપણો, સ્ત્રીપણો, એનો કૂતરો થઈને આવે, ઘરનો ઉંદર બને. દ્વેષભાવથી એવા કર્મો બંધાય. અને અભિમાન કર્યું હોય, જેની સાથે દ્વેષથી અભિમાન કર્યું હોય, એની આગળ પોતાને દીનતા કરવાનો વારો આવે. આ એક કુદરતની વ્યવસ્થા છે. જે માણસો બહુ અભિમાન કરે છે, એને એવા કર્મ બંધાય છે કે એના ફળ આવે ત્યારે એને ઘણી ગરજ અને ઘણી દીનતા, ઘણી યાચકવૃત્તિ કરવી પડે, એવી પરિસ્થિતિ એની આવે.

ગુરુદેવશ્રી એક દ્રષ્ટાંત આપતા હતા કે બહુ અભિમાન કરતો હોય, બહુ માન કરતો હોય કે મારી કિંમત સૌથી વધારે થવી જોઈએ, મને સૌથી વધારે માન મળવું જોઈએ, (એ) એકેન્દ્રિય વનસ્પતિમાં જાય અને મૂળામાં મફતમાં વેચાય, મૂળામાં મફત વેચાય એટલે શું ? એક જમાનામાં એવું હતું કે શાક લેવા જાય, બે-પાંચ-દસ રૂપિયાનું શાક લે તો ઘણું ઘણું શાક ખરીદ્યું કહેવાય, પાંચ-દશ રૂપિયાનું શાક (ખરીદે) પછી ઉપર અમુક ચીજ કોથમીર જેમ મફત લે, મરચાં મફત લે એમ મૂળો મફત માંગી લ્યે. એક મૂળો આપો, છોકરો સાથે છે એને મૂળો ખાવો છે. એ મૂળામાં (પૂર્વ) અભિમાન કરેલા ભાઈ બેઠેલા હોય. એકન્દ્રીયપણો ત્યાં એની સિથિત હોય પેલો કાઢિયો, શાક વેચનારો. મફતમાં આપે એને. અભિમાન કરવાવાળાની એવી દશા થાય છે.

“અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું !” દ્વેષના કારણો એવો જન્મ થયો. “અને તેમ કરવાની તો છચ્છા નહોતી,” બિલકુલ છચ્છા નહોતી. બીજા ઉપર સત્તા ભોગવવી હતી એના બદલે દ્વેષ કરતાં-કરતાં પોતાની ઉપર કોઈ સત્તા ભોગવે એવી પરિસ્થિતિ આવી. પહેલા બીજાને પરતંત્ર કરે. દ્વેષથી શું કરે ? બીજાને પરતંત્ર કરવાના પરિણામ કરે પછી એને પોતાની દીનતા ને એનાથી પરતંત્ર થવાનો વારો આવે

“કહો એ સમરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ?” પોતાને પોતાના પ્રત્યે ધિક્કાર આવે, કે આ જીવ વગર વિચાર્યે એટલે કે અવિચારપણે કેવા વિચિત્ર દ્રેષના પરિણામ કરે છે કે જેથી પોતે જ વધારેમાં વધારે દુઃખી થાય છે. આવી પોતાની મૂર્ખતા ! –ખરેખર તો શું છે ? (એ) પોતાની મૂર્ખતા છે. અભિમાન કરે, દ્રેષ કરે ત્યારે ખબર નથી પડતી પણ એ ખરેખર પોતાની મૂર્ખતા છે અને જ્યારે એ સમજાય છે ત્યારે પોતાને પોતાના ઉપર ધૂશા થાય છે. અને એ વર્તમાન પરિસ્થિતિ એને વિશેષ વૈરાગ્યનું કારણ થાય છે.

આવી જે પરિભ્રમણની ચિંતના ચાલે છે એ અંતઃકરણને શુદ્ધ કરે છે. શું થાય છે ? એ વૈરાગ્ય, એ પશ્ચાત્યાપ, એ ચિંતના-વેદનાના પરિણામથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણની શુદ્ધિ થાય છે એટલે શું ? એ આત્મકલ્યાણની ભાવના જે છે અથવા મોક્ષ પામવાની, સંસારથી ધૂટવાની ભાવના જે છે, એ શુદ્ધ અંતઃકરણથી ઉત્પત્ત થાય છે, એમાં ઉપર ઉપરની છચ્છા નથી કેમકે એમાં એવો પણ એક પ્રકાર છે ખરો, કે કેટલાક જીવોને, મોક્ષમાર્ગમાં આવેલા જીવો જોઈને, પોતાને પણ એવી છચ્છા થાય છે, ઉપર ઉપરથી છચ્છા થાય છે. પણ અંતઃકરણમાં મલીનતા એવી ને એવી પડી હોય છે. પૂર્વ કરેલા અપરાધથી જે મલીન પરિણાતિ થઈ છે એ એવી ને એવી જામ થયેલી, જામી ગયેલી હોય છે. એને કાઢવા માટે, એનો નિકાલ કરવા માટે, આ પરિભ્રમણની ચિંતના આવશ્યક છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અંતકરણની શુદ્ધિનો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ વિના સાક્ષાત્ ભગવાન લેવા આવે તો (પણ) એ ના પાડે.

અન્ય મતમાં એવું એક દૃષ્ટાંત છે. એક શેઠ હતા. ભગવાનના ભક્ત તરીકે પ્રસિદ્ધ હતા. એની ભર્તા ત પણ પ્રસિદ્ધ હતી પણ એના અંતઃકરણની શુદ્ધિ નહીં. ત્યાં (અન્ય મતમાં તો) તો ભગવાન પરીક્ષા કરવા આવે કે શેઠ, તમે આખી જિંદગી મારી બહુ ભર્તા ત કરી છે. આપણા વિમાનમાં બેસી જાઓ ચાલો વૈકુંઠમાં. ત્યારે શેઠ કહે છે કે, પહેલા મારે કોઈ સંતાન નહોતું પણ આપની કૃપાથી અત્યારે જે છે એ દીકરો બહુ નાનો છે. જરાક

મોટો થાય (અને) આ વહીવટ સંભાળી લ્યે તો હું આપની સાથે આવી જાઉં. થોડુંક ખમી જાઓ. છોકરો મોટો થઈને વહીવટ સંભાળવા, કારોબાર સંભાળવા લાગ્યો. એટલે ભગવાન ફરીને આવ્યા. ને કહ્યું ચાલો શેઠ, તમારો છોકરો તો તૈયાર થઈ ગયો. (તો શેઠ કહ્યું) પણ હવે એના સગપણની વાતો ચાલે છે (એટલે) સગાઈ કરીને, લગ્ન કરી લઉં એટલે હું છુદ્દો, પછી આપની સાથે આવી જાઉં. ભગવાનને થયું ઢીક છે, આપણે એક આંટો વધારે. લગ્ન થઈ ગયા એટલે (ભગવાન) વળી પાછા આવ્યા, ચાલો ! (શેઠ કહ્યું પણ) એવું છે ને કે છોકરાની વહુને અધરણી આવે એવું છે. તો જરાક, છોકરાના છોકરાનું મોહું જોઈને આપની સાથે ચોક્કસ આવવાનો ભાવ છે. વળી પાછો બીજો વાયદો નાંખ્યો. એમ ને એમ એ વાયદો કરતા જ ગયા, આટલુંક કરી લઉં, એમાં સારાંશ શું છે ? આશય શું છે ? કે જીવ શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણ માટે તૈયાર નથી હતો ત્યારે કાંઈ ને કાંઈ વાયદો કરે છે. આટલું એક કામ થઈ જાય ને પછી કરીશ ! એક આટલું કામ થઈ જાય ને પછી કરીશ ! હવે એને ખબર નથી કે ઉદ્ય છે એની લાઈન લાગેલી છે, ઉદ્ય એક પછી એક, એક પછી એક, એક પછી એક, ચાલુ જ રહેવાના છે. આ થઈ જાય પછી કરું; આ થઈ જાય પછી કરું; પછી, પછી, પછી કરું એમાં આયુષ્ય થઈ જાય પૂરું ! (એ) શેઠનું આયુષ્ય પૂરું થયું અને વિષ્ટાનો કીડો થયો. ભગવાનને (એમ) થયું કે લાવને, ફરીને એક વાર (પ્રયાસ) કરું, ત્યાં પહોંચાં (અને કહ્યું) કાં શેઠજી ! હવે તો આવવું છે કે નહીં ? ત્યારે શું જવાબ દીધો ? કહ્યું કે એ શેઠના ભવ કરતાં (તો) અહીંથાં વધારે સારું છે. ત્યાંથી તો હું કદાચ આવત પણ અહીંથી (તો) આવવાનું મન થાય એવું જ નથી. એ શું બતાવે છે ? કે કેટલી એને રુચિ થયેલી ત્યારે ત્યાં ગયેલો, પછી તો રુચિના ફળમાં એટલી રુચિ Develop (વર્ધમાન) થઈ જાય છે કે પછી તો એને પોતાને જ ના પાડવાનું મન થઈ જાય છે. પછી કરીશ, પછી કરીશ, પછી કરીશ... વાળો એક વખત એમ કહી દેશો કે હવે નહિ. આ પરિસ્થિતિ આવે છે. એ અરુચિ સૂચક છે. એ શું સૂચવે છે ? અરુચિ

સૂચવે છે, આત્મકલ્યાણની રુચિ નથી. અને રુચિ નથી એટલે જરૂરત નથી એમ આપોઆપ સાબિત થાય છે. સંસારની રુચિ ઘણી છે એમ પણ એમાં સાબિત થાય છે.

(જે) ઉપર ઉપરની ઇચ્છાથી આત્મકલ્યાણ કરવાની વાત કરે છે પણ અંતઃકરણની શુદ્ધિ નથી. અને પ્રમાણિકપણે, ઈમાનદારીથી સંસાર છોડવો છે એ વાત નથી. (પોતાને) સંસારની મીઠાશ છે એમ માનવું. એ અંતઃકરણની શુદ્ધિ વિના ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવાનું જે ધ્યેય બાંધવું છે એ ધ્યેય બંધાતું નથી. ભલે, કોઈને વિકલ્પ આવે, રાગ આવે, ઇચ્છા થાય એ જુદી વાત છે. જેને યથાર્થ પ્રકારે મોક્ષનું ધ્યેય બંધાય, તેને મોક્ષ પ્રત્યેનો પૂરુષાર્થ અને પ્રયત્ન એ ભૂમિકામાં પડે જેને સંવેગ કહેવામાં આવે છે, એ સંવેગની ઉત્પત્તિ થયા વિના રહે નહીં એકદમ જોર આવે. કેમ આવે ? આવવાનું કારણ શું ? કે પોતે જ્યાં ભો છે ત્યાંથી મોક્ષ કેટલો દૂર છે ! એ અંતર અને દેખાય છે. મારે ઘણું અંતર કાપવાનું છે અને મારી પાસે સમય થોડો છે. એવી જ્યારે ખબર પડે ત્યારે ઉતાવળ થયા વિના રહે નહીં, આપોઆપ જ ઉતાવળ થાય. ઘણાં મુમુક્ષુઓની એ ફરિયાદ છે કે બધું સમજુએ છીએ પણ સંવેગ આવતો નથી, જોર થાતું નથી એનું શું કરવું ? કે પૂર્ણતાના લક્ષ વિના, મોક્ષના યથાર્થ ધ્યેય વિના સંવેગની યથાર્થ પ્રકારે ઉત્પત્તિ ન થાય. અને એ લક્ષ બાંધવા માટે અંતઃકરણની શુદ્ધિ અનિવાર્ય છે. અંતઃકરણની શુદ્ધિ માટે પરિભ્રમણની વેદના-ચિંતના અનિવાર્ય છે. એવી રીતે આ કમથી આ પ્રકારે પૂરુષાર્થની ઉપલબ્ધ છે એ વિના પૂરુષાર્થ ચાલે જ નહીં. ઇચ્છા હોય તો પણ થાય નહીં, એવી વ્યવસ્થા છે. એટલે આવા બધા પત્રમાં કેટલું ડાશ છે અને લખનારાનો અનુભવ કેટલો છે એ વિચારવા જેવો (વિષય) છે.

જ્યારે આ પ્રકારે યથાર્થ ચિંતના આવે છે, વૈરાગ્યની ઉત્પત્તિ ઉદાસીનતાની ઉત્પત્તિ થાય છે, ત્યારે હવે આ સંસારમાંથી કાંઈ જોઈતું નથી, હવે માત્ર મારે શેષ કાળમાં, આ ભવના બાકીના સમયમાં, આત્મકલ્યાણ જ કરી લેવું છે. એવી તીવ્ર ભાવનાથી ધ્યેય બંધાય છે. ભલે,

એમ થતાં વચ્ચે થોડી અંદરમાં ગડમથલ ચાલે, એમ બનવાનો સંભવ છે અને તેથી એ ગડમથલ ચાલે તો કેવી ચાલે ? એનો (ચિતાર) હવે પછીનાં વચ્ચનોમાં છે.

“વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવનું એ ચિંતના થઈ પડી છે.” આ જીવે ભૂતકાળમાં તો ભ્રાંતિથી અનંતવાર જન્મ-મરણ કર્યા પણ હવે શું કરવું ? એની એક ચિંતના થઈ પડી છે. એ પરિભ્રમણની ચિંતના છે. એ ચિંતનાના અંતે ‘ફરી ન જ જન્મવું, અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશો છે.’ શું કીધું ? એ ચિંતનાના ફળ સ્વરૂપે હવે કોઈપણ ભોગે જન્મ-મરણ જોઈતા નથી, At any cost, ગમે તે કિંમત ચૂકવવી પડે, હવે આવા દુઃખો કચારેય પણ ભોગવવાં નથી એવી એક દૃઢતા (ઉત્પન્ન થાય છે.) દૃઢ મુમુક્ષુતા ઉત્પન્ન થાય ત્યારે એવી એક દૃઢતા આત્મામાં પ્રકાશો છે એમ લખ્યું છે. શું ? એવો રાગ થાય છે, છચ્છા થાય છે એવું ન લખ્યું, કેવા શબ્દો વાપર્યા છે ! એનો અર્થ એ થાય છે કે એ આત્મા, કે જે પરિભ્રમણની ચિંતનામાં આવે છે, એ આત્મા અંદરથી પોકાર કરે છે કે હવે મારે ધૂટી જ જવું છે. હવે આ પરિભ્રમણથી મારે ધૂટી જવું છે એ આત્માનો અંતરાત્માનો પોકાર છે.

કૃપાળુદેવ એક પત્રમાં લખે છે કે ‘જેને ધૂટવું છે એને કોઈ બાંધનાર નથી’ ! શું લખે છે ? જેને ખરેખર આ સંસારથી ધૂટવું છે એને કોઈ બાંધનાર નથી. બધા બહાના પોતાની અરુચિના છે, બધા બહાના પોતાની ભાવનાની ખામીના છે. બાકી જેને ધૂટવું જ છે એને કોઈ બાંધનાર નથી અને જેને સ્વયં બંધાવું છે એને કોઈ છોડાવનાર નથી. ગમે એવા સમર્થ ગુરુ હો, સમર્થ જ્ઞાની હોય, અરે ! તીર્થકર હોય તોપણ એ છોડાવનાર નથી. ભૂતકાળમાં અનંત પરિભ્રમણમાં, આપણો આત્મા અનંતવાર વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જન્મ્યો છે, એમ નહીં, વિદેહ ક્ષેત્રનું કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નથી, બધા જ ક્ષેત્રમાં અનંતવાર જન્મ્યો છે. અનંતવાર તીર્થકરોના સમોસરણમાં દિવ્ય-ધ્વનિ સાંભળી છે, પણ વેદનાપૂર્વક અંતઃકરણની શુદ્ધિ

કરી નથી. એટલે જે કાંઈ થોડીધાણી અસર આવી હોય એ ઘોવાઈ જતાં વાર લાગતી નથી, (અસર) ઘોવાઈ જાય. કેમ ? જેને સ્વયં બંધાવું છે એને કોઈ છોડાવનાર નથી, જેને સ્વયં છૂટવું છે એને કોઈ બાંધનાર નથી.

“એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું ?” કેટલીક નિરુપાયતા છે, એમાં શું છે ? કે એવા પ્રકારના કર્મના ઉદ્યો સામે હોય છે કે એકદમ ઉલાણીયો કરીને નીકળી જાય, એવી પરિસ્થિતિના નથી હોતી. એટલે મુમુક્ષુજીવ એવી ભૂમિકામાં બહુ બળવાન નથી હોતો કે મુનિ-દીક્ષા લઈને, મુનિ-દીક્ષા અંગીકાર કરીને નીકળી જાય. એવું બળવાનપણું નથી હોતું ત્યારે શું કરવું ? કે એને કેટલુંક Adjustment કરવું પડે છે, કોઈ વ્યવસ્થા ગોઠવવી પડે છે અને પોતે પોતાના કાર્યને આગળ ધ્યાને છે.

આ વિષયમાં થોડી વધારે સ્પષ્ટતા એ પ્રકારે કરવા યોગ્ય છે કે ધ્યેય અને સિદ્ધાંતની અંદર બાંધછોડ હોતી નથી. નિર્ણયની અંદર પણ બાંધછોડ હોતી નથી, શ્રદ્ધામાં પણ બાંધછોડ હોતી નથી. બાંધછોડ Executive stage (અમલીકરણ) માં આવે છે, આચરણ કરતી વખતે બાંધછોડ આવે છે. જેમકે તમારી ટ્રેન (Train) કે પ્લેન (Plane) છૂટી જાય છે એવી બહુ સાંકડી (સમયની) પરિસ્થિતિમાં તમે પૂર ઝડપે પહોંચવા માંગો છો, વચ્ચે ટ્રાફ્ફિક (Traffic) આવે છે, ટ્રાફ્ફિક Signal પણ આવે છે. અને તમારે ન રોકાવું હોય, તો પણ Speed કાપવી પડે છે અને કચાંક રોકાવું પડે છે. જો તમે ત્યાં Adjustment ન કરો અને એક્સીડન્ટ (Accident) કરો તો અધવચ્ચે રહી જાઓ. તો કાયમ માટે પાછાં ! અધવચ્ચે જ રહી જાઓ અને Definately તમે ચૂકી જ જાવ, બીજું કાંઈ ન થાય. (એટલે) (ગાડી) નહીં ચૂકવા માટે પણ તમારે speed ઓછી કરવી કે રોકાઈ જવું (એ) અનિવાર્ય (બને) છે તે પણ Temporary હોય છે. આચરણની ભૂમિકામાં, હંમેશાં મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય (એ) Adjustment કરે છે પણ નિર્ણયમાં ફેર નથી પડતો, લક્ષ બદલતું નથી, શ્રદ્ધા બદલતી નથી, સિદ્ધાંત બદલતા નથી- એ બરાબર પકડી રાખે છે કે આમ કરવું

એટલે આમ જ કરવું આચરણની અંદર Adjustment કરવું પડે છે.

એટલે “જે દફતા છે તે પૂર્ણ કરવી” દફતા છે એતો દફતા એવી ને એવી છે કે, એ તો પૂર્ણ કરવી જ. જે ધ્યેય નક્કી કર્યું છે એ તો પૂર્ણ કરવું જ, જરૂર પૂર્ણ કરવું જ. શું ? “જરૂર પૂર્ણ પાડવી એ જ રટણ છે.” એટલે એ વાત નિરંતર લક્ષમાં છે ‘પણ જે કાંઈ આદું આવે છે, તે કોરે કરવું પડે છે.’’ રસ્તામાં જાડ પડી ગયું હોય તો કાં ગાડી બાજુમાંથી લેવા માટે થોડોક ફેરફાર કરવો પડે છે. પૂરજડપથી તો કાંઈ થાય નહીં, એકવાર તો ગાડી ભી રાખવી જ પડે એ જાડને ખસેડો, કોરે કરો, કાં તો પોતે તરીને નીકળી જાઓ. એ પ્રકારે. “જે કાંઈ આદું આવે છે એ કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે,’’ આદું આવે છે એને ખસેડવું પડે છે, એની વ્યવસ્થા કરવી પડે છે. “અને તેમાં કાળ જાય છે.” તેમાં થોડો સમય પણ લાગે છે એવી એક પરિસ્થિતિ ભી થાય છે. એ જે સમય જાય છે એ સમય બહુ કીમતી જાય છે એવું લાગ્યા વગર રહેતું નથી; એવું લાગ્યા વગર રહેતું નથી, કે “જીવન ચાલ્યું જાય છે.” મારા મનુષ્યભવનું અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે; વારંવાર આ મનુષ્યભવ મળે એવી કોઈ વ્યવસ્થા નથી, ભાગ્યે જ મળે એવી પરિસ્થિતિ છે, કોઈ વારંવાર મળે એવી પરિસ્થિતિ નથી.

જે મનુષ્યભવમાં આત્મકલ્યાણ કરવાની સારામાં સારી તક છે એ મનુષ્યભવમાં આત્મકલ્યાણ કરવા માટે પોતે Negligence (બેદરકારી)માં આવ્યો અથવા બીજા કામ આડે એને ગૌણ કર્યું તો મનુષ્યભવ ફરીને નહીં મળે એવી કુદરતી વ્યવસ્થા છે. ફરી ફરીને એ તક મળતી નથી કેમ કે પોતે એ તકનો લાભ લીધો નહીં, બેદરકાર રહ્યો, દરકાર કરી નહીં; (વારંવાર) મનુષ્યભવ નથી મળતો એવી પરિસ્થિતિ છે. એટલે એમ લાગે છે કે આ બહુ મોઘું “જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું” એને ન જવા દેવું જોઈએ; આ બધી ગડમથલ ચાલે છે, નિર્ધાર થતી વખતે આ ગડમથલ ચાલે છે પછી શુદ્ધ અંત:કરણથી ધ્યેય બંધાય છે. “જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય, ત્યાં સુધી, એમ દફતા છે તેનું કેમ

કરવું ?” કરવું શું પણ ? જીવ એક બાજુ પૂર્વકર્મના ઉદ્યથી ભીસાયેલો છે, બીજી બાજુથી એને સૂર્જયું છે કે મારે બહુ ગડપથી, શીઘ્રપણે, જેટલું થઈ શકે એટલું શીଘ્રપણે આત્મકલ્યાણ કરી લેવું જોઈએ.

પ્રશ્ન : આ લક્ષ બંધાયા પછીના પરિણામ છે ?

સમાધાન : નહીં, હવે લક્ષ બંધાશે. લક્ષ બાંધતી વખતના પરિણામ છે. શું ? લક્ષ બંધાતી વખતે જે ગડમથલ ચાલે છે એના આ પરિણામ છે. વિચાર્યું છે ને ! પછી (એ) વિચારનો નિર્ધાર આવશે. નિર્ધાર આવશે ત્યારે બહુ જોરથી આવશે. “કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન કયાં છે કે જ્યાં જઈને રહીએ ?” પોતાના પૂર્વકર્મને લઈને કોઈ હરાદાપૂર્વક પ્રતિકૂળતા આપે એને ઉપસર્ગ કહેવામાં આવે છે. કુદરતી જે પ્રતિકૂળતા ભી થાય એને પરિષહ કહેવામાં આવે છે.

“ભલે ગમે તે હો ગમે તેટલા દુઃખ વેઠો ગમે તેટલા પરિષહ સહન કરો ગમે તેટલા ઉપસર્ગ સહન કરો ગમે તેટલી વ્યાધિઓ સહન કરો.” શરીરરોગ (આવે), શરીર સાથ ન આપે, ભલે ગમે તેમ હો, આત્મકલ્યાણ કરવું છે, કરવું છે, ને કરવું છે. એટલે એમાં શરીર પ્રતિબંધ ગયો “ગમે તેટલી ઉપાધિઓ આવી પડે,” ઉપાધિઓ એટલે જવાબદારીઓ. એ જવાબદારીઓની વચ્ચે રહીને પણ આત્મકલ્યાણ કરવાની દૃઢતા એવી ને એવી હોય છે.

કૃપાળુદેવ વ્યાપારમાં બેઠા હતા ને ! મુંબઈથી આ પત્રો લખેલા છે, વીસ વર્ષની ઉંમરે વ્યવસાયની અંદર જોડાણા હતા. અને જેમ જેમ આગળ વધતા ગયા, એમ વૈરાગ્ય વધતો ગયો. વ્યવસાય-પ્રવૃત્તિથી છૂટવા માટે ઘણી તીવ્ર ભાવના થઈ પણ એમ ને એમ દસ વર્ષ નીકળી ગયા. ત્રીસમે વર્ષ તો કહી દીધું કે હવે મારી પરિસ્થિતિ કોઈ પણ રીતે વ્યવસાયમાં ભાગ લેવાની છે નહીં. મને છૂટો કરી ધો, હિસાબ-કિતાબ કરીને મને છૂટો કરી ધો. મારા ખાતે જે કાંઈ કમાણીની રકમ એકઠી થયેલી છે એ નાનાભાઈને ખાતે જમા કરીને મારું ખાતું સરભર – Nil કરી દ્યો. અત્યારે ત્રીસ વર્ષ તો ઘણાં કમાણી કરવાની Starting Position માં હોય

છે, એ ત્રીસ વર્ષે નિવૃત્ત થવાની પરિસ્થિતિમાં હતા અને ૨૫ વર્ષે ઘણો વૈરાગ્ય હતો ૨૪-૨૫ વર્ષે તો ઘણો વૈરાગ્ય હતો, કોઈ રીતે છૂટી જાઉં, કોઈ રીતે છૂટી જાઉં (એમ રહ્યા કરતું હતું) પણ પૂર્વ કર્મનો ઉદ્યનો ભીડો એવો હતો (કે) છૂટી શકતા નહોતા. વર્ષમાં એક-બે મહિના નિવૃત્તિ માટે ખંભાતને એ બાજુ ચરોતર બાજુ ચાલ્યા આવતા હતા. પણ વચ્ચે પોણા બે વર્ષ સુધી નથી નીકળી શક્યા. એટલે એક વર્ષ ખાલી ગયું. પછી બીજું પોણું (૩/૪) વર્ષ ગયા પછી લગભગ ચોમાસાના દિવસોમાં દર વર્ષ એ નિવૃત્તિ (અર્થે) નીકળતા હતા. શ્રાવણ-ભાદ્રવો-આસો મહિનામાં, વ્યવસાયની અંદર પણ દરેકને વ્યાપાર ઓછો હોય છે અને એ નિવૃત્તિના દિવસો ગણાય છે. ચોમાસુ એ ધાર્મિક દિવસોમાં ગણાય છે. ચાર મહિના તો બધા શાંતિ રાખીને કાંઈ ધર્મસાધન કરે એમ વચ્ચે પોણા બે વર્ષ ખાલી ગયા ! પોણા બે વર્ષ બહાર નીકળ્યા (હતા) અને ત્યારે પણ જાણો પ્રવૃત્તિનો પછડાટ લાગ્યો હોય એવી પરિસ્થિતિ છે. ઘણો ખેદ થાય છે, એ વાત જ્ઞાનદશામાં છે.

‘એ તો જીવનકાળ એક સમય માત્ર હો...’ આયુષ્ય પૂરું થવાની તૈયારી દેખાય તો સંસારના કાર્યો જલ્દી-જલ્દી પતાવવા કે આત્મકલ્યાણ જલ્દી-જલ્દી કરી લેવું ? સંસારના કર્યો સહુના પ્રારબ્ધ પ્રમાણે થવાના છે, પોતે કરે તો થાય એવી ભાંતિ રાખવા જેવી નથી. ઘરના એકે એક સભ્ય બધા જ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા છે, અનું કારણ એ છે; રોજનો દાખલો છે. કે ઘરમાં એક જ તપેલાની ખીચડી દસ જણાં ખાય એકને ગોસ થાય અને એકને પેટ સાફ આવે; એકને લટી થાય, એકને કબજિયાત થાય ને તો એકને વળી ઝાડા થાય – એ ની એ ખીચડી બધાએ ખાધી છે. બધાના પૂર્વકર્મ પ્રમાણો બધું ચાલે છે. નિમિત્તો સરખા હોવા છતાં પણ એના પ્રત્યાધાતો સરખાં હોતા નથી. જ્યારે એ કુદરતી વ્યવસ્થા છે, પછી હું કરી દઉં એ વાત આવી ક્યાંથી ? એ આપણી કલ્યના છે, આપણો નહીં હોઈએ તોપણ જે ચલવાનું છે એમ જ ચાલવાનું છે. આપણા પિતાશ્રી, દાદાઓ બધા એવું જ ઇચ્છતા હતા, એવું જ માનતા હતા કે અમે બેઠાં

છીએ તો કોઈક બધું સરખું ચાલે છે. એ બધા ચાલ્યા ગયા પણી પણ જેને સરખું ચાલવાનું હતું તેને સરખું ચાલ્યું અને નોંતું સરખું ચાલવાનું તેને સરખું ન ચાલ્યું. એમના હોવાથી પણ નો સરખું ચાલે તો; નો જ સરખું ચાલે. એમાં કોઈનું ડહાપણ કામ આવતું નથી. એ પારબ્ધ ઉપર વિશ્વાસ રાખીને અને એ વિશ્વાસને કારણો પોતે ઉદાસીનતામાં આવે એ પ્રકાર આપણી વિચારધારાનો હોવો જોઈએ, અને સુવિચારણા કહે છે. શું કહે છે ? કોઈ પણ પરિસ્થિતિમાં આત્મકલ્યાણની વાત મુખ્ય થવી અને કોઈ પણ પરિસ્થિતિમાં એ રીતે વાતને વિચારવી અને જ્ઞાનીઓએ સુવિચારણા કીધી છે.

ગમે તે પરિસ્થિતિમાં વિચારવાન જીવ છે એ એમ વિચારે છે કે આ પરિસ્થિતિમાં હું મારું આત્મકલ્યાણ કેવી રીતે કરી શકું ? “જો પ્રગટે સુવિચારણા, તો પ્રગટે નિજજ્ઞાન.” આત્મજ્ઞાન પ્રગટવાનું કારણ આ સુવિચારણા છે. ખાવું છે તો આત્માર્થ, અને ઉપવાસ કરવો છે તોપણ આત્માર્થ; બોલવું છે તોપણ આત્માર્થ અને મૌન રહેવું છે તોપણ આત્માર્થ, રળવું છે કભાવું તોપણ આત્માર્થ અને નિવૃત્તિ લેવી છે તોપણ આત્માર્થ; મારો આત્માર્થ કેમ સરે એ એક જ લક્ષે, મારે જે કંઈ કરવું છે તે કરવું છે અને નથી કરવું તે નથી કરવું. એવી જે વિચારણા અને સુવિચારણા કહે છે. જો એવી સુવિચારણા હોય તો એમાંથી આત્મજ્ઞાન પ્રગટ થાય. “જો જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણા” અને એ આત્મજ્ઞાનથી દર્શનમોહ તો ખલાસ થયો, ચારિત્રમોહ પણ ખલાસ થઈને છેવટે નિર્વાણપદની પ્રાપ્તિ થશે. આ એક કદીમાં સંક્ષેપમાં સુવિચારણાથી નિર્વાણપદ સુધીની આખી સાંકળ (સંકળના) મૂકી દીધી (છે).

કૃપાળુદેવનું વિષયને રજૂ કરવાનું સામર્થ્ય પણ અસાધારણ હતું. કોઈ પણ વિષયને એ વ્યક્ત કરતા હતા (ત્યારે) એમનો ઉપયોગ ચારે પડખે ફરી વળે અને એટલો ઠો જાય !! વિસ્તાર પણ એટલો જ અને ડાણ પણ એટલું જ ! એમની અનેક વિશિષ્ટતાઓ માંહેની (એક) આ પણ વિશિષ્ટતા છે. ઘણી વિશિષ્ટતાઓ હતી. આપણે ‘ધન્ય આરાધના’ માં ઘણી

વાતો લખી છે. ફૂપાળુદેવનું ગુણ સંકર્તન - ગુણોનું કિર્તન કરેલું છે. આપણે એ ગુણસંકર્તનમાં-ઉપોદ્ઘાતમાં બધી વાત નાંખી છે એક એક ગુણ કેવા કેવા હતા. ! (જે આ પુસ્તકની શરૂઆતમાં ફૂપાળુદેવના પરિચયરૂપે છપાયેલ છે).

“ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિભિત હો” નિમિત્તોની અનુકૂળતા ન હો, દુષ્ટ નિમિત્તો હો, પ્રતિકૂળ નિમિત્તો હો, “પણ એમ કરવું જો.” એમ કરવું એટલે આત્મકલ્યાણ કરવું જો. જન્મ-મરણ ન થાય એ રસ્તો પકડવો જો. “ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે.” એટલે આત્મામાંથી, અંતર આત્મામાંથી એ અવાજ આવે છે કે, હે જીવ ! તારે આ જ કરવાનું હોય બીજું તારે વિચારવાનું પણ ન હોય એમાં બીજો વિકલ્પ હોય જો નહીં. ‘અને તે યથાયોગ્ય લાગે છે.’ એવો જે અંદરથી અવાજ આવે છે તે, યથાયોગ્ય લાગે છે. એમાં યથાર્થતા છે અને એ યથાર્થતા વર્ધમાન થઈને સમ્યકૃતવરૂપે પરિણમશે.

મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતા અને જ્ઞાનદશાની ભૂમિકાની સમ્યકૃતા એ બન્ને એકબીજાના અનુસંધાનવાળી વાત છે. એ યથાર્થતાનું અનુસંધાન છે. તે સમ્યકૃતવમાં થશે. એટલે યથાર્થતાની કિંમત છે. શેની કિંમત છે ? યથાર્થતાની કિંમત છે. એમણે આખી જે યોજના લીધી છે તે યથાર્થતા ઉપર લીધી છે. નહીંતર તો જીવનો દર્શનમોહ પૂર્વ અયથાર્થપણે અનેક વાર મંદ થયો છે, પણ પાછો તીવ્ર થઈ ગયો છે. મંદ થયો છે, પાછો તીવ્ર થઈ ગયો છે ચારિત્રમોહ પણ અનંતવાર મંદ થયો છે, પાછો તીવ્ર થઈ ગયો છે. કેમ ? કે યથાર્થ લાઈન હાથમાં નથી આવો. (એટલે) ઉભાંગઠે કાંઈ ને કાંઈ કર્યું, તાત્કાલિક તો ઠીક લાગ્યું, પણ વળી પાછી પરિસ્થિતિ તેની તે.

દાખલા તરીકે, કોઈ એક જીવ જૈન સંપ્રદાયમાં જન્મે છે, ભૂતકાળમાં જૈનધર્મની અનુમોદના કરી લીધી હશે એટલે જૈન ધર્મના કુળમાં એ જન્મે છે. પછી એ પોતાના વીતરાગ દેવ સિવાય બીજાને માનતો નથી; માનતો

હોય તો એ વાત તો વધારે પડતી ખરાબ છે. અનંત સંસારી હોય એ જ એવી રીતે માને પણ કોઈ નથી માનતો, કે, મારા જિન પરમેશ્વર સિવાય મારે બીજા કોઈ દેવ હોઈ શકે નહીં. વીતરાગદેવ એ જ મારા દેવ; કોઈ સરાગી દેવ, મારા દેવ હોઈ શકે નહીં. એવું એને જ્યારે પોતાને પરિણમન રહે છે ત્યારે દર્શનમોહ અવશ્ય ઘટે છે. એવી જ રીતે કોઈ પુણ્યના યોગે જ્ઞાનીના, સમાગમમાં આવી જાય છે અને ત્યાં પણ એને (એ) ઠીક લાગે છે કે આ જ્ઞાનીપુરુષ છે, ભલે ઓળખાણ નથી થઈ (પણ) જ્ઞાનીપુરુષ છે, એમનું બહુમાન કરવા યોગ્ય છે, વગર ઓળખાણે પણ કોઈની સોબતથી, કોઈના સંગથી, કુટુંબના સંગથી ગમે તેમ કરીને પણ એ પ્રકારમાં આવે છે, ત્યાં પણ એનો દર્શનમોહ ઘટે છે. પણ (એ) યથાર્થ પ્રકારમાં નથી આવતો એટલે યારે પાછો તીવ્ર થાય એને ખબર પડે નહીં. Temporary (થોડા સમય માટે) તો એક વાર ઘટી જાય કેમકે બીજા દેવને માનતો નથી, બીજા અજ્ઞાનીઓને માનતો નથી અને વીતરાગી દેવની ઘણી ભર્ત કરે જ્ઞાનીની ભક્તિ કરે, પૂજા કરે, ત્યારે દર્શનમોહ ઘટે, ન ઘટે એમ નથી પણ યથાકમે, સમજણપૂર્વક આગળ ચાલતો હોય તો આખી લાઈન હાથમાં આવી જાય. દર્શનમોહ તીવ્ર ન થાય, ઘટતો જાય, કપાતો - કપાતો - કપાતો - કપાતો સમ્યક્દર્શન સુધી પહોંચી જાય નહિતર (અયથાર્થ પ્રકારે) મંદ થયો હોય, (તે) પાછો તીવ્ર થાય એટલે બધું ગયું જેટલી કમાડી હતી ઈ હારી ગયો.

પ્રશ્ન :- શું થવાથી દર્શનમોહ વધી જાય ?

સમાધાન :- ક્યારેક પાછો કાંઈ કોઈ કુસંગમાં આવી જાય છે, પોતાને અહંભાવ આવી જાય છે, પર્યાયબુદ્ધિ તો છે જ. (એટલે) કાં તો અહંભાવ આવી જાય, (કે) મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, અને એ અહંભાવમાં દર્શનમોહ વધારે છે. ખાસ કરીને પર્યાયબુદ્ધિને લીધે દર્શનમોહ વધે છે, કાં કોઈ કુસંગે ચડી જાય છે, નહીં કરવા યોગ્ય એવી બર્ત તઓનો સંગ કરે એનો રંગ ચડી જાય છે કાં પોતાને જે કાંઈ કર્યું હોય તેનો અહંભાવ આવી જાય છે, અને પર્યાયબુદ્ધિ તીવ્ર થઈ જાય છે.

દર્શનમોહ પાછો તીવ્ર થઈ જાય છે. મેં આટલી ભરી ત કરો, મેં આટલું બહુમાન કર્યું, મેં આટલું સમર્પણ કર્યું, આ બધું ગણવા માંડે – થઈ રહ્યું, પાછો દર્શનમોહ તીવ્ર થયો.

મુમુક્ષુની ભૂમિકા યોગ્ય પરિણામ કરતાં કરતાં પણ દર્શનમોહ ક્યાં-ક્યાં, કેવી-કેવી રીતે ઘટે અને ક્યાં-ક્યાં કેવી-(કેવી) રીતે વધે ? એના ઉપર એક આખો Article (લેખ) લખાઈ ગયો છે. ‘પ્રયોજન સિદ્ધિ’ વાંચી છે ? ‘પ્રયોજન સિદ્ધિ’. આખો Article (લેખ) જ દર્શનમોહ ઉપર છે. મુમુક્ષુની ભૂમિકામાં સ્થૂળપણાથી સૂક્ષ્મપણો જે જે દર્શનમોહ વધવા-ઘટવાના પરિણામ થાય છે તે બધા સમાધાન સાથે આપેલા છે. આ પ્રકારે દર્શનમોહ વધે અને એ જ પ્રકાર તોડવા માટે, આ પ્રકારે દર્શનમોહ ઘટે. ૭૦ થી ૭૫ Points (મુદ્દા) લીધા છે. મોટો Article (લેખ) થયો એટલે નાની પુસ્તકા કરી. એ પણ જરા જોઈ લેવું, (જે આ પુસ્તકના પાછળના ભાગમાં છપાયેલ છે). સમાધાન થઈ જશે ત્યાં એ પણ ખબર પડશે કે આપણને હવે કઈ ભૂમિકામાં શું ચાલે છે ? કેવી રીતે ચાલે છે ? એમાં આપણને ક્યાં વધ-ઘટ થાય છે ? એ પણ સમજાઈ જાય એવું છે. કેમકે કુમથી વાત લીધી છે. શરૂઆત આમ થાય છે, પછી આગળ વધે છે, પછી આગળ વધે, પછી આગળ વધે ત્યારે દરેક ભૂમિકામાં એ કેવી રીતે ભૂલ કરે છે ? તો એને નુકસાન થાય છે, એ (ભૂલ) કેવી રીતે મટે તો નુકસાન ન થાય એ બધો પ્રયોજનભૂત વિષય લીધો છે. એ વિસ્તારથી જોવો હોય (અને) પોતાની ભૂમિકાને Check કરવી હોય તો એ Article (લેખ) જોઈ લેવો. એ Article (લેખ) એવી પરિસ્થિતિમાં લખાણો છે કે ભાવનગરમાં નિયમિત-રોજ સ્વાધ્યાય ચાલે એમાં એક - એક (દરેક) વાતમાં પ્રશ્ન એ આવતો હતો કે (અહીંયા) દર્શનમોહને શું લાગે વળ્ગે છે ? કોઈ પણ ન્યાય ચાલતો હોય, કોઈ પણ ભૂમિકાની વાત ચાલતી હોય, તો ત્યાં દર્શનમોહની પરિસ્થિતિ શું છે અને એ દર્શનમોહમાં તીવ્રતા આવે, મંદ્તા આવે તો એમાં શું શું પ્રકાર છે ? રોજની એ ચર્ચા ચાલતી અને સાંજે Walkingમાં જતા તો એ જ ચર્ચા ચાલતી, કેટલાય પડખાથી વાતો ચાલી,

ત્યારે પછી એમ થયું કે આ તો કાંઈ યાદ નહીં રહે, (કોઈએ કહ્યું કે) આ તો તમે વાત કરે રાખો છો અને અમે સાંભળીએ છીએ. પણ પછી તો કાંઈ આટલી બધી વાતો સ્મરણમાં રહેશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે આના ઉપર કાંઈ લખાય તો સારું. એ દર્શનમોહના વિષયમાં Permanent (કાયમી) વિચારવાનું એક સાધન થઈ જાય. (એ) પછી એના ઉપર લખવાનું શરૂ કર્યું હતું.

પ્રશ્ન : ઓઘસંજ્ઞામાં રહે તો દર્શનમોહ તીવ્ર થાય ?

સમાધાન : હા, તો તીવ્ર થઈ જાય, મૂલ્યાંકન થાય તો મંદ થાય. શું ? કેટલું સરસ લીધું ! મુમુક્ષુની ભૂમિકામાં અંતર આત્માનું જોર કેવું હોય છે ! આ મોક્ષનો Foundation (પાયો) અહીંયા ઘડાય છે. આપણે બહુ મોટું Building (મકાન) બનાવવું હોય તો એનું Foundation (પાયો) સિમેન્ટ-કોંક્રીટ, Concrete Foundation જોઈએ. એમાં પથ્થરા નાંખી દીધા ને ચૂનો નાંખી દીધો એમ ન ચાલે. એનું પણ આખું Engineering છે. પાયાનું આખું Civil-Engineering છે. અને એના જે તજશો હોય છે એની પાસે એની તૈયારી કરાવવી પડે છે. પછી એ Foundation ભરાય છે તો એ બીલ્ડિંગ ઘણાં વર્ષો સુધી ૧૦૦–૨૦૦ વર્ષો સુધી રહેવાને યોગ્ય થાય (છે). જ્યારે આ તો અનંતકાળ સુધી રહેવાને માટે યોગ્ય એવું નિર્વાણપદ છે એનું Foundation છે. અને એ મુમુક્ષુની Foundationની તૈયારી કેટલી જોરદાર હોય ! કેટલી Powerful હોય છે !! એના માટે કૃપાળુદેવે આ વચ્ચનો લખ્યાં છે. અને જ્યારે આપણા મકાનમાં કે આપણા મંદિરમાં આપણે પાયાનો પહેલો પથ્થર મૂકીએ છીએ ત્યારે આપણે તેને Celebrate (જવીએ) કરીએ છીએ, ‘મંગલ શિલાન્યાસ’. એની આમંત્રણ પત્રિકાઓ છપાવીએ છીએ કે નહીં ? એમ આવો જે નિર્ધાર થાય કે કોઈ પણ ભોગે મારે મારું આત્મકલ્યાણ કરી જ લેવું છે અને એમાં જે કાંઈ આદું આવશે તો એને હું કોરે કરીને પણ આત્મકલ્યાણ કરી લઈશ, પણ પાછો તો નહીં વળું એટલે નહીં જ વળું એ નિર્ધાર છે એ મોક્ષપદનો મંગલ શિલાન્યાસ છે. અને મુમુક્ષુતાનો એ મંગલ પ્રારંભ છે.

આપણે ‘આત્મજગૃતિ’ શરૂ કર્યું તારે આ જ વિષય ઉપર ‘મંગલ પ્રારંભ’નો (એક) Article (લેખ) પ્રકાશિત થયેલો છે. પહેલા અને બીજા બે અંકમાં આખો Article (લેખ) પૂરો થયો છે, એમાં ‘મંગલ પ્રારંભ’નું આપણે શીર્ષક આપેલું છે. એ મંગલ પ્રારંભ શેનો ? કે મુમુક્ષુની ભૂમિકાનો, અને મોક્ષપદના પ્રયાણનો મંગલ પ્રારંભ, મહાપ્રયાણ છે. કેવું પ્રયાણ છે ? મહાપ્રયાણ છે, એનો મંગલ પ્રારંભ આવા નિર્ણયથી થાય છે.

કૃપાળુદેવે બહુ સરસ ચિતાર મૂક્યો છે; તે જીવ Exactly આ પરિણામમાં આવે છે અને એના અંતર આત્મામાંથી એવો અવાજ આવે છે કે હે જીવ ! આ વિના તારો ધૂટકો નથી. એને એટલો જ આત્મવિશ્વાસ આવે છે કે હવે મારું કલ્યાણ અવશ્ય થઈ જશે, થઈ જશે ને થઈ જ જશે. જેના અંતરમાંથી પોતાના કલ્યાણ થઈ જવાનો આત્મવિશ્વાસ આવે તો એ બહુ સારી નિશાની છે, બહુ સારું ચિહ્ન છે, અને એ અનુમોદન કરવા યોગ્ય છે. પૂજ્ય ગુરુદેવ તો એમ કહેતા કે આત્મકલ્યાણની આ એક એવી વાત છે, એવી એક Supreme qualityની વાત છે કે એમાં જો ઉત્સાહ આવે, ઉમંગ આવે, ને હોશ આવે, એની અંદરથી આત્મા હા પાડે, તો મોક્ષનો ભણકાર અંદરથી આવે. શું આવે ? મોક્ષના ભણકારા અંદરથી આવે; અને એ બહુ સારું લક્ષણ છે.

એટલે અહીંયા પાયાનો પથ્થર મૂક્યો, પાયાની શિલા મૂકી, હવે એના ઉપર ચાણતર ચાલશે. મુમુક્ષુ પોતાની ભૂમિકામાં આગળ વધશે, ઉત્કૃષ્ટ ભૂમિકામાં આવ્યા પછી (એ) મોક્ષમાર્ગમાં પ્રવેશ કરશે. એ રીતે દર્શનમોહને ક્ષીણ કરીને મોક્ષમાર્ગમાં પ્રવેશ કર્યા પછી નિયમથી ચારિત્રમોહને પણ ક્ષીણ કરવામાં આગળ વધશે જેને મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે, એને નિર્વાણપદનું ત્યાં Registration booking Advance booking થઈ જાય છે, ટિકિટ અહીંયા મળી જાય છે; Reservation ટિકિટ અહીંયા મળી જાય છે. તે મળવાની શક્યતા અહીંયાં છે પણ તૈયારી પોતાને કરવાની છે. શુદ્ધ અંત:કરણથી પોતાને તૈયારી કરવાની છે. આવી એક વર્તમાનની અંદર પરિસ્થિતિ છે, કુદરતી જૈન ફૂળમાં આવવાનું થયું, આત્મકલ્યાણ

કારક એવા જ્ઞાનીપુરુષોના વચનો કુરસદ લઈને વિચારવાનો યોગ, પણ મળ્યો છે, હવે પોતે કેટલો આગળ વધે તે પોતાના પુરુષાર્થ ઉપર આધારીત છે. એટલે એ કરી લેવા જેવું છે, કોઈ પણ ભોગે કરી લેવા જેવું છે એવો જો નિર્ણય આવે તો એનું કામ થઈ જશે, એનું કામ અવશ્ય (થઈ જશે).

પ્રશ્ન : મોક્ષના ભાડાકાર આવે ત્યાર પછી ઓળખાણ થાય ?

સમાધાન : ભલે ઓળખાણ પછી થાય એનો વાંધો નહીં, પછી પણ ઓળખાણ થશે જ. આ તો (હજી) બહુ શરૂઆતની વાત છે; બહુ શરૂઆતમાં ભણકારા આવે પછી તો..... ઓળખાણ થાય પણ એક વાર લાઈન હાથમાં આવે, એકડો શીખે તો બગડો, (૨) થાય, બગડો શીખે તો તગડો (૩) થાય, પણ એકલા મીંડા મીંડા જ કર્યા કરે; એકડો જ ન થાય તો બગડો યાંથી આવડે ? એવું છે. ત્યાર પછી બીજી કેટલીક વાતો લખી છે, જે આવતી કાલના સ્વાધ્યાયમાં લઈશું.

d

પરિભ્રમણની વેદનામાં, પરિભ્રમણના કારણભૂત અજ્ઞાન અને અજ્ઞાનના કારણભૂત રાગના કર્તૃત્વનો તીવ્ર નિષેધ છે અને પરંપરાએ જ્ઞાતાપણાનો / અકર્તાપણાનો આદર છે. - આમ સન્માર્ગ પ્રતિના પ્રથમ ચરણનાં મૂળ ઘણાં તા છે અને સંસાર પરિભ્રમણનાં બીજના નાશક છે.

- પૂર્વય ભાઈશ્રી

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૨૮

પ્રવચન-૬

તા. ૨૭-૧૨-૯૭ (સવારે)

હવે સ્વાધ્યાયમાં ચાલતાં પત્રમાં જ્યાંથી આગળ વધવાનું છે. “ક્ષણો ક્ષણો પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” પ્રતિક્ષણ આપડાં પરિણામો વિચિત્ર પ્રકારે પલટના રહે છે. ચિત્ર-વિચિત્રતા ઘણી છે. એક જ ચીજ એક વખતે રૂચે છે અને તેની તે જ બીજે વખતે અરુચિનું કારણ થાય છે. જીવ જેના ઉપર રાગ કરે છે તેની ને તેની ઉપર જ પાછો દ્રેષ કરે છે. એક જ વ્યા ત હોય, એક જ પદાર્થ હોય, છતાં જીવના પરિણામનનું કોઈ ઠેકાણું નથી. અહીં કહે છે કે હવે એવું પરિણામન નથી જોઈતું. મને તો શાંત, નિરાકૃણ, શાંતિમય પરિણામન જોઈએ છે કે જે અમૃતની ધારા છે. તે સુખ-શાંતિનું અમૃત જ મારે પીવું છે. આ આકૃણતા / ઝેર મને ન જોઈએ. “અમૃક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું.” વિકલ્પની આકૃણતા એટલી બધી થઈ રહી છે કે વિકલ્પથી શૂન્ય થવા માંગું છું

કે એક વખત તો વિકલ્પ શૂન્યાવસ્થાને પ્રાપ્ત થઈ જાય તો સારુ એવી મારી ભાવના છે. ભાવનાનો વિષય લીધો. “તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું.” સંતનો સમાગમ કે જ્ઞાનીનો સમાગમ એ સિવાય કંઈ નથી જોઈતું. નિર્વિકલ્પદશામાં અવાય તેવી યોગ્યતામાં ન આવી શકાય ત્યાં સુધી તે અર્થે સંતસમાગમ મને જોઈએ.

પ્રશ્ન :— અમુક કાળ એટલે શું ?

પૂ. ભાઈશ્રી :— અમુક કાળ એટલે કે નિર્વિકલ્પ થવું છે. છેવટે શું કરવું છે ? નિર્વિકલ્પ થવું છે. સ્વરૂપમાં જામી જવું છે. તેથી વચ્ચે વચ્ચે જે કંઈ આવે છે તે સાદીશાંત અમુક કાળ પર્યત જ આવે છે. જો તેવો સત્તસમાગમ પણ ન મળે તો “તે ન હોય તો અમુક કાળ સુધી સત્તસંગ સિવાય કંઈ નથી જોઈતું.” મુમુક્ષુનો સત્તસંગ, જ્ઞાનીનો-સંતનો સમાગમ, ન મળે તો છેવટે મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે સત્તસંગ તો હોવો જોઈએ. આ સત્તસંગ મુમુક્ષુનો ખોરાક છે. જો સત્તસંગ નિયમિતરૂપે નહીં થાય, દરરોજ નહીં થાય, તો અસત્તસંગથી મનુષ્ય ઘેરાયેલો છે જ. અસત્તસંગથી તેના પરિણામ નીચે તરી જશે એ વાત બનશે. માટે સત્તસંગ તો હંમેશાં-હંમેશાં હોવો જ જોઈએ. જો સત્તસંગ પણ ઉપલબ્ધ ન હોય તો “તે ન હોય તો આર્થાયરણ (આર્થપુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું.” સત્તસંગ પણ ન મળે તો ઓછામાં ઓછું વિચારી રાખવું કે મારુ જે જીવન છે, ઉપજીવન છે એમાં સદાચયરણ બની રહે. નહિતર પરિણામમાં ગડબડ બહુ થઈ જશે અને આજકાલ તો પરિસ્થિતિ બહુ જ, બિલકુલ ગડબડવાળી છે. આ જે પરિણામ છે તે નીચે પડવા લાગશે. એટલે તેને સંભાળવાના છે. સત્તસંગ ન મળે તોપણ આપણે પોતાના પરિણામની સાવધાની રાખવાની છે. સત્તસંગ હોય તો તો સત્તસંગની મદદ પણ મળે પરંતુ સત્તસંગ ન હોય તો પોતાનું વિચારબળ જ કામમાં આવે છે. તે જ આત્મબળ છે. તેનાથી આપણાં પરિણામને સંભાળવાના છે.

પ્રશ્ન :— સંગ અનેક પ્રકારના છે ?

પૂ. ભાઈશ્રી :— વાત ઠીક છે. સંગના અનેક વિશેષજ્ઞ છે. પરમસત્તસંગ,

અસત્સંગ, સત્સંગ અને કુસંગ. એમ ચાર તેના પ્રકાર છે. જ્ઞાનીપુરુષના સંગને પરમ સત્સંગ કહેવામાં આવે છે, પોતાનાથી વિશેષ ગુણવાન, અર્થાત્ આગળ વધેલાં મુમુક્ષુના સંગને સત્સંગ કહેવામાં આવે છે. અથવા પોતાની બરાબરીમાં જે મુમુક્ષુ હોય તેના સંગને પણ સત્સંગ કહેવાય છે. પછી જે અયોગ્યતાવાળા હોય, સંસારની રૂચિવાળા હોય અથવા પોતાના પરિવારના હોય કે મિત્ર મંડળવાળા હોય, સમાજવાળા હોય, બજારવાળા હોય તે બધા સંગ અસત્સંગમાં જાય છે. તેવા સંગને અસત્સંગ ગણાય છે અને તેનાથી પોતે ઘેરાયેલો છે.

પ્રશ્ન :— પરિવારવાળાના સંગને શું ગણવો ?

પૂ. ભાઈશ્રી :— પરિવારમાં આત્મકલ્યાણની ભાવનાવાળા કોઈ હોય તો સત્સંગ છે નહીંતર અસત્સંગ છે. મોટે ભાગે, બહુભાગ અસત્સંગ ધર્માંથી જ શરૂ થઈ જતો હોય છે અને બાકી પછી ક્યાંય પણ બજારમાં જાય, સમાજમાં જાય, મિત્રમંડળમાં જાય, પાર્ટીમાં જાય તે બધો અસત્સંગ છે. સત્સંગનો અભાવ તે જ અસત્સંગ છે અને જે લોકો દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પરુષનો વિરોધ કરતાં હોય, તીવ્ર દોષના પરિણામવાળા હોય તેવા જીવોના સંગને કુસંગ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં જેટલો સત્સંગનો મહિમા છે તેટલો જ કુસંગનો નિષેધ કરવામાં આવ્યો છે. સત્સંગમાં આનંદ અમૃત મળે છે. જ્યારે કુસંગમાં જેરથી પણ વધારે નુકસાનકર્તા ચીજ મળે છે, કે જેની ઉપમા નથી મળતી. જેરની ઉપમા પણ ઓછી પડે છે. એટલા માટે કે કોઈ માનો જેર પી જાય છે તો એક વખત મરે છે. જ્યારે કુસંગમાં જવાવાળો, કુસંગની અસરમાં આવવાવાળો અનંત સંસાર વધારી દે છે. કેટલો ? અનંત સંસાર તેનો વધી જાય છે. અનંત જન્મ-મરણ થાય છે અને અનંત સંસારી થાય છે. માટે કુસંગથી સાવધાન રહેવું.

પ્રશ્ન :— ધર્મવિરોધીઓને હળવા-મળવામાં કુસંગ-દોષ લાગે છે શું ?

પૂ. ભાઈશ્રી :— હળવા-મળવામાં તો શું છે કે ઉદ્યવશાત યારેક મળવું થઈ જાય પરંતુ તે મળવું જ્યારે સારું લાગે છે ત્યારે તેને સંગ કહેવાય છે. શું ? મળવાનું તો થઈ જાય, યારેક પ્રસંગવશાત્ મળવાનું

બની પણ જાય તે પૂર્વકર્મની વ્યવસ્થા છે. ઠીક છે, એમાં કાંઈ આપણું ચાલે નહીં, પણ આપણો સામે ચાલીને મળવા જઈએ એ મળવું આપણને સારું લાગે, તે કુસંગની રુચિ છે. તેની અસર આવ્યા વગર રહેશે નહીં. એટલે કુસંગથી બચવું નહીંતર અનંત જન્મ-મરણનું તે કારણ છે.

પ્રશ્ન :— સત્સંગની રુચિમાં અન્ય સંગ ન રુચે — અવું હોય છે ?

પૂ. ભાઈશ્રી :— એ તો છે જ. સત્સંગની રુચિ, અસત્સંગ અને કુસંગની અરુચિ સહિત જ હોય છે, Automatic સહજ એમ હોય છે એ તેનું બીજું પડખું છે.

હવે જો આ સદાચારણના પરિણામ પણ બરાબર ન રહેતાં હોય તો “તે ન હોય તો જિનભી તમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું” કૃપાળુદેવે આ પણ એક માર્ગદર્શન આપ્યું છે કે જો તારા પરિણામ સત્સંગના અભાવમાં ન ઇચ્છવા છતાં નીચે પડતા જતાં હોય તો શુદ્ધભાવથી એટલે કે શુદ્ધ હેતુથી એટલે કે પોતાના સુધારના શુદ્ધ અભિપ્રાયથી જિનભી તમાં લીન રહેવું. જિનભી ત કરવી. જિનેન્દ્રની જે ભી ત છે તેમાં જિનેન્દ્ર પરમાત્માના ગુણાનુવાદ જે છે તે એક ન્યાયથી આત્માના જ ગુણાનુવાદ છે. ‘જિન સો હી આત્મા, અન્ય હોય સો કર્મ, (કર્મ કટે) જિન પ્રવચનસે’ જેના પ્રવચનથી કર્મ કપાય ‘વહી તત્ત્વજ્ઞાનીકા મર્મ’ કૃપાળુદેવે એક પદ બનાવ્યું છે. જિન સોહી આત્મા. બનારસીદાસજીએ પણ એ વાત લખી છે. “ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન” ઘટ ઘટ અંતર જિન બસે. બધાંયની અંદર પરમાત્મા બેઠો છે, પણ દ્વારા હોવી જોઈએ અને ઘટ ઘટ અંતર જૈન — બધા જૈન જ છે, કોઈ અન્યમતિ છે જ નહીં.

હું જ્યારે First Time (પહેલી જ વખત) સોનગઢ ગયો હતો તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના સમયે પહોંચ્યા હતાં. પ્રવચન પૂરું થયા પછી બહેનો બધા ચાલ્યા જાય, ભાઈઓમાં પણ ઘણાં ખરાં ભાઈઓ ચાલ્યા જાય અને દસ-પંદર જણ ખાસ-ખાસ રસ ધરાવતાં હોય તે પૂ. ગુરુદેવશ્રી પાસે બેસતાં હતાં. હું પણ બેઠો હતો. હું તો કુતૂહલવૃત્તિથી ગયો હતો,

પરીક્ષાદ્વિથી ગયો હતો. કે લાવ અધ્યાત્મની વાતો તો કરે છે ખરેખર શું છે જરા જોઈએ તો ખરા ? પૂજ્ય ગુરુદેવશ્રીએ જોઈ લીધું કે કોઈ એક અપરિચિત વ્યા ત પણ બેઠી છે એટલે મને જોઈને પૂછ્યું કે આ ભાઈ કોણ છે ? કચાંથી આવ્યાં છે ? ત્યારે હું જેની સાથે ગયો હતો તેણે જવાબ આપ્યો; હું તો કંઈ ન બોલ્યો, તેમણે કહ્યું મારી સાથે આવ્યાં છે. ભાવનગરથી આવ્યા છે. વૈશ્વવ છે પણ જૈન ધર્મમાં સારી રુચિ ધરાવે છે. સંક્ષેપમાં એટલો પરિચય આપ્યો. તો ગુરુદેવશ્રી શું બોલ્યા ! કે ‘અહીંયાં તો કોઈ જૈન પણ નથી અને અજૈન પણ નથી બધાં આત્મા જ આત્મા છે’ (મેં તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં) એક આત્મા જ સાંભળ્યો છે અને બીજા પણ અનેક પ્રકારના ન્યાય આવતાં, કંઈક પ્રકારની વાતો આવતી પરંતુ મારું ધ્યાન એક જ જગ્યાએ રહેતું, બીજા વિષયમાં એટલું હું ધ્યાન નહોતો આપતો.

એવી જિનભાઈ ત હોવી જોઈએ અને “તે ન હોય તો માગવાની છચ્છા પણ નથી...” ઓછામાં ઓછું આટલું તો હોવું જોઈએ એ પ્રકારે

તરતા કમમાં મુમુક્ષુજીવના પરિણામ કેવાં પ્રકારના હોવા જોઈએ. એ બતાવ્યું છે.

પ્રશ્ન :- અહીંયાં સ્વાધ્યાય (આદિની) વાત નહીં કરતાં જિનભાઈ તની વાત કહી છે એમાં શું રહેસ્ય છે ?

પૂ. ભાઈશ્રી :- જેની સ્વાધ્યાયની ક્ષમતા જ ન હોય એણે શું કરવું ? કારણ કે એકલાં-એકલાં તો એના પરિણામ સદાચરણારૂપ નથી રહેતાં પરંતુ, અહીંયા-ત્યાં પરિણામ ચાલી જાય છે. વેપાર કરું, આ કરું, તે કરું, પરિવારમાં આ પ્રકારની વ્યવસ્થા કરું, ધંધામાં આ પ્રકારની વ્યવસ્થા કરી દઉં. એ બહું ચાલવા લાગે છે. તેના માટે જિનભાઈ ત ઠીક છે. અને શાસ્ત્ર સ્વાધ્યાયનું તો એવું છે કે પોતે કેવી રીતે નક્કી કરશે કે મારી યોગ્યતા મુજબ મારે ક્યો ગ્રંથ સ્વાધ્યાય કરવા લાયક છે ? તે પોતે નક્કી કેવી રીતે કરશે ? પછી જે કોઈ પણ ગ્રંથ હાથમાં આવે અને વાંચવા લાગે તો એમ કરવાથી તો ગડબડ થવાની છે. બહુભાગ કલ્પનામાં ચરી જશે. એટલે સત્તશાસ્ત્ર

છે તે અમુક યોગ્યતા પછી જ ઠીક છે બધાને માટે ઠીક નથી.

હવે થોડાંક સૂત્રો લખ્યાં છે. “ગમ પડ્યાં વગર આગમ અનર્થકારક થઈ પડે છે” જુઓ એ જ વાત લખી છે. તમને જે પ્રશ્ન ઠચો છે, એનો જ ઉત્તર અહીં આવે છે. શું ? પત્રની રચના કેવી (સુંદર) છે જુઓ ! એટલે શાસ્ત્ર સ્વાધ્યાયની વાત એમાં નથી લીધી. શાસ્ત્ર સ્વાધ્યાયની વાત કેમ નથી આવી ? કે ગમ પડ્યાં વગર આગમ અનર્થકારક એટલે કે નુકસાનનું કારણ થાય છે. ગમ એટલે શું ? ગુરુગમ. ગમ એટલે ગુરુગમ. જ્ઞાનીપુરુષ પાસે શાસ્ત્ર વાંચવાની કોઈ ચાવી હોય છે એ ચાવી મળી જવી જોઈએ, પછી જ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો યોગ્ય છે, નહીંતર માત્ર બુદ્ધિ હોવાથી કોઈ શાસ્ત્ર વાંચન કરી લ્યે તો અનર્થ જ કરે. વળી શાસ્ત્રમાં પરસ્પર વિરુદ્ધ કથન પુષ્ટ આવે છે. સમાધાન કેમ કરશે ? જુદાં જુદાં જ્ઞાનીઓએ પોત-પોતાની શૈલીથી શાસ્ત્રો લખ્યાં છે. એક જ્ઞાનીની વાતથી બીજા જ્ઞાનીની વાત મેળ નથી ખાતી એવું લાગશે ત્યારે શું કરશે ? ત્યારે વધુ વિચારના, સંકલ્પ-વિકલ્પના ચક્કરમાં ફસાશો. એટલે ગમ પડ્યાં વગર આગમ અનર્થકારક થઈ પડે છે. કૃપાળુદેવે તો માર્ગને ખૂબ જ સરળ કરી દીધો છે. કે તું સત્સંગમાં રહે. શાસ્ત્રની વાત પહેલાં નહીં કરતાં તું સત્સંગમાં રહે બસ ! (એમ કહે છે)

શ્રોતા :— પૂ. બહેનશ્રીના વચનામૃતમાં પણ આવે છે કે સત્પુરુષના ચરણમાં રહેવું, મહાપુરુષના ચરિત્રનું સ્મરણ કરવું.

પૂ. ભાઈશ્રી :— હા ! બરાબર છે. તે કથાનુયોગ છે. મહાપુરુષોના ચરિત્ર એટલે કથાનુયોગ. તેમ છતાં ગ્રંથ વાંચવો હોય તો કથાનુયોગનો વાંચવો, ભાવનાનો વાંચવો હોય તો ભાર ભાવનાનો વાંચવો. એ ઠીક છે. શરૂઆત વાળાઓ માટે એ ઠીક છે.

પ્રશ્ન :— ચાવી કઈ છે ?

પૂ. ભાઈશ્રી :— ચાવી તો એ છે કે “આત્મકલ્યાણની અવગાઢ ભાવના” હોવી. તે પછી જ્ઞાનમાર્ગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર છે તે જ્ઞાનમાર્ગ છે. શું છે ? જ્ઞાનમાર્ગ છે. અને એવી અવગાઢ દશા આવ્યા વિના શાસ્ત્ર

વાંચવામાં બહુ જોખમ છે, બહુ જ જોખમ છે. દસ્ત નંબર પત્ર છે. એમાં એ વાત કૃપાળુદેવ કહે છે. ‘જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે’ સહેલો નથી. શાસ્ત્ર વાંચીને આત્મકલ્યાણ કરવું સહેલું નથી, પણ દુરારાધ્ય છે. પરમ અવગાઢ દશા પ્રાપ્ત થયા પહેલાં જ્ઞાનમાર્ગમાં પડવાનાં ઘણાં સ્થાનો છે. પડવાના ઘણાં ઠેકાણાં છે. પહેલી વહેલી તો શંકા થશે તો એમ થશે કે કહેવાવાળાએ આવું શા માટે કહ્યું ? કહેનાર પર શંકા થઈ આવશે કે આ વાત મને બરાબર નથી લાગતી. એ પ્રકારે કહેનાર ઉપર શંકા થઈ આવશે અને વિકલ્પ વધશે. જો સમાધાન નહીં થાય તો વિકલ્પ વધી જાશે. સ્વચ્છંદપણું આવી જશે. જેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી માટે દ્યા કરવાની શી જરૂર છે ? પૂજા-ભર્ત ત કરવાની શી જરૂરિયાત છે ? સત્સંગ કરવાનું પણ શું કારણ છે ? કે જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ પ્રકારે સ્વચ્છંદમાં ચાલ્યો જશે.

પ્રશ્ન :— પરમ અવગાઢ ભાવનાનું કહ્યું Stage છે ?

પૂ. ભાઈશ્રી :— પહેલેથી આત્મભાવનામાં, તીવ્ર આત્મભાવનામાં આવવું જોઈએ અને એને Stage ની દૃષ્ટિએ જોવામાં આવે તો પરિભ્રમણની વેદનાથી શરૂઆત થાય છે અને ખાસ કરીને પૂર્ણતાના લક્ષથી શરૂઆત થાય છે. પૂર્ણતાનું લક્ષ બાંધતી વખતે ભાવના ખૂબ જ અવગાઢ બને છે. પછી મારું જે લક્ષ છે એ લક્ષપૂર્વક આ વાત લખાયી છે, એ પ્રકારે વાત અને આશય પક્કડમાં આવે છે. શાસ્ત્રકર્તાનો આશય પકડી શકાય છે, નહીંતર તર્ક અને વધુ ઉઘાડવાણો હોય તો અતિપરીણામીપણું આવી જાય જેમકે જાણકારી થઈ એટલે કે જાણે જ્ઞાન થઈ ગયું. પછી કહેવા લાગે કે તમે એમ કરો તમારી જાતને જ્ઞાતા-દ્રષ્ટા માની લ્યો-બસ ! જ્ઞાતા-દ્રષ્ટા છું, જ્ઞાતા-દ્રષ્ટા છું, જ્ઞાતા-દ્રષ્ટા છું, જ્ઞાતા-દ્રષ્ટાપણું તો આવ્યું ન હોય પણ અતિપરીણામીપણું થઈ જાય જાણે કે પરિણામન એ પ્રકારે હોય એમ વાત કરવા લાગે છે. આવી બધી જુદા જુદા પ્રકારની ભૂલો વારંવાર તે માર્ગથી (જ્ઞાનમાર્ગ) પડવાનું કારણ બને છે, અને આગળ વધવા હેતી નથી. એટલે કહ્યું કે પરમ અવગાઢ દશામાં આવ્યા વગર જ્ઞાનમાર્ગ કોઈ

આગળ વધી શકતું નથી.

પરમ અવગાઢ દશામાં સૌથી પહેલાં એ વાત પણ આવે છે જેમકે કોઈને પ્રારંભમાં જ પરમ અવગાઢ દશા આવી કે મારે આત્મકલ્યાણ કરી લેવું છે, બસ ! મારે હવે આત્મકલ્યાણ કરી જ લેવું છે – તેને સૌથી પહેલાં એવો ભાવ આવે છે કે જેણે આત્મકલ્યાણ કર્યું છે તેમના ચરણમાં મારે જઈ રહેવું છે. તેને Very First Thought (સૌથી પહેલો વિચાર) એ આવે છે. તે કોઈ ગ્રંથને હાથમાં નહીં લ્યે. તે કોઈ અન્ય પ્રયોગમાં પણ નહીં ચડે. પહેલાં એને એમ થશે કે મારે જ્ઞાનીનો સંગ જોઈએ. જેણે રસ્તો જોયો છે એની સાથે ચાલવું છે અર્થાત્ મારે મારી મનમાની કરવી નથી. અવગાઢ દશામાં એ વાત આવે છે. પછી જ્ઞાની બતાવે છે કે તારે લાયક ફલાણો ગ્રંથ છે, તારે લાયક ફલાણો ગ્રંથ છે તું એનો સ્વાધ્યાય કર, તું એનું વાંચન કર.

કૃપાળુદેવ તો એટલાં બધા વિચક્ષણ હતાં કે અન્યમતના ગ્રંથ વાંચવા માટે પણ ભલામણ કરતાં હતાં. ‘યોગવિશિષ્ટ’નું પહેલું અને ત્રીજું પ્રકરણ વાંચજો, બાકીના પ્રકરણ તમારે વાંચવા લાયક નથી. પોતે ‘મોક્ષમાર્ગપ્રકાશક’ વંચાવતા હતાં. તો એમાં શું છે કે ટોડરમલજ્જસાહેબે શેતાંબર મતનો જોરદાર નિષેધ કર્યો છે. દરેક અન્ય જૈનેતર મતનો (પણ નિષેધ કર્યો છે) શેતાંબર અને સ્થાનકવાસીને જૈનેતરમાં લીધા છે. અને બીજા જૈનના ઈતર મત છે એની પણ આલોચના કરી છે, ટીપ્પણી કરી છે. લઘું છે કે યાંય સમાધાન ન થાય તો જ્ઞાનીની પાસે સમાધાન કરવાની જિજ્ઞાસા રાખવી પણ પોતાની મેળે કહેનારનો નિષેધ ન કરવો. કેટલીક વાતો એવી છે કે આ જે જૈનના નામથી જે ચાલે છે તે ખરેખર જૈન નથી. એ માટે ઘણી દલીલો તેમણે આપી છે. પણ જ્ઞાનીના સંગમાં તેનું સમાધાન કરવાની એક વાત રાખી લેવી. કોઈ પૂર્વગ્રહમાં ન આવી જવું. તોપણ કૃપાળુદેવ વંચાવતા તો હતા પણ એમાં બહુ જ વિચિક્ષણતા હતી કે તેઓશ્રીને ખબર હતી કે દરેક મનુષ્યને પોત-પોતાના સંપ્રદાયનો પક્ષ હોય જ છે. જાણો-અજાણ્યે હોય જ છે. અને તેનો પક્ષબુદ્ધિ-સંપ્રદાયબુદ્ધિમાંથી કાઢવા માટે

પણ વંચાવતા હતાં. એવા એવાં ગ્રંથો પણ વંચાવતા હતાં કે જીવની સંપ્રદાયબુદ્ધિ છૂટી જાય. શું વાંચવું ને શું ન વાંચવું ? તે જ્ઞાનીની સૂચના અનુસાર હોય તો બરાબર છે, નહીંતર એમાં ભૂલ ખાવાના ઠેકાણાં / પડવાનાં ઠેકાણાં ઘણાં છે.

પ્રશ્ન :- જ્ઞાનીના માર્ગમાં ચાલનારનો નિશ્ચય કેવો હોય છે ?

પૂ. ભાઈશ્રી :- જ્ઞાનીના માર્ગમાં ચાલનારનો નિશ્ચય એવો હોય છે કે જે જ્ઞાની કહે તે જ વાત બરાબર છે. જ્યારે આ સંપ્રદાયોમાં તો ગડબડ ઘણી છે. એ વાત તો સ્પષ્ટ છે. કોઈને પણ સમજમાં આવે એવી વાત છે કે દરેક સંપ્રદાયમાં ગડબડ બહુ જ ચાલે છે. અત્યારે કોઈ સંપ્રદાય એવો નથી રહ્યો કે જેમાં ગડબડ ન ચાલતી હોય તે સમજ શકાય એવી વાત છે. એટલે સંપ્રદાયબુદ્ધિ તેની મંદ પરી જાય છે અને એવો જ નિશ્ચય તેને આવે છે કે મારે જ્ઞાનીના માર્ગ જ ચાલવું છે. પછી એને કોઈ તકલીફ કે અડચણ નથી આવતી.

“સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે” શાસ્ત્ર પછી ધ્યાનની વાત લીધી છે. સાધન છે ને ! શાસ્ત્ર-આગમ પણ એક સાધન છે અને ધ્યાન કરવું એ પણ એક સાધન છે. બસે માટે સૂચના કરી છે કે પહેલાં સત્સંગ કરવો પછી સત્સંગમાં ધ્યાન ક્યા Stageમાં આવે છે ? ક્રયું ધ્યાન ક્યા પ્રકારે હોય છે ? ધ્યાનના પ્રકાર કેટલાં છે ? એ બધું સમજ્યા પછી પોતાની ભૂમિકા હોય તો ધ્યાન કરવું. ધ્યાનની ભૂમિકા હોય તો ધ્યાન કરવું, નહીંતર તે ધ્યાનમાં તરંગ ઠશે. કેટલાંય પ્રકારના તરંગ ઠશે કે મને શાંતિ થઈ ગઈ, મને પ્રકાશ દેખાણો, મને આમ થયું, મને તેજનું કિરણ દેખાણું, એવું બધું ઘણું હોય છે. એવાં ઘણાં લોકો મળે છે. શું ? મને આ પ્રકારે ગોળ ચક્કર, ચક્કર દેખાણા- એ બધી ખરેખર ચક્કરમાં પડવા જેવી વાતો છે. સત્સંગ વગર ધ્યાનમાં પ્રવેશ કરવો નહીં. સત્સંગ કરતો ન હોય અને સીધો વિપશ્યનામાં જાય, સત્સંગ તો હજુ સુધી પ્રાપ્ત કર્યો ન હોય, યોગ્યતા સત્સંગ દ્વારા બરાબર આવી ન હોય, એ વિપશ્યના, પ્રેક્ષા અને આ મદ્રાસ તરફ ચાલે છે એ વળી ત્રીજો પ્રકાર છે. તેની

શિબિર અને તેના ધ્યાનકેન્દ્ર અને તેના યોગમાં ચાલ્યો જાય છે. જ્ઞાનીપુરુષ તેની ના પાડે છે.

૪૬૬ નંબરનો પત્રાંક છે આપણાં કૃપાળુદેવના એક ખાસ અનુયાયી હતાં, થોડા પરિચયમાં આવ્યા પછી અને એમ લાગ્યું કે અમે વિપશ્યનામાં દોડધામ કરી આવ્યા પરંતુ કંઈક ભૂલ કરી હોય એમ લાગે છે. એટલે એકાંતમાં મને પૂછ્યું કે હું તો વિપશ્યનામાં ગયો હતો, સારું પણ લાગ્યું હતું પણ હવે તમારી વાત સાંભળ્યા પછી હવે કંઈક એમાં શંકા પડે છે. મેં કીધું કે કૃપાળુદેવનો ગ્રંથ તો તમે વાંચ્યો જ છે. ઘણું વાંચન કર્યું છે. તેમાં ૪૬૬ પત્રમાં છહ્ણો પેરાગ્રાફ છે કે જીવ પોતાની કલ્પના ... એ લાઈન વંચાવી. કૃપાળુદેવને માનતા હતા એટલે વાત તરત બેસી ગઈ નહીંતર માત્ર આપણાં કહેવાથી તો બેસે પણ નહીં. “જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં” સ્પષ્ટ ના પાડી છે, બરાબર છે ? કૃપાળુદેવની આ આજા છે અને આપણે તેઓશ્રીની આજાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. તેમણે તરત એ વાત છોડી દીધી. મને કહું કે મેં તો મારા નામે વિપશ્યનાની બુક છપાવી છે તેનું શું કરવું ? મેં કીધું પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત લેવું અને હવે શું કરવું ? કે “જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે અને તે પરમસત્સંગના યોગે કરી સમજાય છે; માટે એવા વિકલ્પ કરવા મુક્કી દેવા” ધ્યાનના વિકલ્પો છોડી દેવા. બરાબર ! એ રીતે જ્યારે જે પેરેગ્રાફ વાંચતા હોઈએ ત્યારે એમાંથી આપણને જે વાત લાગુ પડતી હોય તે વાત ઉપર ધ્યાન જવું જોઈએ. જો આવી વાત ઉપર આપણું ધ્યાન ન જાય અને આપણે ધ્યાન શિબિર અને ધ્યાન કેન્દ્રમાં જતાં હોઈએ તો એનો અર્થ એ થાય છે કે સ્વાધ્યાયમાં આપણું સ્વલ્પન છે જ નહીં. પરલક્ષથી જ સ્વાધ્યાય ચાલે છે, માટે આપણું ધ્યાન નથી જતું. નહિતર સ્વલ્પનવાળાને પોતાને લાગુ પડતી વાત ઉપર ધ્યાન ન જાય એવું નથી બનતું. પણ એ તો તરત પકડી લ્યે છે કે આ વાત મને લાગુ પડે છે મારે સુધાર કરી લેવો છે. આ મારી ગડબડ છે એમાં

ફેરફાર કરી નાખવાનો છે. સ્વલ્ખશ્વાળો તરત જ અમલીકરણમાં આવે છે. એમ વાત છે. થોડા વિશેષ વિસ્તારથી લઈશું - (આજનો સમય સમાપ્ત થાય છે).

d

જગતવાસી સંસારી જીવની વિષયતૃષ્ણા અનંત છે, તેને વ્યસનની જેમ તલાપ લાગેલી જ રહે છે - એવી સ્થિતિમાં, પૂર્વકર્મ અનુસાર સંયોગીક ફેરફાર થતાં જીવ સંયોગના રસે ચડી જાય છે, અનુકૂળતામાં પ્રાય: વિશેષ સંયોગનો રસ ચડી જાય છે-(કર્તાબુદ્ધિને લીધે) - તો કોઈવાર પ્રતિકૂળતામાં વધુ ખેદાઈને રસ ભોગવે છે. (પરંતુ પોતાનું ધાર્યું કાર્ય અહીં થતું નથી - તેવા અનુભવને વિચારવાનો અહીં અવસર / પ્રસંગ છે. જો વિચારવાન હોય તો જ્યારે અનુકૂળતામાં આવા વિચારની સંભાવના નથી રહેતી). આમ પર-રસનું જેરની માત્રા વધતી જાય છે. તેથી જ પરિભ્રમણ કરતો જીવ કમશા: અધોગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં સત્પુરખનું શરણ જ તેને બચાવે છે, કે જે પુરુષ આત્મશાંતિ દ્વારા વિષય-દાહને શાંત કરવાના ઉપાયમાં જીવને યોજે છે.

- પૂજ્ય ભાઈશ્રી

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૧૨૮

પ્રવચન-૭
તા.૨૭-૧૨-૯૭ (રાત્રિ)

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૧૨૮ ચાલે છે. કોઈ માણસને માનો કે છન્કમટેક્ષનો પણ પ્રોબ્લેમ છે અને તેની ઓફિસમાં પણ નાના-મોટા પ્રોબ્લેમ છે. જેમકે કોઈ પગારવધારો માંગે છે, કોઈક Advance ઉપાડ લેવા માંગે છે, કોઈ કામ બરાબર નથી કરતું તો કોઈક મોડા આવે છે. ત્યારે તે શેને પહેલા ઉકેલ લાવવા માટે હાથમાં લેશે ? એ રીતે આપણાં જીવનમાં પ્રોબ્લેમ તો ઘડા છે પણ સૌથી મોટો પ્રોબ્લેમ શેનો છે ? મૃત્યુનો. કોઈ ભરવું પસંદ નથી કરતાં, કોઈને ભરવું નથી અને અહીં તો એક વખત નહીં પણ અનંત વખત ભરવાની વાત સામે છે. તો સૌથી મોટો પ્રોબ્લેમ યો થયો ? કે અનંત ભરણનો અને અનંત જન્મનો. એટલે જ્ઞાનીઓએ સૌથી મોટા પ્રોબ્લેમને પહેલાં હાથમાં લીધો છે.

આ પત્રાંક - ૧૨૮મો શું સૂચિત કરે છે ? કે નાના-મોટા ઘણા પ્રોબ્લેમ છે લોકો કહે છે ને ! અમારી જવાબદારી છે શું કરીએ ? સંસારના પણ અનેક કાર્યોની પણ અમારી જવાબદારીઓ છે. અમે ગૃહસ્થી નિભાવીએ, ઘંધો સંભાળીએ કે પછી આ ધર્મની વાત હાથમાં લઈએ ? શું કરવું ? કે તુલનાભક બુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે આપણો માનો ઘરનાં પણ પ્રોબ્લેમ છે, વ્યવસાયના પણ પ્રોબ્લેમ છે અને આપણાં જન્મ-મરણનો પણ પ્રોબ્લેમ છે. હવે મુખ્યતા (Priority) કોને આપવી ? કદાચ સમજાવવાની જરૂર નથી. કેમકે જ્ઞાની સૌથી વધારે સમજદાર છે એ વાત એના ઉપરથી સિદ્ધ થશે. સંસારના બુદ્ધિમાન લોકો કરતાં પણ જ્ઞાનીની વિચાર શરીર ત-વિવેક શરીર ત અધિક છે. તે આના ઉપરથી પ્રસિદ્ધ થાય છે. કારણ કે સૌથી મોટી જન્મ-મરણની સમસ્યા તેમણે હાથમાં લીધી છે અને એ સમસ્યાનું સમાધાન / ઉપાય પણ ગોત્યો, અને તેને અનુભવસિદ્ધ કરી પાર થયા. એટલા માટે આ જે ફરિયાદ આવે છે કે અમારા ઘરેલું જીવનનું શું ? અમારા વ્યાવસાયિક જીવન કાર્યોનું શું કરવું ? જો આમાં જ અમે લાગી ગયા તો તેનું શું થશે ? જ્ઞાનીઓએ એ વાતને તો બહુ જ સરળ કરી દીધી છે, જુઓ ! કે આ બધું તો તમારે પ્રારબ્ધાધિન છે. તમારી અક્કલ, હોશીયારી, ચતુરાઈ એ બધું એમાં કામ કરે છે એમ માનવું તે જોખમમાં રહેવા બરાબર છે. કારણ તે બધું તમારા પ્રારબ્ધ અનુસાર થવાનું છે. અત્યાર સુધી એમ જ થયું છે. અક્કલ, હોશીયારી તો એટલી ને એટલી હતી પણ ક્યારેક ગુમાવ્યું છે તો ક્યારેક મેળવ્યું છે. તો પછી એને પ્રારબ્ધ ઉપર છોડીને કલ્યાણનો / જન્મ-મરણના નાશનો જે ઉપાય છે તેને ગ્રહણ શા માટે ન કરી લેવો ? એટલા માટે Top Priority (સર્વોત્તમ મુખ્યતા)માં આ વિષયને રાખ્યો છે. (તેઓશ્રીની) વિચાર શરીર ત કેટલી વિશેષજ્ઞપે કામ કરે છે એનો આ એક પુરાવો છે. એટલા માટે પત્રમાં એ વિષય લીધો છે અને આપણો જે ચાલતો વિષય છે એમાં કેટલાંક સૂત્રો લખ્યાં છે. તેમાં બીજું સૂત્ર ચાલે છે.

“સત્તસંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.” પહેલાં તો ધ્યાન

એટલે શું ? એકાગ્રતા થવી એનું નામ ધ્યાન છે. એક વિષયમાં એટલી હદે એકાગ્ર થાય છે કે બીજા વિષય સંબંધિત વિકલ્પ પણ ન ચાલે, ચિંતા પણ ન થાય તેને ધ્યાન કહેવામાં આવે છે. ઉમાસ્વામી મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં - સૂત્રજ્ઞમાં તેનું સૂત્ર આ પ્રકારે લખ્યું છે કે ‘એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ્ભ’, હવે ધ્યાન જે છે તે ચાર પ્રકારના હોય છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શું લધ્યાન. પ્રકારાંતરે રૂપસ્થ ધ્યાન અને રૂપાતિત ધ્યાન પણ કહેવામાં આવે છે. ચારમાં બધા પ્રકાર આવી જાય છે. અલગ-અલગ દાખિંકોણથી તેનો વિચાર કરવામાં આવ્યો છે.

આર્તધ્યાન તો બધાં જ સંસારી પ્રાણીઓને હોય જ છે. આર્તધ્યાન એટલે શું ? શરીરની ચિંતા, સંયોગની ચિંતા, અનુકૂળતા-પ્રતિકૂળતાની ચિંતા, સમસ્ત પ્રકારના શુભાશુભ પરિણામ કે જેમાં એકાગ્રતા હોય છે તે બધા આર્તધ્યાનમાં જાય છે. આર્ત એટલે ઈચ્છા. ઈચ્છાનાં ખેંચાણને આર્ત કહે છે. ઈચ્છાથી જે પરિણામમાં ખેંચાણ થાય છે તેને આર્ત કહે છે. એ બધાયને હોય છે.

ચારેક યારેક જીવને રૌદ્રધ્યાન થાય છે. જે બહુ જ ખરાબ ધ્યાન છે. રૌદ્રધ્યાનમાં શું થાય છે ? હિંસાનંદી, કે જે હિંસા કરીને આનંદ માને તે હિંસાનંદી છે. ચોરી કરીને આનંદ માને તે ચૌરાંદી છે. એ રીતે તીવ્ર પાપના પરિણામમાં બહુ જ આનંદ અને ખુશીનો અનુભવ થાય અને રૌદ્રધ્યાન કહે છે. આર્તધ્યાનથી બહુભાગ જીવ તિર્યચમાં જાય છે અને તિર્યચ ગતિની સંખ્યા બહુ મોટી છે. ચારેય ગતિમાં સૌથી વધુ સંખ્યા તિર્યચ ગતિમાં હોય છે. સૌથી ઓછી સંખ્યા મનુષ્યગતિમાં હોય છે. એનાથી વધુ સંખ્યા નરકગતિમાં હોય છે. એનાથી વધુ દેવની સંખ્યા છે. જ્યારે સૌથી વધુ તિર્યચ છે. ત્રણેય કાળે આ પરિસ્થિતિ છે. આર્તધ્યાન તિર્યચગતિનું કારણ છે. રૌદ્રધ્યાન તે નરકગતિનું કારણ છે.

ધર્મધ્યાન છે તે મોક્ષનું કારણ છે, જે પંચમગતિ છે. સંસારની ચારગતિને છોડીને જે લોકો મુજબ તમાં જાય છે તે ધર્મધ્યાનના ફળ સ્વરૂપે જાય છે અને ધર્મધ્યાન વિશેષ નિર્મળ હોય છે. તેની ડીગ્રી / તારતમ્યતા

વધી જાય છે ત્યારે એને શુ લધ્યાન કહેવામાં આવે છે. બજેની જાતિ એક છે.

પ્રશ્ન :— રાગનો તીવ્ર રસ શેમાં જાય છે ?

પૂ. ભાઈશ્રી :— તીવ્રરસ તો આર્તધ્યાનમાં જાય છે.

પ્રશ્ન :— ધ્યાન, દરેક જીવને ચાલું જ હોય છે ?

પૂ. ભાઈશ્રી :— કોઈને કોઈ ધ્યાન તો હોય જ છે. ધ્યાન વિનાનો કોઈ જીવ નથી. ધ્યાન તો ચાલુ જ હોય છે. બહુભાગ આર્તધ્યાન ચાલુ હોય છે. મોટે ભાગે આર્તધ્યાન ચાલુ હોય છે. ધ્યાન વિના કોઈ જીવ નથી. હવે Practically (અનુભવ પર્દ્ધિતિથી) આ વિષયનો વિચાર કરીએ તો ધ્યાન શેનું થાય છે ? કે જ્યાં સુખબુદ્ધિ હોય છે, સુખનો નિશ્ચય હોય છે, ત્યાં ધ્યાન લાગી જાય છે. ભલે સુખ ત્યાં હોય કે ન હોય એ બીજી વાત છે પણ જ્યારે કોઈ એક નિશ્ચય કરવામાં આવે છે કે મારું સુખ અહીંથાં છે - ત્યારે પછી તેનું ધ્યાન રહ્યા કરે છે. Practically અનુભવ કરી જુઓ કે એમ થાય છે કે નથી થતું. હવે ભગવાન એમ કહે છે કે તારું સુખ તારા અત્મામાં જ છે આ જ ગ્રંથમાં ૧૦૮ નંબરનો પત્ર છે તેમાં કૃપાળુદેવે વારંવાર તે જ વાત કરી છે, કે હે જીવ ! તું ભૂલીશ મા ! તારું સુખ તારામાં છે, બહારમાં યાંય તારું સુખ નથી અને બહાર ગોતવાથી મળશે પણ નહીં. તો એ પ્રકારે જેને પોતાનું સુખ પોતામાં દેખાય છે, તેને સ્વરૂપનું ધ્યાન, આત્માનું ધ્યાન થાય છે. આત્મામાં સુખ દેખાય વિના આત્માનું ધ્યાન થઈ શકવાનું નથી. કોઈ કેટલાં પણ મન, વચન, કાયાથી પ્રયોગ કરી લ્યે પણ આત્મધ્યાન થવાનું નથી કારણ કે સુખ દેખાયું નથી તો ધ્યાન થશે કેવી રીતે ? અને જ્યાં સુખ માન્યું છે, સુખનો નિશ્ચય કરેલો છે ત્યાં તો પરિણામ ગયા વગર રહેવાના જ નથી.

જેમકે તમે વિપશ્યના ધ્યાનની શિબિરમાં જઈને આવ્યા પણ તમારી સુખબુદ્ધિ તો મટી નથી. સંસારનાં પદાર્થોમાંથી સુખબુદ્ધિ તો મટી નથી, અનુકૂળતામાંથી સુખબુદ્ધિ તો મટી નથી. એક અનુકૂળતામાં પાંચેય ઇન્ડ્રિયના વિષયો સમાય છે. એ સુખબુદ્ધિ એવી ને એવી રહે અને તમારું આત્મામાં

ધ્યાન લાગી જાય એ વાત અસંભવિત છે. યારેય શ ય નથી. કંઈક ફૂત્રિમ પ્રયાસ કરીને Temporary કષાય મંદ થાય છે, પરિણામની ચંચળતા મંદ થાય છે પણ તેથી કંઈ Permanent Solution કાયમી હલાજ નથી નીકળતો.

અહીંયાં ફૂપાળુટેવ એમ કહે છે કે સત્તસંગમાં એ વાત સમજમાં આવે છે કે દુર્ધ્યાન શું છે, અપધ્યાન શું છે અને ધર્મધ્યાન શું ચીજ છે ? અને તે કેવી રીતે હોય છે. જ્યાં સુધી સત્તસંગ દ્વારા એ વાત સમજવામાં ન આવે, અને તે પહેલાં કોઈ એમ જ આંખ બંધ કરીને પદ્ધાસનમાં બેસી જાય એટલે ધ્યાન લાગી જાય એવું કદી બનવાનું જ નથી. વિપશ્યનાનું તો એક દ્રષ્ટાંત છે. આપણાં જૈન સંપ્રદાયમાં પણ ઘણાં લોકો ધ્યાન કરે છે. અલગ-અલગ શિબિરોમાં, સવાર-સાંજ આ ધ્યાનનો પીરિયડ રાખવામાં આવે છે પરંતુ એવી રીતે કંઈ ધ્યાન થવાનું છે નહીં. એ માત્ર સમય અને શરીર તનો દુર્વ્યથ છે. વળી એટલું નુકસાન તો છે જ. બીજું તે ઉપરાંત સૌથી મોટું જે નુકસાન છે તે Misconcept (મિથ્યા અભિપ્રાય)નું છે. અભિપ્રાયની ભૂલ છે. જે વિધિથી જે કામ કરવું જોઈએ તે વિધિથી કામ નહીં કરતાં એ વિષયમાં બીજો નિશ્ચય કરી લેવો એને પછી એમાંથી છોડાવવો બહુ જ મુશ્કેલ થઈ પડે છે. લોકો ઓઘસંજ્ઞામાં ફસાય છે અને બહુ જ વધારે વખત ઓઘસંજ્ઞામાં રહેવાથી ઓઘસંજ્ઞા એટલી બધી દઢ થઈ જાય છે કે સાચા પ્રયોગમાં આવવું મુશ્કેલ થઈ પડે છે અને બહુ જ કઠિન પડે છે.

એટલે જ્ઞાનીઓએ એક વાતની સૂચના કરી છે કે જુઓ કોઈ સાધના કરવામાં વહેલું-મોટું થાય એનો એટલો વાંધો નથી પણ જે કાંઈ કરવું તે યથાર્થ કરવું. ભલે થોડુંક થાય અથવા વહેલું-મોટું થાય, ઓછું થાય અને એમાં થોડો સમય વધુ લાગે એમાં એટલું મુંજાવાની જરૂર નથી. પરંતુ જેટલું - થોડું તે કરવું પણ સાચું કરવું નહીંતર લટાનો પરિશ્રમ વધી જશે.

પ્રશ્ન : આત્મામાં સુખ કેવી રીતે લાગે ?

પૂ. ભાઈશ્રી : બહુ જ સુંદર પ્રશ્ન છે કે સુખથી જીવના પરિણામ

આકર્ષિત થાય છે અને સુખ આત્મામાં છે એવું જ્ઞાનીઓએ બતાવ્યું છે તો તે કેવી રીતે લાગે ? કારણ કે એ લાગવાની ચીજ છે. તો સુખ લાગે કેવી રીતે ? વાત તો બરાબર છે કારણ કે બહારમાં તો સુખ લાગે છે એટલે અમારા પરિણામ બહાર જાય છે. તમે બુદ્ધિથી સિદ્ધ કરો છો કે જુઓ ત્યાં સુખ નહોંતું એટલે તમને સુખ મળ્યું નહીં. એટલે કે તૃપ્તિ થઈ નહીં. લાડવો ખાતાં-ખાતાં પણ તું થાકી ગયો. એના ઉપરથી માન્યું હતું કે મીઠાઈ ખાવામાં સુખ નથી. ઠીક છે એ તો માન્યું ! પણ આત્મામાં સુખ છે એ લાગ્યા વગર માનવું પણ કેવી રીતે ? કહેવા માત્રથી કોઈ માનવાનું નથી.

આ આત્મા પાક્કો વાણિયો છે. પાક્કો વાણિયો એટલે શું ? કે જેમ કોઈ વેપારી હોય એની પાસે જે ગ્રાહક આવે છે અને એમ કહે કે બહુ મોટી ખરીદી કરવી છે અને માલ તમારી પાસેથી લેવાનો છે અને થોડો નથી લેવાનો પણ અમારી ખરીદી ઘણી મોટી છે. ત્યારે વેચવાવાળાને એમ થાય છે કે પૈસા લઈને આવ્યો હશે કે પછી ઉધાર લેવાની વાત હશે ? શું વાત હશે ? કારણ કે મોટી ખરીદી હોય અને ઉધાર હોય તો માલ દેવો કે ન દેવો એ વિચાર કરવો પડે. પછી માનો કે ગ્રાહક દેખાડે કે જુઓ ભાઈ હું તો Hard Cash (રોકડા પૈસા) લાવ્યો છું, રોકડ લઈ ને આવ્યો છું. ચેકથી લેવાની વાત પણ નથી. પછી તો શંકાને સ્થાન નથી રહેતું અને Competitive Rate માં માલ વેચશે કારણ કે પૈસા જોઈ લીધા. શું જોઈ લીધું ? કે પૈસા જોઈ લીધા. એ રીતે જેમ વેપારી માણસો પાક્કા હોય છે, એમ આત્મા પણ એવો જ છે. વ્યાપારનો Principle (સિદ્ધાંત) જ આમાં લાગુ થાય છે.

એમ એને જો સુખ દેખાશે તો સુખની પાછળ દોડશે અને જો નહીં દેખાય તો તીર્થકર કહેશે તો પણ નહીં માને. તીર્થકરદેવની દિવ્યધનિમાં ઘણી વખત સાંભળ્યું કે સુખ તારા આત્મામાં છે પણ વાત ગળે નથી તરી. સુખ જોશે ત્યારે માનશે. કારણ એ સુખ જોવાનો એક ઉપાય છે. પ્રશ્ન તો સુંદર છે કે કેવી રીતે આત્મામાં સુખને જોવું ? બહુ જ પ્રયોજનભૂત

વાત છે. સુખનો મતલબ છે ને ! મતલબની વાત છે, પ્રયોજનની વાત છે, તો જુઓ તમારા પરિણામમાં કષાયના પરિણામ થાય છે. શુભાશુભ બને કષાય છે. તેમાં આકૃણતા અને દુઃખ છે અને સાથે પરિણામનમાં જ્ઞાન પણ પરિણામન કરી રહ્યું છે, કે જેમાં કષાયનો અભાવ છે. પરિણામમાં બે પ્રકાર છે. એક સક્ષાય પરિણામ એટલે કે શુભાશુભ અને એક અક્ષાય પરિણામ એટલે કે જ્ઞાન. કષાયથી ભિન્ન, શુભાશુભ પરિણામથી ભિન્ન એકલાં જ્ઞાનને જો જોવામાં આવે તો જ્ઞાન સુખરૂપ દેખાશે. જેમકે દરેક વ્યક્તિનું કોઈ ને કોઈ રૂપ હોય છે અને એનાથી તે ઓળખવામાં આવે છે. શેનાથી ઓળખવામાં આવે છે ? કે એના રૂપથી ઓળખવામાં આવે છે. ઠીક છે ! બધાના ચહેરા અલગ-અલગ પ્રકારનાં હોય છે એટલે બધાને અલગ-અલગ ઓળખી શકાય છે. એ રીતે જ્ઞાનનું રૂપ તે સુખ છે. જેમ રૂપમાં કુરૂપતા, સુરૂપતા, સુંદરતા, સુરૂપતા એટલે સુંદરતા હોય છે કે નહીં ? એમ આપણો આત્મા જ્ઞાનસ્વરૂપી છે. બહુ જ સુંદર છે. કેવો છે ? બહુ જ સુંદર છે. કેમ ? કે જ્ઞાનનું રૂપ સુખ છે. આપણો યારે જ્ઞાનને એનું રૂપ કેવું છે ? એ દૃષ્ટિથી - એ ઉદ્દેશ્યથી જોવાનો પ્રયાસ જ કર્યો નથી.

હવે આપણાં જ્ઞાનમાં એક ઉદ્દેશ્યને ધારણ કરી આપણાં જ્ઞાનને સ્વયં પોતાના રૂપને જોવા માટે પ્રવૃત્ત કરવામાં આવે તો જ્ઞાન અક્ષાયરૂપ એટલે કે સુખરૂપ માલૂમ પડશે. આ પ્રયોગનો વિષય છે. પ્રયોગ કરવો પડશે અને તે પ્રયોગ યારે થઈ શકશે ? કેમકે આ ભાવભાસનની ભૂમિકા છે. તો તે પહેલાંના બધા Stage (ભૂમિકાઓ) પસાર કર્યા પછી ભાવભાસનના Stage (ભૂમિકામાં) પ્રયોગ થઈ શકે છે. ત્યારે જ્ઞાન સુખરૂપ દેખાય છે. સુખરૂપ દેખાય છે માત્ર એટલું જ નહિ પર્યાયમાં તેનું સેમ્પલ છે. એક સેમ્પલ ઉપરથી અનંતસુખની ખાણનો પતો લાગી જાય છે. એડ્રેસ મળી જાય છે.

જેમ જમીન વિજ્ઞાનમાં તજજ્ઞ હોય છે. શું કહે છે એને ? હા, જીઓલોજિસ્ટ. તો સુવર્ણ પથ્થર જે આવે છે એનું તે લોકો Analysis (પૃથક્કરણ) કરે છે, કે આમાં સોનાના Particals (પરમાણુ) કેટલાં અને

માટીના Particals (પરમાણ) કેટલાં ? એના ઉપરથી એને સોનાની ખાણ દેખાય છે. જો આ જગ્યાએ આવો પથર નીકળે છે તો અહીંથી જરૂર અટલાં ટન સોનું નીકળશે. જ્યારે કે સોનું તો માટીની સાથે ભણેલું છે અને ખાણમાં અલગ-અલગ પરમાણુરૂપે છે તોપણ એને હજારો ટન સોનું દેખાય છે. સેમ્પલ ઉપરથી શું જોયું ? પૂરી સોનાની ખાણ જોઈ. તેવી જ રીતે એ ભૂમિકામાં આવીને માત્ર જ્ઞાનને, જે એકલા જ્ઞાનને જોવા માટે સક્રમ થાય છે તેને અનંત સુખની ખાણ છે એમ જોવા મળે છે અને લાગવા માંડે છે. તે જ્ઞાનને જ્ઞાનવેદનથી Feel (અનુભવ) કરે છે. શેનાથી ? જ્ઞાનમાં મુખ્ય બે ધર્મ છે. એક જાણવાનો અને એક અનુભવ કરવાનો - વેદન કરવાનો. જો જ્ઞાન સ્વયંનો અનુભવ કરે તો તેમાં સુખનું અને નિરાકૃતિનું વેદન થયાં વિના રહેતું નથી.

કૃપાળુદેવે પત્રાંક ૭૫૧માં ભાવભાસનની પરિભાષા આ પ્રકારે લખી છે. “પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ” અનુભવાંશે એટલે લાગવું. ભાવભાસનમાં શું થયું ? સેમ્પલ ચાખી લીધો, ને સુખ લાગ્યું. પત્રાંક - ૪૭૧ અને ૪૭૨માં પત્રમાં કૃપાળુદેવે એને ‘સુધારસ’ કહ્યું છે. બીજજાન કહીને સુધારસ કીધેલ છે. “વહ કેવલ કો બીજજાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે” ભાવભાસન એ સુખ-શાંતિનો સેમ્પલ અનુભવમાં આવે છે ત્યારે અનંત સુખની ખાણનો પત્તો લાગ્યો જાય છે અને પરિણામ પોતાના સ્વરૂપ ભણી દોડ લગાવા માંડે છે. પછી પરિણામ ધીરે-ધીરે નથી ચાલતાં. તેથી જ જેને ભાવભાસન થાય છે તેને સ્વાનુભવ બહુ જ અલ્યકાળમાં થઈ જાય છે, વાર નથી લાગતી.

પરમ કૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને આ ભાવભાસનના વિષયમાં ધ્યાન બેંચ્યું હતું પરંતુ સૌભાગ્યભાઈ કૃપાળુદેવ પ્રત્યે પ્રેમ સમાધિમાં આવી ગયા હતાં. ત્યાંથી એમની સમાધિ ધૂટતી નહોતી. શું ? સમાધિ ધૂટી નહોતી શકતી. વળી કૃપાળુદેવ પોતે વચનબદ્ધ હતા. કૃપાળુદેવે Promise (ખાતરી) આપેલ. વચન આપેલ કે અમે આ ભવમાં તમને આત્મજ્ઞાન પમાડીશું. અને જો અમારા નિભિતે અમારા હાથે એ કામ થયું તો અમે એને અમારું

બહુ મોટું સૌભાગ્ય સમજશું. એ પ્રકારે લખ્યું છે છતાં પણ સૌભાગ્યભાઈ આગળ નહોતા વધતા. (પ્રેમ ભી તમાંથી) નીકળતાં જ નહોતા અને ફૂપાળુટેવ ભાવભાસનની વાત છેડતાં હતાં પણ તેમનું ધ્યાન જતું નહોતું. પછી જ્યારે આયુષ્યના છેલ્લા દિવસો આવી ગયા ત્યારે પછી ફૂપાળુટેવ ટ્રીટમેન્ટ આપી છે અને લઈ ગયા છે ઈડર. ઈડર જઈને ત્યાં અમણે બીજજાન એટલે કે આ ભાવભાસનનો પ્રયોગ દેખાડયો છે. શું દેખાડ્યું છે ? પ્રયોગ દેખાડયો છે. જુઓ ! સ્વરૂપમાં અમારું ધ્યાન આ પ્રકારે લાગે છે. આ અમારા ધ્યાનની પ્રક્રિયા છે. અને આ પ્રકારે પરિણામ અંતર્મુખ થાય છે. તમે જુઓ ! ધ્યાનથી જુઓ ! અધિક ધ્યાનથી ને બારીકાઈ થી જુઓ ! તમને પણ જોવામાં આવશે. (સૌભાગ્યભાઈ)નું તો એક દૃષ્ટાંત છે. કોઈ પણને દેખાઈ શકે છે પણ જોવા માટેની યોગ્યતા હોવી જોઈએ.

એવી યોગ્યતા ભાવભાસનના Stageમાં આવે છે. તે પહેલાં અવલોકનનું Stage આવે છે. સતત અવલોકન થવા અર્થે પૂર્ણતાનું લક્ષ હોવું જરૂરી છે તે વિના સતત અવલોકન થઈ નથી શકતું. પૂર્ણતાનું લક્ષ ક્યારેય શુદ્ધ અંતઃકરણ વિના થઈ શકતું નથી અને પરિભ્રમણની વેદના-ચિંતના વિના અંતઃકરણની શુદ્ધ યારેય થઈ શકતી નથી. એટલા માટે આ કમથી જે આગળ વધે છે તેને પોતાનું સુખ પોતાનામાં દેખાય છે. ‘અનુભવાંશે’ એટલે કે લાગે છે. Feeling Stageમાં એ અનુભવ થાય છે અને ભાવભાસન થયાં પછી તો પરિણામ દોડ લગાવશે. આ વાત સત્સંગ વિના કે પરમ સત્સંગ વિના સંભવિત નથી. એટલે તે પહેલાં જો કોઈ ધ્યાન કરે છે તો તે બધા હવાઈ કિલ્લા સમાન છે. હવાઈ કિલ્લા ! તે હવામાં ચાલે છે. એથી કાંઈ થવાનું નથી. અને તરંગ કીધાં છે. તરંગી લોકો હોય છે ને ! નવા-નવા તરંગ ઉડાવે છે. વાસ્તવિકતાનો એમાં અભાવ છે. વાસ્તવિકતા બિલકુલ એમાં નથી.

“સંત વિના અંતની વાતમાં, અંત પમાતો નથી.” અંત એટલે ભવઅંત. અંત એટલે ભવભ્રમણનો અંત. એનો જે વિષય છે એનો અંત કદી સંત વિના નથી આવી શકતો. એટલે કે મૂળ વાત સમજમાં નથી આવતી. એનો

અર્થ એ થાય છે કે જેણે એવો અનુભવ કર્યો છે, ભવભ્રમણના અંતના વિષયમાં જે અનુભવી છે. તે જ એ વાત બતાવી શકે છે, બીજાને એ વાતની ખબર નથી. યાંથી બતાવશે? એટલે જ્ઞાની વિના આ ભવભ્રમણના અંતની વાત સમજમાં નથી આવતી અને પ્રયોગમાં પણ નથી આવી શકતી.

“લોકસંજ્ઞાથી લોકાંગે જવાતું નથી.” લોકાંગ એટલે સિદ્ધાલય. લોકમાં અગ્ર એટલે સૌથી ઉપર. શું છે? સિદ્ધશિલા. જ્યાં બધા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. આપણી જે ભૂગોળ છે એમાં ત્યાં સિદ્ધશિલા છે. જો આપણે નિર્વાણપદની પ્રાપ્તિ કરવી હોય, સિદ્ધપદની પ્રાપ્તિ કરવી હોય તો આપણે લોકસંજ્ઞાનો ત્યાગ કરવો પડશે. લોકસંજ્ઞા એટલે શું? લોકોની દૃષ્ટિએ આપણે ચાલવું, આપણે કાર્ય કરવું. લોકોને શું લાગશે? આમ કરશું તો લોકોને શું લાગશે? આમ કરશું તો લોકોને-સમાજને શું લાગશે? એ રીતે સમાજના દૃષ્ટિકોણથી જે જીવ જીવે છે તે ચારેય આત્મકલ્યાણ કરી શકતો નથી. કારણ કે આત્મકલ્યાણ કેવી રીતે કરવું એ સમાજનો વિષય નથી. તે એક Special Line (ચોક્કસ પ્રકારનો વિષય) છે. જેમકે કોઈને Heart Attack (હથયરોગનો હુમલો) આવે તો શું તે સમાજને પૂછે છે? કે મારે શું કરવું જોઈએ? એ તો કાર્ડિયોલોજિસ્ટ પાસે જશે અને એમાં પણ સારામાં સારો હશે એની પાસે જશે. તેમાં સમાજની મિટિંગ નથી બોલાવવી પડતી કે જુઓ ભાઈ! મને અહીં છાતીમાં કચારેક કચારેક દુઃખે છે તો તમારી બધાની દૃષ્ટિએ મારે શું કરવું જોઈએ? (અનું કરવા જાય તો) મરી જાય. કારણ કે એ તો તેના Expert (તજ્જ્ઞ) લોકોની Special Line છે.

એ રીતે આત્મકલ્યાણ કરવું એ પણ તેના Expert હોય તેની લાઈન છે. એ સમાજનો વિષય થોડો છે? આપણે કહીએ કે જુઓ! અમારે ધર્મ કરવો છે પણ સમાજવાળાની નજરમાં અમારી આબરૂ એવી ન એવી રહેવી જોઈએ તો – એ પ્રકારે ચારેય આત્મકલ્યાણ થઈ શકતું નથી.

યાં સુધી આ લોકસંજ્ઞા કામ કરતી હોય છે? કે જે ગુપ્તમાં આપણી ઓળખાણ હોય, તે ઓળખીતાઓની નજરમાં આપણું સ્થાન જે હોય તે બરાબર રહેવું જોઈએ, તે ટકી રહેવું જોઈએ – એ પણ લોકસંજ્ઞા છે.

પછી ભવે એ પાંચ-પચ્ચીશ જણા હોય કે કેટલી પણ વધારે સંખ્યામાં હોય. એ લોકસંજ્ઞા છે. બીજા લોકોની નજરમાં મારો દેખાવ કેવો હશે? એ પ્રકાર લોકસંજ્ઞા છે. દૃષ્ટાંત લેવું હોય તો બહુ જ સુંદર દૃષ્ટાંત છે. જેમકે હું અત્યારે બોલી રહ્યો છું અને તમે લોકો સાંભળી રહ્યા છો, તો તમારી સહૃદ્દુની નજરમાં મારી સારામાં સારી Impression-(ધાપ) પડે-એવો પ્રકાર મને હોય તો તે લોકસંજ્ઞા છે. હું એટલું સરસ બોલું, એટલી સરસ વાતો કરું, અને એવી સ્ટાઇલથી બતાવું કે મારી આબરૂ વધે. ઓરેટરી હોય છે ને! વ તૃત્વકળા-વાત કરવાની પણ કળા હોય છે. બધાયને સારુ લાગે અને બધાંયની નજરમાં દેખાવ સારો થાય-એ થઈ લોકસંજ્ઞા. જે માણસ સામાજિક પ્લોટફોર્મ ઉપર ભો હોય તેને લોકસંજ્ઞાનો Chance (ખતરો) વિશેષ હોય છે. આ પ્લોટફોર્મ છે. ગાદી ઉપર બેસવું એ એક પ્લોટફોર્મ છે. ધાર્મિક પ્લોટફોર્મ ઉપર રહી લોકસંજ્ઞાથી બચવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. સમજદાર લોકો તો બેસતાં જ નથી; એમાં જ એની સમજદારી છે. ઠીક! કેટલાય સમજદાર માણસો તો બેસતાં જ નથી. કહી દે છે કે અમારે નથી બેસવું, શું? લોકસંજ્ઞામાં આવી જશું, માટે જેની કેપેસીટી હોય અને લોકસંજ્ઞા ન આવી જાય એમ હોય તેનું અહીંં બેસવાનું કામ છે, બાકી બીજાનું એમાં કામ નથી. લોકસંજ્ઞાવાળાનું આત્મકલ્યાણ યારેય નથી થઈ શકતું.

કૃપાળુદેવનું આ લોકસંજ્ઞાથી લોકાંત્રે જવાતું નથી, સિદ્ધાંતિક સૂત્ર છે. બહુ જ ડા અનુભવથી વાત લખી છે. એટલા સમર્થ પુરુષ હતા. બહુ જ વિશાળ Capacity-ક્ષમતા હતી. મહાજ્ઞાની હતાં એમ કહી શકાય. તેમ છતાં પોતાના વિષયમાં પોતે લખે છે કે અમે ઉપદેશક બનીને કોઈને ઉપદેશ નથી દેતાં કોઈ ધર્મના જિજ્ઞાસુ જીવ આવે છે તો અને દિશાસૂચન કરી દઈએ છીએ, કે ધર્મ તો આ પ્રકારે થાય છે. વળી કોઈ પાત્ર જીવ આવે છે તો અને ધર્મનું રહસ્ય (Secret) જે છે તે બતાવી દઈએ છીએ. જેમકે અમે તો આ પ્રકારે પ્રાપ્ત કર્યું છે, તમારી યોગ્યતા છે એટલે વાત બતાવી દઈએ છીએ. પુરુષાર્થ કરશો તો તમારું કામ થઈ જશો. અમે પણ ઉપદેશક

થઈને આમ કરો, તેમ કરો એવું નથી કહેતાં, એવું કહેવું એ અમારું કામ નથી. કૃપાળુદેવ ક્યારેય Platform પર નથી આવ્યા. સમાજના થોડાક લોકો એમની પાછળ પડી ગયેલાં તો ધર્મની વાત કરી દેતા હતા, પરંતુ એ પણ ઉપદેશક બનીને નહોતા કહેતા, બહુ જ સભાન દશામાં વાત કરતા હતા. એ રીતે તેવા જ્ઞાની બચી શકે છે કેમકે એને લોકસંજ્ઞા નથી હોતી. બાકી તો લોકસંજ્ઞામાં આવનારને ખબર જ નથી રહેતી કે પોતે લોકસંજ્ઞામાં કેવી રીતે આવી ગયો. શું કરે બિયારો ? અને પોતાના આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે. માટે કોઈ મુમુક્ષુએ પોતાનું આત્મકલ્યાણ કરવામાં વચ્ચે સમાજને લાવવાનો નથી અને પોતાનું આત્મકલ્યાણ થઈ જાય (સૌથી મોટી સમસ્યા જે જન્મ-મરણના નાશની છે તેનો નિવેદો થઈ જાય) એ જ કરી લેવા જેવું છે. આ ભવરોગ મટાડવામાં આપણે સમાજની વાત વચ્ચે લાવવાની ન હોય.

ખાસ કરીને હિન્દીભાષી ક્ષેત્રોમાંથી લોકો આવતાં હતાં, અમારે ત્યાં સોનગઢમાં ઘણાં લોકો આવતાં હતાં ઘણાં આવતાં હતાં, તે લોકો એવી વાત કરતા હતાં કે શું કરીએ ? અમારે સમાજની વચ્ચે રહેવું પડે છે. અમારો સમાજ આવો છે અને અમારો સમાજ તેવો છે. આ (તાવની) વાત તો કોઈ સાંભળવા પણ તૈયાર નથી. શું કરીએ ? જેમકે શુભભાવથી ધર્મ નથી થતો એ વાત અમારા સમાજમાં કોઈ સાંભળવા પણ માંગતું નથી. ભી ત, પૂજા એ બધું તો હોવું જ જોઈએ. એ તો સૌથી પહેલાં હોવું જોઈએ અને અમારે ત્યાં તો કોઈ ભગવાનનાં દર્શન કર્યા વગર મોઢે પાણી પણ અડાડતા નથી. મોઢે પાણીનો જવાસ પણ ન અડાડે. શુભભાવથી ધર્મ થતો નથી એમ માનવું અને આવા સમાજની સાથે રહેવું છે, તો કેમ કરવું ? પણ જો એવા સમાજની સાથે જ રહેવું હોય તો લોકાંને સિદ્ધાલયમાં જાવ ! ત્યાં કોઈ સમાજ નથી. ત્યાં સિદ્ધ પરમાત્માઓ છે. પોત-પોતાના ધ્યાનમાં બેઠા છે. તો હવે કોની વચ્ચે રહેવું છે ? સિદ્ધાંની વચ્ચે રહેવું છે કે સંસારીઓની વચ્ચે રહેવું છે ? એ નિર્ણય તમારે કરવાનો

રહે છે. પણ આ સમાજની વચ્ચે અમારી ઇજજત-આબરુ છે એનું શું ? એમ નાક આંદું આવે છે.-અરે ! તું ત્રણલોકનો નાથ છો કે જેની પાસે સમાજની ઇજજત-આબરુ કાંઈ જ નથી. નીચપદમાં ઉચ્ચપદ શા માટે માને છો ? અંદરમાં તું પોતે જ પરમાત્મા છો. સૌથી મોટું પદ પરમાત્માનું છે. સમાજની ઇજજતવાળું પદ એટલું મોટું પદ નથી. સમાજની ઇજજતમાં તો તમને બહુ બહુ તો સેંકડો-હજારો લોકો જાણો છે કે તમે બહુ સારા છો, જ્યારે આ માર્ગમાં જો તમે લાયક થઈ ગયાં, પાત્ર થઈ ગયાં તો અનંત સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં આવશે કે ઠીક ! આ જીવ હવે અલ્ય કાળમાં સિદ્ધ થઈ જશે. કેટલા સિદ્ધ પરમાત્મા છે ? અનંત સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં માલૂમ પડશે પછી એથી વિશેષ તમારે કોની નજરમાં તમારી ઇજજત વધારવી છે ? Comparison (તુલના) કરી જુઓ. સેંકડો-હજારો સંસારી લોકોની વચ્ચે પોતાની ઇજજત રાખવી છે ? કે અનંત સિદ્ધોના જ્ઞાનમાં તમારી ઇજજત રાખવી છે ? કોના જ્ઞાનમાં રાખવી છે ? વિવેક કરવો રહ્યો.

કૃપાળુદેવે એટલે જ લોકસંજ્ઞાના પરિણામોને કાળકૂટ ઝેર કીધાં છે. કેવાં કીધાં છે ? કાળકૂટ ઝેર કીધાં છે. એટલે માટે કાળકૂટ ઝેર કીધાં છે કેમકે જેને લોકસંજ્ઞા હોય છે એનું પરલક્ષ નથી મટતું. એને યારેય સ્વલ્પ ઉત્પન્ન થતું નથી. અને એ પરલક્ષ સહિત ગમે તેટલાં પણ ધર્મસાધન કરી ધૂટો બધા જ નિષ્ફળ જશે. બધે બધાં નિષ્ફળ જશે જરા પણ સફળતા નહીં મળે. એટલે એ પરિણામને કાળકૂટ ઝેર કીધાં છે.

૧૯૪ પત્રાંકમાં ચાર પ્રતિબંધ લીધા છે. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ-વિકલ્પ પ્રતિબંધ. એમાં સૌથી મોટો સમાજ પ્રતિબંધ લીધો છે. એ પ્રકારે કે સમાજને રાજ રાખીને કોઈ આત્મકલ્યાણ કરવા માંગે છે તો એ એને સૌથી મોટો પ્રતિબંધ આડો આવે છે. એ જ રીતે કુટુંબ પરિવારને, બધાને રાજ રાખીને પણ હું મારું આત્મકલ્યાણ કરી લઉં - એ પણ ચારેય બનવાનું નથી. કારણ કે એક કુટુંબમાં જેટલી વ્યા ત હોય બધાના વિચાર એક સરખા હોવા એ યારેય

સંભવિત નથી. વિચાર મેળ હોય તો ઠીક છે, પણ મેળ ન હોય તો પણ પોતાનું આત્મકલ્યાણ તો કરી જ લેવું જોઈએ. એમાં ઘણી તકલીફ થાય છે. કારણ સમાજ પ્રત્યે તો એટલો સ્નેહ નથી હોતો, જ્યારે પરિવારના સદશ્યો પ્રત્યે સ્નેહ હોય છે – પ્રેમ હોય છે. અધ્યાત્મની ભાષામાં તેને રાગ કહે છે. શું કહે છે ? રાગ કહે છે અને તેથી નાજુક પરિસ્થિતિ ભી થાય છે કે જેની ઉપર પ્રેમ હોય, સ્નેહ હોય એને નારાજ કેમ કરવાં ? તે માને નહીં પછી કરે શું ? એ પરિસ્થિતિ મુશ્કેલી ભી કરવાવાળી તો જરૂર છે પણ જેને આત્મકલ્યાણ કરવું જ છે એ એમ વિચારે છે કે આ પરિવારના સભ્યો જેના પ્રત્યે મને સ્નેહ છે તે તો આ ભવ પર્યત છે. આવો સ્નેહ તો હું અનંત કુટુંબો સાથે કરતો કરતો અહીં આવ્યો છું. અને થોડા સમય પછી આ (સ્નેહ) પણ સમાપ્ત થઈ જશે. આ પ્રકાર પણ પૂરો થઈ જવાનો છે. અત્યારે સ્નેહ છે એનો અર્થ એ નથી કે અનંતકાળ સુધી સાથે રહેશું અને અમારો સ્નેહ પણ એવો ને એવો રહેશે, એવું બનવાનું નથી. જ્યારે વાત થોડા સમય પૂરતી જ છે, સીમિત છે તો એને એટલું બધું Weightage વજન દેવું ન જોઈએ, કે આપણે આપણું આત્મકલ્યાણ કરવાનું છોડી દઈએ. એવું ન થવું જોઈએ. કંઈક Adjustment કરીને રસ્તો નીકળતો હોય તો કાઢવો જોઈએ અને ન નીકળે એમ હોય તો આપણી આત્મકલ્યાણની ભાવના વધવી જોઈએ. પણ આપણી ભાવનામાં ઢીલાપણું ન આવવું જોઈએ, તો જ આત્મકલ્યાણ થઈ શકે છે નહીંતર કુટુંબ પ્રતિબંધથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આ કુટુંબ સ્નેહનું ફળ શું છે ? દુર્ગતિ છે. સુગતિ નથી.

કૃપાળુદેવનો ૫૧૦ નંબરનો પત્ર છે. કે બીજા જીવમાં પિતાપણું, પુત્રપણું કરીને આ જીવે પોતાનું માહું કરવામાં કાંઈ મણા રાખી નથી. 'મ' નું એલીટ્રેશન કર્યું છે. આમ બહુ Normal સામાન્ય દેખાય છે. કુટુંબ પ્રેમમાં કોઈને કાંઈ પણ Abnormal નથી લાગતું, કોઈ અપરાધ નથી લાગતો. Normal Position લાગે છે પણ તે જ દુર્ગતિનું કારણ છે. આપણે દીર્ઘદિનથી વિચાર કરવાનો છે. આ કુટુંબસ્નેહ ને કારણો જો હું દુર્ગતિમાં

ચાલ્યો જઈશ, તો આ કુટુંબીઓ શું મને એ હુંખથી છોડાવવા આવશે ? કે નહીં. આ કોઈ આવવાના નથી. મારે એકલા એ જ ભોગવવાનું છે. એ હુંખો મારે એકલાએ જ ભોગવવા પડશે. એટલે આપણે સાવધાન થઈ જવાનું છે અને એની કોઈ એક મર્યાદા કરી લેવાની અને મર્યાદામાં ચાલવું. એક સાથે તેની ઉપેક્ષા ન કરી શકાય તોપણ એની મર્યાદા અવશ્ય કરવી અને એ મર્યાદામાં આપણો જે રસ છે, તીવ્ર રસ છે એ ફિક્કો પડી જશે. એ મર્યાદાનું પહેલું કદમ છે. એ રસ ફિક્કો પડી જવાથી આપણે પ્રવૃત્તિ સીમિત થઈ જશે. આપણા પરિણામ પણ સીમિત થઈ જશે અને આપણો દુર્ગતિનો રસ્તો છોડી મુજબ તના માર્ગ કે જે પંચમગતિ છે એ તરફ પ્રયાણ કરવા માટે તૈયાર થઈ જશું. એટલે એ વિવેક કરવાનો રહે છે કે આપણો લોકસંજ્ઞામાં પણ નથી રહેવાનું અને કુટુંબ પ્રતિબંધમાં પણ નથી રહેવાનું. પછી વાત આવશે શરીર પ્રતિબંધની. શરીરની શાતા-અશાતાને મુખ્ય કરી આપણે આત્મકલ્યાણને ગૌણ નથી કરવાનું.

“લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે” શું કહે છે ? લોકત્યાગમાં અસત્સંગનો ત્યાગ છે અને કુસંગનો ત્યાગ છે. જેને આત્મકલ્યાણ કરતાં ઉદાસીનતા આવી હોય છે તેને લોકોનો પરિચય રુચતો નથી. (એને લાગે છે કે) એમાં શું છે ? શું રહ્યું છે ? થોડાક લોકો ભેગા મળે અને ખાવા-પીવાની અને Entertainmentની થોડી રમતો ચાલે એમાં ફૂન્ટ્રિમ આનંદ લેવાથી વિશેષ શું રહ્યું છે ? એમાં શું છે ? શું રહેલું છે ? સાચો આનંદ તો ત્યાં છે જ નહીં, અને ફૂન્ટ્રિમ આનંદ કેમ પ્રાપ્ત કરવો એનો પ્રયાસ ત્યાં હોય છે. લોકો એક-બીજાને વધારે મળે છે, કોઈ મિત્ર-મંડળ બનાવે છે, કોઈ કલબ બનાવે છે, તો કોઈ સોસાયટી બનાવે છે. કોઈ કાંઈક કરે છે તો કોઈ કાંઈક કરે છે એ રીતે હળવું-મળવું કરે છે. એમાં કંઈ દમ નથી. જ્યારે કે આપણું મનુષ્યજીવન ઘણું મૂલ્યવાન છે. એવા ફૂન્ટ્રિમ આનંદ માટે આપણો આપણો કીમતી સમય ખોવો-બગાડવો વિવેકપૂર્ણ વાત નથી. માટે જેને આત્મકલ્યાણ કરવું છે તેને લોકત્યાગ કરવાનો ભાવ આવે છે. લોકોમાં બધા એકબીજાનો સંબંધ વધારવાનો પ્રયાસ

કરતા હોય છે કે જેટલો સંબંધ વધારે તેટલું વધારે સારું. બધે Contact (સંબંધ) હોવો જોઈએ. જ્યારે આ મોક્ષમાર્ગમાં ચાલવાવાળા સંબંધો કાપતા જાય છે. જે કોઈ સંબંધ હોય છે તેને કાપતા જાય છે. મારે મારું કામ (આત્મકલ્યાણ) કરવું છે, એ બધામાં મને સમય બગાડવો પોસાય તેમ નથી. તેથી પોતાનો સમય બચાવવા માટે અને પરિણામમાં દુર્ગુણ ન આવી જાય એ રીતે બચવા માટે, સદ્ગુણની પ્રાપ્તિ માટે બની શકે તેટલાં Contact સંબંધો ઓછા કરવા જોઈએ.

પ્રશ્ન :— બસે પ્રકારના સંબંધો નિભાવીએ તો કેમ ?

પૂ. ભાઈશ્રી :— બસે બાજુના Contact (સંબંધો) એકસાથે નથી રહી શકતા. સ્વરૂપમાં ધ્યાન લગાવવું હોય તો બહાર ના Attachment ને Detach કરવા જોઈએ ત્યારે જ કામ થશે, એ વિના નહીં થાય. માટે એવી પરિસ્થિતિ ભી થઈ છે.

“એ કાંઈ ઓટું છે ? શું ?” એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. “પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો ?” એટલે કે નિર્ણય કરવો જોઈએ કે હવે મારે પરિભ્રમણ કરવું જ નથી. એવો નિર્ધાર, દઢ નિર્ધાર કરીએ તો એના પ્રત્યાખ્યાન એ રીતે લઈ શકાય ? હા “લઈ શકાય” જો આપણે ધારીએ તો લઈ શકાય છે. આ કોઈ એવી અધરી વાત નથી કે આપણે પરિભ્રમણ મટાડવાં માટે તૈયાર ન થઈ શકીએ. એવી કોઈ વાત છે જ નહીં. જ્યારે પણ ઇચ્છીએ, આજે, અત્યારે ઇચ્છીએ તોપણ લઈ શકાય એમાં કોઈ મોટી વાત નથી. કારણ કે એમાં બહારનો તો કાંઈ ફેરફાર કરવાનો છે નહીં. ગ્રહણ-ત્યાગનો તો કોઈ વિષય છે નહીં. આપણાં પરિણામમાં, ભાવોમાં એક નિશ્ચય કરવાનો છે, નિર્ધાર કરવાનો છે, ને Decision લેવાનું છે કે આ જ કરવું છે. અને બીજુ કાંઈ કરવું નથી. જો એ લઈ શકાય તો “એ પણ આશ્રયકારક છે” શું લઘું છે ? પરિભ્રમણ નથી જ કરવું એવો નિશ્ચય બીજા લોકો તો નથી કરી શકતાં પણ એટલું જ નહીં આ વિચારધારામાં જે લોકો આવે છે તે લોકો પણ બધા નથી કરી શકતા,. એમાં પણ બહુ જ અલ્ય માત્રામાં કોઈક

જીવ એવા નિર્ધારમાં આવે છે. માટે આવો નિશ્ચય કરવાવાળો પણ જો કોઈ હોય તો એને એક આશ્ર્યની ઘટના સમજવી “એ પણ આશ્ર્યકારક છે” એમ લખ્યું છે. કેમ? કેમકે જીવ પરિભ્રમણની ચિંતનામાં આત્માની ચિંતના કરે છે અને એ રીતે આત્માની ચિંતા જ્યારે થાય છે ત્યારે પરપરાર્થની ચિંતના, શરીરની ચિંતના, ભવિષ્યની ચિંતના, વર્તમાનની ચિંતના છૂટી જાય છે અને એ ચિંતાઓ છોડ્યા વિના, અનાત્માની ચિંતા છોડ્યા વિના આત્માની ચિંતા થતી નથી. પરિભ્રમણ સંબંધિત આત્માની ચિંતા કેમ નથી થતી? કેમકે અનાત્માની ચિંતામાં એટલે બધો રોકાયેલો છે કે એને આત્માની ચિંતા ઉત્પત્ત જ નથી થતી. જો કોઈ એ ચિંતામાં ન રોકાણો અને આત્માની ચિંતામાં આવ્યો તો તે એક આશ્ર્યકારક ઘટના છે એમ લેવાનું છે. માટે એમ લખ્યું કે “એ પણ આશ્ર્યકારક છે”

“અત્યારે એ જ” એનાથી વધારે નહીં કહીએ આશ્ર્યકારક છે એમ લખી વાતને પૂરી કરી દીધી છે. અત્યારે તો આટલી જ વાત છે. “ફરી યોગવાઈએ મલીશુ” મળશું ત્યારે મળશું. હવે આ વાતને અહીં જ સમાપ્ત કરીએ છીએ. “એ જ વિજ્ઞાપન” છે. લખનાર “વિ. રાયચંદ્રના યથાયોગ્ય” એમ કરી પત્ર સમાપ્ત કર્યો છે. તો આ રીતે આખા પત્રનો સારાંશ એ છે કે સૌથી મોટી સમસ્યા જે પરિભ્રમણની છે તેને આગ્રતા કમમાં મુકી મુખ્ય કરી એ જ કાર્યમાં આપણો લાગવું જોઈએ. એ જ પરમ વિવિક છે નહીંતર અવિવેકથી તો તેનું ફળ પણ ભોગવવું અનિવાર્ય થઈ જશે. (પત્ર અહીં સમાપ્ત થાય છે.)

શ્રીમદ્ રાજચંદ્

પત્રાંક-૨૬૪

રાજજ, ભાડરવા સુદ્ ૮, ૧૯૪૭

હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દ્યાળ;
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧.
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજુપ;
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરુપ ? ૨.
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં;
આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩.
જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ;
ક્રેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪.
‘હું પામર શું કરી શકું ?’ એવો નથી વિવેક;
ચરણ શરણ ધીરજ નથી, ભરણ સુધીની છેક. ૫.
અચિત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રકુલ્પિત ભાવ;
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬.
અચળરૂપ આસી ત નહિ, નહીં વિરહનો તાપ;
કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭.
ભઈ તમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન;
સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮.
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ;
તોય નહીં વાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯.

સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ;
દેહંદ્રિય માને નહીં, કરે બાધ્ય પર રાગ. ૧૦.
તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં;
નહિ ઉદાસ અનભ તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧.
અહંભાવથી રહિત નહિ, સ્વર્ધમ સંચય નાહીં;
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨.
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય;
નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ?. ૧૩.
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ;
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪.
અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન;
સેવા નહિ ગુરુ સંતને, મૂ યું નહિ અભિમાન. ૧૫.
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક;
પાર ન તેથી પામિયો, જ્યો ન અંશ વિવેક. ૧૬.
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્ત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?. ૧૭.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?. ૧૮.
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯.
પડી પડી તુજ પદ્યંકજે, ફરી ફરી માગું એ જ;
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦.

શ્રીમદ્ રાજચંદ્ર

પત્રાંક-૨૬૪

પ્રવચન-૮

તા.૧૨-૪-૯૯

શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૨૬૪.

કૃપાળુદેવ નિવૃત્તિ ક્ષેત્રમાં લગભગ ભાદરવા / આસોમાં આવતા હતા.
૨૪મા વર્ષે પણ આ ખંભાત બાજુ આવેલા હશે. ખંભાતની બાજુમાં રાજજ
કરીને ગામ છે. એ ગામમાં થોડા દિવસ રહ્યા હતા, ત્યાં એમણે આ
બધા પદ ભાદરવા મહિનામાં બનાવ્યા છે, (પત્રાંક નંબર)
૨૬૪,૨૬૫,૨૬૬,૨૬૭-ચાર પદ ત્યાં રાજજમાં બનાવ્યા છે. એમાં વીસ
દોહરા બનાવ્યા છે એ લલ્લુજી મહારાજ માટે બનાવ્યા છે. એ ભૂમિકાનો
આ વિષય છે કે જે ભૂમિકામાં કોઈ જીવ જ્યારે આત્મકલ્યાણની સૂજમાં
નથી આવતો, કેવી રીતે મારે આત્મકલ્યાણ કરવું એનું સૂજતું નથી ત્યારે
એ જીવે એવી ઈચ્છા કરવી ઘટે કે મને કોઈ સત્પુરુષનું શરણ મળી જાય
તો સારું; જેથી મારા અકલ્યાણ, કલ્યાણ (અર્થે) એક Guardian (વાલી)
તરીકે તે મને દોરી જાય એવી ભાવના અને એવી ઈચ્છા થાય એવા

અર્થમાં આ પદ બનાવીને શ્રી લલુજીને મોકલેલું છે.

“હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દ્યાળ;”

હે પ્રભુ ! ખાસ કરીને મુમુક્ષુ પોતાના શ્રીગુરુ અથવા સત્યરુધને અહીંયાં પ્રભુ કહીને સંબોધન કરે છે, કે હું આપને શું કહું ? આપ તો મારા દેવ છો આપ મારા નાથ છો, અને દ્યાળું છો.

“હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.”

હું અનંત દોષનું ભાજન છું ભાજન એટલે પાત્ર. હે કરુણાનિધાન ! મારામાં અનંત દોષ ભરેલા છે. એ રીતે શ્રીગુરુને કરુણાનિધાન પણ કહે છે. કરુણાળ પણ કહે છે. આપની ઘણી કરુણા છે. અને મારા આત્મકલ્યાણ અર્થે હું આ નિવેદન કરું છું કે મારામાં તો દોષનો પાર નથી. અનંત દોષ છે એટલે કે મારામાં તો દોષનો પાર નથી. કયારે પરિણામ કયાં જાય છે, કેટલા નીચા તરી જાય છે, એના ઉપર મારો કોઈ Control નથી ગમે ત્યારે ગમે તેવા ભાવ થઈ જાય છે. અને એ એમ સૂચવે છે કે મારામાં કોઈ દોષનો પાર નથી. કેટલાક કહું ? શું કહું એટલે કેટલાક કહું ? એમ કહીને પણ જેટલા કહી શકાય એટલા અહીંયાં કહ્યા છે.

પ્રશ્ન :- Control કેમ નથી રહેતો ?

પૂ. ભાઈશ્રી :- Control કયાંથી રહે ? અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મકલ્યાણની સૂજ નથી. કઈ વિધિએ અને કઈ પદ્ધતિએ આત્મકલ્યાણ થાય એ ખબર નથી તો પરિણામોનું ઠેકાણું ન જ રહે ને ! પૂર્વ અનેક પ્રકારનાં વિભાવ ભાવો કર્યા છે અનેક પ્રકારના અપરાધ કર્યા છે, એ વખતે જે કર્મ બાંધ્યા છે, એ જ પાછાં ઉદ્યમાં આવે છે. ઉદ્યમાં આવે છે. ત્યારે પોતાનો Control નહીં રહેતો હોવાથી પોતે ઉદ્યમાં જોડાઈ જાય છે. વળી પાછાં પરિણામ બગાડે છે. આમ ને આમ પરિસ્થિતિ ચાલુ ને ચાલુ રહે છે. પાછાં એ પરિણામ બગાડે અને નવા કર્મ બાંધે. ફરીને પાછો એનો ઉદ્ય આવે ત્યારે એથી વધુ નવા કર્મ બાંધે. એમ ને એમ જીવ નીચે તરતો તરતો, અધોગતિમાં ચાલ્યો જાય છે. પોતાનો Control પોતા ઉપર છે નહીં અને રહેતો નથી. કરવું શું ? એ કાંઈ ખબર

રહેતી નથી. ત્યારે એણો એવું છચ્છવું ઘટે, એવું છચ્છવું જોઈએ કે હું કોઈ સત્પુરુષના ચરણમાં ચાલ્યો જાઉં અને એની આજ્ઞામાં રહી મારું આત્મકલ્યાણ એ કહે તેવી રીતે હું કર્યું. કેમકે કેવી રીતે કરવું એ તો મને ખબર નથી. માટે પહેલાં પોતાની સ્થિતિ કહી દે છે કે મારી આવી ખરાબ સ્થિતિ છે, હવે આપને જેમ ઠીક લાગે એમ મને કહો અથવા મને જે રીતે Treatment આપો એ રીતે હું તૈયાર છું.

“શુદ્ધ ભાવ મુજબમાં નથી, નથી સર્વ તુજૃપ;” મારું અંત:કરણ શુદ્ધ નથી, બહુ મલિન અંત:કરણ છે. અને તમે જ મારા સર્વસ્વ છો. એવું પણ મને આવ્યું નથી.

“નથી લઘુતા કે દીનતા,” મારામાં નમતા પણ નથી અને જે દીનતા હોવી જોઈએ એટલે મારાં કલ્યાણ માટે મારે જે યાચના કરવી જોઈએ એવા ભાવ પણ મારી પાસે નથી. દીન માણસ શું કરે ? યાચના કરે. દીનપણે યાચના કરે. અહીંયા લૌકિક દીનતાની વાત નથી. અહીંયા જે પોતાના આત્મ-કલ્યાણ માટે યાચના કરવી જોઈએ એવી યાચના કરવા જેવા પરિણામ પણ મારામાં નથી રહ્યા, એમ કહે છે. એવો અહંકાર મને વર્તે છે.

“શું કહું પરમસ્વરૂપ ?” આપ તો પરમસ્વરૂપે છો. હું આપને શું કહું ? “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંણી;” શ્રીગુરુની આજ્ઞા મારે ઉઠાવવી, એમાંથી ચલિત ન થવું, આજ્ઞાઆધીનપણે જ રહેવું, આજ્ઞાપાલનમાં વિચલિત ન થવું, એવું પણ મારા હૃદયમાં નથી. ઉર એટલે હૃદય. એવું મારાં હૃદયમાં છે નહીં. માત્ર ઉપર-ઉપરથી બધુ કહું છું કે આપ મારા ગુરુ છો, મારે આપની આજ્ઞામાં રહેવું જોઈએ, મારે આપની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આજ્ઞાંકિતપણે મારે વર્તવું જોઈએ—ખરેખર હૃદયમાં એવું નથી; એ બધો ઉપર-ઉપરથી રાગ થાય છે, પણ મારું હૃદય નથી, એમ કહે છે. શું કહે છે ? “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંણી;” જો એ (આજ્ઞા) હૃદયથી ગ્રહણ કરી હોય તો તો પરિણામ બરાબર મક્કમ રહે, અને આજ્ઞા ભંગ ન થાય. પણ એવું મેં નક્કી નથી

કુદૂ.

“આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.” આપના પ્રત્યે દૃઢ વિશ્વાસ નથી, કયારેક કેવા વિકલ્પ આવી જાય છે, કયારેક કેવી શંકા થઈ જાય છે, કયારે કાંઈક થઈ જાય છે, તો કયારેક કાંઈક થઈ જાય છે એટલે કે આદરબુદ્ધિ તો પૂરી છે નહીં માટે જ એવું થાય છે. એટલે પરમ આદર જે આવવો જોઈએ એ આદર પણ મને હજુ આવ્યો નથી.

“જોગ નથી સત્સંગનો,” સત્સંગનો મને યોગ નથી. “નથી સત્સેવા જોગ;”

અને સત્પરુષની સેવા કરવાનો યોગ પણ નથી. સત્સંગનો યોગ નથી અને સેવા કરવાનો પણ યોગ નથી. “કેવળ અપર્ણતા નથી,” અને જે સર્વાર્પણપણું આવવું જોઈએ, કેવળ અપર્ણતા એટલે સર્વાર્પણપણે જે અપર્ણતા આવવી જોઈએ એ અપર્ણતા મને આવી નથી. હજુ શરીર, કુટુંબ, પરિવાર વ્યવહાર એ બધાની મુખ્યતા એવી રહે છે કે આપ ગૌણ થઈ જાવ છો. આપની મુખ્યતામાં એ બધું ગૌણ થઈ જવું જોઈએ પરંતુ એમ નથી થતું.

“નથી આશ્રય અનુયોગ.” અને આપના આશ્રયમાં રહેવું જોઈએ, અનુસરવું જોઈએ, આપના સમાગમને અનુસરીને આશ્રયમાં રહીને, અનુસરવું જોઈએ. એવો પણ અનુયોગ મારામાં નથી. અનુસરવાનો યોગ તેને ‘અનુયોગ’ કહે છે. કૃપાળુદેવે યોગ શબ્દનો પ્રયોગ જુદી જુદી રીતે બહુ કર્યો છે એમનો શબ્દ સંયોજનનો જે ક્ષયોપશમ છે એમાં આ પ્રકાર વિશેષ છે.

“હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક” અને એવો પણ વિવેક નથી કે હું પામર શું કરી શકું ? વળી જાણો હું કાંઈક છું, હું સમજું છું, હું કાંઈક કરી શકું છું, કાંઈક કરું છું, એ પ્રકારનો અહંકાર મને વર્તે છે. પણ એવો વિવેક, મને આવતો નથી કે હું પામર છું શું કરી શકીશા ? મારી તો કોઈ શર્ત ત જ નથી ! જ્યારે પરિણામો ગમે ત્યારે ગમે તેમ ચાલી જાય છે તેનો અર્થ શું છે કે હું કાંઈ કરી શકું એવી યોગ્યતા મારામાં છે જ નહીં. અને હું ઘણો પામર છું તેમ છતાં

એવું મને લાગતું નથી. જે પામરતા Feel (અનુભવ) થવી જોઈએ એ Feel થતી નથી.

આમ તો આ વીસ દોહરા એવા છે કે જે જીવ વેદનામાં ન આવ્યો હોય અને આ નિવેદનના સ્થાને પોતાને ગોઠવી દે, Involve કરી દે તો વેદના ચાલુ થઈ જાય, એવા ભાવવાહી આ દોહરાઓ છે. પોતાની જાતને અંદર ભેળવી દેવાનું થવું જોઈએ. એ જગ્યાએ હું જ છું એવું પોતાને સ્પષ્ટપણે લાગે તો વેદના ચાલુ થઈ જાય. પોતે પોતાને પામર તરીકે Feel કરે, અનુભવ કરે કે હું શું કરી શકું ? કેટલી પામરતા છે મારામાં ! એક નાનામાં નાના સંયોગમાં હું આખે-આખો વેચાઈ જાઉં છું. જેવો એક સામાન્ય કોઈ પદાર્થ દેખાય ત્યાં ઇષ્ટ-અનિષ્ટપણું થઈ જાય. કોઈ પણ ચીજનો સંયોગ થાય ને ઇષ્ટ-અનિષ્ટપણું થઈ જાય. એક ભાણામાં શાક બરાબર ન થયું હોય તો અનિષ્ટપણું થઈ જાય. જરાક ઠીક થયું હોય તો ઇષ્ટપણું થઈ જાય. મારામાં કેટલી બધી પામરતા છે ! શું ?

પ્રશ્ન : આપને ભી ઇસ પદકા અપનેમં પ્રયોગ કીયા હૈ ?

પૂ. ભાઈશ્રી : હાં, શુરૂ શુરૂમં હમ યે બહુત લેતે થે, બહુત લેતે થે. કંઈસ્થ હો ગયા થા. ખાસ કરકે સુબહ સત્સંગકો જાતે થે, ઘરસે સવા ચાર બજે નિકલતે થે પાંચ બજે પહુંચતે થે. હમારા સત્સંગકા સમય થા ૫ સે ૭ બજે તકકા, ૭ – ૭ા સે ૨-૨ા ઘંટે સત્સંગ કરતે થે. ઉન દિનોમં ચાર બજે ઉઠ જાતે થે. કુલ્લા વગેરે કર લેતે થે, તબ ફિર વહીં સે સત્સંગ કે બાદ ચાઈ - પાની પિકર નિકલતે થે, ઘર પર સિફ્ફ મુંહ સાફ કર લેતે થે. ઔર ફિર નિકલ જાતે થે. સાધન કોઈ નહીં થા, ઉસ જમાનેમં હમારે પાસ સાઈકિલ ભી નહીં થી, કરીબ દો મીલ પૈદલ હી જાતે થે. દો મીલ માને કિતને કિલોમીટર હો ગયે ? કરિબ તીન કિલોમીટર, અભી સુબહ પૈંતાલીસ મિનિટ ચલતે હું ઉતના હી, બસ ! સિટીમેંસે ઈધર આ જાતે થે, કરીબ પૈંતાલીસ મિનિટ લગતી થી. પૈંતાલીસ મિનિટ હમારા યહી (બીસ દોહરા) ચલતા થા, ઔર કાફી વેદના ભી રહતી થી. અપનેકો Involve કરે તો તો વેદના આ જાય ઐસી બાત હૈ. ઐસી રચના કૃપાલુદેવને

જ્ઞાનદશામે બનાઈ હૈ, જ્ઞાનદશામે લિખી હૈ, વહું બૈઠકર લિખી હૈ – ફિર ભી વેદનાકી ભૂમિકામે બૈઠકર લિખા હો, ઐસી બાતે આયી હૈ.

પ્રશ્ન :– લિખતે સમય વેદનામે આકર લિખા હૈ ?

સમાધાન :– નહીં, ઉસ વ ત, લિખતે વ ત ઉનકો વેદના આઈ હૈ ઐસી બાત નહીં હૈ, લેકીન રચના કરનેકા સામર્થ્ય અસા હૈ કિ જિસ ભૂમિકા કી રચના કરતે હૈનું, Exact કર પાતે હૈનું. યોંકિ ભૂતકાળકા અનુભવ તો સ્મરણમે હોતા હૈ ન ! રહતા હૈ કિ નહીં રહતા હૈ ?

પ્રશ્ન :– જોગ નથી સત્સંગનો.... (એમાં શું કહેવા માગે છે?)

સમાધાન :– યોગ હોય, તો એ યોગમાં આપણો કેટલું લીધું ? તારે તો યોગ છે. નહીં તો યોગ પણ અયોગ જ છે ને, બીજું શું ? “વિષય કષાય સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.” સત્સંગ હોવા છતાં જેણે એવા વિષમ પરિણામ રાખ્યા તેને એ વિષમ પરિણામને લઈને એ યોગ પણ અયોગ બરાબર સાબિત થયો, સિદ્ધ થયો. એટલે સત્સંગનો યોગ હોય તો સત્સંગમાંથી ગ્રહણ થવું જોઈએ. ન ગ્રહણ કરે તો પરિણામની વિષમતા છે એટલે ગ્રહણ થતું નથી. માટે તેનો ખેદ થવો જોઈએ, કે યોગ હોવા છતાં અયોગ બરાબર મારી સ્થિતિ રહી છે (તો) એનો ખેદ થવો જોઈએ. સો રૂપિયાની નોટને ઓચિંતી ઝાળ લાગે અને એક સેકન્ડમાં રાખ થઈ જાય, તો કેવું લાગે ? ત્યાં તો સો રૂપિયાના પુષ્ય બળ્યાં, અહીં તો અમૂલ્ય સત્સંગ યોગ છે, કે જે અમૂલ્ય પુષ્યનો યોગ છે. જો એમાંથી કાંઈ ન લીધું તો એ નોટને બાળી નાખી અને રાખ કરી, હાથમાં શું આવ્યું ? કે રાખ આવી. પુષ્ય વપરાઈ ગયા, પુષ્ય બળી ગયા, હાથમાં આવી રાખ. ઓલી સો રૂપિયાની નોટ એક સેકન્ડમાં બળી જાય તો દુઃખ થાય, આ એથી (પણ વધારે) કે જેનું મૂલ્ય ન થઈ શકે એવી નોટ (બેઠો બેઠો) બાળે છે. બેઠો બેઠો હાથે કરીને દીવાસળી ચાંપે છે.

“ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.” મૃત્યુ સુધી જે ચરણ-શરણ ગ્રહણ કરવું જોઈએ, સત્પુરુષનાં ચરણનું શરણ ગ્રહણ કરવું

જોઈએ એટલે કે છેક સુધી આમરણાંત, જીવન પર્યત, એ પણ મેં કર્યું નથી.

“અચિંત્ય તુજ મહાત્મ્યનો, નથી પ્રકુલ્પિત ભાવ;

અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.”

જ્ઞાનીનું જે માહાત્મ્ય આવવું જોઈએ, જ્યારે તે અચિંત્ય મહિમાધારી છે, તો એમનું માહાત્મ્ય પણ એવા પ્રકારે જ આવવું જોઈએ, અને જે ભાવમાં પ્રકુલ્પિતતા આવવી જોઈએ, એ નથી. જો ખરેખર યોગ થયો હોય તો એવો પ્રકાર આવે. જો સત્સંગનો યોગ થયો હોય તો એવા પ્રકારનો પ્રકુલ્પિત ભાવ આવે, અને ઘણો મહિમા આવે. ‘અચિંત્ય’ એવો પ્રકાર હજુ મારામાં આવ્યો નથી. એટલે કે યોગ થયો છે પણ હું ઠેકાણા વગરનો છું, એમ લ્યે છે અને એનો ખેદ થાય છે. એ ખેદ કરતાં કરતાં આ વાત કરે છે. આ બધા જે વચ્ચનો છે એ ખેદ સહિતના છે. શું ? ખેદ એટલે એવો સ્વભાવિક ખેદ પણ છે કે એક વખત તો એને રો વા માંગે તોપણ રોકાય નહીં, એવો ખેદ થાય છે, અને અંદરથી જીવ બળે. શું થાય ? અંદરથી જીવ બળે. “અચિંત્ય તુજ મહાત્મ્યનો, નથી પ્રકુલ્પિત ભાવ.” મહિમા આવીને જે પ્રકુલ્પિત ભાવ આવવો જોઈએ, એ પ્રકાર હજુ મને આવતો નથી, આવ્યો નથી.

“અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.”

વળી આપનાથી પ્રભાવીત થઈને, મને જે સ્નેહ-જે પ્રેમ આવવો જોઈએ તેનો એક અંશ પણ હજુ મને આવ્યો નથી. રાગ થવો એ બીજી વાત છે અને સ્નેહ થવો બીજી વાત છે, બેય જુદી જુદી વાત છે, શું ? રાગ છે એ ઉપરછલ્લો થાય છે. પ્રેમ જે થાય છે, સ્નેહ જે થાય છે તે અંદરથી થાય છે અને એનો સંબંધ ગુણ સાથે હોય છે, સ્નેહનો, પ્રેમનો, સંબંધ ગુણ સાથે હોય છે. રાગનો સંબંધ ગુણ સાથે નથી. રાગ છે એ કલિપ્ત ભાવ છે, જેનું કોઈ ઠેકાણું નથી. જેનું, કોઈ, ઠેકાણું નથી – કેમ ? કે રાગ ક્યારે દ્વેષમાં પલટશે એનો કોઈ નિયમ રહેવાનો નથી. કઈ ક્ષણે એ રાગ પલટો મારીને, દ્વેષમાં આવશે એની કાંઈ ખબર નહીં રહે. એટલે

એમ કહે છે કે મને જે થવું જોઈએ એવું કાંઈ નથી થયું. આપનાથી પ્રભાવિત થઈને જે સ્નેહ, જે નિર્મળ, પ્રેમ આવવો જોઈએ, એનો એક અંશ પણ આવ્યો નથી., રાગ થાય એ શું કામનું ? રાગ તો કાંઈ કામની ચીજ નથી, એ પોતે જ દોષ છે, રાગ છે એ પોતે જ દોષ છે.

“અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ;”

કથા અલઘ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ.”

બહુ સરસ ભાવ લીધા છે ! શું ! કે જે આપના પ્રત્યેની આસા ત અચલિત રહેવી જોઈએ, ચલાયમાન ન થાય એવી હોવી જોઈએ એવી આસક્તિ પણ (મને) થઈ નથી, થતી નથી. અને મને આપના વિરહનો તાપ, (નથી લાગ્યો) (તાપ એટલે), સહન ન કરી શકાય એવી સ્થિતિ - એવું પણ મને કંઈ થતું નથી. એટલે કે એ સિવાયના સંયોગો, એ સિવાયના ઉદ્યો, એના ઉપર મારું એટલું વજન છે કે આપનો સંયોગ (કે), વિયોગ હોય એનો કાંઈ ખાસ ફરક મને દેખાતો નથી (એમ લાગે છે કે), ઠીક છે, પણ જે વિયોગનો તાપ લાગવો જોઈએ, પરિતાપ લાગવો જાઈએ, ઘણો તાપ લાગવો જોઈએ, સહન ન થાય એવો તાપ લાગવો જોઈએ એ પ્રકાર હજ મારામાં આવ્યો નથી. અને જે તમારો અલઘ્ય પ્રેમ છે એની કથા, એનું કહેવું એ પણ મારામાં નથી. શું ? મહિમા આવે, તો વાત કરું ને ! જેને મહિમા આવે, એ વાત કર્યા વગર, રહી શકે નહીં. એ નથી એનો પણ મને પરિતાપ નથી.આસક્તિ નહીં હોવાથી વિરહનો તાપ નથી, આસક્તિ હોય તો વિરહનો તાપ લાગ્યા વગર રહે નહીં. એવી જે Feeling position હોવી જોઈએ. એવી જે લાગણીની સ્થિતિ હોવી જોઈએ, એવી કોઈ લાગણી મારામાં ઉત્પન્ન થઈ નથી. કેમ ન થઈ ? કે હું દર્શનમોહ આદિ ઘણાં દોષથી ભરેલો છું. એવી લાગણી નહીં થવાનું શું કારણ ? કે હજ મારો દર્શનમોહ ઘણો ગાઢ છે, ઘણો તીવ્ર છે, એટલે આ બધું જે થવું જોઈએ તે થતું નથી. દર્શનમોહનો અનુભાગ ઘટે ત્યારે આ બધું ભું થાય, પરંતુ એ થયું નથી, એ થતું નથી.

“મર્મ તમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ

ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.” જે યથાર્થ ભ્રિ ત આવવી જોઈએ, બહુમાન જે યથાર્થપણે હોવું જોઈએ, એમાં હજ મારો પ્રવેશ થયો નથી. જેને ભ્રિ ત માર્ગ કહીએ એ માર્ગમાં તો (પ્રવેશ થયો જ નથી) માર્ગ એટલે ઉપાય, એમાં તો હજ મારો પ્રવેશ જ થયો નથી એવું લાગે છે. શું ? “ભ્રિ તમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન;” અને જે ભજન થવું જોઈએ (એ પણ થયું નથી) પછી (મન) આપને જ ભજે, મન છે એ બીજાને ભજે નહીં, એવી દૃઢના જે આવવી જોઈએ એ પણ નથી. એ સંબંધીનું કંઈ ભાન પણ નથી, કે એ કેવી સ્થિતિ હોય !

“સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.”

અને મારો જે આત્મધર્મ છે એનો મને કોઈ સમજ નથી અને મને કોઈ આત્મધર્મ પ્રાપ્ત થાય, એવા ઠેકાણો મારું સ્થાન પણ નથી. વળી એવા સ્થાનમાં, એવા ક્ષેત્રમાં પણ મારું રહેવું થતું નથી.

“કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ;

તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ સુજ કર્મ.”

‘કાળદોષ કળિથી થયો,’ કળિ કાળમાં જન્મ થયો અને જે વિષમ પરિસ્થિતિ છે એ અનુસાર મારા પરિણામ પણ વિષમ જ છે. ખરેખર તો વિષમ પરિણામો છે એ જ વિષમ કાળ છે પછી એને લગતા બહારના સંયોગો હોય છે એટલે આરોપ એના ઉપર કરવામાં આવે છે પણ મૂળમાં તો જીવના પરિણામ જ વિષમ છે એટલે પછી આ કળિયુગમાં કોઈ મર્યાદા રહેતી નથી. એ કળિકાળનો, પંચમ કાળનો પુરાવો છે કે એ મર્યાદાધર્મ રહેતો નથી.

પ્રશ્ન :— મર્યાદા એટલે આજ્ઞારૂપ ધર્મ ?

પૂ. ભાઈશ્રી :— હા, આજ્ઞારૂપ ધર્મ, એમાં શું છે ? વિચિત્રતા કેવી હોય છે જેનું એક દૃષ્ટાંત લઈએ. ગુરુદેવને ગુરુદેવ તરીકે બધા વંદન કરે, ચરણ સ્પર્શ કરે, પ્રવચન સાંભળો, નમસ્કાર કરે પણ જ્યારે પોતનો અભિપ્રાય સ્પષ્ટપણે ઘ્યાલમાં આવે કે મારો અભિપ્રાય અને એમના અભિપ્રાયમાં વિરુદ્ધતા છે ત્યારે મર્યાદા તો એ છે કે પોતે પોતાનો અભિપ્રાય

મૂકી દવો જોઈએ.

શ્રોતા :— પોતાનો અભિપ્રાય મૂકી દવો જોઈએ ?

પૂ. ભાઈશ્રી :— હા, મૂકી દવો જોઈએ. જેમકે ગુરુદેવશ્રીએ જાહેર કર્યું કે સોગાનીજ એક જ્ઞાનીપુરુષ થઈ ગયા. છતાં અમુક લોકો અભિપ્રાય ફેરવી ન શા યા. તો એ મર્યાદા બહારનો વિષય થઈ ગયો. નહિતર શ્રી ગુરુ કહે એટલે રાત Finish થઈ જાય છે. ત્યાં પૂર્ણવિરામ આવી જાય. મને સમજાય ન સમજાય, મને ખબર પડે ન પડે, એ પ્રશ્ન રહેતો જ નથી; તેઓ દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત. નહીંતર મર્યાદા છૂટી જાય છે. એટલે કૃપાળુદેવે કહ્યું “કાળદોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ” એટલે એના ઉપરથી એવું લાગે છે કે કે સત્યુગમાં એવું કદાચ નહીં થતું હોય. આ કાળે જે આવા પ્રકારો જોવા મળે છે એ પ્રકારો કદાચ સત્યુગમાં નહિ જોવા મળતો હોય.

“તોયે નહીં વ્યાકુળતા” તોપણ એની વ્યાકુળતા, એનું હુઃખ થવું, એનો ખેદ થવો એવું કાંઈ મને થતું નથી. મારાં કર્મ તો જુઓ ! કર્મ એટલે મારી યોગ્યતા અયોગ્યતા તો જુઓ ! કેમકે પોતે ઉદ્યાધિન પરિણમે છે ને કર્મને આધિન થઈને વર્તે છે, પ્રકૃતિ પાસે હારી જવાય છે, જુઓ આ મારા કર્મ ! વળી એનો પણ મને ખેદ થતો નથી.

“સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ;

દેહદ્રિય માને નહિ, કરે બાધ્ય પર રાગ”

આપની સેવામાં રહેતા, જે બંધન આડા આવે છે એનો હું ત્યાગ નથી કરતો. એટલે કે (હું) એટલો પ્રતિબંધમાં છું, એ પ્રતિબંધનો મેં ત્યાગ નથી કર્યો, એટલે આપની સેવા હું કરી શકતો નથી. મારા કુટુંબ-પરિવારની હું સેવા કરું છું. મારા સંયોગો અનુકૂળતા-પ્રતિકૂળતાની સેવા કરું છું અને એ બંધન આડે હું આપની સેવા નથી કરતો. અને પ્રતિકૂળ જાઉં છું, સેવાથી હું પ્રતિકૂળ વર્તું છું. હજુ પણ એવા બંધનનો મેં ત્યાગ કર્યો નથી, પરંતુ પૂરેપૂરો બંધનમાં પડ્યો છું.

“દેહદ્રિય માને નહીં, કરે બાધ્ય પર રાગ.”

વળી મને જે પંચેન્દ્રિયના વિષયો જોઈએ, એનું જોર એટલું બધું છે કે એના રાગમાં હું તણાવ છું. એના રાગમાં તણાયા વગર મારે જે આપની સેવામાં રહેવું જોઈએ, એ હું કરી શકતો નથી. આ પરિસ્થિતિ ઘેદને લઈને અસહ્ય થવી જોઈએ, તેમ છતાં પણ વ્યાકુળતા થતી નથી.

“તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં;

નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી, ”

જે વિયોગનું હુઃખ લાગવું જોઈએ, એ લાગતું નથી. “વચન નયન યમ નાહિં;” એ અંગેના વચન, એ અંગેનો દાખિકોણા, એ અંગેનો સંયમ, યમ એટલે સંયમ, એવું કાંઈ મારામાં નથી.

“નહિ ઉદાસ અનભ તથી, તેમ ગૃહાદિક માંહી.” અને ઘરમાં અનભ તથી જે ઉદાસીનતા આવવી જોઈએ (અંગે) ઉદાસીનતા અને નિરસતા પણ મારામાં જરાય નથી.

“અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહિં;

નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ.”

હું અહંભાવથી રહિત નથી એટલે હજ મને અહંભાવ ઘણો વર્ત છે, ધર્મના ક્ષેત્રમાં જે કાંઈ થોડી ઘણી પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ કરતાં તો અહંભાવ ઘણો વધી જાય છે. શું ? કેશવલાલભાઈએ (પત્રાંક ૭૦૬માં) કહું ને કે કાંઈક પણ કરવા જઈએ છીએ ત્યારે એનો અહંભાવ એથી વધારે થઈ જાય છે, (તો) હવે કરવું શું ? કાંઈ પણ ત્યાગ કરીએ છીએ તો ત્યાગનો અહંભાવ વધી જાય છે. “સ્વધર્મ સંચય નાહિં” સ્વધર્મ નો સંચય એટલે પ્રાપ્ત કરવું. નિજધર્મની પ્રાપ્તિ મેં કાંઈ કરી નથી. પરિણામોમાં નિર્મળપણે જે નિવૃત્તિ એટલે. કે નિરસપણું આવવું જોઈએ, એવું પણ કાંઈ આવ્યું નથી. અન્યધર્મની એટલે અન્ય પદાર્થના પર્યાયો સંબંધી, અન્ય પદાર્થનો ધર્મ એટલે પર્યાયો સંબંધી, જે નિરસપણું આવવું જોઈએ, એવું પણ કાંઈ મારામાં આવ્યું નથી.

શ્રોતા :— આમાં અનભક્ત લીધું છે એટલે ભૂત ન હોય એવા બીજા મનુષ્યો ?

પુ. ભાઈશ્રી :— હા એના સંગમાં પણ હું રસ લઉં છું. એથી મને જે ઉદાસીનતા આવવી જોઈએ, અસત્સંગથી જે ઉદાસીનતા આવવી જોઈએ, એવો પ્રકાર પણ મારામાં નથી. જૂના પરિચિતો મળી જાય, તો રસ પડી જાય. તેનું સ્મરણ થાય તો રસ પડી જાય. અને ઘરની અંદર જે નિરસપણું આવવું જોઈએ, ઘર અને ઘરનાં કાર્યો, એમાં જે નિરસપણું આવવું જોઈએ એ નિરસપણું પણ મને આવ્યું નથી, ખરેખર તો બોજો લાગવો જોઈએ, ઘર અને ઘરનાં કાર્યાનો, બોજો લાગવો જોઈએ, જે જે કાર્યો પહેલાં પોતે રસથી કરતો હતો, તે જ ઘરમાં અને તે જ કાર્યમાં, તે જ ઘર અને તે જ કાર્યો બોજારુપ લાગવા જોઈએ પરંતુ એવું એ હજ કાંઈ થતું નથી એમ કહે છે. એ પણ મારો દોષ છે કે એવું મને કાંઈ થતું નથી.

“નથી નિવૃત્તિ નિર્મળપણે” નિર્મળપણે જે નિરસતા આવવી જોઈએ, પરિણામ ન લાગે તો જ નિવૃત્તિ થાય ને ! પરિણામ રસથી લાગે તો પ્રવૃત્તિ થાય અને નહીંતર પછી પરિણામ-ઉપયોગ એનાથી નિવૃત્ત થાય, નકામું લાગે. અન્ય ધર્મ એટલે અન્ય વસ્તુધર્મ છે એ નકામા લાગે તો નિવૃત્ત થાય. પરથી ઉપયોગ નિવૃત્ત થાય તો સ્વકાર્ય કરે ને ! ઉપયોગની જ નિવૃત્તિ ન હોય તો કેવી રીતે સ્વ-કાર્ય કરે ? બહારમાં વ્યવસાયમાં નિવૃત્તિ લીધી હોય, પણ ઉપયોગની નિવૃત્તિ ન હોય તો શું કામ લાગે ? ઉપયોગ ચાલ્યો જતો હોય, ઉપયોગ એ બાજુ કામ કરતો હોય. તો જે નિર્મળતા અને નિરસતા આવવી જોઈએ, એ પ્રકાર આવ્યો નથી.

“એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું ય;

નહીં એકે સદ્ગુણ પણ, મુખ બતાવું શું ય ?”

શું કહે છે ? કે એવા સર્વ પ્રકારે હું સાવ ઠેકાણા વગરનો છું. સાધન-રહિત એટલે ઠેકાણા-વગરનો છું મારી યોગ્યતામાં કોઈ ઠેકાણું નથી મારામાં એક પણ સદ્ગુણ નથી. શું જોઈને હું આપને મારું મોહું બતાવું ? મોહું બતાવવાને પણ હું લાયક નથી.

“કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ;

પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રમુજ્જ હાથ.”

આપ તો કરુણાની મૂર્તિ છો, નિષ્કારણ કરુણાળ છો, જે દીન થાય એના બંધુ છો, જે દીન થાય એના નાથ છો, બંધુ પણ તમે છો અને નાથ પણ તમે જ છો; એની સામે હું અનાથ છું. મને કોઈ આશ્રય નથી. રખડી ગયો છું, રખડી મર્યાદ છું. અને પાપી છું. ઘણાં પાપનાં પરિણામ થાય છે, મારો કોઈ રીતે હાથ પકડો, એટલે કોઈ પણ રીતે મને હવે તમે લાઈન ઉપર લઈ આવો, એવી મારી વિનંતી છે.

“અનંત કાળથી આથડાઓ, વિના ભાન ભગવાન;

સૈવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.”

મારો ભૂતકાળ જોઉં છું ત્યારે સ્પષ્ટ માલૂમ પડે છે કે અનંતકાળથી હું આથડતો રહ્યો છું, મારા સ્વરૂપના ભાન વિના, હે ભગવાન ! હું અનંતકાળથી આથડું છું.

“સૈવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.”

જે શ્રીગુરુ અને સંતનું સેવન કરવું જોઈએ તે મેં કર્યું નહીં. કેમ ન કર્યું ? કારણ મેં અભિમાન મૂક્યું નહીં અભિમાનમાં રહીને મેં સત્ત્વ-સેવન ન કર્યું, સત્તસંગ ન કર્યા, સત્ત્વેવા ન કરી એ અભિમાનમાં રહીને ન કરી.

શ્રોતા :- કિસ બાતકા અભિમાન કિયા ?

પૂ. ભાઈશ્રી :- જૈસે હમ હમારા કલ્યાણ અપને આપ કર સકતે હું. કર લેંગે (ઇસલિયે) શ્રીગુરુકે પાસ નહીં ગયા. ઉનકી સેવા નહીં કી. ઔર અભિમાનમે રહકર દૂર રહા. અભિમાનમે રહકર નહીં ગયા, અગર જાતા તો અભિમાન છોડના પડતા કી મેરેમે કુછ નહીં હૈ, આપ મુજે સમજાઈયે. આપ મુજે મેરે હિતક માર્ગ બતાઈયે મુજે આત્મકલ્યાણકે રાસ્તો પર લે જાઈયે. લેકિન એસા ભી મૈને કબી કિયા નહીં.

“સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક;

પાર ન તેથી પામિયો, જ્યો ન અંશ વિવેક.”

સંતચરણ વિના, સંતચરણના આશ્રય વિના, બધાય સાધન કર્યા. જેને ધર્મસાધન કહેવાય એવા દીક્ષા પર્યતના બધાય સાધન કર્યા પણ જ્ઞાનીના

શરણમાં રહીને, એ કાંઈ કર્યું નહીં. અને તેથી હું સંસારનો પાર પામ્યો નહીં. અને એ વિશેનો, એ બાબતનો એક અંશ વિવેક પણ મને જ્યો નહીં.

આપણે થોડા દિવસ પહેલા ચર્ચા થઈ હતી કે જો જીવને અંતરથી આત્મકલ્યાણની ભાવના જગી હોય તો એને First Thought (પહેલો વિચાર) એ હોય છે, કે મારે કોઈ જ્ઞાનીપુરુષનું શરણ જોઈએ; અને એના માટે મારી પૂરી તૈયારી હોવી જોઈએ. મને જો અહીંયાં મળે, મારા ગામમાં મળે તો જ (સત્સંગ કરીશ) એમ નહીં, જ્યાં હોય ત્યાં, દુનિયાના કોઈ પડમાં – જ્યાં હોય ત્યાં, મારે ત્યાં જઈને રહેવું છે; મારે બીજે રહેવું નથી. એ જાતનો First thought (પહેલો વિચાર) આવ્યા વગર (રહેતો નથી). Very First thought – પહેલો જ વિચાર આવે એનું નામ વિવેક છે; ભાવનામાંથી ઉત્પત્ત થયેલો વિવેક છે જેને જ્ઞાનીપુરુષની જરૂર નથી ભાસી એને ખરેખર આત્મકલ્યાણ કરવાની જરૂર પણ નથી ભાસી એમ સાબિત કરવાનું રહેતું નથી; પરંતુ આપોઆપ જ સાબિત થાય છે. Natural Position તો આ છે.

“સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક” એ શું વિચારે છે ? હું મારીમેળે બધું કરી લઈશ. “પાર ન તેથી પામયો, જ્યો ન અંશ વિવેક” એમાં વિવેકનો અંશ એક છાંટો પણ નથી.

આ ગ્રંથમાં એક ૫૦૦ નંબરનો પત્ર છે એમાં એક વાત લીધી છે. કે જીવે બીજભૂત ભૂલ એ જ કરી છે; મૂળભૂત ભૂલ આ જ કરી છે પછી કુ. દેવે એ ભૂલને ખોલી નથી પણ એ ભૂલ રહેવાથી બધી ભૂલ ઉભી રહી છે, એમ કરીને એક ૫૦૦ નંબરનો પત્ર છે એમાં એ વાત લખી છે. બહુ મોટો પેરેગાફ લખ્યો છે.

“વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ધમાનસ્વામી જેવા મહાત્માપુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હેવે કેવા પ્રકારે ક્ષીણ કરવી ? અને એવી કઈ ભૂલ આ જીવની

રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામવું થયું છે ?” એટલે જન્મ-મરણ ચાલુ રહ્યા છે. (એવી કઈ ભૂલ રહી છે ?) “આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણો સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં,” (ફં ત) વિચારતાં – એમ ન લીધું, ફરી ફરીને એકાગ્રપણો વિચારતાં એમ ન લીધું, – “સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે,” તે ભૂલને જિનાગમમાં ઠામ ઠામ કહી છે પોતે પોતાના નામે હજુ કહેતાં નથી. તે ભૂલને જિનાગમમાં ઠામ ઠામ કહી છે; “કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય.” એવી રીતે ઠામ ઠામ એ વાત કરી છે. એ જાણીને ભૂલ તોડે આમ તો “જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે;” જીવ અનંત ભૂલો કરે છે ઘણી જ ભૂલો કરે છે, “પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ,” – કઈ છે ? “સર્વ ભૂલની બીજભૂત ભૂલ એ જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વ ભૂલનો વિચાર થાય છે;” બધી ભૂલો સમજાય છે; “અને જે ભૂલના મટવાથી સર્વ ભૂલો મટે છે.” આટલી વાત લીધી છે. પછી “કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા છયછે,” અનેક ભૂલ મટાડવા ઈચ્છે “તોપણ તે કરત્વ છે. અને તેવી અનેક ભૂલોથી છૂટવાની છયછા મૂળભૂતથી છૂટવાનું સહેજે કારણ થાય છે.” સંપૂર્ણ નિર્દોષ થવું હોય તો અને મૂળ ભૂલ મટાડવા તરફ ધ્યાન જવું જોઈએ, કે મને કોઈ સત્પરુષ જોઈશે; હું તદ્દન અંધ છું, અને કઈ દિશામાં એક પગલું માંડવું એ મને ખબર નથી. કેવી શૈલીથી વાત કરી છે ! જુઓ ! શૈલી કેવી લીધી છે અને ઠેઠ સુધી વાતને Suspense માં (રહસ્યમાં) રાખી છે.

અહીંયાં શું કહે છે “સંતયરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામયો, જ્યો ન અંશ વિવેક.” એ બધાં સાધન શું થયા ? “સહુ સાધન બંધન થયાં રહ્યો ન કોઈ ઉપાય; સત્ત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?” શબ્દાર્થ તો બહુ સહેલાં છે. શું થયું ?

કે “પ્રભુ પ્રભુ લય લાગી નહીં” ગુરુ માટેની જે લય લાગવી જોઈએ

એ લય લાગી નહીં. “પડયો ન સદ્ગુરુ પાય; દીઠાં નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?”

પહેલાં પ્રથમ (તો) પોતાના દોષ જ દેખાતાં ન હોય. તો એને કાઢવાનો સવાલ, મટાડવાનો સવાલ જ કયાં ભો થાય છે ? બીજો તો કોઈ ઉપાય નથી; પહેલો ઉપાય જ એ છે કે એણે પોતાના દોષ સમજી લેવા જોઈએ. નુકસાનનો વેપાર બંધ કરે નહિ અને નફાનો વેપાર ચાલુ થાય કર્યા દિવસે ? પછી એમ અંદરથી એમ આવવું જોઈએ કે – “અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ય ?” એવું દેખાવું જોઈએ કે આ જગતમાં કોઈ સર્વથી દોષિતમાં દોષિત હોય, નીચમાં નીચ હોય, અધમમાં અધમ કોઈ હોય તો તે હું જ છું, બસ, મારાં જેવું કોઈ નહીં હોય. એવું થયા વિના જે સાધન કરવા માટેનો પુરુષાર્થ પડવો જોઈએ તે પુરુષાર્થ પડતો નથી. એક વાર એવું આવવું જોઈએ – આવવું ઘટે છે. પછી જ પુરુષાર્થ પડે છે; પરિભ્રમણની વેદનામાં એક વાર એવું આવે છે.

“પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ;”

હવે તારા પદપંકજમાં એટલે ચરણકમળમાં પડીને, વારંવાર પડીને, ફરી ફરીને એ જ માંગુ છું “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દબ્તા કરી દે જ.” બસ, મને સદ્ગુરુ જોઈએ – મને સંત જોઈએ; એ સિવાય મને સ્વરૂપ મળવાનું નથી. સ્વરૂપ મેળવવા માટે સંત અને સદ્ગુરુ જોઈએ – અને એ જ મને આપ, એ જ હું માગું છું; બીજું હું કંઈ માગતો નથી; જ્ઞાન નથી માગતો - એમ કહે છે; ગુરુઆશ્રય, ગુરુચરણ માંગુ છું.

એ રીતે વીસ દોહરા બહુ સરસ લખ્યાં છે વેદનામાં આવવું હોય એનાં માટે ભાવથી એ અંગીકાર કરવા જેવો વિષય લીધો છે. પદ અહીંયાં સમાપ્ત થાય છે.



મુખુકુની ભૂમિકામાં દર્શનમોહ યાં યાં અને
કેવી રીતે વધે-ઘટે છે તે સંબંધી અપૂર્વ,
આણમોલ તથા હિતકારી માર્ગદર્શન

પરમ ઉપકારી માર્ગદર્શા : શક્રેય પુ. 'ભાઈશ્રી' શશીભાઈ

અનંતકાળથી સંસારમાં રખડતા આત્માને નિજહિતનું પ્રયોજન કર્યાં છે ? કેવી રીતે આ પ્રયોજન સિદ્ધ થાય ? – તે વિષય અત્યંત રહસ્યમય રહ્યો છે, અર્થાત્ ગુપ્ત રહ્યો છે.

અનાદિથી અકારણપણે-ઇતાં દર્શનમોહવશ, જીવ પરમાં સુખ માની રહ્યો છે, તેથી પરસંયોગ પાછળ જીવની દોડ રહી છે; તે ત્યાં સુધી કે-પોતાનો માનેલો ધર્મ, એટલે કે પુણ્યકર્મ કરીને (તે) તેના ફળસ્વરૂપ અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરીને સુખબુદ્ધિથી પુણ્યકાર્યમાં પ્રવર્ત છે. કોઈ વળી, પૂર્વ-પુણ્યથી પ્રાપ્ત ભોગ-ઉપભોગના ત્યાગને ધર્મ માને છે, અને બાબ્ય ત્યાગમાં પણ વર્ત છે, તોપણ માત્ર કષાયની મંદ્તામાં (અર્થાત્ પુણ્યભાવમાં) રહી કાળક્ષેપ કરે છે. પરંતુ પરિભ્રમણના મૂળ કારણરૂપ દર્શનમોહનો અભાવ કરવાના વિષયમાં અજ્ઞાત્ હોવાને લીધે બાબ્ય કિયામાં જ રોકાઈ જાય છે. તો કોઈ પરલક્ષી શાસ્ત્ર-અધ્યયનને જ્ઞાનકિયા માની તેમાં રોકાઈ જાય છે. પરંતુ તેમાં પણ પ્રયોજનની સિદ્ધ થાય છે કે નહિ ? – તેનાથી અજ્ઞાત્ હોવાને લીધે મિથ્યા સંતોષમાં કાળક્ષેપ કરે છે. પરંતુ ઓધસંજ્ઞાએ કરેલી જ્ઞાન, કિયા, ભ્રમ ત આદિથી દર્શનમોહ યાં-કેવી રીતે વૃદ્ધિગત્ થાય છે ? અથવા યથાર્થતાથી તેનો રસ મંદ થઈ, સમ્યક્-સન્મુખતા કેમ થાય ? – તેવા મૂળ પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જતું નથી. તત્ત્વનો નિત્ય સ્વાધ્યાય

કરનારને આ પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જાય અને સર્વ મુમુક્ષુ જીવોનું શ્રેય થાય તેવી ભાવનાથી આ “પ્રયોજન-સિદ્ધિ” નું પ્રકાશન અહીં છે.

સ્વલ્પે પરિણામનું અવલોકન થવા અર્થે, કાર્તિપય પરિણામોના વિવરણ દ્વારા અહીં કેટલાક બેદ-પ્રબેદ જાગ્રત્ત યોગ્ય છે :—

(૧) સરાગીદેવ, સરાગીગુરુ રાગવર્ધક શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા, પ્રશંસા, અનુમોદના, સ્થાપના આદિ કરવી, કરાવવી, અનુમોદના કરવાથી દર્શનમોહ તીવ્ર થઈ ગૃહીત મિથ્યાત્વ થાય છે. તેમજ વીતરાગીદેવ, નિર્જથગુરુ અને તેમણે નિરુપેલ શાસ્ત્રની નિંદા, અવમાનના, ઉત્થાપના, વિરોધ આદિ કરવા, કરાવવા, અનુમોદવાથી પણ ગૃહીત મિથ્યાત્વ થાય છે, પરંતુ તેથી પ્રતિપક્ષરૂપ વીતરાગ સર્વજ્ઞદેવ, ભાવલિંગી સંત-ગુરુ, અને સત્ત શાસ્ત્ર પ્રત્યેનો બહુમાન / ભર્ત તનો ભાવ મિથ્યાત્વ-રસને મંદ કરનારા પરિણામ છે.

(૨) વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્રની ઓઘસંજ્ઞાએ શ્રદ્ધા કર્તવ્ય નથી. લાંબો સમય ઓઘસંજ્ઞા રહેતાં દર્શનમોહ વૃદ્ધિગત થાય છે, તેથી દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ ઓળખીને પૂજતાં દર્શનમોહ મંદ થાય છે.

(૩) અરહંતદેવનું દ્રવ્ય, ગુણ, પર્યાયપણે સ્વરૂપ ઓળખીને પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ કરતાં જીવ દર્શનમોહનો નાશ કરી શકે છે.

‘જે જાગતો અર્હતને ગુણ, દ્રવ્ય ને પર્યાય પડો,
તે જીવ જાણો આત્મને, તસુ મોહ પામે લય ખરે.’

(પ્રવચનસાર ગાથા - ૮૦)

(૪) આત્મ-સ્વરૂપની ઓળખાણ કરવાના ઉદ્દેશ્ય / હેતુથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને દર્શનમોહ મંદ થાય છે. પરંતુ ઓઘસંજ્ઞાએ અથવા આત્માર્થ સિવાયના કોઈપણ લક્ષથી શાસ્ત્રાભ્યાસ, દર્શનમોહની વૃદ્ધિનું કરણ થાય છે; ભલે શાસ્ત્ર-અભ્યાસ દ્વારા કષ્યોપશમ વધેલો હોય, અને મંદ કષાય પણ થયો હોય.

(૫) આત્મસ્વરૂપ પ્રાપ્તિની અત્યંત ભાવનાને લીધે જેને આ જગત્તમાંથી “કાંઈ જોઈતું નથી, એક માત્ર પોતાનો આત્મા જ જોઈએ છે,” તેને દર્શનમોહનો રસ ઘટે છે. જેને જગતના કોઈને કોઈ પદાર્થની જરૂરત લાગે

છે તેને ઉં ત ભાવના હોઈ શકતી નથી, અને તેથી આવી ભાવના-વિહીન કોઈપણ પ્રકારના પરિણામ દર્શનમોહ મટાડવાના કારણભૂત થતા નથી.

(૬) ઉં ત ભાવનાને લીધે નિજ પરમ તત્ત્વની અપૂર્વ જિજ્ઞાસા ઉત્ત્ર થતાં જીવને યાંય ગમે નહીં, પરંતુ જિજ્ઞાસાપૂર્વક સ્વરૂપની ખોજના તીવ્ર પરિણામ નિરંતર રહ્યા કરે છે, તો તે જીવ યથાર્થ નિર્ણયની ભૂમિકામાં આવવા જેટલો દર્શનમોહને મંદ કરે છે. પરંતુ તત્ત્વજ્ઞાનના વાંચન-શ્રવણ દ્વારા બહિર્લક્ષી ઉધાડ / ધારણાથી આત્માના વિષયમાં જાણપણું થતાં જિજ્ઞાસા બંધ થઈ જાય, અને ધારણાનો વિષય વિકલ્પ દ્વારા વારંવાર રટણ થતાં દર્શનમોહ તીવ્ર થવા લાગે છે.

(૭) જો પરિપૂર્ણ નિર્દ્દેખતા / શુદ્ધતાનું લક્ષ (ધ્યેય) શરૂઆતમાં ન બાંધવામાં આવે તો વાસ્તવિક શરૂઆત થતી નથી, અર્થાત્ "પૂર્ણતાના લક્ષે જ વાસ્તવિક શરૂઆત થાય છે." એટલે કે- મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ પ્રકારે આગળ વધાય છે; નહીં તો ગમે તે સાધનથી શરૂઆત કરનારનો ધ્યેય અન્યથા હોવાથી સંયોગની અનુકૂળતાની પ્રાપ્તિનું લક્ષ થઈ જાય છે, અથવા પ્રશસ્ત રાગનું લક્ષ થઈ જાય છે, અથવા અલ્ય વિકાસવાળી દશાનું લક્ષ રહે છે, જે દર્શનમોહ વધવાનું કારણ બને છે.

(૮) ઉં ત પ્રકારે પૂર્ણતાના ધ્યેયપૂર્વક, ધ્યેયપ્રાપ્તિની પૂરી લગની અને ધગશવાળા પરિણામો ઉત્તરોત્તર દર્શનમોહને વધુ મંદ કરે છે. પરંતુ લગનીના અભાવમાં પ્રમાણ રહે છે, જે આત્મગુણને ચોરે છે, અર્થાત્ પોતાને ખબર ન પડે / પકડાય નહીં તેવા અહિતરૂપ પ્રમાણના પરિણામમાં જીવ વર્ત છે, તે સમ્યક્ત્વથી દૂર જાય છે.

(૯) ઉપરો ત આત્મભાવના, જિજ્ઞાસા, લગની, ધ્યેયનું લક્ષ વગેરે ભાવોથી પરિણામ સ્વલ્ભી થાય છે, અર્થાત્ નિજહિત-અહિતરૂપ પ્રયોજનના વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ પ્રવર્તવા લાગે છે, ત્યારે પોતાના દોષ અપક્ષપાતપણે જોવાય છે, અને તે મટાડવાનો ઉપયોગ રહે છે, તેથી પણ દર્શનમોહનો રસ તૂટે છે. પરંતુ જેને પ્રયોજનભૂત વિષયમાં સ્થૂળ બુદ્ધિ છે તે અપ્રયોજનભૂત વિષયમાં રસ લે છે, અને પોતાના પ્રયોજનના

વિષયને પકડી શકતો નથી, તે પણ દર્શનમોહને વધારે છે.

(૧૦) પૂર્વના અનેક વિપરીત સંસ્કારને લીધે જીવને મિથ્યા આગ્રહ વર્તે છે; જેથી અસત્યનો અથવા દોષનો પક્ષપાત થાય, અથવા અસરળતા હઠાગ્રહના પરિણામનું પ્રાબલ્ય રહે, અથવા પૂર્વ કરેલી અયથાર્થ સમજણની પક્કડમાંથી જીવ છૂટી શકે નહિ, ત્યાં દર્શનમોહ તીવ્ર થાય છે. જ્યારે આત્માર્થી જીવ તો પૂર્વગ્રહ છોડવાની તૈયારીવાળા - અભિપ્રાયવાળો, મધ્યસ્થ ભાવે વર્તનારો, સરળતાથી વર્તનારો અથવા સરળતાથી પોતાના દોષને કબૂલનારો, સત્યને / સત્તને વળગવાના વલણવાળો હોવાથી દર્શનમોહના અભાવ કરવાનું સામર્થ્ય વધારે છે.

(૧૧) વળી, દર્શનમોહથી તે જ જીવ છૂટી શકે છે જેને પોતાના અનંત-ભવભ્રમણથી થયેલા દુઃખોનો ત્રાસ લાગેલ હોય, ભવ-ભ્રમણના કારણરૂપ દોષિત પરિણામનો ડર હોય, અથવા સંસારથી ભયભીત હોય, અને તેથી જન્મ-મરણથી છૂટવાનો માર્ગ શોધતો હોય. પરંતુ જે જીવ માત્ર પ્રતિકૂળતાઓ ટાળવા અથવા અનુકૂળતાઓની અભિલાષાથી પુણ્યભાવોમાં પ્રવર્તે છે, અને ભવ-ભ્રમણનો ભય જેને નથી તેને દર્શનમોહ છૂટતો નથી.

(૧૨) જે જીવ શુભરાગના હિમાયતી છે, જેને શુભરાગની મહત્ત્વ છે, અને તેથી જેને શુભનો આગ્રહ બંધાઈ જાય છે, અથવા શુભમાં સંતોષાઈ જાય છે તે જીવ પણ દર્શનમોહ વધારે છે. પરંતુ મોક્ષાર્થી જીવ તો “પૂર્વ શુદ્ધતાને લક્ષે પુરુષાર્થ કરે છે.” તેના શુભ પરિણામો ઉચ્ચકોટિના થવા છતાં પણ તેને વિભાવની તુચ્છતા લાગે છે, તેથી તેની મહત્ત્વ લાગતી નથી, તેવા ભાવો ઉપર વજન રહેતું નથી. પરંતુ શુદ્ધતા પ્રગટ થવાને બદલે શુભમાં પોતે સ્થિત થઈ જાય છે તે ખટકે છે; તેને શુદ્ધતા ન પ્રગટવાથી અસંતોષ રહે છે, ગમે તેવા શુભભાવમાં પણ અટકતો નથી, પરંતુ દર્શનમોહનો અભાવ કરી શુદ્ધતા પ્રાપ્ત કરશે.

(૧૩) સત્તપુરુષોની શિક્ષા એ છે કે – “સર્વ ઉદ્ય પ્રસંગોમાં મંદ રસે કરીને પ્રવર્તવું,” રાગથી વિરક્ત થવું, કારણ કે રાગમાં રહેલો રસ / ચીકાશ, અને રાગમાં સાવધાની દર્શનમોહ વર્ધક છે. તેથી ઉપયોગ કરીને

રાગરસ મંદ થતાં, રાગની અરુચિ થતાં દર્શનમોહનું મંદપણું ભજે છે. રાગપ્રવૃત્તિમાં ઉત્સાહ લાવવા જેવું નથી.

(૧૪) જગત્કાના બાધ્ય પદાર્થો સંબંધી કુતૂહલ, અથવા અપ્રયોજનભૂત એવા આગમના વિષયોમાં જાણપણું મેળવવા થતું કુતૂહલ, અથવા પરલક્ષી જ્ઞાનાદિ ભાવની પ્રવૃત્તિ દર્શનમોહ વર્ધક છે, પરંતુ સ્વલ્ષ્ણી પરિણામ અને નિજાવલોકન મુમુક્ષુની ભૂમિકામાં હોવા યોગ્ય છે, તેમજ પ્રયોજનભૂત વિષયનું શ્રવણ આત્મરૂચિને ઉગ્ર કરે, ત્યાં દર્શનમોહ મંદ થાય.

(૧૫) વિકલ્પ માત્રમાં દુઃખ છે. તેમ છતાં દર્શનમોહને લીધે જીવ કેટલાક વિકલ્પમાં સુખની કલ્યના કરે છે, અથવા આત્મિક સુખના ભાવ-ભાસન વિના, મંદકષાયયું ત પરિણામમાં / શાતાના વેદનમાં જીવને સુખનો આભાસ થાય છે. પરંતુ આત્માર્થી જીવને ભેદજ્ઞાનના અભ્યાસથી વિકલ્પમાં દુઃખ લાગે છે, તેથી તેને વિકલ્પમાત્રથી ખસવાનું વલાણ થઈ આવે છે, જેથી નિર્વિકલ્પદશા થવામાં તેને પ્રતિબંધ થતો નથી, આમ દર્શનમોહ ઘટવાથી વિકલ્પ (આત્મસ્વભાવના વિકલ્પ શુદ્ધા) દુઃખરૂપ અર્થાત્ આકૃણતામય લાગે છે, તેથી કોઈ પણ વિકલ્પમાં રોકાવવાનું સ્થાન રહેતું નથી, ત્યારે શીંગ નિર્વિકલ્પ દશાની સમીપતા થાય છે.

(૧૬) ગુણગ્રાહીપણું અને ગુણપ્રમોદ દર્શનમોહને મંદ કરનારાં છે. પરંતુ દર્શનમોહ તીવ્ર થતાં, દોષનાં ભાવમાં પણ ગુણની કલ્યના થઈ આવે છે, અથવા ગુણને દોષમાં ખતવવાનું થાય છે. પોતાના દોષનો બચાવ કરવો / પક્ષપાત કરવો, જેના પ્રત્યે રાગ હોય તેવી વ્યા તના દોષનો બચાવ કરવો વગેરે પ્રકાર પણ ઉત્પન્ન થાય છે, અને તેથી ગુણવાનનો અવર્ણવાદ પણ થઈ જાય છે, જે દર્શનમોહ વર્ધક છે.

(૧૭) જ્ઞાનનો ક્ષયોપશમ અને ચારિત્રગુણના ક્ષયોપશમવાળા પરિણામ થતાં તેમાં સંતુષ્ટ થવું; તેની મહત્ત્વા આંકડી, ગણાના થવી એ વગેરે પ્રકાર દર્શનમોહ વૃદ્ધિનું કારણ છે. પરંતુ દર્શનમોહને તોડનાર જીવ પોતાની દશામાં દ્યા, શાંતપણું, નમ્રતા, ક્ષયોપશમ, ગંભીરતા, ઉદારતા, વૈરાગ્યાદિ ગુણો પ્રગટ થવા છતાં, તેને “ધણું બાકી છે.....” તેવું લાગ્યા કરે છે; તેને પ્રાપ્ત સદ્ગુણો

ગૌણ થઈ જાય છે, તેની ગણના કે મુખ્યતા થતી નથી.

(૧૮) દર્શનમોહને હટાવનાર જીવ ડા. મંથન અને ચિંતવનપૂર્વક સત્ત્વશાસ્ત્રોનું અધ્યયન કરે છે, તેમાં ચૈતન્યની રુચિનું પોષણ કરે છે, અને ચૈતન્યતત્ત્વનું ઘૂંઠણ કરે છે. જ્યારે રૂઢિગતપાણે પરંપરાના લક્ષથી શાસ્ત્રાભ્યાસ કરનાર, ક્ષયોપશમની રુચિ પોષનાર, ઇન્દ્રિયજ્ઞાનના ઉઘાડના રસમાં ઉત્સાહિત થનાર, તે તે ભાવોમાં રાગની રુચિ વધારી, દર્શનમોહમાં વૃદ્ધિ કરે છે.

(૧૯) સ્વરૂપ વિચારણા કાળે અભેદ / સામાન્ય સ્વરૂપનો રસ અને રુચિ દર્શનમોહની હાનિ થવામાં કારણ પડે છે, ત્યાં વિચારણામાં ભેદો જાણવા છતાં ગૌણ થઈ ને અભેદનું મુખ્ય વલણ રહે છે; પરંતુ તત્ત્વજ્ઞાનના વિચારોમાં ભેદ પ્રધાનતાથી, અર્થાત્ ભેદની રુચિથી ભેદ કલ્પના દફ્ટ થતાં દર્શનમોહમાં વૃદ્ધિ થાય છે.

(૨૦) મુમુક્ષુ જીવને અંતરમુખી ચિંતનની વિચારધારામાં જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવની ઓળખાણ / યથાર્થ સ્વરૂપ નિશ્ચય થતાં, સ્વરૂપ સન્મુખ થતાં દર્શનમોહનો રસ મંદ થાય છે, કારણ કે પ્રતિભાસિત નિજ સ્વરૂપ નિર્માહીતત્વ છે, અને સ્વભાવથી મોહનું ઘાતક છે. પરંતુ બહિર્મુખી વિચારોથી માત્ર તર્ક-યુદ્ધ ત-ન્યાય અને શાસ્ત્રના આધારે કલ્પિત, અથવા અન્યગુણને લક્ષણ બનાવીને અયથાર્થ નિર્ણય કરવામાં આવે તો તે કલ્પના દફ્ટ થવાથી મિથ્યાત્વ તીવ્ર થાય છે.

(૨૧) મુમુક્ષુની ભૂમિકામાં અંતર્મુખ થવા માટે અનુભૂતિના માર્ગના / ઉપાયના જ માત્ર પાયા શોધનાર મુમુક્ષુને તો તે કાલમાં દર્શનમોહ મંદપણાને પામે છે- "માર્ગનું શોધકપણું જેટલું ઉગ્ર, તેટલું માર્ગનું સમીપપણું થાય છે." જ્યારે માર્ગની સંશોધકવૃત્તિના અભાવમાં, ધારણાની પ્રધાનતામાં જીવ રોકાય છે; અથવા ખંડન-મંડન, અથવા વિધિ-નિષેધના ભંગમાં અથવા નય-ભંગમાં જીવ રોકાઈ જાય છે.

(૨૨) દર્શનમોહના પ્રાબલ્યને લીધે 'સ્વાનુભવ પ્રાપ્તિ કઠણ છે / દુર્ગમ છે, ઘણા જીવો પ્રયત્ન કરવા છતાં સમ્યકૃત્વ પામી શકતાં નથી'

વગેરે પરિણામો અને અભિપ્રાય વર્ત્યા કરે છે. તેમજ કર્તવ્ય હોવા છતાં, તેમ માનવા છતાં, ‘પછી કરીશ’.... ‘પછી કરીશ’.... પહેલા અમુક કાર્ય કર્યા બાદ, ‘પછી કરીશ’ આવા પરિણામો દર્શનમોહની પ્રબળતાને પ્રદર્શિત કરનારા છે. આત્મારીને તો શીધપણે આત્મકાર્ય કરવાના અભિપ્રાય પૂર્વક પ્રવૃત્તિ હોય છે, તેથી અપ્રયોજનભૂત વિષયમાં વર્થ સમય ગુમાવવો તેને પોષાય નહિં, તેવું વલણ રહે છે.

(૨૩) સ્વરૂપ સંબંધી સૂક્ષ્મ બોધની અભિલાષાથી દર્શનમોહનો રસ મંદ થાય છે. પરંતુ દર્શનમોહની તીવ્રતા થતાં સ્વરૂપનો સૂક્ષ્મબોધ સત્ત્વપુરુષનાં શ્રીમુખેથી ચાલતો હોય ત્યારે લક્ષ રહેતું નથી, અન્યભાવોમાં ઉપયોગ પ્રવાહિત થઈ જાય છે. પ્રબળ દર્શનમોહવાળા જીવને તો સૂક્ષ્મ પારમાર્થિક બોધ ચાલતો હોય ત્યારે તંડ્રા કે નિંદ્રા જેવી સ્થિતિ પણ વર્તે છે.

(૨૪) લોકસંજ્ઞા અથવા લૌકિક અભિનિવેશથી જીવની દૃષ્ટિ લોકો ઉપર રહે છે. સમાજ અથવા લોકોની નજરમાં પોતાનો દેખાવ, સ્થાન પ્રાપ્ત કરવાની કલ્યાણથી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં દર્શનમોહ વૃદ્ધિ પામે છે. પરંતુ, આત્મહિતની મુખ્યતાવાળો જીવ તો માન/સ્થાન મળવાના પ્રસંગોથી દૂર ભાગવાની સહજ વૃત્તિમાં રહે છે, પોતાની ઉચ્ચકક્ષા હોય તોપણ ગોપવીને / દબાવીને રહેવા માંગો છે, જેથી પરસંગ અને પરપરિચય વધે નહીં, અને સ્વકાર્યને તેમજ-અસંગવૃત્તિને પોષણ મળે.

ઉપદેશ નોંધ (૨) માં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે :

‘ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે.... ધર્મનું મહત્વ તો બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે.’

(૨૫) ઓધસંજ્ઞાએ પ્રવર્તતાં જીવનું કદી કલ્યાણ થતું નથી, કારણ કે ઓધસંજ્ઞામાં જીવને ધર્મની ખરી જરૂરિયાત લાગતી નથી, ત્યાં દર્શનમોહ કેમ મટે ? પરંતુ જે જીવને ચારગતિના સમસ્ત પ્રકારનાં દુઃખનો અભાવ, તેમજ સાદિ અનંતકાળના પરિપૂર્ણ અનંત સમાધિ-સુખની પ્રાપ્તિનું વાસ્તવિક મૂલ્યાંકન થાય, તેને જ ધર્મની કિંમત સમજાય છે, અને તેને જ વાસ્તવિક

જરૂરિયાત લાગે છે, તેથી તે સત્તુપુરુષાર્થમાં સહજ જોડાય છે, તેને દર્શનમોહ મટે છે.

(૨૬) રૂઢિગત ધર્મ-કિયામાં જીવ અનેક પ્રકારનાં નાના દોષ ટાળવાની મુખ્યતા રાખે છે, પરંતુ દર્શનમોહ અને અજ્ઞાન જેવા મહાદોષ છેદવા પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તેને મિથ્યાત્વ અને અજ્ઞાનથી થતા નુકસાનની ગંભીરતા સમજાઈ નથી, તેથી તે દર્શનમોહની વૃદ્ધિ કરે છે. પરંતુ સમ્યક્ત્વ અને સમ્યક્જ્ઞાનનું સ્વરૂપ સમજાને તેનો મહિમા આવતાં, મુખ્યતા થતાં, તે જીવ દર્શનમોહનો મહાદોષ ટાળવા પ્રયત્ન કરે છે.

(૨૭) જીવ નિજહિતના વિષયમાં જેટલો ગરજવાન થાય છે તેના પ્રમાણમાં તેનો દર્શનમોહ મંદ પડે છે. તેને ‘માર્ગ લીધે જ છૂટકો...’ એવી તાલાવેલી લાગે છે. જ્યારે બીજા જીવોને તત્ત્વજ્ઞાનનો વિષય માત્ર મનોરંજનનો એક પ્રકાર બની જાય છે, તેથી જાગૃતિનો અભાવ રહે છે, તે દર્શનમોહ વધારે છે.

(૨૮) ઉદ્યકાળે પરપદાર્થમાં અભિપ્રાય સહિત છાટ-અનિષ્ટપણું થતાં દર્શનમોહ વધે છે, તેમાં નિજજ્ઞાયકને ભૂલીને એકત્વભાવે પ્રવર્તત્વં થાય છે. પરંતુ ‘હું જ્ઞાયક માત્ર છું’ - તેવી જાગૃતિ સહિત અને ‘કોઈ પદાર્થ સારા કે ખરાબ નથી’ - તેવા અભિપ્રાય સહિત ઉદ્યકાળે સમસ્ત પરપદાર્થ માત્ર ‘જ્ઞાનનું જોય છે’ - તેવો ઉપયોગ / સાવધાનીરૂપ અભ્યાસથી/પ્રયત્નથી દર્શનમોહ તૂટે છે.

(૨૯) માર્ગ પ્રાપ્તિની યથાર્થ વિધિરૂપ ભેદજ્ઞાનનો પ્રયોગ સમજવા કાળે, પ્રયોગના વિષયની વ્યાખ્યાને પરલક્ષી જ્ઞાનમાં માત્ર ધારણાનો વિષય બનાવી દેવાથી, અને તે વિષયની સમજણ-પ્રાપ્તિનો સંતોષ લેવાથી-દર્શનમોહમાં ફેર પડતો નથી; પરંતુ જ્ઞાનને ધીરું અને સૂક્ષ્મ કરીને અંતમુખ થવાની વિધિરૂપ જ્ઞાનમાં અસ્તિત્વને ચેહણ કરવાનાં પ્રયોગાભ્યાસથી દર્શનમોહ ઘટે છે.

(૩૦) સમસ્ત નય અને ન્યાયનાં પડખાઓ સમજતાં પ્રયોજનની મુખ્યતામાં રહેવું, અને તદ્દ અનુસાર અંતરગવેષણ ચાલવી તે દર્શનમોહ

મંદ થવાનું કારણ છે. પરંતુ અનેક પ્રકારે ન્યાય અને નયના વિષયને સમજતાં મૂળ પ્રયોજન ગૌણ થઈ જાય તો દર્શનમોહ વૃદ્ધિ પામે છે.

(૩૧) જગત્તાં કોઈ પદાર્થમાં ૩- ૩ સુખની કલ્યાના અર્થાતું સુખબુદ્ધિ રહી જવાથી બાધ્ય પદાર્થની મહત્ત્વા રહે છે, તેથી દર્શનમોહ વૃદ્ધિ પામે છે. પરંતુ આભાર્થીને તો ‘જગત ઇષ્ટ નહિ આભાર્થી’ એ સિદ્ધાંતના ગ્રહણથી સમસ્ત જગત પ્રત્યે ઉદાસીનતા રહે છે, તેમજ આત્મિક આનંદની ભાવનાપૂર્વક જિતેન્દ્રિયપણું થાય છે, તેને બાધ્ય વિષયોની મહત્ત્વા આવતી નથી, તેમાં સુખાભાસ થતો નથી, પણ આકુળતાના કારણ દેખાય છે, તેનો દર્શનમોહ ઘટે છે.

(૩૨) સૌથી વધુ દર્શનમોહને તીવ્ર કરનારો મહાદોષ ‘સ્વચ્છંદ’ છે, તેથી તેને સારી રીતે સમજવો આવશ્યક છે. શ્રીમદ્ભૂત કહે છે કે :

“રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ;

પામ્યા એમ અનંત છે, ભાષ્યું જિન નિર્દોષ”

(આત્મસિદ્ધિ શાસ્ત્ર - ૧૫)

-એવો સ્વચ્છંદનો સદ્ગ્રાવ (*) અને સ્વચ્છંદનો અભાવ (O) દર્શાવતા કેટલાક ભાવો સંબંધી વિવરણ નીચે પ્રમાણે છે :

* શાસ્ત્ર સંગત કે વિસંગત જ્ઞાનનાં ક્ષયોપશમ સંબંધમાં ‘હું સમજુછું’ તેવો ભાવ રહ્યા કરવો, અને તેથી જિજ્ઞાસાનો અભાવ રહેવો.

O જ્ઞાનનો ક્ષયોપશમ વિશોષ શાસ્ત્ર અનુકૂળ હોવા છતાં પણ, અપૂર્વ દશા / નિરાવરણપણું પ્રગટ નથી, તેનું જિજ્ઞાસા સહિત સભાનપણું રહેવું.

* સત્પુરુષનાં વચનમાં શંકા, તેમજ ભૂલ દેખવાની વૃત્તિ રહેવી/થવી, અર્થાતું ગાથાર્થ અથવા શર્ધાર્થની મુખ્યતા કરી – ભૂલ સમજવી.

O સત્પુરુષનાં વચનમાં નિઃશંકપણે પરમ ગ્રીતિ થવી.

* સત્પુરુષમાં શ્રદ્ધાનો અભાવ, તેમજ અભિ તના પરિણામ થવા.

O સત્પુરુષ એટલે પ્રગટ સત્ત-જીવંત સત્ત જાહીને અટલ શ્રદ્ધા, દૃઢ આશ્રય, અને અતુલભિ ત થવી.

* સત્પુરુષનો વિરોધ/અવર્જાવાદ કરવો.

○ સજીવન મૂર્તિને પરમહિતનું કારણ જાણી, એક નિષ્ઠા, અને સર્વાર્પણ બુદ્ધિપણે મહિમા આવવો, આજ્ઞાશીલપણો વર્તવું, ગુણાનુવાદ કરવા.

* ચૈતન્યને સ્પર્શિને આવતી સત્પુરુષની વાણી પ્રત્યક્ષ શ્રવણ થવા છતાં અહોભાવનો અભાવ અર્થાત્ ઉપેક્ષાભાવ થવો, નિરુત્સાહના ભાવ થવા.

○ અત્યંત મહિમાપૂર્વક અને અત્યંત જિજ્ઞાસામાં રહીને સત્ત્વશ્રવણ કરવું અથવા શ્રવણ કાળે તે વાણી મુમુક્ષુનાં અંતરંગને સ્પર્શવી.

* સત્પુરુષ પ્રત્યે વિનય-ભર્ત તમાં ન્યૂનતા, ‘મને આવડે છે’ તેવી હૂંફ ચડવી.

○ સત્પુરુષની અંતરંગાદશાને ઓળખીને પરમ દૈન્યત્વ-પરમ વિનય રહેવો; પોતાની લઘુતાનું ભાન થવું.

* સત્પુરુષનાં ચારિત્રદોષનું લક્ષ રહેવું, મુખ્યતા થવી.

○ સત્પુરુષનાં અલૌકિક ચારિત્રને લક્ષમાં લઈ પુરુષાર્થની પ્રેરણા થવી.

* સત્પુરુષની લોકભય, સમાજભય, અપકીર્તિભય અથવા અપમાનભયથી ઉપેક્ષા થવી, અથવા વિમુખતા થવી.

○ સમાજને ગૌણ કરીને, માન-અપમાનને ગૌણ કરીને પણ સત્ત્વસમાગમને પરમહિતનું કારણ જાણીને ઉપાસવો.

* સત્પુરુષ કરતાં કુટુંબ-પરિગ્રહાદિ પ્રત્યે અધિક રાગ રહેવો.

○ કુટુંબ-પરિગ્રહાદિ કરતાં પણ સત્પુરુષ પ્રત્યે અધિકાઈ થવી તે પ્રગટ સત્તનું મૂલ્યાંકન છે, તેવો સમજપૂર્વક આદર થવો.

* પોતાની કલ્યાણ પ્રમાણો, અથવા પોતા સમાન કલ્યાણ કરીને સત્પુરુષનાં વચ્ચનોનું તોલન કરવું, અથવા તેને લૌકિક અર્થમાં ઘટાવવા; અથવા અતિશયોઈ ત, ભાવાવેશ, અથવા અજાગ્રત ઉપયોગે વચ્ચનાલાપ ગણવો.

○ જ્ઞાનીનાં વચ્ચનને અલૌકિક અર્થમાં ઘટાવવા, તેમનાં વચ્ચનમાં રહેલા

પરમાર્થને સમજવાનો દષ્ટિકોડા રાખવો, અર્થાત् તેમાં રહેલી માર્ગની વિધિના ગંભીર રહણને ગાહન ચિંતવનથી શોધવું.

* પ્રત્યક્ષ સત્ત્વપુરુષનો યોગ હોવા છતાં શાસ્ત્ર-સ્વાધ્યાયને વધુ મહત્વ આપી સત્તસંગ ગૌડા કરવો.

○ શાસ્ત્ર-સ્વાધ્યાયથી પણ સત્ત્વપુરુષનો સમાગમ વધુ ઉપકારી સમજવો, અને તેને મુખ્ય કરીને ઉપાસવો.

* સત્ત્વપુરુષનાં ઉપકારને છુપાવવો, અથવા સત્ત્વપુરુષનાં ઉપકારને ઓળવવો અથવા પોતાના અપ્રસિદ્ધગુરુને ગોપવીને પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ પ્રગટ કરવું. (માનાર્થે).

○ સત્ત્વપુરુષરૂપ ગુરુનાં ઉપકારને અગોધ્યભાવે પ્રસિદ્ધ કરવો, અને તેના ઉપકારને સર્વોત્કૃષ્ટ મહિમાથી ગાવો.

* સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે તત્ત્વપ્રચાર-પ્રભાવના અંગેની પ્રવૃત્તિ કરવી, અને તે પોતાની રીતે કરતાં સત્ત્વપુરુષની આજ્ઞાની અવગાણના કરવી.

○ લોકદષ્ટિથી દૂર રહીને, જ્ઞાનીની આજ્ઞાએ અથવા પરમાર્થના લક્ષસહિત ધર્મપ્રભાવના અને તત્ત્વપ્રચારનાં કાર્યો કરવા (નિજહિતની ખટક સહિત).

* ગ્રંથ સંબંધી વ્યાખ્યાન/લેખનની કુશળતાથી પોતાની મહત્તમ દર્શાવવાની ઈચ્છા રહેવી; આચાર્યપ્રણીત ઉચ્ચ કોટિના આધ્યાત્મિક-ન્યાય દર્શાવતાં પોતાની મહત્તમ દર્શાવવાનો મુખ્ય હેતુ રહેવો.

○ શાસ્ત્ર વાંચન / લેખન આદિ પ્રવૃત્તિમાં નિપુણતા હોવા છતાં તે કાર્યોમાં ગુરુ-ઉપકાર/મહાપુરુષના ઉપકારને પ્રદર્શિત કરવો. આધ્યાત્મિક-ન્યાયો સમજતાં જે આત્મલક્ષ રહ્યું હોય તે જ ભાવે સ્વલ્ભે તેનું નભ્રપણો નિરૂપણ કરવું.

* સત્ત્વશાસ્ત્રનો અવિનય થવો, સત્ત્વશ્રવણની ઉપેક્ષા થવી, તેથી સત્ત્વશ્રવણમાં અનિયમિતતા થવી. (શ્રોતા માટે).

○ સમ્યક્કજાનનું નિમિત જાડીને શાસ્ત્રજ્ઞનો વિનય કરવો. સ્વાધ્યાયમાં

નિયમિત રહેવું. (શ્રોતા માટે).

* શાસ્ત્રજ્ઞના વિષય-પ્રતિપાદનને છોડીને વિષયાંતરમાં પ્રવર્તવારૂપ પદ્ધતિ તે વ તાનો શાસ્ત્ર પ્રત્યેનો અવિનય છે.

○ શાસ્ત્ર-વિષયને છોડીને વિષયાંતર ન થાય તેની જગૃતિ રાખવી.
(૧ તા માટે).

* સર્વજ્ઞ વીતરાગની પ્રતિમામાં વિકૃતિ કરવી, અથવા તેની સ્થાપનાનો વિરોધ કે નિષેધ કરવો.

○ સર્વજ્ઞ વીતરાગની પ્રતિમાજ્ઞને સ્વસંવેદન દર્શાવવાનું કારણ જાડીને મૂળ આભાયમાં વિકૃતિ ન થાય તેવા અભિપ્રાયપૂર્વક સ્વ-પર હિતાર્થ સ્થાપવી, અનુમોદના કરવી.

* બારઅંગનો સાર-શુદ્ધાત્માનુભૂતિ-પ્રાપ્ત સત્ત્વપુરુષનાં એક વચનમાં અનંત આગમ રહેલા છે. તેમ છતાં તેમના વચનો સંમત કરવા અર્થે આગમ આધારનો આગ્રહ રાખવો.

○ જ્ઞાનીના પ્રત્યેક વચનમાં અનંત નયોની સંધિ રહેલી છે, તેમ જાણી તેના અર્થ ગાંભીર્યને સંમત કરવું.

* શ્રીમદ્ભ્રગુણાંશુભૂતિ-પરોક્ષ જિન ઉપકાર :

“પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર;

એવો લક્ષ થયા વિના, ઉગો ન આત્મવિચાર.” (આત્મસિદ્ધિ / ૧૧)

ઉપરો ત ગાથા અનુસાર પ્રત્યક્ષ સત્ત્વપુરુષનો ઉપકાર અર્થાત્ ભર્તી ત નહીં થતાં, ગુણસ્થાન આદિનું માપ મુખ્ય કરીને ભર્તી તમાં ન્યૂનતા થવી, અથવા અભર્તી ત થવી, અથવા પરોક્ષ અન્ય જ્ઞાનીઓની પ્રત્યક્ષ જ્ઞાની સાથે તુલના કરવી.

○ પ્રત્યક્ષ સત્ત્વપુરુષનો ઉપકાર ઉ ત ગાથા અનુસાર સમજીને સર્વથી અધિક ઉપકારી સમજ તેમનાં ચરણોની વિનયોપાસના કરવી.

* પ્રત્યક્ષ જ્ઞાનીની અતિશય ભર્તી તને નિયમિત પ્રધાનતા સમજવી.

○ સજ્જવનમૂર્તિનાં પ્રત્યક્ષ સમાગમનું ફળ અનંત ભવનો છેદ જાણીને, ઉપાદાનમાં પુરુષાર્થની જગૃતિ સહિત અન્ય ભર્તી તના પરિણામ થવા.

(આવા પરિણામમાં રાગ ગૌણ છે, અને જ્ઞાન તથા પુરુષાર્થ મુખ્ય છે).

.... જે જીવને ભવ-ભ્રમણનો ભય રહેતો નથી તે ઉપરો ત (*) પરિણામે સ્વચ્છંદમાં વર્તે છે અને આવા સ્વચ્છંદથી બચીને જે જીવ આત્માર્થ/ સ્વચ્છંદના પ્રતિપક્ષરૂપભાવે (૦) વર્તે છે – તેને દર્શનમોહનો અભાવ થઈ, મોક્ષ પર્યતની સિદ્ધિ મળે છે, તેવી ખાતરી શ્રીમદ્ભગુના ઉપરો ત આત્મસિદ્ધિના પદમાં પ્રસિદ્ધ છે.

(૩૩) લોકમાન્ય શ્રદ્ધાવાનપણાની મહત્તમા, લોકોની નજરમાં ધર્મશ્રદ્ધાવાન દેખાવવાની વૃત્તિ, ધાર્મિક સમાજમાં રાજનીતિરૂપ પ્રવૃત્તિ - જે લોકસંજ્ઞાના ભાગરૂપ જ છે, જે ભિથ્યાત્વ તીવ્ર કરે છે. જ્ઞાનીનાં અભિપ્રાયે તો સત્યની શ્રદ્ધામાં સંખ્યા ગૌણ છે. સત્યને સંખ્યાની અપેક્ષા નથી. લોકમાન્યતાની અપેક્ષા નથી, તેવા જોરમાં મુમુક્ષુ જીવને દર્શનમોહનો રસ મંદ પડે છે.

(૩૪) ચાર અનુયોગમાં અમુક અનુયોગની રૂચિ અને ક્ષયોપશમ વધતાં અધ્યાત્મ તત્ત્વની ગૌણતા થવી, તે સમ્યક્રત્વ પ્રાપ્તિને પ્રતિકૂળ છે. સમ્યક્ર- સમીપ જનાર તો ચારે અનુયોગમાંથી અધ્યાત્મ દૃષ્ટિ કેળવે છે, અને તે જ ચારેય અનુયોગમાંથી ચારેય અનુયોગનું તાત્પર્ય જાણી આગળ વધે છે.

(૩૫) રાગ અને પરમાં એકત્વબુદ્ધિ પૂર્વકના અધ્યાસનો ત્યાગ થયા વિનાના બાબ્ય ત્યાગમાં ધર્મ/પરમાર્થની કલ્યના થતાં કર્તાપણારૂપ દર્શનમોહ વૃદ્ધિગત થાય છે; તેવી સ્થિતિમાં એવા અજ્ઞાની ત્યાગીની અનુમોદના થાય છે, તેમને અનુસરવાનું બને છે. પરંતુ પ્રથમ અધ્યાસનો ત્યાગ કરવાના હેતુથી એકત્વ પરિણામન કાળે પણ ‘હું જ્ઞાનમાત્ર છું’ તેમ જુદા પડવાનો પ્રયત્ન-અભ્યાસ થવો તે દર્શનમોહના નાશનો ઉપાય છે.

(૩૬) બાબ્યતપ, સંયમના ફળમાં સિદ્ધિમોહ અથવા અનુકૂળ સંયોગોની અપેક્ષા દર્શનમોહને વધારનારા પરિણામ છે. પરંતુ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાપૂર્વક બાબ્ય કિયાના આગ્રહ વિના, હઠ વિના, સહજ સંયમ-તપના પરિણામ થવા યોગ્ય છે, જે ભાવનાને અનુકૂળ થાય.

(૩૭) સંપ્રદાયમાં/સમાજમાં માન-સ્થાનના લક્ષે તપ-ત્યાગ કરતાં દર્શનમોહ વધે છે. પરંતુ માત્ર અંતર્શુદ્ધિના લક્ષે યથાશર્ટ ત સહજ ત્યાગ-

વૈરાગ્ય થતાં દર્શનમોહનો રસ મંદ પડે છે.

(૩૮) વ્રત, સંયમમાં, દેહની કિયામાં આત્મબુદ્ધિ થતાં દેહાત્મબુદ્ધિ દૃઢ થવાથી ભિષ્યાત્વની પુષ્ટિ થાય છે. પરંતુ દેહથી ભિન્ન ચૈતન્યની પ્રતીતિ / અનુભવ અર્થે વ્રત, સંયમનો પ્રયોગ કરતાં દર્શનમોહ તૂટી શકે છે.

(૩૯) સ્વરૂપલક્ષે, સ્વરૂપની અનન્ય રુચિપૂર્વક, ચૈતન્યના અપૂર્વ મહિમાને લીધે સહજ ચાલતું સ્વરૂપ-ચિંતવન અને નિજતત્ત્વનું ઘોલન દર્શનમોહને ગાળી નાખે છે. પરંતુ યથાર્થ લક્ષ વિનાના લૂખા ચંચળતાવાળા વિકલ્યો, નયની ભંગજાળ, તર્ક પ્રધાનતાના-આધારવાળા વિકલ્યો વધારનારી વિચારણા, દર્શનમોહનો રસ વધવામાં કારણ થાય છે.

(૪૦) આત્મજ્ઞાન થયાં પહેલાં તત્ત્વની પ્રરૂપણામાં નિઃશંકતા હોઈ શકે નહિં, ત્યાં સંદિગ્ય અવસ્થામાં ઉપદેશક થતાં, તેમજ સ્વયંથી પ્રતિપાદિત સિદ્ધાંતની રક્ષા કરતાં, તેમજ તત્ત્વજ્ઞાનમાં વિવાદ થતાં પોતાની માન્યતાને પ્રતિષ્ઠાનું અંગ (મુદ્રા) બનાવતાં, દર્શનમોહ વૃદ્ધિ પામે છે. પરંતુ જેને દર્શનમોહનો અભાવ કરવો છે તેવા આત્માર્થીને આત્મજ્ઞાન થયાં પહેલાં ઉપદેશકના સ્થાનથી દૂર રહેવાનો અભિપ્રાય અને પ્રયત્ન હોય છે; તેમ છતાં ઉદ્યવશ શાસ્ત્ર વાંચન કરવું પડતું હોય તો મુખ્યપણે પરમાર્થના માર્ગને અનુસરવાના હેતુભૂત એવા સત્તુપુરુષના ગુણગાન-ભર્ત, સત્તુપુરુષ પ્રત્યે પ્રમોદભાવના, અને સત્તુપુરુષ પ્રત્યે અવિરોધ ભાવના ઉપદેશતાં દર્શનમોહનો રસ મંદ પડે છે, અથવા સજ્જવનમૂર્તિનાં આશ્રયે તત્ત્વ પ્રચાર / પ્રસારની પ્રવૃત્તિ કરતાં દોષથી બચી શકે.

(૪૧) ઉપદેશક પોતે અપરિણામી રહીને ઉપદેશ કરતાં તેમજ વ તત્વમાં સિદ્ધાંત તૂટતાં, તેમજ આધ્યાત્મરસ રહિત ઉપદેશક દર્શનમોહને બાંધે છે; કારણ તેવા પ્રસંગે રાગરસ/વિકલ્યરસ અથવા કથનશૈલીનો રસ (પુદ્ગલરસ) વૃદ્ધિગત થઈ જાય છે. જ્યારે સમ્યકૃત-સમીપ જનારો જીવ યથાર્થ સમજણાને પરિણામનમાં ઉતારવાનો પરલાર્થ કરે છે, અને તત્ત્વ પ્રતિપાદન કાળે આત્મભાવનો આવિર્ભાવ થાય - તેવા રસપૂર્વક તેની પ્રવૃત્તિ હોય છે, તેમજ યાંય પણ સિદ્ધાંત તૂટે નહીં તેવા સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક

પ્રતિપાદન કરવાની સાવધાની / અભિપ્રાય રહેતાં દર્શનમોહ તીવ્ર થઈ શકતો નથી, મંદ્તાને પામે છે.

(૪૨) તત્ત્વ પ્રચાર / ધર્મ પ્રભાવના વગેરે કાર્યોમાં રસ અથવા મહત્ત્વને લીધે પ્રત્યક્ષ સત્તુપુરુષના સમાગમનો અવકાશ ન લેવો, અર્થાત્ પ્રત્યક્ષ યોગરૂપ સત્તસંગને ગૌડા કરતાં દર્શનમોહ વધે છે; (આ સૂક્ષ્મ સ્વચ્છંદ છે, પરંતુ ભાવિમાં તે વધી જાય છે). જેથી પરમ આદરનો અભાવ થાય છે. તેમજ બાધ્ય પ્રવૃત્તિમાં અગ્રેસર થવાથી ‘હું કાંઈક છું’, તેમ થતાં પોતાની અલ્યતા અને લઘુતા તે જીવ વિચારી શકતો નથી, તેથી તેનો સ્વચ્છંદ રોકાતો નથી. પરંતુ જેનો દર્શનમોહ મટવાનો છે તેવા મુમુક્ષુ જીવને ખરા આત્મભાવે સત્તુપુરુષ પ્રત્યે મહાત્મ્યબુદ્ધિ હોવાથી તે સર્વ પ્રકારની બાધ્ય ધર્મ પ્રવૃત્તિ/પ્રચાર - પ્રસાર કરતાં પણ પ્રત્યક્ષ સત્તસંગને વધુ મહત્વ આપે છે, અને ‘હું તો સેવક છું’ તેવી વૃત્તિએ સમાગમ કરે છે.

(૪૩) પ્રત્યક્ષ યોગમાં બોધ વચનો એકાંતે આત્માર્થ પરમ આદર ભાવથી ગ્રહણ કરનારનો દર્શનમોહ તૂટે છે. પરંતુ આત્માર્થ સિવાય અન્ય હેતુથી થયેલ શ્રવણ દર્શનમોહને તીવ્ર કરે છે.

(૪૪) બહાર પડવાના ઉદ્યમાન પ્રસંગોમાં (પૂર્વપુષ્યોદયને લીધે) જે જીવને મીઠાશ વર્તે છે તે દર્શનમોહ વધારે છે. આત્માર્થી જીવને તો બહાર પાડવાવાળા પ્રસંગોને નિઃસાર જાણીને, તેનાથી દૂર ભાગવાની વૃત્તિ રહે છે.

(૪૫) પ્રત્યક્ષ સત્તુપુરુષનો સમાગમ અનાદિ ઓધસંજ્ઞા મટવાનું કારણ છે; તેમ છતાં તીવ્ર દર્શનમોહને વશ જીવ ઓધસંજ્ઞાનો ત્યાગ કરતો નથી; તેમ સમજી, સત્તસમાગમ કરવામાં ઓધસંજ્ઞા મટવાથી/ભાવભાસન થવાથી દર્શનમોહ મંદ પડે છે.

(૪૬) બાધ્યદ્વિને લીધે અજ્ઞાની જીવના ઉધાડજાન અને વાક્પટુતામાં આકર્ષિત થઈ તેને જ્ઞાની માની, અનુમોદન / અનુસરણ કરતાં દર્શનમોહ વધે છે. આત્માર્થી જીવતો વિદ્વતા અને જ્ઞાન જુદી-જુદી ચીજ છે - તેમ જાણી, પરીક્ષા કરી, યથાર્થ સમજણ કરી, વિવેક કરે છે.

(૪૭) પરમ શાંત ઉપશમરસ છલકતી વીતરાગ ભાવવાહી જિનબિંબ-જિનપ્રતિમાળ સર્વ ક્ષેત્રવર્તી ભૂત-વર્તમાન-ભાવીના અનંત તીર્થકરો, અર્હતોની પ્રતિરૂપ-પ્રતિનિધિયમાન છે. પરંતુ એવા કોઈ એક જિનબિંબ-જિનપ્રતિમાળની સ્થાપનાદિનો નિષેધ-અવમાનનાદિ કરવા, પરંતુ બીજા જિનપ્રતિમાળની સ્થાપનાદિ કરવી, અથવા કોઈની મુખ્યતા પરંતુ કોઈ અન્યની ગૌણતા કરવી; અથવા એવી જિનપ્રતિમાળની પણ સ્થાપના-પૂજા-ભર્ત કરવી અને અન્ય કુદ્વાદિની પણ સ્થાપના-પૂજાદિ કરવી – તે વિપરીત અભિનિવેશ પૂર્વકની પ્રવૃત્તિ છે.

સદ્ગુરુ, સત્ત્વશાસ્ત્ર અને સત્ત્વપુરુષને માનવા, ભર્ત ત-વિનયાદિ કરવા અને અસદ્ગુરુ, અસત્ત્વશાસ્ત્ર અને અસત્ત્વપુરુષને પણ માનવા, ભર્ત ત-વિનય-પ્રશંસાદિ કરવા-તે પણ વિપરીત અભિનિવેશનો જ પ્રકાર છે.

વિદ્યમાન સત્ત્વપુરુષની અવમાનના-ગૌણતા કરવી અને અવિદ્યમાન સત્ત્વપુરુષની મુખ્યતા કરવી (દેશનાદિના બહાને); અથવા એક સત્ત્વપુરુષની ભર્ત ત-વિનયાદિ કરવા પરંતુ અન્ય સત્ત્વપુરુષની ઉપેક્ષા-ગૌણતાનો ભાવ પણ વિપરીત અભિનિવેશનું જ પરિણામ છે.

- ઇત્યાદિ અનેક સ્થૂલ અને સ્કૂલ વિપરીત અભિનિવેશના પ્રકારો છે, તે સર્વ ગૃહીત ભિથ્યાત્વના પોષક અને દર્શનમોહની વૃદ્ધિ કરનારા છે.

પરંતુ, જેમ વિપરીત અભિનિવેશ રહિત નવ તત્ત્વનું જ્ઞાન તે જ સમ્યક્જ્ઞાન છે-તેમ માત્ર વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રને જ સ્વીકારવાવાળા; તેમજ વિદ્યમાન સત્ત્વપુરુષને ઓળખીને દેશનાલભિન્નનું નિમિત્ત જાણી, ભવભ્રમણના અભાવનું કારણ સમજી, અયંત ભર્ત તપૂર્વક વર્તનારને સહજ જ દર્શનમોહનો રસ ઘટે છે, અને જ્ઞાનમાં સ્વરૂપ નિશ્ચય થવા માટેની નિર્મળતાની ભૂમિકા ઉત્પન્ન થાય છે.

(૪૮) હીનગુણીનો સંગ કોઈપણ ભૂમિકાના સાધકને પતનનું કારણ થાય છે. જે કુસંગ એટલે હીનગુણીનો સંગ પણ કરે, અને જ્ઞાની અથવા વિશેષ ગુણીનો સંગ પણ કરે-તેનો સત્તસંગ નિષ્ફળ જાય છે. દુર્લભપણે

પ્રાપ્ત એવો સત્સંગ નિષ્ફળ જવાનું આ (સાધારણતઃ) ન પકડાય તેવું કારણ છે; તેથી દર્શનમોહને ટાળવા જેમ સત્ત્સંગનું મહત્વ વિશેષ છે, તેમ જ હીનગુણીના સંગની રુચિ તે ગુણ પ્રગટવાથી દૂર જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અથવા તેની પરિણાતિ પડા પડી જાય છે.

(૪૬) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થવા છતાં, વ્યવહારનયનો પક્ષ સ્થૂળપણે કે સૂક્ષ્મપણે રહેતાં દર્શનમોહ વધે છે. પરંતુ દ્રવ્યસ્વભાવની ઓળખાણ થાય ત્યારે નિશ્ચયનો પક્ષ યથાર્થ પ્રકારે થતાં, એટલે કે પક્ષરૂપ પર્યાયની ગૌણતા અને સ્વભાવની મુખ્યતા (પક્ષમાં દક્ષપણું) રહેતાં દર્શનમોહ ઘટે છે.

(૪૭) કૃત્રિમપણે નિશ્ચયનો પક્ષ કરતાં, અર્થાત્ માત્ર વિકલ્પ-વાઙીમાં નિશ્ચયની મુખ્યતા કરતાં દર્શનમોહ વધે છે. પરંતુ સ્વભાવના ભાવ-ભાસનથી ઉત્પન્ન મહિમા, ક્ષણો-ક્ષણો વર્ધમાન થતો સ્વરૂપમહિમા, અંતે પક્ષાતિકાંત થવાથી દર્શનમોહનો નાશ થાય છે.

(૪૮) નિજસ્વભાવ લક્ષણત થતાં, અંતમુખી ચૈતન્યવીર્યની સ્કુરણા થતાં દશાની દિશા બદલાય, અને પુરુષાર્થ જેમ-જેમ વધે, તેમ-તેમ સમ્યકૃત્વ-સમીપતા થાય. પરંતુ બાધ્ય પ્રવૃત્તિમાં વીર્ય રોકાય, અથવા ઉગ્ર થાય તો સ્વભાવથી દૂર જવાનું થાય.

(૪૯) દાખિનાં વિષયભૂત સામાન્ય તત્ત્વનું જોર ‘આ.. હું, આ.... હું’ તેમ નિજ અસ્તિત્વનું જોર દર્શનમોહને મંદ કરે છે. પરંતુ વિકલ્પનું જોર વિકલ્પમયતા પ્રાપ્ત કરાવી, નિર્વિકલ્પ સ્વભાવથી દૂર લઈ જાય છે.

(૫૦) જેમ-જેમ સ્વરૂપને ગ્રહવાનું જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે, તેમ-તેમ દર્શનમોહ શિથિલ થતો જાય છે. પરંતુ સ્વરૂપ ગ્રહણના પુરુષાર્થના અભાવમાં ઉપયોગ સ્થૂળ થતો જાય છે, પરિણાતિમાં કાંઈ ફેર પડતો નથી, અર્થાત્ પર રસવાળી પરિણાતિ ચાલુ જ રહે છે, તેમાં પરરસ વધે છે.

(૫૧) દર્શનમોહને લીધે જીવ પર્યાયદાખિથી પર્યાયને જ જોયા કરે છે, અને કવિધ પર્યાયની અધિકાઈ ત્યાં વર્ત્યા કરે છે. જ્યારે સ્વભાવરસ/ચિદ્રરસવાળી પરિણાતિમાં કોઈના આલંબન વિના (વિભાવરસની મંદતારૂપ

પૂર્વ પર્યાયના પણ આલંબન વિના) અદ્વરથી ધૂન ચાલતાં, નિર્વિકલ્પ સ્વભાવના લક્ષનું જોર ચાલતાં પર્યાયદાષ્ટ રહેતી નથી.

(૫૫) જ્ઞાયાકાર જ્ઞાનની મુખ્યતા અર્થાત્ જ્ઞેય લુભ્યતા દર્શનમોહને વધારે છે. પરંતુ સામાન્યના આવિર્ભાવથી જ્ઞાનમાં/વેદનમાં સ્વપણું થતાં સ્વસંવેદન ઉપજે છે, ત્યારે દર્શનમોહનો નાશ થાય છે.

(૫૬) સાધનની ભૂલ પણ મિથ્યાત્વને દઢ કરે છે, તેથી મન, વચન, કાયાના યોગરૂપ પરિણામ વગેરે કોઈને કોઈ અન્યથા બાધક ભાવમાં સાધનની કલ્પના થાય છે. પરંતુ અંતર્મુખ થવામાં જ્ઞાન જ સાધન છે; તેમ વાસ્તવિકપણે સાધનનો સ્વીકાર થતાં, પ્રયત્નનું સ્થાન ‘માત્ર જ્ઞાન’ માં જ કેન્દ્રિત થતાં દર્શનમોહ ઘટે છે.

(૫૭) ચાર અનુયોગમાંથી કોઈ એક અનુયોગના ક્ષયોપશમ વિશેષને લીધે, પક્ષપાતવાળો રાગ થવાથી, કોઈ અન્ય અનુયોગ પ્રત્યે સ્થૂલરૂપથી અથવા સૂક્ષ્મરૂપથી નિષેધ અથવા તિરસ્કાર/ અનાદર થવો તે દર્શનમોહની વૃદ્ધિનું કારણ છે, પરંતુ યથાર્થ ભૂમિકામાં તો ચારેય અનુયોગનું મૂલ્ય પોતે પોતાના સ્થાનમાં ઠીક છે- તેમ સમજાય છે અને તે સર્વનું તાત્પર્ય વીતરાગતા જણાય છે, જે દર્શનમોહને મંદ કરે છે.

(૫૮) સમ્યક્દર્શનાદિ અધ્યાત્મદશાઓનો મહિમા સત્ત્વાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ પ્રત્યેના જોરમાં તે મહિમા થયો છે, તે પ્રકારે યથાર્થરૂપે મહિમા આવવાને બદલે, મહિમા કરનારને માત્ર પર્યાય ઉપરનું જોર થયા કરે તેને પર્યાયનું એકત્વ છૂટવાને બદલે દઢ થવાનું બને ત્યાં દર્શનમોહ તૂટતો નથી, પરંતુ ત્રિકાળીના લક્ષે ધ્રુવ સ્વભાવનો મહિમા / જોર થતાં દર્શનમોહ તૂટે છે, અને યથાર્થપણે અધ્યાત્મદશાનો મહિમા રહે છે.

દર્શનમોહને લીધે જીવ સર્વજ્ઞપ્રણીત માર્ગથી વિમુખ વર્તવામાં વેગવાન થાય છે, તેનો પુરુષાર્થ વિપરીતતામાં બળવાન થાય છે, અને આત્મ-સ્વભાવ પ્રત્યે તેને રુચિ થતી નથી-તે જીવ પોતાનું હિત વિચારી શકતો નથી, પરંતુ અહિતરૂપ ભાવોમાં રાચે છે. શાસ્ત્રકર્તા કહે છે કે જીવનો સ્વભાવ તો

સમ્યક્કપણે પરિણમવાનો હોવા છતાં દર્શનમોહથી મૂર્ખદીને જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે છે. આ રીતે દર્શનમોહને, સ્વભાવનો ઘાતકભાવ જાણી-તે સબંધી અનેક પડખાઓને લક્ષમાં રાખી આત્મારી જીવે ધર્મ-પ્રવૃત્તિમાં પ્રવર્તવું યોગ્ય છે, અન્યથા સંસારથી છૂટવાને બદલે સંસાર વૃદ્ધિનું કારણ થવાની સંભાવના છે. - અસ્તુ



श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट

उपलब्ध प्रकाशन (हिन्दी)

ग्रंथ का नाम एवं विवरण

मूल्य

| | | |
|----|---|--------|
| ०१ | जिणसासण सच्चं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन) | ०८-०० |
| ०२ | द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग - पूज्य श्री निहालचंद्रजी सोगानीजीके पत्र एवं तत्त्वचर्चार्य) | ३०-०० |
| ०३ | दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) | ०६-०० |
| ०४ | दंसणमूलो धर्मो (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार) | ०६-०० |
| ०५ | निर्भ्रात दर्शनकी पगड़ंडी (ले. पूज्य भाईश्री शशीभाई) | १०-०० |
| ०६ | परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीखामीके १००८ वचनामृत) | १०-०० |
| ०७ | प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई) | ०४-०० |
| ०८ | मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीखामीके विविध प्रवचन) | ०८-०० |
| ०९ | विधि विज्ञान (विधि विषयक वचनामृतोंका संकलन) | १०-०० |
| १० | सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक) | १५-०० |
| ११ | तत्त्वानुशीलन (भाग १-२-३) (ले. पूज्य भाईश्री शशीभाई) | २०-०० |
| १२ | अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल) | |
| १३ | ज्ञानामृत (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत) | |
| १४ | मुमुक्षुता आरोहण क्रम (श्रीमद् राजचंद्र पत्रांक-२५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) | |
| १५ | सम्यग्दर्शनके सर्वोत्कृष्ट निवासभूत छः पदोंका अमृत पत्र (श्रीमद् राजचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) | १८-०० |
| १६ | आत्मयोग (श्रीमद् राजचंद्र पत्रांक-५६९, ४९१, ६०९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) | २०-०० |
| १७ | परिम्रणके प्रत्याख्यान (श्रीमद् राजचंद्र पत्रांक-१९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) | २०-०० |
| १८ | अनुभव संजीवनी (पूज्य भाईश्री शशीभाई द्वारा लिखे गये वचनामृतोंका संकलन) | १५०-०० |
| १९ | धन्य आराधना (श्रीमद् राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर पूज्य भाईश्री शशीभाई द्वारा विवेचन) | |
| २० | सिद्धपदका सर्वश्रेष्ठ उपाय | २५.०० |
| २१ | कुटुम्ब प्रतिबंध | २५.०० |

| | | |
|-----|---|-------|
| ૨૨ | દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૬૬, ૪૪૯, ૫૭૨ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈને પ્રવચન) | ૨૫.૦૦ |
| ૨૩ | પ્રવચન નવનીત ભાગ-૧ (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ને પ્રવચન) | ૭૫.૦૦ |
| ૨૪ | ગુરુ ગુરુ સંભારણા (પૂજ્ય બહિનશ્રી ચંપાવહન દ્વારા ગુરુ ભક્તિ) | ૧૫.૦૦ |
| ૨૫ | આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચન (પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા) | ૫૦.૦૦ |
| ૨૬ | કહાન રલ સરિતા (પરમાગમસાર ને વિભિન્ન વચનામૃતોને પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈને પ્રવચન) | ૩૦.૦૦ |
| ૨૭ | સુવિધિ દર્શન (સુવિધિ લેખ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈને પ્રવચન) | ૪૦.૦૦ |
| ૨૮. | વચનામૃત રહસ્ય (પૂજ્ય ગુરુદેવશ્રીના નાયરોબી માટે હુએ પ્રવચન) | ૨૦.૦૦ |

વીતરાગ સત્ત્વસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ

ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી)

| ગ્રંથનું નામ તેમજ વિવરણા | મૂલ્ય |
|---|----------|
| ૦૧ ગુરુગુણ સંભારણા (પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેશી સ્કુરિત ગુરુભ્રાતા) | ૦૫.૦૦ |
| ૦૨ જિણસાણણ સંવન્ધ (શાનીપુરુષ વિષયક વચનામૃતોનું સંક્લિન) | ૦૮.૦૦ |
| ૦૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવત્ કુંદુંદાચાર્યદેવ વિરચિત) | ૦૨.૦૦ |
| ૦૪ દ્રવ્યઘટિપ્રકાશ ભાગ-૩ (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજની તત્ત્વચર્ચા) | ૦૪.૦૦ |
| ૦૫ દસલક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો) | ૦૬.૦૦ |
| ૦૬ ધન્ય આરાધના (શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મમ દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિચેન) | ૧૦.૦૦ |
| ૦૭ નિર્ભાત દર્શનની કેડીએ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ) | ૧૦.૦૦ |
| ૦૮ પરમાત્મપ્રકાશ (શ્રીમદ્ યોગીન્દ્રદેવ વિરચિત) | ૧૫.૦૦ |
| ૦૯ પરમાગમસાર (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮ વચનામૃત) | ૧૧.૨૫ |
| ૧૦ પ્રવચન નવનીત ભાગ-૧ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો) | અનુપલબ્ધ |
| ૧૧ પ્રવચન નવનીત ભાગ-૨ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૧૨ પ્રવચન નવનીત ભાગ-૩ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ નય ઉપર ખાસ પ્રવચનો) | ૩૫.૦૦ |
| ૧૩ પ્રવચન નવનીત ભાગ-૪ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ શાલ તથો ઉપર ખાસ પ્રવચનો) | ૭૫.૦૦ |
| ૧૪ પ્રવચન પ્રસાદ ભાગ-૧-૨ (પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) | ૬૫.૦૦ |

| | | |
|----|---|----------|
| ૧૫ | પ્રયોજન સિદ્ધિ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ) | ૦૩.૦૦ |
| ૧૬ | વિધિ વિજ્ઞાન (વિધિ વિષયક વચ્ચનામૃતોનું સંકલન) | ૦૭.૦૦ |
| ૧૭ | ભગવાન આત્મા (દ્વારાદિષ્ટ વિષયક વચ્ચનામૃતોનું સંકલન) | ૦૭.૦૦ |
| ૧૮ | પથ પ્રકાશ (માર્ગદર્શન વિષયક વચ્ચનામૃતોનું સંકલન) | ૦૬.૦૦ |
| ૧૯ | સમ્યક્ષાનદીપિકા (લે. શ્રી ધર્મદાસજી કુલ્લક) | ૧૫.૦૦ |
| ૨૦ | આધ્યાત્મિક પત્ર (પૂજ્ય શ્રી નિહાલયંડળ સોગાનીજના પત્રો) | ૦૨.૦૦ |
| ૨૧ | અધ્યાત્મ સંદેશ (પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો) | પ્રેસમાં |
| ૨૨ | જ્ઞાનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચ્ચનામૃતો) | ૦૬.૦૦ |
| ૨૩ | બીજું કાઈ શોધ મા (પ્રત્યક્ષ સત્પુરુષ વિષયક વચ્ચનામૃતોનું સંકલન) | ૦૬.૦૦ |
| ૨૪ | મુમુક્ષુતા આરોહણ કમ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૫૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૧૫.૦૦ |
| ૨૫ | સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ નિવાસામૃત છ પદનો અમૃત પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૮૩ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૦.૦૦ |
| ૨૬ | આત્મયોગ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૫૬૮, ૪૮૧, ૬૦૯ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૦.૦૦ |
| ૨૭ | પરિભ્રમાશના પ્રત્યાખ્યાન (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૬૫, ૧૨૮ તથા ૨૬૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૦.૦૦ |
| ૨૮ | અનુભવ સંજીવની (પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા લિખિત વચ્ચનામૃતોનું સંકલન) | ૧૫૦.૦૦ |
| ૨૯ | સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૬૪, ૨૦૦ ૫૧૧, ૫૬૦ તથા ૮૧૮ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૩૦ | કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, ૫૨૮, ૫૩૭ તથા ૩૭૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૩૧ | વચ્ચનામૃત રહસ્ય (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં 'બહેનશ્રીના વચ્ચનામૃત' પર થ્યેલાં પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૩૨ | પ્રવચન સુધા (ભાગ-૧) 'પ્રવચનસાર' શાસ્ત્રના સણંગ પ્રવચનો | ૪૦.૦૦ |
| ૩૩ | પ્રવચન સુધા (ભાગ-૨) 'પ્રવચનસાર' શાસ્ત્રના સણંગ પ્રવચનો | ૮૪.૦૦ |
| ૩૪ | દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૬૬, ૪૪૯, ૫૭૨, પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૩૫ | કહાન રત્ન સરિતા (ભાગ-૧) ('પરમાગમસાર' માંથી ચૂંટેલા કેટલાક વચ્ચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૩૬ | સમયસાર દોહન (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં 'સમયસાર' પરમાગમ ઉપર થ્યેલાં પ્રવચનો) | ૩૫.૦૦ |

| | | |
|----|--|-------|
| ૩૭ | સુવિધિર્દ્થન (પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત 'સુવિધિ' લેખ ઉપર તેમાં પ્રવચન) | ૨૫.૦૦ |
| ૩૮ | સ્વરૂપભાવના (શ્રીમહ્રિ રાજચંદ્ર પત્રાંક-૮૧૩, ૭૧૦ અને ૮૧૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૨૫.૦૦ |
| ૩૯ | સમકિતનું બીજ (શ્રીમહ્રિ રાજચંદ્ર ગ્રંથમાંથી સત્પુરુષની ઓળખાડા વિષયક પત્રો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૩૦.૦૦ |
| ૪૦ | પ્રવચન સુધા (ભાગ-૩) 'પ્રવચનસાર' શાસ્ત્રના સણંગ પ્રવચનો | ૩૦.૦૦ |
| ૪૧ | કહાન રલ સરિતા (ભાગ-૨) ('પરમાગમસાર' માંથી કમબદ્ધ પર્યાય વિષયક ચૂંટેલા કેટલાક વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) | ૩૦.૦૦ |
| ૪૨ | પ્રવચન સુધા (ભાગ-૪) 'પ્રવચનસાર' શાસ્ત્રના સણંગ પ્રવચનો | ૩૦.૦૦ |
| ૪૩ | અધ્યાત્મ સુધા (ભાગ-૧) 'બહેનશ્રીનાં વચનામૃત' ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સણંગ પ્રવચનો | ૩૦.૦૦ |
| ૪૪ | કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૧) 'કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનીજીસ્વામીના સણંગ પ્રવચનો | ૩૦.૦૦ |
| ૪૫ | કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૨) 'કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનીજીસ્વામીના સણંગ પ્રવચનો | ૩૦.૦૦ |
| ૪૬ | બૃહદ્ દ્રવ્યસંગ્રહ પ્રવચન (ભાગ-૧) 'દ્રવ્યસંગ્રહ' ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનીજીસ્વામીના સણંગ પ્રવચનો. | ૨૦.૦૦ |
| ૪૭ | બૃહદ્ દ્રવ્યસંગ્રહ પ્રવચન (ભાગ-૨) 'દ્રવ્યસંગ્રહ' ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનીજીસ્વામીના સણંગ પ્રવચનો. | ૨૦.૦૦ |
| ૪૮ | પ્રવચન સુધા (ભાગ-૫) 'પ્રવચનસાર' શાસ્ત્રના સણંગ પ્રવચનો | ૩૦.૦૦ |
| ૪૯ | અધ્યાત્મ સુધા (ભાગ-૨) 'બહેનશ્રીનાં વચનામૃત' ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સણંગ પ્રવચનો (પ્રેસમાં) | |

वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या

| | | |
|----|---|--------|
| ०१ | प्रवचनसार (गुजराती) | १५०० |
| ०२ | प्रवचनसार (हिन्दी) | ४२०० |
| ०३ | पंचास्तिकायसंग्रह (गुजराती) | १००० |
| ०४ | पंचास्तिकाय संग्रह (हिन्दी) | २५०० |
| ०५ | समयसार नाटक (हिन्दी) | ३००० |
| ०६ | अष्टपाहुड (हिन्दी) | २००० |
| ०७ | अनुभव प्रकाश | २१०० |
| ०८ | परमात्मप्रकाश | ४१०० |
| ०९ | समयसार कलश टीका (हिन्दी) | २००० |
| १० | आत्मअवलोकन | २००० |
| ११ | समाधितंत्र (गुजराती) | २००० |
| १२ | बृहद द्रव्यसंग्रह (हिन्दी) | ३००० |
| १३ | ज्ञानामृत (गुजराती) | १०,००० |
| १४ | योगसार | २००० |
| १५ | अध्यात्मसंदेश | २००० |
| १६ | पद्मनंदीपंचविंशती | ३००० |
| १७ | समयसार | ३१०० |
| १८ | समयसार (हिन्दी) | २५०० |
| १९ | अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित) | ३००० |
| २० | द्रव्यदृष्टि प्रकाश (गुजराती) | १०,००० |
| २१ | द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) | ६६०० |
| २२ | पुरुषार्थसिद्धिउपाय (गुजराती) | ६९०० |
| २३ | क्रमबद्धपर्याय (गुजराती) | ८००० |
| २४ | अध्यात्मपराग (गुजराती) | ३००० |
| २५ | धन्य अवतार (गुजराती) | ३७०० |
| २६ | धन्य अवतार (हिन्दी) | ८००० |
| २७ | परमामगसार (गुजराती) | ५००० |
| २८ | परमागमसरा (हिन्दी) | ४००० |

| | | |
|----|---------------------------------|------|
| ૨૯ | વचનામૃત પ્રવચન ભાગ-૧-૨ | ૫૦૦૦ |
| ૩૦ | નિર્ભાત દર્શનની કેડીએ (ગુજરાતી) | ૮૫૦૦ |
| ૩૧ | નિર્ભાત દર્શનકી પગડંડી (હિન્દી) | ૭૦૦૦ |
| ૩૨ | અનુભવ પ્રકાશ (હિન્દી) | ૨૦૦૦ |
| ૩૩ | ગુરુગુણ સંભારણા (ગુજરાતી) | ૩૦૦૦ |
| ૩૪ | જિણ સાસણ સવં (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૩૫ | જિણ સાસણ સવં (હિન્દી) | ૨૦૦૦ |
| ૩૬ | દ્વાદશ અનુપ્રેક્ષા (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૩૭ | દસ લક્ષ્ણ ધર્મ (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૩૮ | ધન્ય આરાધના (ગુજરાતી) | ૧૦૦૦ |
| ૩૯ | ધન્ય આરાધના (હિન્દી) | ૧૫૦૦ |
| ૪૦ | પ્રવચન નવનીત ભાગ-૧-૪ | ૫૮૫૦ |
| ૪૧ | પ્રવચન પ્રસાદ ભાગ-૧-૨ | ૧૫૦૦ |
| ૪૨ | પથ પ્રકાશ (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૪૩ | પ્રયોજન સિદ્ધિ (ગુજરાતી) | ૩૫૦૦ |
| ૪૪ | પ્રયોજન સિદ્ધિ (હિન્દી) | ૨૫૦૦ |
| ૪૫ | વિધિ વિજ્ઞાન (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૪૬ | વિધિ વિજ્ઞાન (હિન્દી) | ૨૦૦૦ |
| ૪૭ | ભગવાન આત્મા (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૪૮ | સમ્યક્જ્ઞાનદીપિકા (ગુજરાતી) | ૧૦૦૦ |
| ૪૯ | સમ્યક્જ્ઞાનદીપિકા (હિન્દી) | ૧૫૦૦ |
| ૫૦ | તત્ત્વાનુશીલન (ગુજરાતી) | ૪૦૦૦ |
| ૫૧ | તત્ત્વાનુશીલન (હિન્દી) | ૨૦૦૦ |
| ૫૨ | બીજું કાંઈ શોધ મા (ગુજરાતી) | ૪૦૦૦ |
| ૫૩ | દૂસરા કુછ ન ખોજ (હિન્દી) | ૨૦૦૦ |
| ૫૪ | મુસુકૃતા આરોહણ ક્રમ (ગુજરાતી) | ૨૫૦૦ |
| ૫૫ | મુસુકૃતા આરોહણ ક્રમ (હિન્દી) | ૩૫૦૦ |
| ૫૬ | અમૃત પત્ર (ગુજરાતી) | ૨૦૦૦ |
| ૫૭ | અમૃત પત્ર (હિન્દી) | ૨૦૦૦ |
| ૫૮ | પણ્ણમણના પ્રત્યાખ્યાન (ગુજરાતી) | ૧૫૦૦ |
| ૫૯ | પણ્ણમણને પ્રત્યાખ્યાન (હિન્દી) | ૨૦૦૦ |
| ૬૦ | આત્મયોગ (ગુજરાતી) | ૧૫૦૦ |
| ૬૧ | આત્મયોગ (હિન્દી) | ૨૦૦૦ |

| | | |
|----|--|------|
| ૬૨ | અનુભવ સંજીવની (ગુજરાતી) | ૧૦૦૦ |
| ૬૩ | અનુભવ સંજીવની (હિન્દી) | ૧૦૦૦ |
| ૬૪ | જ્ઞાનામૃત (હિન્દી) | ૨૫૦૦ |
| ૬૫ | વચનામૃત રહસ્ય | ૧૦૦૦ |
| ૬૬ | દિશા બોધ (હિન્દી-ગુજરાતી) | ૩૦૦૦ |
| ૬૭ | કહાન રલ સારિતા (હિન્દી-ગુજરાતી) | ૨૫૦૦ |
| ૬૮ | પ્રવચન સુધા (ભાગ-૧) | ૧૦૦૦ |
| ૬૯ | કુટુંબ પ્રતિબંધ (હિન્દી-ગુજરાતી) | ૩૫૦૦ |
| ૭૦ | સિદ્ધપદ કા સર્વત્રેષ ઉપાય (હિન્દી-ગુજરાતી) | ૩૦૦૦ |
| ૭૧ | ગુરુ ગિરા ગૌરવ (હિન્દી-ગુજરાતી) | ૩૦૦૦ |
| ૭૨ | આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચન | ૭૫૦ |
| ૭૩ | પ્રવચન સુધા (ભાગ-૨) | ૭૫૦ |
| ૭૪ | સમયસાર દોહન | ૭૫૦ |
| ૭૫ | ગુરુ ગુણ સંભારણા | ૭૫૦ |
| ૭૬ | સુવિધિદર્શન | ૧૦૦૦ |
| ૭૭ | સમકિતનું બીજ | ૧૦૦૦ |
| ૭૮ | સ્વરૂપમાવના | ૧૦૦૦ |
| ૭૯ | પ્રવચન સુધા (ભાગ-૩) | ૧૦૦૦ |
| ૮૦ | પ્રવચન સુધા (ભાગ-૪) | ૧૦૦૦ |
| ૮૧ | કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન ભાગ-૧ | ૧૦૦૦ |
| ૮૨ | કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન ભાગ-૨ | ૧૦૦૦ |
| ૮૩ | સુવિધિ દર્શન (હિન્દી) | ૧૦૦૦ |
| ૮૪ | પ્રવચન સુધા (ભાગ-૫) | ૧૦૦૦ |
| ૮૫ | દ્રવ્યસંગ્રહ પ્રવચન (ભાગ-૧) | ૧૦૦૦ |
| ૮૬ | દ્રવ્યસંગ્રહ પ્રવચન (ભાગ-૨) | ૧૦૦૦ |
| ૮૭ | વચનામૃત રહસ્ય (હિન્દી) | ૧૦૦૦ |

પાઠકોની નોંધ માટે

ॐ

नमः सिद्धेभ्य

પાર્વિત્રી બ્રહ્મા માણિલા

પ્રચારા ઘણાન

(‘શ્રીમદ્ રાજચંદ્ર’ પત્રાંક ૧૮૫, ૧૨૮, તથા ૨૬૪
ઉપર પૂજ્ય ભાઈશ્રી ‘શશીભાઈ’ ના પ્રવચનો)

પ્રકાશક

વીતરાગ સત્ત્વસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર

પ્રકાશક – પ્રાપ્તિ સ્થાન :

વીતરાગ સત્તસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ

૫૮૦, જુની માણોકવાડી, પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી માર્ગ

ભાવનગર-૩૬૪૦૦૧

ફોન : ૨૪૨૩૨૦૭, ૨૫૧૫૦૦૪

પ્રથમાવૃત્તિ : એપ્રિલ, ૧૯૯૯ (પ્રતિ : ૧૫૦૦)

દ્વિતીયાવૃત્તિ : ડિસેમ્બર, ૧૯૯૯ (પ્રતિ : ૫૦૦)

તૃતીયાવૃત્તિ : ઓગસ્ટ, ૨૦૦૦ (પ્રતિ : ૫૦૦)

ચતુર્થાવૃત્તિ : જુલાઈ, ૨૦૦૫ (પ્રતિ : ૫૦૦)

પૂર્ણ સંખ્યા : ૪ + ૧૫૨ = ૧૫૬

પડતર કિંમત : ૩૫/-

વેચાણ કિંમત : ૨૦/-

લેસર ટાઈપ સેટિંગ :

પૂજા ઇમ્પ્રેશન્સ

લોટ નં. ૧૦૭૫-એ,

‘માતૃધારા’, આંબાવાડી

ભાવનગર-૩૬૪૦૦૧

ફોન: ૨૨૦૩૪૭૦

મુદ્રક :

ભગવતી ઓફસેટ

૧૫, સી. બંસીધર મિલ કમ્પાઉન્ડ

બારડોલપુરા,

અમદાવાદ-૩૮૦૦૦૪

ફોન : ૯૮૨૫૪૭૭૭૪૪

પ્રકાશકીય નિવેદન

આ ‘પરિભ્રમણના પ્રત્યાખ્યાન’ શીર્ષકનો લઘુકાય ગ્રંથ એ કૃપાળુદેવ શ્રીમદ્ રાજયંક્રના પત્રાંક ૧૮૫, ૧૨૮, તથા ૨૬૪ (વીસ દોહરા) ઉપર પ્રત્યક્ષ ઉપકારી પરમ પૂજ્ય ‘ભાઈશ્રી’ શશીભાઈના અદ્ભુત માર્મિક શૈલીમાં થયેલાં પ્રવચનોનું એક આગવુ સંકલન છે કે જે દર્શનમોહ (મોહરાજા) નો પરાજ્ય કરવા અર્થે પ્રથમ પ્રહારરૂપ છે, તેમજ મુમુક્ષુતાની યથાર્થ શરૂઆત અને મોક્ષ મહેલના મંગળ શિલાન્યાસ કરવા માટેનું પરમ હિતકારી માર્ગદર્શન તેમાં રહ્યું છે. વળી, આ ગ્રંથના પાછલા ભાગમાં મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમોહ કેવા-કેવા પ્રકારે વધે-ઘટે છે એ સંબંધિત દુર્લભ માર્ગદર્શન પણ ઉપલબ્ધ છે. આટલી હટે સ્પષ્ટતા અન્યત્ર યાંય ઉપલબ્ધ નથી.

વળી, આપણાં પરમ તારણહાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી પણ પરમ કૃપાળુદેવના વચનોથી કેટલા પ્રભાવિત હતા અને કેટલો મહિમા કરતા હતા તે તો આપણે સૌ જાણીએ જ છીએ. યારેક કોઈક નવા મુમુક્ષુ શરૂઆતમાં શેનો સ્વાધ્યાય કરવો ? એમ પૂછતા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહેતા કે ‘શ્રીમદ્ વાંચો’. પૂજ્ય બહેનશ્રીએ પણ મુમુક્ષુની ભૂમિકામાં ‘શ્રીમદ્ રાજયંક્ર’ ગ્રંથનો સ્વાધ્યાય કર્યો હતો. તેમજ હાલમાં પ્રત્યક્ષ વિદ્યમાન એવા પૂજ્ય ‘ભાઈશ્રી’ ને આત્મજ્ઞાન થવામાં આ કૃપાળુદેવનો ગ્રંથ જ ઉપકારી થયેલ છે.

કૃપાળુદેવના આવા ચમત્કારિક વચનયોગમાં અનેક જગ્યાએ મુમુક્ષુતાનો વૃદ્ધિક્રમ પ્રસ્થાપિત થયેલ છે. પરંતુ એ ક્રમમાં યો વિષય પહેલા-પછી કેવી રીતે છે, તેને પોતાની વિશેષ પ્રજ્ઞાથી પ્રસિદ્ધ કરી વર્તમાન તેમજ ભાવિના સર્વ સામાન્ય મુમુક્ષુ જીવો પર પૂજ્ય ભાઈશ્રીએ અતિ-અતિ ઉપકાર કર્યો છે અને મુમુક્ષુના વર્થ પરિશ્રમને બચાવી આત્મકલ્યાણના કાર્યને સહેલુ કરી આપ્યું છે.

એ ક્રમના પ્રથમ પગથિયે કેવી રીતે સંસારની ઉપાસનાનો અભિપ્રાય સર્વથા નાણ કરી ‘હવે પરિભ્રમણ કરવું જ નથી’ તે રૂપ ‘પરિભ્રમણના

પ્રત્યાખ્યાન' લેવામાં આવે છે તેનો હુબહુ ચિતાર આ ગ્રંથમાં પ્રકાશિત છે. મુમુક્ષુઓની માંગણીને વશ આ ગ્રંથની ચતુર્થ આવૃત્તિ પ્રકાશિત કરતાં અમો અત્યંત હર્ષ અનુભવીએ છીએ.

આ ગ્રંથની ચતુર્થ આવૃત્તિના પ્રકાશન અર્થે પ્રાપ્ત દાનરાશિનું વિવરણ અન્યત્ર આપેલ છે તે દાતાર મહાનુભાવોના પણ અમે આભારી છીએ.

આ ગ્રંથમાં પ્રસિદ્ધ પ્રવચનોને ઓડીયો ટેપ ઉપરથી શબ્દશઃ ઉતારો કરી આપનાર શ્રી ડોલરભાઈ હેમાણી, કલકત્તા તેમજ અન્ય મુમુક્ષુઓ કે જેમણે સહયોગ આપ્યો છે તેમના અમો આભારી છીએ. તેમજ આ ગ્રંથના સુંદર ટાઈપ સેટીંગ માટે પૂજા ઇમ્પ્રેશન્સ, ભાવનગરનો તથા સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ ભગવતી ઑફ્સેટ, અમદાવાદનો પણ અમો આભાર માનીએ છીએ.

અંતત: આ લઘુકાય ગ્રંથનો વિષય સર્વ મુમુક્ષુઓને ચરિતાર્થ થાય તેવી ભાવના ભાવતા-ભાવતા અત્ર વિરમીએ છીએ.

ભાવનગર

તા. ૧૨-૬-૦૫

(શ્રુત પંચમી)

લિ. ટ્રેસ્ટીગણ

વીતરાગ સત્ત્વસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ

ભાવનગર

'પરિભ્રમણના પ્રત્યાખ્યાન' પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશિ

| | |
|--|---------|
| શ્રીમતી ચંદ્રિકાબહેન શશીકાંતભાઈ શેઠ, ભાવનગર | ૨,૧૦૦/- |
| શ્રીમતી વિમલાદેવી હીરાલાલ જૈન, ભાવનગર | ૨,૧૦૦/- |
| શ્રીમતી લક્ષ્મીબહેન ખીમજભાઈ ગંગર, વિલેપાર્લા | ૧,૦૦૦/- |

પરમ કૃપાળુદેવાય નમઃ

પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો આધ્યાત્મિક જીવન પરિચય

શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સંવત ૧૮૨૪ કાર્તિક પૂર્ણિમા રવિવાર વવાણિયા ગામે (ગુજરાત) થયો હતો. તેઓ બાળવયથી જાતિસ્મરણ તથા અનેક જ્ઞાનના ધણી હતા.

શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેતાઓમાંના એક છે. શ્રીમદ્ રાજચંદ્ર એટલે અધ્યાત્મગાળનમાં જળકી રહેલી અદ્ભૂત જ્ઞાનજ્યોતિ ! માત્ર ભારતની જ નહિ પણ વિશ્વની એક વિરલ વિભૂતિ ! અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના જળહળતા પ્રકાશથી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉદ્ઘોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવની તલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ !

શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તો આપણને અનેક ભળે પણ જેમનું જીવન જ સત્તાસ્ત્રનું પ્રતીક બની રહે એવી વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તો જળહળતા આત્મજ્ઞાનમય ઉજ્જવળ જીવનનો અંતરંગ પ્રકાશ હતો એટલે જ એમને અદ્ભૂત અમૃતવાળીની સહજ સ્કુરણા હતી.

રાખ્યપિતા મહાત્મા ગાંધીજી લખે છે : “મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદ્ મારા ઉપર તી અસર કરી છે. ધણી વાર કહી ને લખી ગયો છું કે મેં ધણાના જીવનમાંથી ધણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિ-શ્રી (શ્રીમદ્ રાજચંદ્ર) ના જીવનમાંથી છે.

પરમ કૃપાળુદેવની વિશેષતાઓને ત્રણ વિભાગમાં જોઈ શકાય, તેમ છે.

યथા :-

૧. તેઓશ્રીની આત્મંતર અધ્યાત્મદશાની વિશેષતાઓ;
૨. તે અધ્યાત્મદશાની સાથે સાથે પ્રવર્તિત ઉત્ત્ય/આદર્શ વ્યવહારપરિણામની વિશેષતાઓ; અને

૩. તીર્થકરદેવનો મૂળમાર્ગ પ્રકાશવાની શરી તરૂપ વિશેષતાઓ.

— આ ગ્રંથ પ્રકારની વિશેષતાઓનો ઉલ્લેખ, તેઓશ્રીના જ વર્તન અને વચનામૃતો દ્વારા, કરવા યોગ્ય છે; અને તે વડે તે પ્રતીત કરવા યોગ્ય છે, ભર્તી ત કરવા યોગ્ય છે.

॥ પરમ નિઃસ્પૃહતા : પરિપૂર્ણ આત્મસ્વરૂપના અવલંબનપૂર્વક સર્વ બાધ્ય પદાર્થો પ્રત્યેની અપેક્ષાબુદ્ધિ વિલય પામે છે; જગતના કોઈ પણ પદાર્થની સ્પૃહા રહેતી નથી. એટલું જ નહિ, સ્વસ્વરૂપદૃષ્ટિની મસ્તીમાં તો ભાવી મોક્ષ-પર્યાયની પણ અપેક્ષા નથી હોતી. તેવા આશયને પ્રકાશાતું તેઓશ્રીનું વચન પત્રાંક-૧૬૫માં છે કે : “એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણાને કાર્ય જરૂર નથી.”

॥ અદ્ભૂત વિદેહીદશા : જ્ઞાનદશાના પ્રારંભથી જ તેઓશ્રીની પરિણામિમાં સ્વરૂપમાં સમાઈ જવાની લય લાગેલી હતી. અને તેઓશ્રીએ બાધ્ય ધર્મ-પ્રભાવનાના પરિણામોને ગૌણ કરી, નિશ્ચયધર્મની પ્રધાનતા કરી, તે સ્પષ્ટ જોવામાં આવે છે. આ સંદર્ભમાં સ્પષ્ટ ઉલ્લેખ પત્રાંક ૧૭૬માં ઉપલબ્ધ છે : “એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે, અને એક બાજુથી અલખ ‘લો’માં સમાઈ જવું અમે રહે છે....અદ્ભૂત દશા નિરંતર રહ્યા કરે છે. અભધુ થયા છીએ;” આ ઉપરાંત તેઓશ્રીએ પત્રાંક-૨૫૫માં સ્વયંની અંતરંગદશા આ શબ્દોથી પ્રકાશી છે : “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ;... સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા

નથી;...હદ્ય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની હચ્છા પ્રમાણો વર્તે છે;...” વગેરે વચનો, તેઓશ્રીની અદ્ભુત વિદેહી દશાને પ્રકાશે છે. વળી તેઓશ્રીના ચિત્તની આત્માકાર સ્થિતિનો ઉલ્લેખ પત્રાંક-૭૮૮માં પણ જેવા મળે છે : “આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદવાને યોગ્ય નથી.....”

□ અપૂર્વ વીતરાગતા : મોક્ષમાર્ગના પ્રારંભમાં જે તેઓશ્રીની સાધનામાં અપૂર્વ વીતરાગતા પ્રગટ થયેલી તેનો ઉલ્લેખ પત્રાંક-૩૧૩માં આ પ્રકારે છે : “કોઈ એવા પ્રકારનો ઉદ્ય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન કયાંય વિરામ પામતું નથી,... ચિત્તનો પણ જાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે.” આ ઉપરાંત, તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૩૧૭માં આ પ્રમાણો છે : “ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુ તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે... જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ.” ...વગેરે.

□ અલૌકિક સ્વરૂપ-જાગૃતિ : ગૃહસ્થદશા અને અનેક પ્રકારના વ્યાવસાયિક પ્રસંગોની વચ્ચે પણ તેઓશ્રીની અલૌકિક સ્વરૂપ-જાગૃતિ સ્પષ્ટ ઉપસી આવે છે. તે જાગૃતિને વશ સ્વયંના સૂક્ષ્મ પરિણામોનું અવલોકન થઈ, તે વિષય તેઓશ્રીએ અનેક પત્રોમાં અસાધારણપણે વ્યક્ત કર્યો છે. તેવી જાગૃતિનો ઉલ્લેખ, આરાધક પુરુષોના પુરુણાર્થને સ્મરણમાં લઈ, તેઓશ્રીએ પત્રાંક-૭૮૮માં આ પ્રમાણો કર્યો છે : “અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદ્ય વર્ત્યા છતાં જે પુરુષો તે ઉદ્યથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વર્ધમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષોના ભીષ્મપ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ.”

□ અદ્ય પુરુષાર્થ : કૃપાળુદેવના જીવનની-પરિણમનની આ કોઈ અસાધારણ વિલક્ષણતા હતી જે તેઓશ્રીના પ્રબળ પુરુષાર્થને પ્રકાશે છે. તેઓશ્રીએ લગભગ દશ વર્ષના સાધકજીવનમાં જ અદ્ય પુરુષાર્થ વડે સંસારને માત્ર એક ભવ પૂરતો સંક્ષેપ કરી નિર્વાણ-પદની સમીપતા સંપ્રાપ્ત કરી. જેનો ઉલ્લેખ, તેઓશ્રીએ પોતાની આભ્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧/૩૮માં આ શબ્દોથી કર્યો છે : “વૈશ્વવેષે અને નિર્ગ્રથભાવે વસ્તાં કોટી કોટી વિચાર થયા કરે છે... નિર્ગ્રથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિર્ગ્રથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે... તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રથતા યથાર્થ રહે નહીં, અને ઉદ્યરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી... તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષીણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણાતિ વર્ત છે. તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત (-આત્મપુરુષાર્થ) વિશ્રાંતિ પામે એમ જ્ઞાતું નથી...”

તેઓશ્રીનો પુરુષાર્થ તો વર્તમાન ભવમાં જ પૂર્ણ દશા પ્રાપ્ત કરવાનો હતો; અને તે અંગેનો પુરુષાર્થ પણ તેમને ઉપાડ્યો હતો. જેનો ઉલ્લેખ તેઓશ્રીના અંતિમ વચનામૃત પત્રાંક-૮૫૧માં જોવા મળે છે : “ધારી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો (પૂર્વકર્મનો) રહ્યો હતો તે આત્મવીર્ય કરી (- તીવ્ર પુરુષાર્થ કરી) જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રવટના (યોજના) કરતાં પગે નિકાયિત ઉદ્યમાન થાક ગ્રહણ કર્યો. જે (વસ્તુ)-સ્વરૂપ છે તે અન્યથા થતું નથી.” આ અને આવા અનેક તીવ્ર પુરુષાર્થ-ઘોતક ભાવોનાં દર્શન તેઓશ્રીના વચનામૃતોમાં થાય છે. અને તેઓશ્રીનો કરડો પુરુષાર્થ જોઈ સહજ જ મસ્તક નમી જાય છે.

□ સભ્યકુ ઔદાસીન્ય વૃત્તિ : જ્ઞાનદશાની સાથે અવિનાભાવીપણે પજ્તો વૈરાગ્ય તેઓશ્રીની આરાધકદશાની પૂર્વ જ અને ત્યાર પછી પણ

પ્રબળ હતો. તેના દર્શન તેઓશ્રીના અનેક પત્રોમાં થાય છે. તેઓશ્રી પત્રાંક-૪૧૪માં લખે છે કે : “ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદ્યમાં વર્તત્યાં સુધીમાં ‘સર્વથા’ અયાયકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાનીપુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજાયે છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્થિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે.” પત્રાંક-૫૦૮માં તેઓશ્રી દ્વારા વ્યક્ત ઉદ્ગારો મુમુક્ષુજીવે હૃદયંગમ કરવા યોગ્ય છે : “આ સંસારને વિષે કોઈ પ્રકાર રૂચિયોગ્ય જ્ઞાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે;... વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જ્ઞાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; ...બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણો સ્થિતિ છે.” વળી, તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૨૧૪માં દ્રષ્ટવ્ય છે : “અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો અમને તૃપ્તાવત્ત છે;” કૃપાળુદેવની અંતર ભાવનાના દર્શન પત્રાંક-૨૧૭માં થાય છે – તેઓશ્રી લખે છે કે : “વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં વણું કરીને આત્માને ભેદ રહ્યો નથી,... વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ’ વનમાં જઈએ એમ થઈ આવે છે.”

□ અદીન વૃત્તિ : જ્ઞાનદશામાં નિજ પરમેશ્વર પદનું અવલંબન રહેતું હોવાથી જ્ઞાનીપુરુષને ક્યાંય કોઈ પ્રસંગમાં દીનતા સહજ જ થતી નથી. તેમ જ ઉદ્ય પ્રત્યે ઉપેક્ષા અને અસાવધાની રહેવા છતાં ભવિષ્યની કોઈ ચિંતા થતી નથી. તે જ્ઞાનદશાની વિલક્ષણતા છે; કારણ કે સર્વ અજ્ઞાની જીવોને ભવિષ્યની ચિંતા આડે વર્તમાનમાં આત્મહિતનો પુરુષાર્થ ઉપડતો જ નથી. આ સંદર્ભમાં તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૨૧૭માં આ પ્રમાણે છે

જે મુમુક્ષુજીવે અવધારવા યોગ્ય છે : “ઉદ્યકર્મ ભોગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક કાણાનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી.”

□ સમદર્શિતા : તેઓશ્રીના વિચારોમાં પ્રથમથી જ સર્વ આત્માઓ પ્રત્યે સમદૃષ્ટિ રાખવાનો અભિપ્રાય હતો. તેના દર્શન ૧૭માં વર્ષે રચેલાં ‘અમૃત્ય તત્ત્વવિચાર’ કાવ્યમાં થાય છે : “સર્વાત્મમાં સમદૃષ્ટિ ધો આ વચનને હૃદ્યે લખો.” તે ઉપરાંત તેઓશ્રી પત્રાંક-જડદામાં લખે છે કે : “જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે... જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ.” એ વગેરે પ્રકારે આ પત્રમાં તેઓશ્રીના સમદર્શિત ગુણને વ્યક્ત કરતા અનેક પાસાઓ પ્રકાશિત થયા છે. જે જૈનદર્શનની વિશાળતાને દર્શાવે છે.

□ પ્રશમ દર્શા : તેઓશ્રીની પ્રશમ મુદ્રાના પ્રત્યક્ષ દર્શન જે મુમુક્ષુઓએ કર્યો હશે, તેઓ તો ખરેખર સૌભાગ્યવંત ગણવા જોઈએ. પરંતુ તેઓશ્રીની છવિમાં (જે મહાન્ સદ્ગ્રામયે ઉપલબ્ધ છે તેમાં) પણ આજે તેઓશ્રીની પ્રશમતા અભિવ્ય ત થાય છે. આ પ્રકારની પ્રશમતા જ્ઞાનીપુરુષની બાધાભ્યંતરદશાનું એક પ્રગટ લક્ષણ છે. અને તે પ્રયોગાત્મક રીતે જ્ઞાનદશાનું બોધ કરાવનાર છે. કૃપાળુદેવની પ્રશમદશા તો ખરેખર અભિવંદનીય છે.

□ જિતેન્દ્રિયતા : વર્તમાન કાળના આયુષ્યના ધોરણનો વિચાર કરતાં કુમાર અવસ્થા, યુવાવસ્થાનો પ્રારંભ કાળ અને યુવાવસ્થાની મધ્યમ સ્થિતિમાંથી તેઓશ્રીના જીવનનું અવલોકન કરતાં અસાધારણ જિતેન્દ્રિયપણાનું આપણને દર્શન થાય છે. પંચેન્દ્રિયના વિષયો પ્રત્યે તેઓશ્રીના વિચારો જોતાં ‘અપ્રતિમ વૈરાગ્ય’ તેઓશ્રીના વચનોમાં ઠામઠામ જોવા મળે છે. જીવનના ઉત્તરાર્ધમાં તો તેઓશ્રીએ જાણો કે ભર યુવાનીમાં સર્વસંગપરિત્યાગ કરી આહાર આદિનો સંક્ષેપ પણ કરી નાખ્યો હતો. તેઓશ્રીને કોઈ પણ ઇન્દ્રિયના વિષયોએ આકર્ષા હોય તેવું શોધવાનો જો પ્રયાસ કરવામાં આવે તો પણ તે શોધી શકાય તેમ નથી. ટૂંકમાં તેમ અવશ્ય કહી શકાય છે કે, તેઓ ગૃહસ્થવેષમાં

પણ એક મહા યોગીરાજ હતા.

□ સહજતા : સહજ આત્મસ્વરૂપ સાથે અભેદભાવે વર્તતી જ્ઞાનીપુરુષોની દશામાં સહજતા ઉત્પત્ત થઈ આવે છે, જે જ્ઞાનદશાના અનેક મુખ્ય લક્ષણો માંદેનું એક મુખ્ય લક્ષણ છે. કૃપાળુદેવની દશામાં પણ સહજતા ઠામદામ જોવા મળે છે. તેનો ઉલ્લેખ તેઓશ્રીએ પત્રાંક-૬૧૮માં કર્યો છે : “જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણાતિ રહે છે;” એટલે કે તેવી પરિણાતિમાં સહજતા કરવી પડતી નથી પણ આરાધકદશાને લીધે આવી સહજતા પણ છે.

□ લોકોત્તર સરળતા : તેઓશ્રીની સરળતાનો પ્રકાર તો ખરેખર વંદનીય છે. મુમુક્ષુઓ કરતાં અત્યંત ઉચ્ચ કોટિની જ્ઞાનદશાને સંપ્રાપ્ત હોવા છતાં, તેઓશ્રીએ પોતાના પરિણામોનું નિવેદન (અસ્થિરતાને લીધે અલ્ય દોષયું ત હોય તે પણ) અનેક પત્રોમાં અત્યંત સરળભાવે કર્યું છે. જેને અનુસરીને મુમુક્ષુજીવોએ પણ કૃપાળુદેવના જીવનને સ્વયં બોધસ્વરૂપ જાણીને પોતાના દોષોનું નિવેદન કરવાની સરળતા પ્રાપ્ત કરી હતી. શિષ્ય જો જ્ઞાની સદ્ગુરુ પ્રત્યે પોતાના દોષોનું નિવેદન કરે તો તો તો ઉચ્ચિત જ છે. પરંતુ જ્ઞાની પોતાના દોષેનું નિવેદન કરે તે તો લોકોત્તર સરળતા છે. કૃપાળુદેવનાં વચ્ચનામૃતોમાં આવી અલૌકિક સરળતાના દર્શન ઠામદામ થાય છે.

□ મધ્યસ્થતા : કૃપાળુદેવની મધ્યસ્થતા અસાધારણ હતી. જેને લીધે આજે પણ તેઓશ્રીના અક્ષરદેહરૂપ વચ્ચનામૃતોથી આકર્ષિત થઈને ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાંથી અનેક પાત્ર જીવો સંપ્રદાયબુદ્ધિનો ત્યાગ કરી, મૂળમાર્ગને સ્વીકારતા થયાં છે. જૈન સિવાયના અન્ય મત સંબંધી તેઓશ્રીનો પત્ર વ્યવહાર સમકાલીન પ્રખ્યાત વિદ્વાન શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અને શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી) સાથે થયેલ, તેમાં તેઓશ્રીએ અત્યંત મધ્યસ્થતાપૂર્વક તેઓના પત્રોના પ્રત્યુત્તર આપેલ છે, તે મધ્યસ્થતા કેળવવા અર્થે મુમુક્ષુજીવે વારંવાર અનુપ્રેક્ષણીય છે. આજે અનેકાનેક જૈનેતર લાયક મુમુક્ષોઓને કૃપાળુદેવનાં વચ્ચનામૃત પ્રત્યે જે બહુમાન અને ભર્તી ત સુદૂરે છે તે તેઓશ્રીની મધ્યસ્થતાનો પ્રબળ અને જીવંત પુરાવો છે. તેઓશ્રીનું પંદર વર્ધની ઉંમરે લખાયેલું આ વચ્ચનામૃત (પુષ્પમાળા-૧૫) અત્યંત પ્રસિદ્ધ

છે : “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભર્ત, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” આમ મધ્યસ્થભાવે કોઈ પણ ધર્મની ચર્ચા કરવા છતાં તેઓ અસાધારણ વિચક્ષણતાથી મૂળમાર્ગ (-શ્રી તીર્થકરદેવના માર્ગ)ની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન/સ્થાપન કરવાનું ચૂં યા નથી; અને અનેક જીવોને સન્માર્ગ વાયા છે. જે બદલ તેઓશ્રીના ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓછા પડે છે.

□ ગુણ ગંભીરતા : દુર્લભ અને મહાન જ્ઞાનદશા પ્રાપ્ત હોવા છતાં તેઓશ્રી અપ્રગટ-ગુપ્ત રહેવા છચ્છા હતા કે જેથી બાબ્ય પ્રસિદ્ધ કે જે મોક્ષમાર્ગને સ્યાત્પ્રતિકૂળ છે, તેનાથી બચી શકાય. તેનો નિર્દ્દિષ્પ પત્રાંક-૧૮૮માં મળે છે : “માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે.” તેમ જ પત્રાંક-૧૭૦માં આ વચનો જોવા મળે છે : “આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા છચ્છા થતી નથી.... સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની છચ્છા બાંધી રાખી છે.”

□ પરેચ્છાચારિતા : આત્મપરિણાતિનું અખંડપણું રહેવા અર્થે એટલે કે બાધ ન પામે તે અર્થે તેઓશ્રીએ બાબ્ય પ્રવૃત્તિમાં બહુભાગ બીજાની છચ્છાને અનુસરવાની નીતિ અપનાવી હતી. આ પ્રકારની વિચક્ષણતા તેઓશ્રીના વચનામૃત પત્રાંક-૩૭૬માં જોવા મળે છે : “હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ.” તેમ જ પત્રાંક-૩૧૭માં પણ આ વચનો દ્રષ્ટવ્ય છે : “ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મું તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ.”

□ સમ્યક આચરણા : પરમ કૃપાળુદેવ બાબ્ય સંયોગોની અપેક્ષાએ સામાન્ય મનુષ્યોની જેમ જ સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરતા દેખાવા છતાં, અંતરંગમાં એકદમ અસંગવૃત્તિએ રહી શકતા હતા. કારણ કે તેઓશ્રીને કોઈ સંયોગોમાં સ્વપણું અનુભવાતું ન હતું. (જુઓ પત્રાંક-૩૨૮). તે ઉપરાંત પરાનુક્રંપા અર્થે પણ ઉદ્ય વેદવાનું તેઓશ્રીથી બન્યું છે જેનો ઉલ્લેખ તેઓશ્રીએ

પત્રાંક-૪૦૮માં આ પ્રકારે કર્યો છે : “તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની છચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણો-કારણપણો પ્રવર્તવાની છચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વ કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદ્યાળોગ છે, એમ જાણી વચ્ચિત્ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તે પરાનુક્રાત્પ જણાય છે..” પત્રાંક-૩૭૮માં વ્યાવહારિક પ્રવૃત્તિ સંબંધી તેઓશ્રીના વચનામૃતો લક્ષમાં લેવા યોગ્ય છે : “હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાબ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. વચ્ચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વ નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે. થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થ સેવીએ છીએ.” આવું વ્યાવહારિક કાર્ય કરતા પણ તેઓશ્રીના પરિણામની સ્થિતિ કેવા પ્રકારની વર્તતી હતી, તે પત્રાંક-૩૪૭માં દર્શિત થાય છે : “જાણીએ છીએ કે ઘણા કાળો જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળો પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણો વર્તે છે.... હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દર્દીએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી. પોતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે.” આમ પ્રારબ્ધની નિવૃત્તિઅર્થે તેઓશ્રી ઉદ્યને સમ્યક્ પ્રકારે વેદતા હતા. તેઓશ્રીની એવી સમયકુ આચરણા હતી. તે સંબંધમાં, તેઓશ્રીની આત્મશર્ચ ત બળવાન હોવાથી ઉદ્યકાળે વિશેષ પુરુણાર્થ દ્વારા પૂર્વ કર્મની વિશેષ નિર્જરા અર્થે ઉપાધિ યોગનો ત્યાગ કરવાને બદલે સમ્યક્ પ્રકારે પૂર્વ કર્મનો ભોગવટો તેઓશ્રી કરતા હતા. આ એક રહસ્યભૂત વિષય તેઓશ્રીની અધ્યાત્મદશાનું અવલોકન કરતા સમજાય છે. આ વિષે સ્પષ્ટ ઉલ્લેખ પત્રાંક-૩૭૮માં છે : “હાલ જે ઉપાધિજોગ પ્રાપ્તપણો વર્તે છે, તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે; તથાપિ તે ઉપાધિજોગના વેદવાથી

જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઇચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે, એમ જાણીએ છીએ.” આમ હોવા છતાં, અંતરંગ પારમાર્થિક નિવૃત્ત દશાને બાધ્ય ઉપાધિ વ્યવહારે અનુકૂળ નથી. તેથી તેઓશ્રીને ઉપાધિથી છૂટવાની તીવ્ર વૃત્તિ રહ્યા કરતી હતી. જેનો ઉલ્લેખ તેઓશ્રીએ પત્રાંક-પહુંચમાં કર્યો છે : “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે કયારેય બુદ્ધિ થતી નથી... નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જળીએ છીએ.” એવા પ્રકારે વર્તતી તેઓશ્રીની સમ્યક્ આચરણ નિઃસંદેહ અભિવંદનીય છે, અનુકરણીય છે.

□ ઉપાધિમાં સમાધિ : તેઓશ્રીનું વ્યવહાર-ઉપાધિમાં રહેવું પૂર્વ પ્રારબ્ધયોગે થતું હતું, જે આરાધકદશાથી પ્રતિકૂળ હોવા છતાં, તેઓશ્રી અંતરંગ સમાધિભાવમાં નિરંતર રહેતા હતા. તેનો ઉલ્લેખ તેઓશ્રીના અનેક પત્રોમાં જોવા મળે છે તેનો નમૂનો પત્રાંક-૨૪૭માં આ પ્રમાણે છે : “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે; જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિદિચ્છા (-ભવિતવ્ય) સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ.” અર્થાત્ સમ્યગ્જાનમાં ચારે પડખેથી સર્વ પ્રકારના સંયોગ-વિયોગમાં અસમાધાન ઉત્પત્ત થતું નથી; પરંતુ સહજ સમાધિભાવ રહે છે. જે તેઓશ્રીએ અવારનવાર પત્ર દ્વારા જણાયું છે. પત્રાંક-૪૦૮ અને ૭૧૦ના વચ્ચનામૃતો, (ઉદ્ય-પ્રવત્તિમાં જેદ છતાં સમ્યક્ પ્રકારે સમતાભાવે વેદવામાં આવે છે,) તેના ઉદાહરણરૂપે છે.

તેઓશ્રીની આરાધનાની સહવર્તી બીજી અનેકવિધ વિશેષતાઓ પણ ઉલ્લેખનીય છે. અંતર્ આરાધનાની સાથે સાથે તેને અનુરૂપ અને અનુકૂળ એવા બાધ્ય પરિણમનમાં અનેકવિધ પ્રકારે તેઓશ્રીના અનેક ગુણો પણ મુમુક્ષુજીવને અવલોકનમાત્રથી ઉપકારી થાય તેવા છે. જેનું યત્કિંચિત્ વર્ણન આ પ્રમાણે છે :-

□ સતિશય જ્ઞાન-યોગ : પરમ કૃપાળુદેવને ચિન્તમાં કોઈ પણ વાતની સુરૂરણા થતી તેમાં ધ્યાન નયાય ત તે તે વાત ગતી, એટલે કે કોઈ એક વાતના સમર્થનમાં અનેક નયોની સંધિ તેઓશ્રીના જ્ઞાનમાં સુરીત થઈ જતી, તેવો ઉલ્લેખ તેઓશ્રીએ પોતાના શબ્દોમાં પત્રાંક-૨૨ઉમાં કરેલો છે : “લેખનશર્ચ ત શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિન્તમાં ગેલી વાત ધ્યાન નયાય ત હોય છે, અને તે લેખમાં આવી શકતી નથી (-સંભવિત નથી).” તદ્દુરાંત તેઓશ્રીના ઉપયોગની તીક્ષ્ણતા-તીવ્રતા-વિશાળતાનો ઉલ્લેખ પત્રાંક-૮૧૭માં જોવા મળે છે : “એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.”

□ વિવેકદાસ્તિ : પરમ કૃપાળુદેવની વિવેકદાસ્તિને વિચારતાં, કોઈ પણ વિચારવાન જીવનું મસ્તક નમી પડે તેમ છે. કોઈ પણ લૌકિક કે પારમાર્થિક વ્યવહાર સંબંધિત મુદ્દો ઉપસ્થિત થાય અને તે તેમની સમક્ષ આવે ત્યારે તેઓશ્રીનો ઉપયોગ ચારેય પડાયે ફરી વળતો દેખાય છે. આ વિષયમાં તેઓશ્રીના પત્રોમાં વિભજ કોટિના મુમુક્ષુઓને જે માર્ગદર્શન આપ્યું છે તેનું જો વર્ણન કરવામાં આવે તો આ વિષયક એક પુસ્તક જેટલું કદ થઈ જાય તેમ છે. પરંતુ સંક્ષેપમાં એટલું અવશ્ય કહી શકાય છે કે સમ્યજ્ઞાન સહિત જ્ઞાનનું યથાર્થપણું તેઓશ્રીના અનેક પ્રકારના માર્ગદર્શનમાં પ્રતીત થાય છે, અર્થાત્ તેઓશ્રીની જ્ઞાનદશાની પ્રતીતિ કરાવે છે, અને તે દ્વારા તેઓશ્રી પ્રત્યે ભર્તી ત પજવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે.

□ ગુણ-પ્રમોદ : આ વિષયમાં તેઓશ્રીનું ગુણ-ગ્રાહકપણું અથવા ગુણ પ્રાપ્તિની દાસ્તિ ધણી તીક્ષ્ણ હતી, તેમ સમજાય છે. તેઓશ્રી ચારેય અનુયોગોમાંથી સર્વત્ર આત્મગુણ પ્રગટાવવાનો આશય ખેંચી કાઢતા હતા. એટલું જ નહિ, અન્ય મતમાં જન્મેલા માર્ગનુસારી મહાત્માઓના વચનો પણ આત્મગુણ પ્રગટવામાં કેવી રીતે પ્રેરક છે, તેવો આશય ખેંચીને વ્ય ત કરવામાં તેઓશ્રીના વચનો વર્તમાન સાહિત્યમાં કદાચ બેજોડ છે. તે ઉપરાંત તેઓશ્રી કોઈ પણ વ્ય તના દોષોને ગૌણ કરીને, તેના ગુણના અલ્ય અંશને પણ મુખ્ય કરતા. જેના સંદર્ભમાં તેઓશ્રીની એક પર્દી ત અત્ર ઉદ્ધરણ કરવા યોગ્ય છે : “ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ.” જેનદર્શનનાં

અનુયોગના સંદર્ભમાં પ્રવાહિત થયેલું આ પદ ગુણ-પ્રમોદની ફળશ્રુતિને અંતર્મુખતામાં અભિવ્ય ત કરતું પ્રવાહિત થયું છે. જે આપણને તેઓશ્રીની ગુણ-પ્રમોદતાના દર્શન કરાવે છે.

□ વાત્સલ્ય અને પ્રભાવના : પોતાની આત્મદશા વડે જેમણે ‘નિશ્ચયપ્રભાવના’ પ્રગટ કરી છે, તેવા ધર્મત્વાઓની એવી નીતિ હોય છે કે ‘વ્યવહારપ્રભાવના’ પ્રસંગે જે જીવ તેઓની સમીપમાં-સાનિધ્યમાં આવે છે તેનું રિસ્થિતિકરણ તેઓ અત્યંત વિચક્ષણતાપૂર્વક કરે છે, અને વાત્સલ્ય કરે છે. આ વ્યવહારપ્રભાવનાના મુખ્ય અંગો છે. મહાન् જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને તેઓશ્રીની સમીપમાં આવનારા મુમુક્ષુજીવો વચ્ચેનાં પત્ર વ્યવહારને જો આ દૃષ્ટિકોણથી ગવેખવામાં આવે તો આ વિષયમાં તેઓશ્રીની અસાધારણ વિચક્ષણતા અને પ્રજ્ઞાના દર્શન થાય છે. ગમે તે અન્ય મત-પંથમાંથી આવનાર સામા જીવને તેઓશ્રી પ્રથમ ભો રાખી, મૂઢુ ભાષાથી આવકાર આપે છે તથા વાત્સલ્યતા, મધ્યસ્થતા અને સરળતાપૂર્વક તેની સાથે યથોચિત વ્યવહાર / વર્તન / ઉપચાર / માર્ગદર્શન કરે છે કે જેથી આવનાર મુમુક્ષુ, જ્ઞાનીથી કદાપિ દૂર ન થઈ જાય. તેમાં પણ શ્રી સૌભાગ્યભાઈ જેવા અનેક મુમુક્ષુઓને તો જાણે કે સંસારસમુદ્રમાંથી હાથ જાલીને બહાર કાઢતા હોય-બચાવી લેતા હોય – તેવી પરિસ્થિતિ સ્પષ્ટ માલૂમ પડે છે.

□ નિષ્કારણ કારુણ્યવૃત્તિ : જ્ઞાનદશાને અનુરૂપ ઉત્તર અનેક વિશેષતાઓ સિવાય, તેઓશ્રીની અન્ય મુમુક્ષુજીવો પ્રત્યે નિષ્કારણ અભિનભાવે કારુણ્યવૃત્તિ પણ અસાધારણ હતી. આ વિષયમાં તેઓશ્રીના વચ્ચેનો પત્રાંક-૧૮૮માં દૃષ્ટય છે : “અમારી વૃત્તિ જે કરવા છય્યે છે, તે નિષ્કારણ પરમાર્થ છે.” તેમજ તેઓશ્રી પત્રાંક-૨૮૮માં જણાવે છે કે : “આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકૂળા હદ્યને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પુરુષનું ઓળખાડા થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સાચુવન થાય અને કોઈ પણ જીવોને – ઘણા જીવોને – પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકૂળા અખંડપણે રહ્યા કરે છે;” તેમ જ તેઓશ્રી પત્રાંક-૫૨૭માં પણ જણાવે છે કે : “અનેક

જીવોની અજ્ઞાનદ્શા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે છચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે.”

□ અલૌકિક વિનમ્રતા : કૃપાળુદેવના જીવનમાં જે પ્રકારની વિનમ્રતા જોવા મળે છે તેવું બીજું દ્યાંત કયાંય પણ જોવા મળતું નથી. તેવી અજોડ વિનમ્રતાના દર્શન તેઓશ્રીના વચનામૃતોમાં અનેક પ્રકારે થાય છે. તેઓશ્રી પત્રાંક-૨૧૦માં લખે છે કે : “અમારા ઉપર તમારી ગમે તેવી ભ્રિ ત હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણો કાળને માટે દાસ જ છીએ.” કૃપાળુદેવના ચિત્તની અધ્યાત્મમય દર્શાને લીધે, મુમુક્ષુજીવોને પ્રત્યુત્તર મોડા લખવા અથવા પ્રત્યુત્તર નહિ લખી શકવા બદલ તેઓશ્રીએ અનેક પત્રોમાં ક્ષમા માંગી છે. જોકે તેમ થવાનું કારણ તેઓશ્રીની મહાન્ન અધ્યાત્મપરિણાતિ છે; તેથી તેઓશ્રી ક્ષમા માગવાને યોગ્ય નથી. તેમ છતાં પણ, તેઓશ્રીએ અનેકવાર તેમ થવા માટે મુમુક્ષુજીવોની ક્ષમા માંગી છે. તે પ્રકાર તેઓશ્રીની આલૌકિક/અસાધારણ વિનમ્રતાને પ્રકાશિત કરે છે. તે સિવાય પત્રાંક-૫૨૩ તેઓશ્રીના અંતરંગને પ્રદર્શિત કરે છે : “બાબ્ય માહાત્મ્યની છચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાબ્ય માહાત્મ્ય ઘણું કરી છચ્છતી જણાતી નથી.” તેઓશ્રીની સ્મૃતિ અસાધારણ હોવાને લીધે શતાવ્ધાન આદિ પ્રયોગ દ્વારા તેઓશ્રીની ઘ્યાતિ વધેલી, તેમ છતાં, ૨૩મે વર્ષ લખેલી ‘સમુચ્ચયવયચર્યા’માં તેઓશ્રીના નમ્રતા સૂચક વચનો આ મુજબ છે : “સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ઘ્યાતિ ભોગવે છે, તેટલી ઘ્યાતિ ભોગવવાથી તે કંઈ અપરાધી થઈ છે.” તે ઉપરાંત પત્રાંક-૭૦૮માં તેઓશ્રીના નિજાવલોકનપૂર્વકના વચનો આ પ્રમાણે છે : “ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહથી પણ વખતે આવી વૃત્તિ (ધર્મ સ્થાપવાની) રહે, પણ આત્માને ઘણીવાર તાવી જોતાં તે સંભવ હવેની દર્શામાં ઓછો જ દેખાય છે.” આ વચનામૃત એમ સૂચવે છે કે તેઓશ્રીએ અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક માન કષાય ઉપર વિજય મેળવ્યો હતો. જે મુમુક્ષુજીવે

અનુસરણ થવા અર્થે ઉપકારી છે અને ખરેખર ભૂ ત કરવા યોગ્ય છે.

□ નિર્ગંધતાની ભાવના : તેઓશ્રીના પરિણમનનું નાંદનીય પાસું એક એ પણ છે કે તેઓશ્રીને પૂર્જતાના ધ્યયને લીધે યથાર્થ પુરુષાર્થની ઉગ્રતા વર્તતી હતી અને તે કારણથી તેઓશ્રીને યુવાનવયમાં જ સર્વસંગપરિત્યાગ કરી બાચ્યાભ્યંતર નિર્ગંધ થવાની ઉત્કટ ભાવના વર્તતી હતી. આ વિષયમાં તેઓશ્રીએ સ્વયંની અંતર્ભાવનાને હાથનોંધ-૧(૪૫)માં વ્ય ત કરી છે : “હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર !... ષભાદ્રિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યુ છે.” વળી તેઓશ્રીનાં હદ્યમાં રહેલી આ ભાવના પત્રાંક-૪૫૭માં પણ આ શબ્દોમાં સ્કુરિત થઈ છે : “મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિયોગ મટી બાચ્યાભ્યંતર નિર્ગંધતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂજાતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી.” એ જ પ્રકારની ભાવના તેઓશ્રીએ પત્રાંક-૫૬૦માં દર્શાવી છે : “...તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદ્ય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેધો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂજયાં કર્યુ છે.” આ ઉપરાંત તેઓશ્રીની બાચ્યાભ્યંતર નિર્ગંધતાની ભાવનાને અભિવ્યક્ત કરતું “અપૂર્વ અવસર” કાબ્ય તો જગ પ્રસિદ્ધ છે જ. ધન્ય છે તેઓશ્રીની આરાધના !

□ કથન-અવિરુદ્ધતા : જેમનાં અતીનિદ્રય પ્રત્યક્ષ જ્ઞાનમાં નિજાત્મસ્વરૂપ અનુભવ ગોચર થયું હોય, તેવા કોઈ પણ જ્ઞાનીપુરુષનાં વચ્ચનમાં પૂર્વાપર વચ્ચન-વિરુદ્ધતા કયાંય પણ હોતી જ નથી. તે ખાસ લક્ષમાં રાખવા જેવું છે. આત્મપદાર્થમાં કેટલાક પરસ્પર વિરુદ્ધ ધર્મો છે, અને તે એક જ પદાર્થ-સત્તામાં રહેલાં હોવાથી તેની અવિરોધપણે અભિવ્યક્ત, સ્વાનુભવ-વિભૂષિત પુરુષનાં જ વચ્ચનોમાં આવી શકે તેમ છે. બીજાં જીવોને કે જેમને સ્વાનુભવ નથી પરંતુ શાસ્ત્રનું પઢન-પાઠન છે તેવા જીવોને પદાર્થદર્શન નહિ હોવાને લીધે – પૂર્વાપર વિરોધપણું આવ્યા વિના રહેતું નથી. જ્ઞાનીપુરુષનાં વચ્ચનોનું પૂર્વાપર અવિરોધપણું તે ખાસ પ્રકારનું - વિલક્ષણ સ્વરૂપ છે; અને તે જેને સમજાય/ઓળખાય છે, તેને તો તે જ્ઞાની પ્રત્યે

अत्यंत अહोभाव सहज સ્ફुરે છે. એવી કथन-અવिरुદ્ધતा પરમ કૃપાળુદેવનાં વચનોમાં રહેલી છે.

॥ વિધિ-દર્શકતા : બાર અંગના સારભૂત સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષય અંતર્મૂખ થઈને સ્વસ્વરૂપ પ્રાપ્તિની વિધિ/કાર્યપદ્ધતિનો છે, અને તે સ્વાનુભવી જ્ઞાનીપુરુષની વાણી સિવાય ક્યાંય પણ પ્રાપ્ત થવો સંભવિત નથી. સ્વરૂપ-પ્રાપ્તિની વિધિની સૂક્ષ્મતા અને અંતર્દ્ર ધ્વનિની અભિવ્યક્તિ ત એક માત્ર જ્ઞાનીપુરુષની વાણીમાં જ હોય છે, તેવી વસ્તુસ્થિતિ છે. કૃપાળુદેવે આ વિષયમાં (જ્ઞાનીપુરુષની વાણી વિષેના) કેટલાક લક્ષણો પત્રાંક-૬૭૮માં પ્રસિદ્ધ કર્યા છે : તેમાં આત્મભાન કરવાનો આશય, પદાર્થદર્શનને લીધે વિરુદ્ધ સ્વભાવોનું પણ અવિરુદ્ધ નિરૂપણ, આત્માર્થ ઉપદેશકપણું, અપૂર્વ સ્વભાવના અપૂર્વ અર્થનું નિરૂપણ, આત્મજાગૃતિને લીધે સતત જાગૃત કરનાર, શુષ્કતા રહિત અધ્યાત્મ નિરૂપણ, વાસ્તવિક અને યથાસ્થિત પદાર્થ-નિરૂપણ વગેરે લક્ષણો કૃપાળુદેવે પોતાના સ્વાનુભવમાંથી દર્શાવ્યા છે અને તેથી વર્તમાન નિકૃષ્ટ કાળમાં પણ અખંડ મોક્ષમાર્ગ જીવંત રહેવા પામ્યો છે.

॥ ધર્મ-પ્રવૃત્તિમાં વિચક્ષણાતા : શ્રી તીર્થકરદેવનો માર્ગ પ્રકાશવાની શરીર તનું હોવાપણું એટલે કે સામર્થ્ય હોવા છતાં (પત્રાંક-૭૦૮) બીજા જીવોને અંદેશો ઉપજે તેવો બહારમાં પૂર્વ પ્રારબ્ધયોગ હોવાથી તેઓશ્રીએ મૂળમાર્ગનો ઉપદેશ ન કરવો - તેવું અનેક પડખાઓથી વિચારેલું. આ વિષયમાં લખાયેલા પત્રાંક-૫૦૦ અને ૫૮૨ વિશેષ ગવેષણીય છે. પત્રાંક-૬૨૧માં તો લોકોને નુકસાન ન થાય તે દાખિકોણથી પણ કૃપાળુદેવે સમાજની વચ્ચે (- સમજિતગતપણો) ધર્મ-પ્રકાશકપણે પ્રવૃત્તિ કરી નથી; તેવો ઉલ્લેખ તેઓશ્રીના શાખાઓમાં આ પ્રમાણે છે : “આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદ્ય હોવાથી ગુણવ્ય તત્ત્વ હોય તોપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમજ પૂર્વ મહાપુરુષના (નિર્ગ્રથના) અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય.” તેઓશ્રીની આ વિષયમાં અનેક પડખાઓથી ઘણી સૂક્ષ્મ વિચારણા ચાલી હતી તેનો પુરાવો તેઓશ્રીની હાથનોંધ-૧ (૭૩)માં મળે છે : “એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાકરમ

ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તતવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શરીર ત થોડા વખત પૂર્વ અત્ર જણાતી હતી,...” – તથારૂપ શરીર ત પોતામાં હતી, છતાં પણ અનેકવિધ કારણોસર તેઓ ગુપ્ત રહ્યાં હતા. તે માંદેની એક સૂક્ષ્મ વાત, અતિ ગૂઢ વચનોમાં આ જ હાથનોંધ (૧/૭૩)માં જોવા મળે છે : “દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જો જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની (દર્શનની) રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે.”

ઉપરોક્ત પ્રકારે તેઓશ્રીને માર્ગ-પ્રવર્તનની રીતિ-નીતિના વિષયમાં ઘણા સૂક્ષ્મ ને ગણન વિચારો આવ્યાં છે; અને પરસ્પર વિરોધી પડખાઓનો ડો વિચાર ચાલ્યો છે; તેવું તેઓશ્રીના ઉક્ત વચનોથી સમજાય તેમ છે. તે સર્વના નિર્જરૂપે તેઓશ્રીએ સ્વયંની આરાધનાને મુખ્ય કરીને, ગૌણપણે જે જે પાત્ર જીવો જણાયા તેમની વચ્ચે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને, માર્ગ-પ્રવર્તિવવાની પ્રવૃત્તિ યથાર્થપણે અને યોગ્યરીતે કરી છે, તેમ સમજાય છે.

સ્વયંના ઉદ્યભાવ અને ઔદ્યિક સંયોગોની પરિસ્થિતિ જોઈને, શાસન પ્રવર્તવવાના અંતરંગ ગુણો હોવા છતાં, શાસનનાયક અથવા ઉપદેશકના સ્થાને રહીને તેઓશ્રીએ ધર્મ-પ્રવૃત્તિ કરી નથી; તે આ વિષયમાં તેઓશ્રીની ડી વિચારણા અને દીર્ଘદર્શિતા પ્રદર્શિત કરે છે.

“પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ;
જેણે આપું ભાન નિજ, તેને સદા પ્રણામ.”

ગુણ સંકિર્તન
– શ્રદ્ધેય પૂ. ‘માઈશ્રી’ શશીભાઈ

સૌમ્યમૂર્તિ પૂ. ભાઈશ્રી શશીભાઈનો આધ્યાત્મિક જીવન પરિચય

સામાન્યતઃ કોઈપણ સાધારણ મનુષ્યનો ઇતિહાસ કે જીવનચરિત્ર લખાતું નથી પરંતુ જે સ્વયંના પુરુષાર્થથી સ્વયંનો ઇતિહાસ બનાવે છે અર્થાત્ જન્મ-મરણનો છેદ કરીને જીવનમું ત થાય છે, તેનું જીવન ચરિત્ર લખાય છે અને તેની યશગાથા સમસ્ત લોકમાં પ્રસરે છે. એવા જ એક પુરુષાર્થવંત આત્માનું અર્થાત્ ‘પૂ. ભાઈશ્રી’ નું જીવનચરિત્ર અત્ર પ્રસ્તુત છે.

જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં અનેક તીર્થકરો, આચાર્યો તથા જ્ઞાની ભગવંતો થતા આવ્યા છે. આ કારણથી આ ભૂમિ હ મેશા પવિત્ર રહી છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતા અનેક જીવો આ ક્ષેત્રથી સાધના સાધીને મોક્ષમાં પદ્ધાર્યા છે. એવા આ ભારત દેશના સ્ટો ૨૧૭૫-૧૧



જન્મધામ - સુરેન્દ્રનગર (મોસાળ)

સુરેન્દ્રનગર નામના એક નાનકડા ગામમાં, સંવત ૧૯૮૮ના માગશર સુદ આઠમ, તા-૨૪-૧૧-૧૯૮૮ના મંગલ દિવસે પ્રમાણિક સદ્ગૃહસ્થ શ્રી

મનસુખલાલ લઘરચંદ શેઠને ત્યાં આવા જ કોઈ પવિત્ર આત્માનું આગમન થયું. માતુશ્રી રેવાબહેનની કુખ દીપી ઢી. પ્રભાવશાળી પુરુષના પુનિત આગમનથી કોને હર્ષ ન થાય? અર્થાત્ સર્વને હર્ષ થાય.

વાતાવરણ પ્રકૃતિલિત અને અનેરા પ્રકારના આનંદોલલાસથી હર્ષવિભોર થઈ છ્યું છે. ભરત ભૂમિ ફરી એકવાર ગૌરવવંતી બનીને ધન્યતાનો અનુભવ કરી રહી છે. માતા-પિતાના હર્ષનો પાર નથી. બાળકની શાંત અને સૌભ્ય મુખમુદ્રા દેખી તૃપ્તિ થતી નથી. સૌ કોઈ આ આત્માને જોઈને અનેરી શાંતિ અનુભવે છે. અનંત તીર્થકરો જે માર્ગ ચાલ્યા એ માર્ગ ચાલવા આ શૂરવીર આત્માએ આગમન કર્યું છે. અહો! ધન્ય છે આ ભૂમિને! અને ધન્ય છે આ માતા-પિતાને! ફરીથી જન્મ ધારણા ન કરવો પડે એ અર્થે જેણે જન્મ ધારણા કર્યો છે. ચંદ્રની ચાંદની જેમ શીતળતા રેલાવે છે અને ભૂમિને શૈત કરે છે, તેમ ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુળ થઈને જાંઝવાના જણને લેવા દોડતા લેખિત આત્માઓને શીતળતા પ્રાપ્ત કરાવનાર અને દોષોની કાલિમાને ધોઈ પવિત્ર અને શૈત દશા પ્રાપ્ત કરાવનાર આ બાળકનું નામ 'શશીકાંત' રાખવામાં આવ્યું.

(૧) બાળપણ :

મૂળ વાતાના
રાણપુરમાં બાળકુમાર
શશીકાંતની નયનરભ્ય
ચેષ્ટાથી સૌ કોઈ મનોમન
મહલકાઈ રહ્યાં છે. સ્વયંની
નિર્દોષ ચેષ્ટાથી લોકોના
મન હરનાર બાળકુમારનું
જીવન આનંદથી વ્યતીત
થઈ રહ્યું છે. અત્યારથી જ
આ બાળકુમાર નીડર,
પાપભીરુ, ગુણગ્રાહી, સ્વતંત્ર વિચારક તથા આદર્શ વિચારધારા ધરાવે છે.



રાણપુરનું ઘર જ્યાં બાળપણ વ્યતીત થયું

પ્રથમથી જ અસાધારણ બુદ્ધિમત્તાને કારણો શાળામાં પ્રાય: પ્રથમ અથવા દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ૮-૧૦ વર્ષની વધે તેમના દાદાજી દારા તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. વૈશ્વ કુટુંબમાં જન્મ થયો હોવાને કારણો રામાયણ, ગીતા, મહાભારત, ભાગવત વગેરે ગ્રંથો વાંચે છે. પાણીના પુરની જેમ ચાલી રહેલી સ્મરણ શર્ત તના કારણો જોતજોતામાં શ્રીમદ્ ભાગવત ગીતાના બે-ત્રણ અધ્યાયોના સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી લીધાં છે. બાળકુમાર પ્રત્યેક કાર્ય ચુસ્તતાથી તથા દઢ મનોબળથી કરે છે. આ તો અલૌકિક આત્મા, આત્માની સાધના સાધનારા છે તે સાધારણ બાળકોની કોટિમાં કઈ રીતે આવી શકે ? બાળકુમારની ચુસ્તતા તથા દઢ મનોબળના દર્શન આપણો નિભલિભિત પ્રસંગ ઉપરથી જોઈએ.

ઉનાળાના દિવસો છે, કાળજાળ ગરમી રેલાવતો સૂર્ય આકાશમાં તપી રહ્યો છે. આવા અતિથિય પ્રખર તાપમાં નિશાળમાં આર. એસ. એસ. પરેડ ચાલી રહી છે. પરેડ દરમ્યાન અત્યંત તૃપ્તાને કારણો કંઠ સુકાઈ રહ્યો છે છતાં નિયમોનું પાલન ચુસ્તપણો કરવાનું હોવાથી બાળકુમાર કંઈપણ બોલતા નથી. એકબાજુ ધોમધખતો તાપ, બીજુ બાજુ કડકપણો ચાલી રહેલી પરેડ, સુકાઈ ગયેલો કંઠ જાણો કે પાણીના બિંદુ માટે પોકાર કરી રહ્યો છે, તેવામાં પરેડ પુરી થવાની જ્યાં તૈયારી થાય છે ત્યાં બાળકુમાર ચક્કર ખાઈને નીચે પડી જાય છે. જુઓ !

કુમાર શશીકાંતની સવતંગ
વિચારધારા તથા અનુભવ પ્રધાનતાના
દર્શન પણ અત્ર કરવા યોગ્ય છે. ૧૪
વર્ષની ઉમર છે, યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી
કાનજીસ્વામી જેવા મહાપ્રતાપી સત્પુરુષ
રાણપુરમાં પધાર્યા છે. કુમાર શશીકાંતને
આત્મકલ્યાણકારી મંગળ પ્રવચનો
સાંભળવાની ઉત્કંઠા થાય છે અને પ્રવચન



બાળકુમાર શશીકાંત (ઉમર વર્ષ
૧૪)

સાંભળવા જાય છે. પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી ફરમાવી રહ્યાં છે, ‘જુઓ ! આત્મામાં જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે. આ જ્ઞાન વાણીથી ઉત્પન્ન થતું નથી કે ગુરુથી પણ ઉત્પન્ન થતું નથી. આપમેળે જ ઉત્પન્ન થયા કરે છો’. આ વાત સાંભળતી વખતે ‘જુઓ’ શબ્દનો પ્રયોગ થયો હોવાથી, કુમાર શશીકાંત અંદર જુએ છે અને તેને પણ એમ લાગો છે કે ‘ખરેખર, મારું જ્ઞાન પણ સ્વયં સહજ ઉત્પન્ન થઈ રહ્યું છે’. જુઓ ! પૂર્વ સંસ્કારને કારણે અનુભવ પદ્ધતિ કેવી રીતે જાગૃત થાય છે ! આવા-આવા અનેક સદ્ગુણો ધરાવનાર કુમાર યૌવન અવસ્થામાં પ્રવેશ કરે છે.

(૨) યુવાવસ્થા :

અસાધારણ બુદ્ધિમત્તાને કારણે ખૂબ-ખૂબ ભજાવાના વિચારો આવે છે અને એફ. આર. સી. એસ. (લંડન) ડૉ ટર થવાની બળવાન મહાત્માકંશા સેવાય છે. પરંતુ પ્રારથ્ય કંઈક જુદુ જ હોવાને કારણે અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાને કારણે યુવાવયમાં પ્રવેશ થતાં મેટ્રીકનો અભ્યાસ પૂર્ણ કરી પિતાજીના વ્યવસાયમાં જોડાવું પડે છે. તેની કાર્યકુશળતા, બુદ્ધિમત્તા અને પ્રમાણિકતા જોઈને તેમના એક સ્નેહીએ મુંબઈ જેવા મોટા કોત્રમાં જવાની પ્રેરણા આપી અને મુંબઈમાં એક મોટા કમીશન એજન્ટને ત્યાં નોકરીએ રહી જાય છે.


આ અરસામાં મુંબઈમાં નોકરી દરમ્યાન વિરમગામના શ્રી દોશી કીરચંદ લક્ષ્મીચંદના પુત્રી, ચંદ્રાવતી સાથે સગપણ થયું. આ દિવસોમાં જ પાંડુરંગ શાસ્ત્રીજીને સાંભળવાનો પ્રસંગ પણ થાય છે અને તત્ત્વજ્ઞાન સંબંધીનો રસ જાગૃત થયો. મહાત્મા નિશ્ચલદાસજી કૃત શ્રી વિચારસાગર ગ્રંથ વાંચવાનું બન્યું. આ વાંચનથી તત્ત્વવિચાર તથા મંથન તીવ્રતાથી ચાલવા લાગ્યું. આવી અંતરંગ પરિસ્થિતિમાં સમ્યકુજ્ઞાનને અનુસરતો એક દૃષ્ટિકોણ સાધ્ય કરવાનો અભિપ્રાય થાય છે કે ‘કોઈપણ પ્રસંગે મારી તે પરિસ્થિતિ અંગેનો નિર્ણય યથાર્થ પ્રકારે લેવાય તેવો દૃષ્ટિકોણ મારે પ્રાપ્ત કરવો જોઈએ’ આ વિષય ઉપર નિરંતર ચિંતન તથા મંથન ચાલ્યા કરે છે.

પ્રથમથી જ આદર્શની મુખ્યતારૂપ વિચારધારા, તત્ત્વજ્ઞાનનો રસ,

કુળધર્મનો અપક્ષપાત, મધ્યસ્થતા, સાંપ્રદાયિક ધર્મ પ્રત્યેના આકર્ષણનો તથા અંધશ્રેષ્ઠાના અભાવરૂપ સદગુણો સાથે જૈન દર્શન પરતે યા પ્રકારે આકર્ષણ થયું તે પણ અત્ર દૃષ્ટવ્ય છે.

એક વખત મુંબઈમાં પેઢી ઉપર બેઠા છે, તેવામાં સાથે કામ કરવાવાળા એક સદગુહસ્થ આવી, હાથ જોડીને ક્ષમા માગે છે. ત્યારે આશર્ય સાથે ક્ષમા માંગવાનું કારણ પુછે છે અને ત્યારે જાણવા મળે છે કે જૈન ધર્મમાં આ પ્રકારે આખા વર્ષ દરમ્યાન જો કોઈપણ પ્રકારે એક-બીજા પ્રત્યે દોષ થયો હોય તો તેની ક્ષમા માંગવામાં આવે છે. આનંદાશર્ય સાથે જૈનદર્શન પ્રત્યે અહોભાવ જાગે છે

અને આકર્ષણ થાય છે અને રાણપુરના બાળપણનો દિવસ યાદ આવે છે; ત્યાં પણ જૈન ધર્મના ઘરમાં કેવા પ્રકારની રીતિ-નીતિ હોય છે તે તાદૃશ્ય થાય છે. અગાઉ રાણપુરમાં એક દિવસ એક જૈન ધર્મના ઘરમાં જવાનો પ્રસંગ ભો થયો હતો. ત્યાં છાણા ભેગા કરેલા હતા તેમાંથી રસોઈના કામ અર્થે છાણા કાઢવામાં આવે છે અને તાપકાંમાં મુક્તા પહેલા ખંખેરીને જુઓ છે કે કોઈ જીવાત આદિ તો નથી ? આ જોઈને એમ થયું હતું કે જૈન દર્શનમાં નાનામાં નાના જીવની હિંસા ન થાય તેની પણ કેટલી કાળજી રાખવામાં આવે છે !! અહો ! પુત્રના લક્ષણ પારણાંમાંથી એ કહેવત અનુસાર જેમના થકી સમસ્ત જિનશાસનની પ્રભાવના થવાની છે એવા આ પવિત્ર આત્માને ગુણ પ્રત્યે પ્રમોદ આવે છે. આમ જૈનદર્શન અને કુળધર્મને તુલનાત્મક દર્શિકોણથી જોવાનું સહજ બને છે. મુંબઈમાં અતિશય કામકાજનું દબાણ તથા સખત પરિશ્રમના કારણો સ્વાસ્થ્ય કથળે છે અને મુંબઈ છોડી દઈ ભાવનગર આવે છે અને ભાવનગરમાં એક



ઉત્તર વર્ષ - ૧૯

સબંધીની પેઢીમાં નોકરીએ રહી જાય છે.

પરંતુ ભાવનગરમાં તત્ત્વજ્ઞાનના રસને પોષણ નહીં મળતું હોવાને કારણો તેની ક્ષતિ લાગ્યા કરે છે. કોઈ સત્તસંગ નથી મળતો, કોઈ તત્ત્વજ્ઞાનની વાત કરવાવાળું પણ નથી દેખાતું તે કારણો મન ઉદાસ રહ્યા કરે છે. પરંતુ જેણો આત્મા ખરેખર આ પરિભ્રમણથી છૂટી જવાનો છે તેનાથી સત્ય કેટલા દિવસ દૂર રહી શકે ? શું ભાવના સાથે કુદરત બંધાયેલી નથી ? અવશ્ય બંધાયેલી છે.

(3) દિશાબોધ :

સત્તસંગનો અભાવ, સ્વયંના તત્ત્વજ્ઞાનના રસને નહીં મળતું પોષણ, સત્યની શોધ અને સુખથી વંચિત અંતરંગ અતૃપ્ત પરિણાતિ, આવી અંતરંગ પરિસ્થિતિ વચ્ચે, વિધિની કોઈ ધન્ય પળ આવે છે. એક દિવસ પેઢી ઉપર બેસીને કામ કરી રહ્યાં છે. ત્યાં બાજુમાં પડેલા એક ગ્રંથ ઉપર નજર જાય છે અને ગ્રંથનું નામ વાંચે છે - 'શ્રીમદ્ રાજચંદ્ર'. જૈન દર્શનમાં પ્રવેશ થવાનું પહેલું નિમિત્ત કારણ બની ગણ્યું. મું ત થવાની દિશાના મંડાણનો પ્રથમ મંગલ પ્રસંગ બન્યો. જિજ્ઞાસા સાથે ગ્રંથના પાના ફેરવી જોતાં લાગ્યું કે કોઈ તત્ત્વજ્ઞાન વિધયક ગ્રંથ છે. ગ્રંથનો વિશેષ અભ્યાસ કરતાં લાભનાર એવા કુ. દેવ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતોથી પોતે પ્રભાવિત થાય છે. તેમની મધ્યસ્થતા જોઈને હદ્ય પ્રકુલ્પિત થઈ ઉઠ્યું. તત્ત્વજ્ઞાનના રસને પોષણ મળ્યું, અંતરંગ અતૃપ્ત પરિણાતિને જાણો કે વિશ્રાંતિનું સ્થાન મળ્યું !!

આ ગ્રંથ વાંચતા એવી પ્રતીતિ થાય છે કે જૈન દર્શનમાં જીવ અને જડ પરમાણુનું વિજ્ઞાન છે અને બસ્તે પદાર્થોમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધે જે અસર ઉત્પત્ત થાય છે તેનાથી જીવમાં સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી જાય તો હંમેશાને માટે બહુ મોટુ કામ થઈ જાય. આ અપેક્ષાથી જૈન દર્શનમાં ડા ઉત્તરવાનો અત્યંત રસ ઉત્પત્ત થયો. ગુણ-દોષની ચર્ચા, પદાર્થની વૈજ્ઞાનિક દસ્તિકોણથી નાય, પ્રમાણાની પદ્ધતિથી સુવ્યવસ્થિત પ્રતિપાદન કરવાની પદ્ધતિ જોઈને જૈન દર્શનની


સર્વोત્કૃષ્ટતા હદ્યમાં અંકિત થઈ ગઈ. અનંત કાળથી ચાલી રહેલા જન્મ-મરણ અને તે દરમ્યાન થતાં દુઃખ અને લેશથી ધૂટવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે, આ વાત ઉપર ધ્યાન જાય છે. આ કારણથી ગમે તેમ કરીને કોઈપણ આત્મજ્ઞાનીના સાત્ત્બિધ્યમાં રહીને પોતાના પ્રત્યેક પરિણામોનું નિવેદન કરીને માર્ગદર્શન મેળવવું એવો સૌ પ્રથમ ભંગલ વિચાર ઉદ્ભવે છે. કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સત્તસંગના મહાત્વ અંગેના વિચારો યથાર્થ પ્રકારે સમજાયાથી સત્તસંગ અર્થે તીવ્ર ભાવના રહ્યા કરે છે અને 'જ્યાં ચાહ છે ત્યાં રાહ છે' એ અનુસાર ભાવના ફળે છે અને ભાવનગરમાં એક ધર્મપ્રેમી મુમુક્ષુને ત્યાં સત્તસંગની સુભંગલ શરૂઆત થાય છે.

(૪) નિજ પરમાત્માના વિયોગની વેદના તથા જુરણા :

કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અત્યંત ગહન અવગાહન ચાલે છે અને સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી શકે એમ છે તેમ દેખાતાં હદ્ય પ્રતિદિન આ સમસ્યાને ઉકેલવા માટે તે-તે ઉત્તરવા લાગ્યું. સત્ય સુખ યાં છે ? દુઃખની નિવૃત્તિ કેમ થાય ? સર્વ પ્રકારના દોષથી કર્દ રીતે નિવૃત્ત થવાય ? જન્મ-મરણ શા માટે ?

જન્મ-મરણનો આત્મંતિક વિયોગ યા પ્રકારે થાય ? આવા-આવા અનેક પ્રકારના પ્રશ્નો માનસપટ પર છિવાયેલા રહે છે. આવી અંતરંગ પરિસ્થિતિ વચ્ચે સત્તસંગની શરૂઆત થઈ અને રોજ પરોછિયે ચાર વાગે સત્તસંગ અર્થે જવાનું શરૂ થયું. એક બાજુ કૃ. દેવના ગ્રંથનું અધ્યયન અને બીજી બાજુ અંતરંગમાં આવી પરિણામોની સ્થિતિ !

સવારે ૪ વાગે એકાંતનો સમય છે. કડકડતી ઠંડીમાં જ્યાં સમસ્ત વિશ્વ ભાવનિક્રિયા અને દ્રવ્યનિત્રામાં પોઢી રહ્યું છે ત્યાં જન્મ-મરણનો ઉકેલ શોધવા નીકળેલો આ આત્મા ધીર, ગંભીર અને ધીમી



નિજ સ્વરૂપના વિયોગવશ
ઉદાસીનતા

ચાલથી ચાલતાં-ચાલતાં સત્સંગમાં જઈ રહ્યો છે. બાજુના ગામડામાંથી અડધી રાતે રવાના થઈ એક ખેડુત ગાડુ લઈને ઉકરડો (ખાતર) ભેગો કરવા માટે ચાલ્યો આવે છે. આ જોઈને વિચાર આવે છે કે આવી તુચ્છ વસ્તુ માટે પણ આ ખેડુત કેટલી પ્રતિકુળતા અને પરિશ્રમ વેઠે છે તો પછી હું તો જગતનું સર્વોન્કષ્ટ કાર્ય કરવા નિકળ્યો છું; તે માટે આથી વધુ કોઈપણ કિમત ચુકવવી પડે તો તેમાં શું વિશેષતા છે? બસ! પછી તો આવી મંગલ વિચારધારા વચ્ચે આંખમાંથી ચોધાર આંસુની ધારા વહી રહી છે કોઈ રોકવા ચાહે તો રોકી શકાય નહિ એવી હદ્ય દ્રાવક વેદના વચ્ચે અંતરંગ શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલે છે. હદ્યમાંથી તીવ્ર વેદના સહિત ધ્વનિ નીકળી રહ્યો છે,

“હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીપાનાથ દયાળ,
હું તો દોષ અનંતનું, ભાજન છું કર્દાણ
અનંત કાળથી આથડચો, વિના ભાન ભગવાન
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?”

‘નિજ દોષનો અત્યંત પશ્ચાતાપ થયા વિના પવિત્રતાની શરૂઆત થતી નથી’. એ સિદ્ધાંત અનુસાર અનંત કાળથી ચાલ્યા આવતા નિજ દોષનો અત્યંત તીવ્ર પશ્ચાતાપ અને નિજ પરમાત્મ સ્વરૂપના વિયોગની વેદનાથી આ આત્માનું હદ્ય હમેશા રડ્યા કરે છે. સંસારની ઉપાસનાના અભિપ્રાયથી મળિન રહેતું અંતઃકરણ આ વેદનાથી શુદ્ધ થાય છે.

(૫) પૂર્ણતાનું લક્ષ :

ઉપરો ત વેદનાને કારણે ઉત્પત્ત થયેલી ઉદાસીનતાથી યાંય રસ નથી આવતો. જીવન રસવિહીન થઈ ગયું. એકમાત્ર આત્મકલ્યાણ કેમ થાય? બસ! એક જ વાતના પાયા શોધાઈ રહ્યા છે. અંદરમાં અનેક

પ્રકારની લૌકિક મહત્વાકંસ્કાઓ અને બહારમાં નબળી આર્થિક કૌટુંબિક પરિસ્થિતિ વચ્ચે સૌ પ્રથમ ભૌતિક જીવનની સર્વ મહત્વાકંસ્કાઓનો હદ્યમાંથી ત્યાગ કરે છે. એક પળ માટે સામે આવતા ભવિષ્યના વિચારને જોરથી લાત મારી, ફગાવી દઈ શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ કરી લેવાનો દૃઢ નિર્ધાર જન્મ લે છે અને અંતરંગમાં આવા મહાન કાર્યના પુરુષાર્થમાં આ આત્મા પરોવાઈ જાય છે. અહો ! કેવો અદ્ભુત સંવેગ પ્રગટ થયો છે !! જેમ વાદળા જોઈને સૂર્ય પાછો ફરતો નથી અને નદીનું જળ, વચ્ચે પડેલા પત્થરને ભેટી આગળ વધે છે, પાછુ જતુ નથી. તેમ ધસમસતા પ્રગટ થતાં નિર્ધાર સહિતના આ પરિણામોને હવે વિશ્વની કોઈ તાકાત રોકી શકે ખરી ?

જીવન સમક્ષ ફ ત એક જ લક્ષ / ધ્યેય અને સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના કરવા જતાં ભલે અનેક પ્રકારની અજિન પરીક્ષામાંથી પસાર થવું પડે તો પણ આત્મકલ્યાણ કરી જ લેવું છે. એમ વારંવાર આવ્યા કરે છે. અસાધારણ નિશ્ચય શા ત અને પરમાર્થને પ્રતિકૂળ પ્રિયજનોનાં અભિપ્રાય સામે અડગ રહેવાની અને જાણુભવાની તાકાત અંદરથી સ્કુરાયમાન થઈ રહી છે. નાહિંમત નહિ થવાની લોખંડી વજ જેવી હિંમત અને છતાં નિર્દોષ વૃત્તિ સાથે અનાદિ અજ્ઞાન અંધકારને ભેદવા માર્ગની શોધ ચાલી રહી છે. આવા અસાધારણ નિશ્ચય સાથે આગળ વધતો આ આત્મા મૂંજવણથી મૂંજાતો પણ નથી અને પ્રમાદ પણ નથી થવા દેતો. અત્યંત ધીરજ અને ગંભીરતા સાથે માર્ગને ગ્રહણ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.

જુઓ ! કેવા અસાધારણ ગુણો પ્રગટ થયા છે ! મુમુક્ષુતા દૈદીઘ્યમાન થઈને જળકી રહી છે. જેને છૂટવુ જ છે તેને બાંધનાર કોઈ નથી. ! એ સિદ્ધાંત અનુસાર આ આત્માના આવા અદ્ભુત ગુણો જોઈને હદ્ય નભી પડે છે. અનંતકાળમાં જે સત્પાત્રતા પ્રાપ્ત થઈ નહોતી તે સત્પાત્રતા પ્રગટ થઈ. સમ્યદર્શનને રાખવાનું પાત્ર તૈયાર થઈ ગયું !!

(૬) નિજ દોષનું અપક્ષપાતપણો અવલોકન :

‘નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબુલાત છે’. એ

સિદ્ધાંત અનુસાર અડોલ વજ જેવી હિંમત સાથે નિર્દોષ થવા નિકળેલો આ આત્મા સ્વયંના દોષોનું અપક્ષપાતપણે અવલોકન કરે છે અને તે દોષને ટાળવા અર્થે અમલીકરણ પણ કરે છે. કૃ. દેવના ગ્રંથનું ગહન ચિંતન તથા મંથન ચાલી રહ્યું છે. જે તે વાતનો નિશ્ચય કરવા અર્થે પરિણામના અવલોકનપૂર્વક પ્રયોગ પદ્ધતિથી કાર્ય કરવાનું શરૂ થયું. જુઓ ! કેવી આત્મહિતની સૂજ આવી છે ! અંદરથી જ અનુભવપદ્ધતિથી કાર્ય કરવાની આવી સૂજ મોક્ષાર્થીને જ આવી શકે. બહારમાં કૃ. દેવના ગ્રંથ દારા મળતું માર્ગદર્શન અને અંદરમાં પ્રયોગ પદ્ધતિથી અનેક પ્રકારના પૂર્વગ્રહ તથા વિપર્યાસો મોળા પડવા લાગ્યા. આમ સતત અપક્ષપાતપણે


દોષોનું અવલોકન ચાલતાં અંદરમાં જ્ઞાનની નિર્મણતા વધતી ચાલી.

(૭)

સાતપુરુષમાં
પરમેશ્વરબુદ્ધિ :

તારણાહાર કૃ.

દેવના આત્મકલ્યાણના



હેતુભૂત માર્ગદર્શનનું મૂલ્યાંકન અતીશયપણો વધતું ચાલ્યું. ઉપકારી શ્રીગુરુની છભીમાં પરમાત્માના દર્શન થતાં તેમના ભૌતિક દેહની છભીમાં મનુષ્યાકૃતિની આકૃતિ ગૌણ થઈને ભાવાત્મક પરમાત્માના દર્શન થતાં હદ્ય અશ્રુભિનું થઈ ઠે છે. અનંતકાળથી રજણપાટ કરતાં આ આત્માને તારવા અર્થે જ જાણો કે આ ગ્રંથની રચના થઈ હોય તેમ વારંવાર લાગી આવે છે. આમ કૃ. દેવને માત્ર એક સતપુરુષની નજરે નહીં જોતા એક તારણાહાર પરમાત્માની નજરે જોઈ રહે છે. હદ્યમાંથી ધ્વનિ સરી પડે છે અહો ! આ પુરુષ આવા વિષમકાળમાં મારે માટે પરમ શાંતિના ધામરૂપ અને કલ્યવૃક્ષ સમાન છે. અહો ! મારે માટે તો આ બીજા શ્રીરામ અને મહાવીર

છે. આમ કૃ. દેવની ભર્ત તમાં લીન થઈને તેમના લક્ષણોનું ચિંતન ચાલે છે અને તેઓશ્રીની મુખાકૃતિનું હદ્યથી અવલોકન કરે છે. અહો ! જ્ઞાનીઓએ હદ્યમાં રાખેલું અને નિર્વાણને ર્થે માન્ય રાખવા યોગ્ય પરમ રહસ્યને પ્રાપ્ત થાય છે.

એક મરણાથી બચાવે તેના પ્રત્યેનો ઉપકાર પણ વિસ્મૃત થતો નથી તો પણી જે અનંત જન્મ-મરણાથી બચાવે તેના પ્રત્યે શું પરમેશ્વરબુદ્ધિ ન આવે ? અર્થાત્ પરમેશ્વરબુદ્ધિ આવે %. સર્વ શાસ્ત્રોનો અને સર્વ સંતોના હદ્યના મર્મરૂપ બીજની પ્રાપ્તિ થઈ અર્થાત્ પ્રથમ સમકિત પ્રાપ્ત થયું. આવા પ્રકારના પરિણામોથી જ્ઞાનમાં નિર્મળતા આવવા લાગી, આત્મરૂપિ તીવ્ર થતી ગઈ અને અંદરથી આત્માને અનંતકાળમાં નહીં આવેલી તેવી અપૂર્વ જગૃતિ આવી. આ જગૃતિ અપૂર્વ છે એવી ચોક્કસ પ્રકારની પ્રતીતિ આવે છે.

(૮) અંતર ખોજ :

ઉપરો ત પ્રકારના નિર્મળ પરિણામોની સાથે-સાથે આત્મરૂપિ તીવ્ર થતી જાય છે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા વશ ઉત્પન્ન વૈરાગ્ય એક નવા તબક્કામાં પ્રવેશ કરે છે. નિજ પરમાત્મસ્વરૂપની અંતર ખોજમાં આ આત્મા એટલો બધી ખોવાયેલો રહે છે કે બહારના બ્યવહારમાં તથા ખાવા-પીવા છત્યાદિ નિત્યકમમાં ઘ્યાલ પણ રહેતો નથી. વૈરાગ્યને કારણે ઉદાસીનતા એટલી બધી આવી ગઈ છે કે જમતી વખતે શું જમે છે ? તેનો ઘ્યાલ નથી રહેતો. જમવામાં કઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે ? તેનો પણ ઘ્યાલ નથી રહેતો. પહેરવશ અને બીજી રહેણી-કરણીમાં એટલી બધી સાદાઈ આવી ગઈ છે કે ધરના લોકોને એવી દહેશન થાય છે કે આ જૈન ધર્મની દીક્ષા લઈ લેશો કે શું ? અહો ! ધન્ય છે તે ઉદાસીનતાને !

આત્મ સાધના કરવા નીકળેલા આવા આત્માને સંસારમાં શું રૂચે ? જેમ હંસને મોતીના ચારામાં જ રસ હોય છે તેમ આવા સાધક આત્માને નિજ સ્વરૂપ સિવાય બીજે યાંય રસ નથી આવતો. સુખની સહેલી અને અધ્યાત્મની જનેતા જ્યાં છે ત્યાં સત્ય સુખ અને આત્માનુભવ કેટલા દિવસ

દૂર રહી શકે ? અર્થાતું એ તો હવે પ્રગટ થવાના જ છે.

(૯) સ્વરૂપ નિશ્ચય :

અહો ! જેના આધારે અનંત કાળનું સુખ પ્રાપ્ત થવાનું છે, જેના આધારે અનંત કાળથી ચાલી આવતી જન્મ-મરણની શુંખલા તુટવાની છે, જેના આધારે અતૃપત આત્મા પરિતૃપતતાને પામવાનો છે એવા નિજ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસાવશ ઉત્પત્ત વૈરાગ્ય તથા ઉદાસીનતાથી આ આસત્તે ભવ્ય જીવના જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. જ્ઞાનમાં સ્વભાવ તથા વિભાવ જીતિની પરખ કરવાની ક્ષમતા પ્રગટ થઈ છે. સર્વ પ્રકારના વિભાવભાવ આકુળતારૂપ, મહિનતારૂપ અને વિપરીત સ્વરૂપે ભાસે છે. ચાલતા જ્ઞાન સાથે વિભાવભાવની વારંવાર મિંઢવણી ચાલે છે અને આ પ્રકારે મિંઢવણી ચાલતાં જ્ઞાન તદ્દન અનાકુળ, પવિત્ર અને અવિપરીત સ્વભાવે ભાસે છે. આમ અંતર ખોજ સાથે ચાલતા અવલોકનથી જીતિની પરખ આવવી શરૂ થાય છે. ત્યાં તો, કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સાતિશય વચ્ચન યોગને ઉજમાળ કરતો એ ધન્ય દિવસ આવી પહોંચ્યો ! કે જે દિવસે નિજ પરમાત્માનો અંતરંગમાં સ્પષ્ટપણે પત્તો લાગી ગયો. ચાલતા જ્ઞાનના પર્યાપ્તમાં જ્ઞાન સામાન્ય / વેદનના આધારે અખંડ એકરૂપ અનંત જ્ઞાન અને અનંત સુખના સામર્થ્યરૂપ સહજ સ્વરૂપનું ભાવભાસન આવ્યું. લૌકિક સમુદ્રને તો તળિયું હોય છે પરંતુ આ તળિયા વગરના નિજ સુખ સમુદ્રને જોતાં અને અનંત ગુણ રત્નોની નિધિને જોતાં પુરુષાર્થે ઉછાળો ખાધો. નિજ સિદ્ધપદનું સાક્ષાત અસ્તિત્વ ગ્રહણ થવાથી નિજ સ્વરૂપનો અપૂર્વ મહિમા ચાલુ થઈ ગયો અને ગુણ નિધાનની અનન્ય રૂથિનો ઉછાળો સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થપૂર્વક આવવા લાગ્યો. જેના કારણો ઉદ્યભાવમાં જતો ઉપયોગ વારંવાર છાટકી-છાટકીને સ્વરૂપ ભણી આવવા લાગ્યો.

આ પ્રક્રિયા દિન-પ્રતિદિન વેગ પકડે છે. સંવેગ તથા નિર્વદ બને પ્રકારના પરિણામના અપ્રતિમ જોરના કારણો, સ્વરૂપલક્ષના પરિણામપૂર્વક નિજ પરમાત્મપદની ધૂન ચડી ગઈ અને પુરુષાર્થનો વેગ ફાટફાટ થવા લાગ્યો. જાણો કે અંદરથી પુરુષાર્થનો બંબો ન ફાટયો હોય ! અનંત કાળથી

સુખને અર્થે બહારમાં ભટકતા ઉપયોગને વિશ્રાંતિનું સ્થાન મળી ગયું. જન્મ-મરણાની જટીલ સમસ્યાનો ઉકેલ આવી ગયો. પછી તો વિશ્વની એવી કોઈ શરીર નથી કે જે આવા પુરુષાર્થને રોકી શકે કે ઉપયોગને નિજ પરમાત્માથી અન્ય રાખી શકે. નિજ સ્વરૂપથી અન્ય - જુદી નહિ રહી શકવાને કારણો વર્તમાન પર્યાયે સ્વરૂપ સાથે અન્ય થવા અર્થે પુરી શરીર તથી પુરુષાર્થ ઉપાડ્યો.

(૧૦) આત્મ સાક્ષાત્કાર :

આજ અરસામાં શ્રી દીપચંદજી કાસલીવાલ કૃત ‘અનુભવ પ્રકાશ’ ગ્રંથ હાથ આવે છે. તેમના લખાયેલા વચન અનુસાર સ્વરૂપ લક્ષ સહિત ભેદજ્ઞાનનો પ્રયોગ ચાલી રહ્યો છે. ‘અનુભવ પ્રકાશ’ ગ્રંથના ગાણન અભ્યાસપૂર્વકનું રસાસ્વાદન કરી જેમ એક પાણીદાર અશ્વ તેના માલિકના એક જ ઇશારાથી પવનવેગે દોડવા લાગે છે તેમ આ પૂર્વ સંસ્કારી આત્માને અંતરંગ પરિણામનમાં અપ્રતિહતભાવે પુરુષાર્થની ધારા શરૂ થઈ ગઈ છે.

૨૧ વર્ષની ઉમર છે. બહારમાં સાવ સામાચ દેખાવ હોવા છતાં અંદરમાં આ આત્માને નિજ પરમાત્મ પદનો પતો લાગી ગયો છે તે કોઈથી કણી શકતું નથી. ૧૦૦ રૂ. ના પગારની નોકરી કરતા આ આત્માને એમ લાગતું કે હું પરમેશ્વર છું અને ત્રણ લોકનો નાથ છું. અંતરંગ પરિણાતિ પલટી ગઈ. સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થ પૂર્વક ભેદજ્ઞાન ધારાવાઈરૂપે ચાલી રહ્યું છે.

પૂર્વ કર્મ અનુસાર શુભાશુભ ભાવ અને કર્મશાઃ ઉદ્ય પ્રસંગ છે; તે સર્વથી હું જ્ઞાનમયપણે હોવાને લીધે ભિન્ન છું. તેમ સમભાવે - સ્વને જ્ઞાનરૂપે વેદવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. ક્ષણો-ક્ષણો, પ્રસંગો-પ્રસંગો આ પ્રકારનો અભ્યાસ ચાલી રહ્યો છે. જ્ઞાનમાં સ્વ અસ્તિત્વનું ગ્રહણ વેદનથી થતાં ચિદ્રરસ ઉત્પત્ત થાય છે. આ ચિદ્રરસ પરિણાતિમાં સહેજે જઈને ભળે છે. પરિણાતિ ઉપયોગને વારંવાર પોતા તરફ ખેંચી લાવે છે. આ પ્રકારના વારંવારના ભેદજ્ઞાનના અભ્યાસથી નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ઉત્પત્ત થયો અને આત્માના પ્રદેશો-પ્રદેશોથી સ્વસંવેદનજ્ઞાન અને

અપૂર્વ આનંદનો અનુભવ થયો. જન્મ-મરણાની શુંખલા તૂટી ગઈ, પરિણાતિમાં આનંદના પૂર ઉમટ્યા અને અનાદિકાળથી કર્તૃત્વના બોજ નીચે દબાયેલી પરિણાતિ મું તતાનો અનુભવ કરવા લાગી. અનુપમ અમૃત આસ્વાદથી પરિણાતિ તૃપ્ત થઈ.

અહો ! ધન્ય છે આ અજોડ પુરુષાર્થને !

ધન્ય છે આ પવિત્ર સાધનાને !

(૧૧) યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી તથા અન્ય ધર્માત્માઓનો સમાગમ :

સુવર્ણપુરી - સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ઉપદિષ્ટ પ્રવચનોનું સંકલન કરતા માસિક 'આત્મધર્મ' ના ૪-૫ અંકો એક મુમુક્ષુ ભાઈ પાસેથી મળતાં તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો સાંભળવાનો પ્રથમ પ્રસંગ બને છે ત્યારે સાથે રહેલા મુમુક્ષુ દ્વારા તેમની વૈશ્વ તરીકેની ઓળખાણ આપવામાં આવે છે. આ સાંભળી પૂ. ગુરુદેવશ્રી બોલ્યા 'અહીંયા તો અમારે કોઈ જૈન કે વૈશ્વ નથી. અમારી દાખિયાં તો બધા જ આત્માઓ છે' તેઓશ્રીના સમહદ્ધિભર્યા વચ્ચનોથી આકર્ષણ થયું અને ત્યાર પછી તો અવાર-નવાર પૂ. ગુરુદેવશ્રીને સાંભળવાનો પ્રસંગ ચાલુ રહ્યો. પ્રથમ ૪-૫ પ્રવચનો પરિક્ષાદાચિ અને ચિકિત્સાવૃત્તિથી સાંભળીને એવા નિર્ણય પર આવ્યા કે 'આ તો કોહિનુર હીરો છે'. તેઓશ્રીને આત્મજ્ઞાની તરીકે સ્વીકારીને વધુમાં વધુ સત્સંગ મળો એવી ભાવના રહે છે. પૂ. ગુરુદેવશ્રીનો જિનમાર્ગ પ્રભાવનાનો ઉદ્ય જોઈને માર્ગ પ્રભાવના માટે અભિપ્રાયપૂર્વક એવા ભાવ થાય છે કે આ અલૌકિક જગત ડિનકારક માર્ગની પ્રભાવના થતી હોય તો તે



પરમ પ્રેમપૂર્ણ સાત્ત્વિક

પ્રભાવના પેટે પાટા બાંધીને પણ કરવી જોઈએ. જુઓ ! કેવી અદ્ભુત માર્ગ ભી ત પ્રગટ થઈ છે !!

પૂ. ગુરુદેવશ્રી સાથે આત્મીયતા વધી ગઈ છે અને સ્વયંની પરિણાતિના રસનું પોષણ થતું હોવાને કારણે તેઓશ્રીની સાથે અવાર-નવાર એકાંતમાં ચર્ચાનો પ્રસંગ બને છે. બે જ્ઞાની પુરુષોની જ્ઞાનગોષ્ઠી કેવી હશે !! જાહેર પ્રવચનમાં વારંવાર થતું પ્રેમાળ સંબોધન, ખાસ સૂક્ષ્મ વિષય ચાલે ત્યારે એક-બીજાનું સ્મરણ એક અદ્વિતીય પ્રેમને સૂચયે છે. એક પ્રભાવશાળી પુરુષના પ્રેમ સાનિધ્યમાં રહેવાનો સુદીર્ઘ કાલીન યોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળવા જેવું બન્યું.

પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની દિવ્ય વાડીનો પ્રથમ યમતકારિક સ્પર્શ થતાં જ જેમને વિશ્વની ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ એવા પુરુષાર્થમૂર્તિ પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજના સમાગમમાં આવવાનું બને છે. પાંચ વર્ષ સુધી સતત તેઓશ્રીના પરિચયમાં રહે છે તે વખતે તેઓશ્રીની ઉગ્ર અધ્યાત્મ પરિણાતિના નિકટતાથી દર્શન કરે છે. તે જોઈને તેમના પોતાના પરિણામો વિશેષ ભળવાન થાય છે. આ દૃષ્ટિકોણથી તેમનો અસીમ ઉપકાર ભાસે છે. પૂ. સોગાનીજની ચિરવિદાય બાદ તેઓશ્રીના પત્રો અને તત્ત્વચર્ચાનું સંકલન કરી 'દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ' જેવા અધ્યાત્મના ઉચ્ચ કોટિના ગ્રંથનું પ્રકાશન કરે છે. આ રીતે, પૂ. સોગાનીજ જેવા એકાવતારી, અદ્વિતીય મહાપુરુષના અક્ષરદેહ દ્વારા તેમની તીવ્ર જ્ઞાનદશાના મુમુક્ષુ સમાજને દર્શન કરાવી મુમુક્ષુ સમાજ ઉપર ઉપકાર કરે છે.

પૂ. ગુરુદેવશ્રીની સભાના ધર્મશોભારૂપ પૂ. બહેનશ્રીના સાનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પણ સંપ્રાપ્ત થયું. પૂ. બહેનશ્રી પ્રાણે સેવા, ભી ત તથા સમર્પણનો અપૂર્વ લાભ પણ તેઓશ્રીને પ્રાપ્ત થયો. આમ આવા દુષ્મકાળમાં જ્યાં એક ધર્મત્વા મળવા પણ દુર્લભ છે ત્યાં ઉ-ઉ મહાપુરુષનો સમાગમ એ કોઈ અલૌકિક ભાવનાનું ફળ છે. આમ સમગ્ર જીવન પ્રગાહ સત્સંગ યુ ત બન્યું.

(૧૨) પ્રભાવના યોગ :

પૂ. ગુરુદેવશ્રીના પ્રભાવના યોગને જોઈને સ્વયંને પ્રભાવના કરવા સંબંધી જે ભાવના હતી તેને સર્વપ્રકારે તેઓશ્રીએ સાકાર કરી. જેમાં મુખ્યતઃ શ્રી સીમંધર સ્વામી જિનમંદિર-ભાવનગર, શ્રી પરમાગમ મંદિર-સોનગઢ, શ્રી નંદિશ્વર જિનાલય-સોનગઢ જેવા જિનમંદિરોનાં નિર્માણ કાર્યમાં ગુપ્ત રહી અપૂર્વ ભૂત ત પૂર્વક સમર્પણ કર્યું. તદઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની ભાવિ પર્યાય - સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપના ગામે-ગામ કરાવીને પૂ. બહેનશ્રીની ભાવનાને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું.



પ્રવચનામૃત પીરસત્તા પૂ. ભાઈશ્રી

વળી, તેઓશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવશ્રીની સંમતિપૂર્વક શાસ્ત્ર પ્રકાશનાર્થે 'શ્રી વીતરાગ સત્ત્ર સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ'ની સ્થાપના થઈ. જેમાં લાખ્યો ગ્રંથ પ્રકાશિત થયા અને વર્તમાનમાં પણ પ્રકાશિત થઈ રહ્યાં છે.

વળી, તેઓશ્રીએ વિવિધ આચાર્યાં અને જ્ઞાનીઓ દ્વારા

લિખિત સો-એક શાસ્ત્રો જેવા કે શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પરમાત્મપ્રકાશ, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી સમયસાર કણશટીકા, શ્રી અનુભવપ્રકાશ, શ્રી અષ્ટપાણુડ, શ્રી પંચાધ્યાયી, શ્રી ચિદ્વિલાસ, શ્રી સમ્યક્જ્ઞાન દીપિકા, શ્રી નાટક સમયસાર, શ્રીમદ્ રાજયંત્ર વચનામૃત અને પુરાણો ઇત્યાદિકનો ગહન અભ્યાસ કરી તેના રહસ્યને તથા હાઈને સ્વયંની મૌલિક અને સરળ શૈલીથી પ્રવચનો દ્વારા મુમુક્ષુઓને અમૃતપાન કરાવ્યું. નિષ્કારણ કરુણાથી ઉપ વર્ષ તેઓશ્રીએ સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાણુડ, કણશટીકા, શ્રીમદ્ રાજયંત્ર, અનુભવ પ્રકાશ, ચિદ્વિલાસ, બહેનશ્રીના વચનામૃત, ગુરુદેવશ્રીના વચનામૃત, પરમાગમસાર, સ્વાનુભૂતિદર્શન, ઇત્યાદિક અનેક ગ્રંથો પર જાહેર સ્વાધ્યાય આપ્યો. આ

સ્વાધ્યાયમાં માર્ગની વિધિ, ભેદજ્ઞાન, સત્પુરુષ અને સત્સંગનું માહાત્મ્ય, સત્પુરુષ પ્રત્યેની ભર્તા, ભાવના ઈત્યાદિ અનેક વિષયો ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો. તદ્દઉપરાંત સાતિશય જ્ઞાનયોગ તથા વચનયોગના પ્રતાપે મુમુક્ષુ જીવોને વર્તમાન ભૂમિકાથી આગળ વધી મોક્ષમાર્ગ પર્યત પહોંચવાના ક્રમનું, સ્વયંની મૌલિક શૈલીમાં સુવ્યવસ્થિત પ્રતિપાદન કરીને સમસ્ત મુમુક્ષુ જગત ઉપર અવિસ્તરણિય ઉપકાર કર્યો છે. વર્તમાનમાં જેની ૪૫૦૦ ઓડીયો કેસેટો ભાવનગરમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેમજ વિદેશમાં પણ જિનમાર્ગની પ્રભાવનાનું કાર્ય તેઓશ્રી કરેલ છે.


તદ્દઉપરાંત, સ્વયંની અનોખી પ્રાયોગિક શૈલીમાં ‘નિષ્ઠાત દર્શનની કેરી’, ‘પ્રયોજન સિદ્ધિ’, ‘તત્ત્વાનુશીલન ભાગ-૧-૨-૩’, ‘મુમુક્ષુતા આરોહણ કરું’, ‘સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત છ પદનો - અમૃત પત્ર’, ‘પરિભ્રમણના પ્રત્યાખ્યાન’, ‘આત્મયોગ’ અને ‘અનુભવ સંજીવની’ કે જેમાં સ્વયંના અંતર મંથનમાંથી સ્કુરિત વચનામૃતોની સમર્થ રચના દારા જન્મ-મરણની જટિલ સમસ્યાને હલ કરવા અતિ ઉપકારી માર્ગદર્શન આપ્યું છે. વળી, તેઓશ્રીએ ‘જ્ઞાનામૃત’, ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’, ‘પરમાગમસાર’, ‘પથ પ્રકાશ’, ‘ભગવાન આત્મા’, ‘વિધિ વિજ્ઞાન’, ‘બીજું કાંઈ શોધમાં’, ‘ધન્ય આરાધના’, ‘અધ્યાત્મ પરાગ’, ‘જિણ સાસણ સલ્વ’, ઈત્યાદિ અનેક ગ્રંથોને સંકલન તથા વિવેચનરૂપે પ્રકાશિત કર્યા.

અધ્યાત્મમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પંચ પરમાગમ તથા અન્ય પરમાગમો ઉપરના વિશિષ્ટ પ્રવચનો ધ્વનિમુક્તિ કેસેટો ઉપરથી અક્ષરશઃ પુસ્તકાકારરૂપે પ્રકાશિત થાય તેવી તેઓશ્રીની વિચારધારા અને ભાવનાના ફળસ્વરૂપે ‘પ્રવચન રત્નાકર’ ભાગ ૧ થી ૧૧ પ્રકાશિત કરવામાં તેઓશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન તથા યોગદાન રહ્યું છે.

તદ્દઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સાધનાના દોહનના ફળસ્વરૂપ, માખણ સ્વરૂપ ૧૪૩ પ્રવચનો પ્રકાશિત થવામાં વિલંબ થયો હોવા છતાં તેઓશ્રીના નિર્દેશન તળે ‘પ્રવચન નવનીત’ ભાગ ૧-૨-૩ પ્રકાશિત થયા અને ટુંક સમયમાં ભાગ ૪ પણ પ્રકાશિત થશે. પૂ.

ગુરુદેવશ્રીના અન્ય પરમાગમો ઉપરના પ્રવચનો પ્રકાશિત થાય તેવી તેઓશ્રીની ભાવના હતી અને તે પણ કમશા: પ્રકાશિત કરવામાં આવશે.

(૧૩) શુંત ભર્ત :



પ્રાચીન તાડપત્રીનું નિરીક્ષણ કરી રહ્યાં છે

મહાન દિગંબર આચાર્યો રચિત અનેક પ્રાચીન પરમાગમો જે ઉપલબ્ધ નથી તેની શોધ અર્થે શ્રી કુંદકુંદ કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ નામક ટ્રસ્ટમાં તેઓશ્રીએ તામિલનાડુ તથા કર્ણાટક પ્રાંતમાં શાસ્ત્રની શોધ ચલાવેલ.

જર્મન યૂનિવર્સિટી સાથે આ પ્રાચીન શાસ્ત્ર-શોધ અર્થે પ્રયાસ કરી રહ્યાં હતા. તેમજ ઇંગ્લેન્ડ,

ફાંસ, જર્મની વગેરે સ્થળોની પ્રસિદ્ધ લાયબ્રેરીઓની મુલાકાત પણ લીધેલ. ભારતમાં આવેલી અન્ય સંસ્થાઓ સાથે મળીને પણ આ પ્રાચીન શાસ્ત્ર શોધનું કાર્ય કરી રહ્યાં હતા અને વર્તમાનમાં પણ તેઓશ્રીની ભાવના અનુસાર આ કાર્ય ચાલી રહ્યું છે.

‘શ્રી સત્શુંત પ્રભાવના ટ્રસ્ટ’માં હિન્દી તથા ગુજરાતીમાં પ્રકાશિત થતી માસિક આધ્યાત્મિક પત્રિકા ‘સ્વાનુભૂતિપ્રકાશ’ને અપૂર્વ નિર્દેશન આપી રહ્યાં હતાં. આ પત્રિકા દારા સમાજ પર્યત અધ્યાત્મ તત્ત્વ પહોંચે તેવી ભાવનાથી આ પત્રિકાનું નિઃશુલ્ક વિતરણ પણ તેઓશ્રીના અનુગ્રહથી ચાલી રહ્યું છે.


(૧૪) મહાપ્રયાણ :

તા.૨૧-૩-૮૮, ચૈત્ર સુદ ચોથ, રોજંદા કમ પ્રમાણે સાંજના સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. કુદરતની કોઈ અકળ ગતિ આવી પહોંચી. રાત્રિના ૧:૩૦ વાગે હદ્યમાં દુખાવો શરૂ થયો. વેદના વધતી જતી હતી તેમ છતાં

કોઈ અણસાર આવવા દીધો નહીં. પોતે પોતાના પુરુષાર્થમાં લાગેલા રહ્યાં. તેમના નાના દિકરા પંકજભાઈ સાથે પૂ. બહેનશ્રીની તથા પૂ. ગુરુદેવશ્રીની વાતો કરવા લાગ્યા. અંદરમાં આત્મસ્વરૂપ પ્રત્યેની પુરુષાર્થની ભીસ વધતી ગઈ, બહારમાં ઉપકારી શ્રી ગુરુના સ્મરણો વાગોળતા ગયા. અશાતા વેદની

ગૌણ થઈ ગઈ અને આત્મિક પુરુષાર્થ

વિશ્વવિભૂતિનું મહાપ્રયાણ



બળ પકડવા લાગ્યો. ડૉ ટરોની સૂચના પ્રમાણો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ગયા ત્યારે શારિરીક પરિસ્થિતિ કાંઈક વધારે કથળી અને અંતરમાં અણસાર આવી ગયો કે હવે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છૂટવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેથી પોતે તીવ્ર વેદના હોવા છતાં ધ્યાનમાં બેસી ગયા. આજીવન સાથેલી અખંડ આત્મ સાધના છેલ્લી ઘડીએ આવિર્ભૂત થઈ. અશાતા વેદનીને અત્યંત ગૌણ કરી, ઉપેક્ષા કરી ઉપયોગે અંતર્મુખ થવાનો પુરુષાર્થ આદર્યો. સામાન્ય જ્ઞાનવેદન આવિર્ભૂત થઈ પ્રદેશો-પ્રદેશો સ્વસંવેદનનું

રસાસ્વાદન થયું, પુરુષાર્થ ભીસ લગાવી નિજ સ્વરૂપનું અવલંબન લીધું, ઉપયોગ સર્વથી છૂટો પડી નિજ સ્વરૂપમાં રમવા લાગ્યો. અનંતા કર્મોની નિર્જરા થઈ. બહારમાં ડૉ ટરો એમનું કામ કરતા રહ્યાં, મુમુક્ષુઓ અસહાય બની સ્વયંના બાલા શ્રીગુરુની સ્થિતિ જોતા રહ્યાં અને પંચમકાળ પોતાનું કામ કરતો રહ્યો. દેહ અને આત્મા જુદા છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરી પોતે જીવન સફળ બનાવ્યું. ચૈત્ર સુદ-૫, તા-૨૨-૩-૮૮, પરોઢીયે ૪:૧૫ કલાકે એક ભવ ઓછો કર્યો અને ધ્યેયની સમીપ પહોંચ્યા. ન જોઈતી,

નહિ ઇચ્છણેલી પરિસ્થિતિ આવીને ખડી થઈ ગઈ. અંદરમાં દેહ અને આત્માનની બિત્તતાનો અનુભવ અને બહારમાં પણ દેહ અને આત્માની બિત્તતાની વાસ્તવિકતા ખડી થઈ ગઈ.

મુમુક્ષુઓના જીવન આધાર, મુમુક્ષુઓને નિઃસહાય, અનાથ મુક્તીને ચાલ્યા ગયા. શું કુદરતને આ પરિસ્થિતિ મંજુર નથી કે આવા દિવ્ય પુરુષો શાશ્વત આ ધરાતલ પર બિરાજમાન રહે ? શું કુદરત આટલી હદે નિષ્ઠુર થઈ શકે છે ? શું કાળને કોઈપણ પ્રકારની દયા ન આવી અને સર્વ મુમુક્ષુઓના જ્ઞાલસોયા પરમેશ્વરને છીનવી લીધા ? આવા-આવા અનેક પ્રશ્નોના અસમાધાન વચ્ચે મુમુક્ષુઓ ચોધાર આંસુએ જોતા રહ્યા. એક વિરાટ બ્ર્યાં તત્ત્વનો વિયોગ - મુમુક્ષુઓ માટે એક વજપાત સમાન નિવડચો. મુમુક્ષુઓ અવાયક નેત્રોથી સ્વયંના શ્રીગુરુની વસમી વિદાય જોઈ રહ્યાં. દૂર-દૂર સુધી ફેલાયેલી અમાપ ક્ષિતિજોમાં સ્વયંની આભા ફેલાવી આ વિશ્વવિભૂતિનું મહાપ્રયાણ થયું.

ઉપોદ્ધાત

એક મહાન સમસ્યા અને તેનું નિરાકરણ

આ વિશ્વમાં સમસ્યાના અસંખ્ય પ્રકારો છે. પરંતુ જીવની સૌથી મોટી સમસ્યા અનંતકાળથી જન્મ-મરણ કરો, પરિભ્રમણ થઈ રહ્યું છે, તે છે. વિધિની સૌથી મોટી વિધિત્રતા પણ એ છે કે જીવ નાની-મોટી સમસ્યાઓની ચિંતાથી ઘેરાયેલો રહે છે તેથી મોટી સમસ્યાનું વિસ્મરણ અનાદિથી ચાલ્યું આવ્યું છે. અરે ! આવી કોઈ સમસ્યા છે અને તેનું સમાધાન પ્રાપ્ત કરવું જરૂરી છે-તેની પણ બહુભાગ જીવોને ખબર નથી.

જેનું ડોનહાર સારું છે તેવો કોઈ જીવ કોઈ મહાપુષ્યના ઉદ્ઘે સત્તસંગમાં આવે છે ત્યારે તેને આખો સંસાર કેવળ ફુઃખમય લાગે છે; અને ‘મારું’ પરિભ્રમણ થઈ રહ્યું છે, અને પરિભ્રમણના કારણરૂપ પરિણામ હજી ચાલી રહ્યાં છે તેમ લાગવા માંડે છે; અને તે જીવને પરિભ્રમણથી છૂટવાનો ભાવ આવે છે અર્થાત્ પોતાનું હિત કરવાનો ભાવ જાગે છે, ત્યારે તે જીવ પોતાના દોષ ભણી દૃષ્ટિ કરે છે. તેમાં અવું લાગે છે કે-મારો પરમાં પોતાપણાનો ભાવ છે તે જ પરિભ્રમણ કરાવે છે. પરમાં પોતાપણાના ભાવને લીધે હું પરની ચિંતાથી અત્યાર સુધી ઘેરાયેલો રહ્યો અને તેથી જ પરિભ્રમણની સમસ્યાનું વિસ્મરણ રહ્યું; આ ઘણી મોટી ગંભીર ભૂલ થઈ.’ - એવી યથાર્થ સમજજણથી પોતે નક્કી કરે છે કે ‘મારે કોઈપણ ભોગે હવે પરિભ્રમણ કરવું નથી.’ - આ નિશ્ચયથી પોતાના દોષ જોવાનું શરૂ કરે છે ત્યારે પોતાના દોષ દેખાવા લાગે છે. અને જેમ જેમ તે પ્રયાસ વધતો જાય છે તેમ તેમ તેમાં સૂક્ષ્મતા આવતી જાય છે. પરંતુ ઉદ્ય-પ્રસંગમાં જે કંઈ રાગ-દ્રેષ્ટ, હર્ષ-શોક થયા કરે છે, અને જેટલો કોઈ વિભાવરસ દેખાય છે, તેનો પશ્ચાત્તાપ એવા પ્રકારે થાય છે કે-મારે તો પરિભ્રમણથી છૂટવું છે તેમ છતાં પરિભ્રમણ કરાવવાવાળા આવા પરિણામો થાય છે તે મારે જોઈતા નથી. એમ કરતાં કરતાં સહજપણે એની વેદના શરૂ થઈ જાય છે.

ઉ ત પ્રકારે વેદના વધીને તીવ્ર થાય છે ત્યારે ઘણી ઉદાસીનતા વર્તે છે. અને યાંય પણ મન લાગતું નથી. ખાવું-પીવું, કોઈની સાથે હળવું-મળવું,

વાતચીત કરવી ગમતી નથી. કોઈ આવી ચેત તો તે બોજારુપ લાગે અને બેચેન...બેચેન રહ્યા કરે. તે બેચેની એટલી હદે વધી જાય છે કે ઘ પણ આવતી નથી.-એવી બેચેની અને વેદના દરમ્યાન એવો નિર્ણય થાય છે કે ‘હવે મારે આ સંસારમાંથી કાંઈ જોઈતું નથી.’ જે કોઈ પદાર્થો મેળવવાની વૃત્તિ ઠે તો તે આકૃષ્ણતામય લાગે છે. અને જે જે છયાજાઓ થાય તેમાં આકૃષ્ણતાનો જ અનુભવ થાય છે.-આવી તીવ્ર વેદનાના સમયે ચારે પ્રકારના (સમાજ, કુટુંબ, શરીર અને સંકલ્પ-વિકલ્પ) પ્રતિબંધ મોળા પડી જાય છે. બહુભાગ આ વેદના ઘણા દિવસ ચાલે છે, જેને લઈને અંત:કરણની શુદ્ધિ થાય છે. બે-ચાર દિવસ ચાલેલી વેદના ઘણું કરીને યથાર્થ હોતી નથી. પરંતુ તે ભાવુકતામય હોય છે. પરંતુ લાંબા સમય ચાલેલી વેદના, અત્યંત ઉદાસીનતાપૂર્વક, પૂર્ણ શુદ્ધિના લક્ષમાં પરિણામે છે.

આવી વેદનાવાળા મુમુક્ષુના પરિણામનાને જોઈને પણ બીજા જીવને તથારુપ પરિણામન આવે છે; ત્યારે તેને એવું દેખાય છે કે-આ જીવને પરિભ્રમણનો કેવો થાક લાગ્યો છે ! મને તો હજુ સંસારમાં રસ પડે છે, તેથી હજુ હું પરિભ્રમણથી થા યો નથી, વગેરે વિચારણાથી તેને લાગી આવે છે, અને આ રીતે તે જીવ, પરિભ્રમણની યથાર્થ વેદનામાં આવે છે.

આવા સમયે તેને એક માર્ગદર્શક પુરુષની જરૂર પડે છે. તેમાં પોતાને એમ લાગે છે કે ‘હું સંસારસમુક્રની મધ્યમાં દૂબી રહ્યો છું. તેમાંથી સત્પુરુષ મને દૂબતો બચાવી શકશે. તેથી જ્ઞાનીપુરુષના આશ્રયથી જ મારું પરિભ્રમણ મટશે. બીજો કોઈ ઉપાય છે જ નહીં.’ - એવી સૂજ અંદરથી આવે છે. જ્યારે એવી સૂજ આવે છે ત્યારે પ્રાય: તેને જ્ઞાનીપુરુષનો ભેટો થાય છે. અને પરમ સત્સંગયોગે ઘનિષ્ઠ પરિચય સાધીને તેને જ્ઞાનીપુરુષનું અંતર્દ્રપરિણામન દેખાય છે અને તેમના હદ્યમાં બિરાજમાન પરમાત્માનાં દર્શન થાય છે; જેને લીધે જ્ઞાનીપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય છે. સર્વપ્રિણાપણબુદ્ધિએ અપૂર્વ સ્નેહ અને અચળ પ્રેમથી સત્સંગને આરાધે છે, અને સત્પુરુષ પ્રયે પરમપ્રેમાર્પણભાવ રહેવાથી પરિણામોની નિર્મળતા આવતી જાય છે. જો કદાચ ઉપકારી સત્પુરુષના વિયોગમાં એક ઘડી પસાર કરવી પડે તો અત્યંત વિટંબણાપૂર્ણ લાગે છે. અને નિરંતર સત્સંગના સંયોગમાં કે વિયોગમાં પરિભ્રમણ મટાડવાનો લક્ષ અને પ્રયાસ ચાલે છે.

આ ભૂમિકામાં કેટલીક નિર્મળતા આવવાથી અંદરથી - જે જે અસમાધાન હોય છે તેનું - સમાધાન, નિર્મળતાને લીધે, સહજ આવે છે. અને આગળ શું કરવું, તેની સૂજ આવતી જાય છે અને જ્ઞાનમાં વિવેક આવતો જાય છે અને તે જીવ આગળ વધતો જાય છે.

એમ નથી કે માત્ર પ્રતિકૂળતા જોઈને જ પરિભ્રમણ દેખાય; પરંતુ અનુકૂળતામાં ફસાતા જીવોને જોઈને પણ તે પરિભ્રમણનું જ કારણ દેખાય છે. તેથી પોતાનું હિતરૂપ કાર્ય કરવામાં શીଘ્રતાવાળા પરિણામ રહ્યા કરે છે. અર્થાત્ તે જીવ નીચે મને બેસી રહેતો નથી, સ્વકાર્યની તાલાવેલી અને લગની લાગે છે અને પરિપૂર્ણ નિર્દ્દિષ્ટ થવાનો નિર્ધાર સહજ થાય છે. જેમાં દોષનો એક કણ પણ કલંકરૂપ જાણી ‘તે ન જોઈએ’ અને તે માટે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ ચાલવાનું વલણ રહે છે. તેમજ જ્ઞાનીપુરુષનું પરિણામન જોઈને પોતાને પણ વીરોદ્ધાસ આવે છે જેને લીધે પોતાના આત્મહિતની નિઃશંકતા પણ છે.

પરમાપકારી પુ. ‘માઈશ્રી’

ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના અભાવના પ્રયત્ન માટે આ ભવ છે. ભવભ્રમણ કેટલાં હુઃખોથી ભરેલું છે તેના ગંભીરતાથી વિચાર તો કર ! નરકનાં ભયંકર હુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળનાં આયુષ્ય કેમ પુરાં થયાં હશે ? નરકનાં હુઃખ સાંભળ્યાં જાય એવાં નથી. પગમાં કાંઠો વાગે તેટલું હુઃખ પણ તું સહન કરી શકતો નથી, તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંતાનંતરગુણાં હુઃખ પડ્યાં છે એવા મિથ્યાત્વને છોડવાને ઉદ્યમ તું કેમ કરતો નથી ? ગફલતમાં કેમ રહે છે ? આવો ઉત્તમ યોગ ફરીને યારે મળશે ? તુ મિથ્યાત્વ છોડવાને મરણિયો પ્રયત્ન કર, એટલે કે શાતા-અશાતાથી બિજ તેમજ આકુળતામય શુભાશુભ ભાવોથી પડા બિજ એવા નિરાકૃપ જ્ઞાપક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એ જ આ ભવમાં કરવા જેતું છે.

-પૂ. બહેનશ્રીના વચનામૃત - ૪૧૬

સ્મરણાંજલિ

જન્મ :

તા-૨-૧૦-૧૯૩૪

દહ્યવિલય :

તા-૧૮-૪-૧૯૬૮

સ્વ. શ્રી હસમુખભાઈ જમનાદાસ અજમેરા

પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેની આપની અનન્ય ભી ત, અપૂર્વ નિષ્ઠા અંતરથી તેમના પ્રત્યેનો આપનો છલોછલ પ્રેમ આદિ સદગુણો અમારા માટે પ્રેરણાસ્પદ છે. કૃપાળુદેવ દર્શાવેલા માર્ગ ચાલવા માટેનું અપૂર્વ માર્ગદર્શન છેલ્લા છ વર્ષથી પૂ. શ્રી શશીભાઈ શેઠના સત્સંગ યોગમાં રહી પ્રાપ્ત કરતાં હતા અને તેમની પ્રેરણથી વચ્ચામૃતનું પાન કરતા હતા.

અત્યિતમ ક્ષણોમાં પણ આપ તેનું જ વિંતન અને સ્મરણ કરતા કરતા શાંત વિતે આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય ભવ સાર્થક કર્યો છે. અને ધર્મ પ્રાપ્તિના ભાવની કમાડી કરીને પ્રયાણ કરેલા આપના આત્માને અમે સૌ ભાવભરી સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ. અને ભવિષ્યમાં સત્સંગી તરીકે આપનો યોગ મળે એવી ભાવના ભાવીએ છીએ.

આપે સત્ફદેવ, ગુરુ અને ધર્મનો આશ્રય લઈને અમને સૌને તે દ્વારા ધર્મની આરાધના કરવા માટે જ અમૂલ્ય પ્રેરણા અને સંસ્કારરૂપી મુડી આપી છે. તેને જ અમે સાચો વારસો માનીએ છીએ અને તેને અમારા જીવનમાં અંગીકાર કરી આત્મહિતની દિશામાં શીત્લ પ્રગતિ કરીએ તેવી પ્રયાચના કરીએ છીએ.

આપનો પરિવાર

પૂ. શ્રી જમનાદાસ ખુશાલદાસ અજમેરા

અનસુયા હસમુખરાય અજમેરા

સંદીપ અજમેરા - ચારુ અજમેરા

સ્વ. લીલાવંતી જ. અજમેરા

નીતિન અજમેરા - પુનિતા અજમેરા

પૌત્રિઓ- સિદ્ધિ, આયુષી, કીના, શેલી

